

ઉદ્યોગ અને ખાણ વિભાગ
કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૩૯૪(૨) અન્વયે
બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડનો ચોથો વહીવટી અહેવાલ
(નાણાંકિય વર્ષ ૨૦૨૧ -૨૨)

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ (BRCL) કંપની ધારા, ૨૦૧૩ હેઠળ નોંધાયેલ ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને માણતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડ સાથેની જોઇન્ટ વેન્યર સરકારી કંપની છે. જેની સ્થાપના તા.૧૩.૧૨.૨૦૧૮ ના રોજ થયેલ છે.

આ કંપનીની રચના ગુજરાત રાજ્યના કટોસણ રોડ-બેચરાજી-ચાણસમા-રણૂજ (૬૫ કીમી) લાઇનના ગેજ કન્વર્જન માટે પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવો, નાણાકીય ધીરાણ, આયોજન અને અમલીકરણ અર્થે થયેલ છે.

ચાલુ વર્ષ દરમિયાન કંપનીએ નીચે મુજબની પ્રોજેક્ટની ગતિવિધિઓ હાથ ધરેલ છે :

એ) માણતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL) એ બેચરાજી ખાતે સરળ રેલ કનેક્ટિવિટી માટે પ્લાન્ટ યાર્ડના વિકાસ માટે નું કામ BRCL ને સોંપ્યું છે.

બી) પ્રોજેક્ટની વિવિધ ગતિવિધિઓ માટે ટેન્ડર મંગાવવા, મોનિટરિંગ અને પ્રોજેક્ટના અમલીકરણ માટે ટ્રાન્ઝેક્શન એડવાઇઝરી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટનું કામ જી-રાઈડને સોંપવામાં આવ્યું છે. પ્રોજેક્ટના તબક્કા -૧ અને તબક્કા -૨ માટે ઈપીસી કોન્ટ્રાક્ટરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તબક્કા -૧ અને તબક્કા -૨ માટેના અમલીકરણનું કાર્ય પ્રગતિમાં છે.

સી) ફિલ્ડ સુપરવિઝન અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે.

ડી) અન્ય રોજીંદા કામકાજો પ્રોજેક્ટના સરળ પ્રગતિ માટે હાથ ધરેલ છે.

ઈ) પ્રોજેક્ટને લગતી જમીન સંપાદનની પ્રક્રિયા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટ કચેરી સાથે સંકલન પ્રગતિમાં છે.

એફ) પ્રોજેક્ટની વિવિધ ગતિવિધિઓની પ્રગતિનું દેખરેખ રાખવામાં આવેલ છે.

જી) પ્રોજેક્ટને લગતા વિવિધ મુદ્દાઓ માટે રેલવે અને રાજ્ય સરકાર સાથે સંકલન પ્રગતિમાં છે.


મેનેજમેન્ટ તેની પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યું છે અને વર્ષ દરમિયાન પ્રોજેક્ટના અમલીકરણને ઝડપી બનાવી રહ્યું છે.

કંપનીના રીપોર્ટીંગ સમયગાળા દરમિયાન રૂ.૫૨,૮૩,૫૮૪/- નો નફો થયેલ છે.



મુખ્ય કારોબારી અધિકારી
બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ





અધિક મુખ્ય સચિવ
ઉદ્યોગ અને ખાણ વિભાગ,
ગુજરાત સરકાર



બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન : યુ84101જીજે201૮એસજીસી104૬0૨

ચોથો વાર્ષિક અહેવાલ

(નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨)

તારીખ : ૨૨/૦૮/૨૦૨૨

સમય : ૦૧:૩૦ કલાકે

સ્થળ : બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન,
સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧,
ગુજરાત.

: રજીસ્ટર્ડ ઓફીસ :

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧

ફોન : ૦૭૯-૨૩૨-૩૨૭૨૮ / ૨૯, ઈ-મેલ : info@brcl.org.in

બહુચરાણ રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

અનુક્રમણિકા

ક્રમ	વિગત	પાના નં.
૧.	બોર્ડના નિયામકો	૪
૨.	ચોથી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ	૫
૩.	સંચાલક મંડળનો અહેવાલ	૮
૪.	સી એન્ડ એજનો અહેવાલ	૨૧
૫.	સ્વતંત્ર ઓડીટરનો અહેવાલ	૨૩
૬.	બેલેન્સ શીટ	૪૧
૭.	નફા નુકશાનનો હિસાબ	૪૩
૮.	રોકડ પ્રવાહ પત્રક	૪૬
૯.	નાણાકીય પત્રકોની નોંધો	૪૮

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

સંચાલક મંડળ

ક્રમ	ડિરેક્ટરનું નામ અને ડિઆઈએન	હોદ્દો
૧.	શ્રી સંતોષ કુમાર - ૦૭૮૫૪૧૭૯	નિયામક
૨.	શ્રી બજરંગ ઇગનભાઈ વર્લી - ૦૭૧૩૩૯૪૨	નિયામક
૩.	શ્રી પવન અગ્રવાલ - ૦૯૬૫૦૭૪૦	નિયામક
૪.	શ્રી રાજ સ્વરૂપ કપુર - ૦૮૩૦૩૬૮૮	નિયામક
૫.	જવલેશ પીયુશભાઈ જવેરી - ૦૯૫૦૭૨૨૪	નામાંકિત નિયામક
૬.	સંતોષ કુમાર - એએફપીપીકે૫૭૭૬ડી	સી. ઈ. ઓ
૭.	શંભુપ્રસાદ જોષી - એબીઈપીજે૬૫૬૮કે	સી. એફ. ઓ

વેધાનિક ઓડિટર

મેસર્સ શાહ એન્ડ દલાલ,
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,
અમદાવાદ.

બેન્કર્સ

યસ બેન્ક, ગાંધીનગર
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, ગાંધીનગર

રજીસ્ટર્ડ ઓફિસ

બ્લોક નં. ૬, ૭ મો માળ,
ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧,
ગાંધીનગર - ૩૮૨૦૧૧.

ચોથી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી ઓટીસ આપવામાં આવે છે કે કંપની બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડની ચોથી વાર્ષિક સામાન્ય સભાની બેઠક ગુરૂવાર, બાવીસમી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ ૧:૩૦ કલાકે (શોર્ટ નોટીસમાં) વીડીયો કોન્ફરન્સીંગ / ઓએવીએમ મોડ દ્વારા ઠલોક નંબર ૬, ૭ મા માળે, ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧ ખાતે રાખવામાં આવેલ છે અને તેમા નીચે મુજબની કાર્યવાહીઓ હાથ ધરવા માટે રાખવામાં આવેલ છે.

સામાન્ય કાર્યવાહી:-

૧. ૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ પૂર્ણ થતી આ કંપનીની ઓડીટેડ નાણાંકીય પત્રકોને પ્રાપ્ત કરવા, ચકાસવા અને મંજૂર કરવા અને તેની સાથો સાથ બોર્ડ ઓફ ડીરેક્ટર અને ઓડીટરોના રીપોર્ટ અને કોમ્પટ્રોલર અને ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની ટીપ્પણીઓ બાબતે ઘટતું કરવા સારૂ.
૨. શ્રી બી. સી. વર્લી (ડીઆઈએન : ૦૭૧૩૩૮૪૨) કે જેઓ નિયામક તરીકે રોટેશનથી નિવૃત્ત થાય છે તેઓને તેમની લાયકાતને ધ્યાને રાખી તેઓએ ફરીથી નિયુક્તી માટે પોતાને પ્રસ્તુત કરેલ હોય જેથી તેઓને નિયામક તરીકે નિયુક્ત કરવા સારૂ.
૩. શ્રી રાજ સ્વરૂપ કપુર (ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૮) કે જેઓ નિયામક તરીકે રોટેશનથી નિવૃત્ત થાય છે તેઓને તેમની લાયકાતને ધ્યાને રાખી તેઓએ ફરીથી નિયુક્તી માટે પોતાને પ્રસ્તુત કરેલ હોય જેથી તેઓને નિયામક તરીકે નિયુક્ત કરવા સારૂ.
૪. સી. એ. જી દ્વારા સુચિત કરવામાં આવેલા સ્ટેચ્યુટરી ઓડીટરને કંપનીના હિસાબોની ચકાસણી માટે વર્ષ ૨૦૨૨-૨૩ માટે બોર્ડના નિયામકોને મજૂરી આપવા બાબત.

ખાસ કાર્યવાહી:-

૫. જો યોગ્ય લાગે તો નીચે દર્શાવેલ ઠરાવને ખાસ ઠરાવ તરીકે ફેરબદલી સાથે કે તેના વગર પસાર કરવા સારૂ.

સામાન્ય ઠરાવ

આથી ઠરાવવામાં આવે છે કે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૮ અને ૧૫૨ અને શેડ્યુલ ૪ ને વંચાણે લેતા અને અન્ય લાગુ પડતી ધારાઓને ધ્યાને રાખી કંપની (નિયામકોના નિયામન અને લાયકાત) નિયમો, ૨૦૧૪ (જેમાં સેટ્યુટરી સુધારાઓ કે ફેર સુધારાઓ કે જે સમય સમયમાં કરવામાં આવેલ છે) તેના અનુસંધાને શ્રી પવન અગ્રવાલ (ડીઆઈએન : ૦૮૬૫૦૭૪૦) કે જેઓને કંપનીના એડીશનલ ડાયરેક્ટર તરીકે કંપનીના બોર્ડ ઓફ ડીરેક્ટર દ્વારા ૨૦ મી જુલાઈ, ૨૦૨૨ કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૬૧ (૧) મુજબ નિમવામાં આવેલ છે અને તેઓએ કંપનીના આર્ટીકલ ઓફ એસોસીએશનથી વાર્ષિક સામાન્ય સભાની મીટીંગની તારીખ સુધી કામગીરી સંભાળેલ છે તેઓને હવે કંપનીના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવે છે કે જેઓ મારૂતી સુઝુકી ઈન્ડિયા લીમીટેડ (એમએસઆઈએલ) દ્વારા નોમીનેટ કરવામાં આવેલ છે.

રજીસ્ટર્ડ ઓફિસ:-

બ્લોક નં. ૬, ૭મો માળ,

ઉદ્યોગ ભવન,

સેક્ટર - ૧૧,

ગાંધીનગર - ૩૮૨૦૧૧.

તારીખ: ૨૨-૦૯-૨૦૨૨

બોર્ડના નિયામકોના હુકમ મુજબ

સહી/-

ચેરમેન/નિયામક

નોંધ:-

૧. આ અહેવાલના કોઈ પણ ભાગને લગત માહિતી મેળવવા ઈચ્છુક કોઈપણ શેરધારકે આ બાબતે કંપનીને અગાઉથી જ લેખિતમાં જાણ કરવી જેથી કે મેનેજમેન્ટ દ્વારા જરૂરી માહિતી સમયસર તૈયાર કરી શકાય.
૨. સેટ્યુટરી ઓડીટરોને દર વર્ષે વાર્ષિક ધોરણે કોમ્પ્રોલર અને ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયાના સુજાવ ઉપર નિયુક્ત કરવામાં આવે છે. પરંતુ નાણાંકીય વર્ષ ૨૦૨૨ -૨૩માં કંપનીને કોમ્પ્રોલર અને ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા પાસેથી સુજાવ માટે કોઈપણ પત્ર મળેલ નથી. આથી, નોટીસના એજન્ડા આઈટમ નંબર - ૪ માં એવો પ્રસ્તાવ કરવામાં આવેલ છે કે નિયામક મંડળને સત્તા આપવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેના સીએજી દ્વારા સૂચીત કરવામાં આવેલા સ્ટેચ્યુટરી ઓડીટરની નિમણૂક બાબતે.

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૦૨ (૧) અન્વયે સ્પષ્ટીકરણ નિવેદન

ખાસ કાર્યવાહી

આઈટમ નં. ૫

શ્રી પવન અગ્રવાલ (ડીઆઈએન : ૦૯૬૫૦૭૪૦) ને માફતી સુગુકી ઈન્ડીયા લીમીટેડ (એમએસઆઈએલ) દ્વારા નોમીનેટ કરવામાં આવેલ કંપનીના નિયામક તરીકે નિયુક્તિ આપવા સાફ.

શ્રી પવન અગ્રવાલ (ડીઆઈએન : ૦૯૬૫૦૭૪૦), કે જેઓને કંપનીના અધિક નિયામક તરીકે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૬૧ (૧) મુજબ ૨૦ મી જુલાઈ, ૨૦૨૨ ના રોજથી નિમણૂક કરવામાં આવેલ છે અને તેઓએ વાર્ષિક સામાન્ય બેઠકની તારીખે જવાબદારી સંભાળેલ છે અને તેઓ માફતી સુગુકી ઈન્ડીયા લીમીટેડ (એમએસઆઈએલ) ના પ્રતિનિધિ તરીકે કંપનીના નિયામક બનવા માટે લાયકાત ધરાવે છે.

કંપનીના નિયામક મંડળે મંજૂરી માટે સામાન્ય ઠરાવ સૂચવેલ છે.

કંપનીના બોર્ડ ના નિયામક ખાસ મેનેજેરીય પર્સનલ (જેમાં નિયામકો અને ખાસ મેનેજેરીય પર્સનલના સબંધીઓનો સમાવેશ થાય છે) નો આ ઠરાવમાં કોઈ પણ જાતનો સંબંધ કે રૂચી નાણાંકીય કે અન્ય કોઈપણ રીતે રહેલ નથી.

રજીસ્ટર ઓફિસ:-

બ્લોક નં. ૬, ૭ મો માળ,

ઉદ્યોગ ભવન,

સેક્ટર - ૧૧,

ગાંધીનગર - ૩૮૨ ૦૧૧.

બોર્ડના નિયામકોના હુકમ મુજબ

એસડી/-

સીઈઓ અને નિયામક

તારીખ:- ૨૨ મી સપ્ટેમ્બર, ૨૦૨૨

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

રજીસ્ટર્ડ ઓફિસ: પ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧

સંચાલક મંડળનો અહેવાલ

પ્રતિ,

સભ્યો,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ,

ગાંધીનગર, ગુજરાત

તમારા નિયામકોને બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ (“કંપની”)ની કામગીરી અને ધંધા બાબતે અને ૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિતના હિસાબોનો ચોથો વાર્ષિક અહેવાલ આપની સમક્ષ પ્રસ્તુત કરતા ખૂબ જ આનંદ થાય છે.

૧. નાણાંકીય વિગતો અથવા કંપનીની કામગીરીને લગત અગત્યની બાબતો:-

૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિતના સમયગાળા માટે કંપનીની નાણાંકીય સ્થિતિ નીચે મુજબ છે.

(રકમ રૂપિયામાં)

વિગત	૨૦૨૧-૨૨	૨૦૨૦-૨૧
ઓપરેશન-સમાંથી આવક	૪૩,૯૨,૪૫,૫૩૬	-
અન્ય આવક	૩,૫૯,૭૪,૯૫૬	૧,૯૭,૭૯,૨૩૨
કુલ આવક	૪૭,૫૨,૨૦,૪૯૨	૧,૯૭,૭૯,૨૩૨
ઓછા : કુલ ખર્ચ	(૪૬,૦૬,૩૦,૬૯૨)	(૧,૨૭,૭૭,૮૫૮)
નફો / (નુકશાન) ટેક્ષ પહેલા	૧,૪૫,૮૯,૮૦૦	૭૦,૦૧,૩૭૪
ઓછા : ટેક્ષ ખર્ચ	૯૩,૦૬,૨૧૬	૫૫,૦૨,૫૮૨
નફો / (નુકશાન) ટેક્ષ બાદ	૫૨,૮૩,૫૮૪	૧૪,૯૮,૭૯૨

૨. આ સમયગાળા દરમિયાન કંપનીની કામગીરીની વિગતો:-

કંપની દ્વારા નીચે મુજબની ધંધાકીય કામગીરીઓ હાથ ધરવામાં આવેલ છે.

એ) મારૂતી સુઝુકી ઈન્ડિયા લીમિટેડ (એમએસઆઈએલ) એ બીઆરસીએલ ને એમએસઆઈએલ ઈન પ્લાટ યાર્ડ માં બહુચરાજી ખાતે સુચારૂ રેલ જોડાણના વિકાસ માટે જવાબદારી સોંપેલ છે.

- બી) ટ્રાન્સેક્શન સલાહકારની અને પ્રોજેક્ટ મેનેજમેન્ટની કામગીરી જી-રાઈડને સોંપવામાં આવેલ છે કે જેથી પ્રોજેક્ટના ટેન્ડરને ફાળવવા, મોનીટરીંગ અને પ્રોજેક્ટના અમલીકરણ કરી શકાય. પ્રોજેક્ટના ફેઝ - ૧ અને ફેઝ - ૨ માટે ઈપીસી કોન્ટ્રાક્ટર નક્કી કરવામાં આવેલ છે.
- સી) ફીલ્ડ સુપરવીઝન અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એજન્સીને નક્કી કરવામાં આવેલ છે.
- ડી) કંપની દ્વારા રોજબરોજના ઈનહાઉસ કામગીરીના સુચારુ અમલીકરણ માટે આયોજન કરવામાં આવેલ છે.
- ઈ) રાજ્ય સરકાર અને જીલ્લા વહીવટ દ્વારા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.
- એફ) જુદી જુદી કામગીરીઓ માટે પ્રોજેક્ટના પ્રોગ્રેસને ચકાસવામાં આવી રહેલ છે.
- જી) પ્રોજેક્ટની તમામ બાબતો માટે રેલ્વે અને રાજ્ય સરકાર વચ્ચે સંપર્ક કરવામાં આવી રહેલ છે.
- મેનેજમેન્ટ એમની કામગીરીમાં ગતી વધારી રહ્યું છે કે જેથી પ્રોજેક્ટની અમલીકરણમાં વર્ષ દરમિયાન ઝડપથી થઈ શકે.

૩. કોવીડ - ૧૯ ની અસરો:-

નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯)ને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ એક પડકાર જનક વર્ષ રહ્યું. કોવીડ ૧૯ના અનુગામી તરંગો દ્વારા ઉભા થયેલા પડકારો દૂર કરવા અસમ્પ્ય પગલા લેવામાં આવ્યા કે જે પડકારોના નવા સમૂહનો સામનો કરવા માટે અને અમારા કર્મચારીઓ પડકારી શકે. કંપની કોઈ પણ ભૌતિક ફેરફારોની નજીકથી દેખરેખ રાખશે જેથી કરીને ભવિષ્યની આર્થિક સ્થિતિ અને તેની પ્રવૃત્તિ પર તેની અસર થાય નહીં.

૪. ધંધામાં ફેરફારો જો કોઈ હોય તો:-

હાલના નાણાકીય વર્ષના સમયગાળામાં કંપનીના ધંધામાં કોઈ પણ જાતના ફેરફારો થયેલ નથી.

૫. ડીવીડન્ડ:-

હાલના રિવ્યુના સમયગાળા દરમિયાન બોર્ડના નિયામકોએ કંપનીના ઈકવીટી શેરોમાં કોઈપણ પ્રકારનો ડીવીડન્ડ સૂચવેલ નથી.

૬. રીઝર્વમાં ટ્રાન્સફર:-

હાલના નાણાકીય વર્ષના સમયગાળા માટે કંપનીએ કોઈ પણ રકમને જનરલ રીઝર્વમાં ટ્રાન્સફર કરેલ નથી.

૭. કંપનીના શેર ભંડોળ અને કંપનીના શેર ભંડોળમાં કોઈ ફેરફાર હોય તો તે:-

કંપનીનું ૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત ઓથોરાઈઝ, બહાર પાડેલ, સબસ્ક્રાઈબ્ડ અને પેઈડ અપ શેર ભંડોળ નીચે મુજબ છે.

શેર ભંડોળની રૂપરેખા	
ઓથોરાઈઝડ શેર કેપીટલ	રૂ. ૭,૮૬,૨૨,૦૦,૦૦૦/- (રૂપીયા સાતસો છ્યાસી કરોડ બાવીસ લાખ પૂરા) ને રૂ. ૧૦ ના ૭૮,૬૨,૨૦,૦૦૦ (ઈકઠયોતેર કરોડ બાસઠ લાખ વીસ હજાર) ઈકવીટી શેરોમાં વિભાજીત કરવામાં આવેલ છે.
ઈશ્યુ, સબસ્ક્રાઈબ અને પેઈડ અપ શેર કેપીટલ**	રૂ. ૪,૯૬,૯૧,૭૨,૦૦૦/- (રૂપીયા ચારસો છત્રુ કરોડ એકાણુ લાખ બોતેર હજાર પૂરા) ને રૂ. ૧૦ ના ૪૯,૬૯,૧૭,૨૦૦ (ઓગણ પચાસ કરોડ ઓગણસીતેર લાખ સત્તર હજાર બસો) ઈકવીટી શેરોમાં વિભાજીત કરવામાં આવેલ છે.

****** કંપનીના દરેક ઈકવીટી શેર ધારકને રૂ. ૧૦/- (દસ) ના ૩૦,૪૫,૪૨,૨૦૦ (ત્રીસ કરોડ પીસતાલીસ લાખ બેતાલીસ હજાર બસો) શેર રાઈટ બેઝીસ પર ફાળવવામાં આવેલ છે, જે ૧૧મી જુન, ૨૦૨૧, ૩ જી ફેબ્રુઆરી, ૨૦૨૨ અને ૮ મી માર્ચ, ૨૦૨૨ ના રોજના અસરથી હાલના શેર ધારકોને પારી પાસુની અસરથી ફાળવવામાં આવેલ છે.

૮. સબસીડરીઓ, સંયુક્ત સાહસો અને એસોસીએટ્સ કંપનીઓ:-

કંપનીએ ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને માડ્રુતી સુઝુકી ઈન્ડીયા લીમીટેડનું એક સંયુક્ત સાહસ છે. તેથી શેર હોલ્ડીંગ પદ્ધતિ અનુસાર કંપની જે. વી. પાર્ટનર્સનો એક સંયુક્ત સાહસ છે.

૯. ફેરબદલીના હકકો સાથે ઈકવીટી શેરો બાબતેના ખુલાસાઓ:-

આ સમયગાળા દરમ્યાન કંપનીએ ડીફરન્શીયલ વોટીંગ હકકો સાથે કોઈ પણ ઈકવીટી શેરો ઈશ્યુ કરેલ નથી અને તેથી કંપનીને કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડીબેન્ચર) નીયમો, ૨૦૧૪ ના નીયમ ૪ (૪) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૦. સ્વેટ ઈકવીટી શેરો બાબતેના ખુલાસાઓ:-

આ સમયગાળા દરમ્યાન કંપનીએ કોઈ સ્વેટ ઈકવીટી શેરો બહાર પાડેલ નથી અને તેથી કંપનીએ કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડીબેન્ચર) નીયમો, ૨૦૧૪ ના નીયમ ૮ (૧૩) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૧. કર્મચારી સ્ટોક વિકલ્પ બાબતેના ખુલાસાઓ:-

આ સમયગાળા દરમ્યાન કંપનીએ કર્મચારી સ્ટોક વિકલ્પ સ્કીમ અંતર્ગત કોઈ શેરો બહાર પાડેલ નથી તેથી કંપનીને કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડીબેન્ચર) નીયમો, ૨૦૧૪ ના નીયમ ૧૨ (૯) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૨. કર્મચારીઓની વિગતો:-

બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડ એક લીસ્ટેડ કંપની ન હોવાથી કલમ ૧૯૭ (૧૨) અને કંપનીઝ (એપોઈન્ટમેન્ટ એન્ડ રેમ્યુનેશન ઓફ મેનેજેરીયલ પર્સનલ) નીયમો, ૨૦૧૪ મુજબ કર્મચારીઓના વિગતની બાબત કંપનીને લાગુ પડતી નથી.

૧૩. નિયામકો અને ખાસ મેનેજેરીયલ અધિકારીઓ:-

હાલના રીવ્યુના નાણાંકીય વર્ષમાં રીપોર્ટની તારીખે નિયામક મંડળ અને ખાસ મેનેજેરીયલ પર્સનલ ની વિગતો અને નિયામક મંડળ અને ખાસ મેનેજેરીયલ પર્સનલના બાંધામાં થયેલ ફેરફારોની વિગતો નીચે મુજબ છે:-

ક્રમ	નિયામકોના નામ/ નિયુક્ત થયેલ કેએમપી	નિયામક ઓળખ નંબર	નિયુક્તીની તારીખ	સમાપ્તિની તારીખ
૧	અશ્વિનીકુમાર યાદવ, આઈએએસ	૦૬૫૮૧૭૫૩	૧૩/૧૨/૨૦૧૮	૧૧/૧૧/૨૦૨૧
૨	બજરંગ છગનભાઈ વર્લી	૦૭૧૩૩૯૪૨	૧૩/૧૨/૨૦૧૮	-
૩	સંતોષ કુમાર, આઈઆરએસઈ	૦૭૮૫૪૧૭૯	૧૩/૧૨/૨૦૧૮	-
૪	કવીતા રાકેશકુમાર શાહ (શેઠ)	૦૮૨૬૮૫૫૮	૦૬/૦૨/૨૦૨૦	૨૯/૦૩/૨૦૨૨
૫	બચ્ચુ વેનુગોપાલ	૦૮૩૦૩૬૮૭	૧૩/૧૨/૨૦૧૮	૨૦/૦૭/૨૦૨૨
૬	રાજ સ્વરૂપ કપુર	૦૮૩૦૩૬૮૮	૧૩/૧૨/૨૦૧૮	-
૭	જવલેશ પીયુશભાઈ ઝવેરી	૦૯૫૦૭૨૨૪	૧૬/૦૨/૨૦૨૨	-
૮	પવન અગ્રવાલ	૦૯૬૫૦૭૪૦	૨૦/૦૭/૨૦૨૨	-
૯	સંતોષ કુમાર, આઈઆરએસઈ (સીઈઓ)	એપીપીપીકે ૫૭૭૬૩	૨૨/૦૯/૨૦૨૦	-
૧૦	શંભુપ્રસાદ જોષી (સીએફઓ)	આબીઈપીજે ૬૫૬૮૬	૨૨/૦૯/૨૦૨૦	-

૧૪. મેનેજેરીયલ રીમ્યુનરેશન:-

આ કંપનીએ મેનેજેરીયલ રીમ્યુનરેશન બાબતે કંપનીઝ (એપોઈન્ટમેન્ટ એન્ડ રીમ્યુનરેશન ઓફ મેનેજેરીયલ પર્સનલ), નીયમ, ૨૦૧૪ ના નિયમ ૫ મુજબ ખુલાસો કરવાનો રહેતો નથી કારણે કંપની એક અનલીસ્ટેડ કંપની છે.

૧૫. રોકાણો:-

રીવ્યુના હાલના સમયગાળા દરમ્યાન કંપનીએ પબ્લીક પાસેથી કોઈપણ પ્રકારના રોકાણો મેળવેલ નથી અને તેથી કંપનીને કંપની (એકાઉન્ટ) નીયમો, ૨૦૧૪ લાગુ પડતુ નથી.

૧૬. રોટેશન મુજબ નિવૃત્ત થનાર નિયામકો:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૫૨(દ) મુજબ શ્રી બી. સી. વર્લી (ડીઆઈએન : ૦૭૧૩૩૯૪૨) અને શ્રી રાજ સ્વરૂપ કપુર (ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૮) કંપનીના એજીએમ ખાતે રોટેશનથી નિવૃત્ત થવાના છે અને લાયકાત હોવાથી તેઓએ પોતાને ફરી-નિયુક્તિ માટે પ્રસ્તુત કરેલ છે.

કંપનીને ફોર્મ ડીઆઈઆર - ૮ મુજબના ખુલાસા મળેલ છે જેમા દર્શાવેલ છે કે તેઓ કંપનીના વાર્ષિક સામાન્ય બેઠક દરમ્યાન ફરી નિયુક્તિ માટે લાયકાત ધરાવે છે.

૧૭. બોર્ડની બેઠક:-

બેઠકની નોટીસ તૈયાર કરવામાં આવેલ છે અને તે અગાઉથી જ નિયામકોને સેક્રેટેરીય ધોરણો મુજબ પાઠવવામાં આવેલ છે. હાલના વર્ષ દરમ્યાન ચાર બોર્ડની બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે અને તે ૨૬ મી મે, ૨૦૨૧, ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૧, ૨૮ મી ડીસેમ્બર, ૨૦૨૧ અને ૨૨ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧ (ફક્ત પહેલા બે ક્વાર્ટર માટે) માટે એમસીએ દ્વારા છુટછાટ આપવામાં આવેલ છે કારણ કે કોવીટ - ૧૯ ના ફેલાવથી તારીખ ૩ થી મે, ૨૦૨૧ ના સામાન્ય ઠરાવ ક્રમાંક : ૦૮/૨૦૨૧ થી બે બોર્ડ બેઠક વચ્ચે ૧૮૦ દિવસનો અંતર મંજૂર કરવામાં આવેલ છે.

૧૮. બોર્ડનું ઈવેલ્યુએશન:-

તમારો બોર્ડ તેની કામગીરીની ચકાસણી માટે કટીબધ્ધ છે કે જેથી તેઓ પોતાની કામગીરીની ચકાસણી કરી શકે અને તેઓની ક્ષમતા કયા ક્ષેત્રમાં છે તે જાણી શકે અને તે પણ જાણી શકે કે કયા ક્ષેત્રમાં તેઓની કામગીરી સુધારી શકે અને સ્વતંત્ર નિયામકો, બોર્ડના ચેરમેન સંપૂર્ણ બોર્ડની કામગીરીની ચકાસણી માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. નિયામકોની નિયુક્તિ/ફેર નિયુક્તિ/નિયામકોને ચાલુ રાખવા તે વાર્ષિક ચકાસણી પદ્ધતિ પર આધારીત છે.

૧૯. વાર્ષિક રીટર્નની વિતગો:-

કંપની પાસે કોઈ પણ વેબસાઈટ રહેલ નથી અને તેથી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ (૩) (એ) અને તેને લગત નિયમો કંપનીને લાગુ પડતુ નથી કે જે વાર્ષિક રીટર્ન (ફોર્મ એમજીટી ૭) માં વેબ સાઈટની વિગતને લગત છે.

૨૦. ઓડીટરો:-

કમ્પ્રોલર અને એડીટર જનરલ ઓફ ઈન્ડિયાની ટીપ્પણીઓ મુજબ દર વર્ષે સ્ટેચ્યુટરી ઓડીટરોની નિયુક્તિ કરવામાં આવે છે. કમ્પ્રોલર અને એડીટર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી નાણાંકીય વર્ષ ૨૦૨૨ - ૨૩ માટે ટીપ્પણી મળતાની સાથે નિયામક મંડલ સ્ટેચ્યુટરી ઓડીટરોની નિયુક્તિની બાબત ધ્યાને લેશે.

૨૧. ઓડીટરોનો અહેવાલ:-

ઓડીટરોના અહેવાલમાં કોઈ પણ પ્રકારની ખામીઓનો સમાવેશ કરવામાં આવેલ નથી. તેઓના અહેવાલના એકાઉન્ટ અને ઓડીટરના નોટ સ્વયં સ્પષ્ટ છે અને તે બાબતે વધુ કોઈ ટીપ્પણી આપવાની રહેતી નથી.

૨૨. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) મુજબ કોમ્પ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની ટીપ્પણીઓ:-

કંપનીને પત્ર ક્રમાંક નં. એ.એમ.જી.૧/એકાઉન્ટ/બીઆરસીએલ/૨૦૨૧-૨૨/ઓડબલ્યુ.૭૦૬ તારીખ ૯ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ કમ્પ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી પ્રાપ્ત થયેલ છે અને તે કંપનીના ૩૧/૦૩/૨૦૨૨ અંતિતના ઓડીટેડ હિસાબો બાબતેનો છે અને તેમા જણાવેલ છે કે એવી કોઈ પણ બાબત ધ્યાન પર આવેલ નથી કે જેથી કરીને સી એન્ડ એજીએ સ્ટેચ્યુટરી ઓડીટર્સ રીપોર્ટ પર કોઈ ખાસ ટીપ્પણી કરવાની જરૂર રહેલ છે.

૨૩. આંતરિક ઓડીટ અને કન્ટ્રોલ:-

મેસર્સ તૃપલ જે. પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે આંતરિક ઓડીટર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. મેસર્સ તૃપલ જે. પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સેવાઓ સંતોષકારી જણાઈ આવેલ છે અને તેથી તેઓને વધુ એક વર્ષ માટે એટલે કે નાણાંકીય વર્ષ ૨૦૨૨ - ૨૩ માટે બોર્ડ દ્વારા ફરી નિયુક્ત કરવામાં આવેલ છે.

૨૪. કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર)

ચકાસણીના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૫ મુજબ કોર્પોરેટ સામાજિક જવાબદારીની કલમ કંપનીને લાગુ પડતુ નથી.

૨૫. રીસ્ક મેનેજમેન્ટ પોલીસી:-

બીઆરસીએલ દ્વારા તેઓના ધંધાને લગત ખતરાઓને શોધી કાઢશે અને તેઓ એક રીસ્ક મેનેજમેન્ટ રૂપરેખાને લાગુ કરશે કે જેથી આવા ખતરાઓનો સામનો કરી શકે જેથી કે ધંધાના ઉદ્દેશ્યોને કોઈ જાતના અડજણ સીવાય પૂર્ણ કરી શકાય. બીઆરસીએલ દ્વારા આવા ખતરાઓને તેઓના એક્ષપોશર નિયંત્રીત કરી અને ધંધાને થનાર નુકશાનને ઘટાડશે.

૨૬. ઉર્જાનો બચાવ, ટેકનોલોજીની સ્વીકૃતિ અને વિદેશી નાણા પ્રાપ્ત કરવા ચૂકવવા સાર:-

કંપની દ્વારા એવી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી કે જે ઉર્જાના બચાવ, ટેકનોલોજીની સ્વીકૃતિ

બાબતે ખુલાસો કરવાની જરૂરીયાત રહેલ છે કારણ કે તે કે ઉત્પાદન કરતી કંપની નથી. રીવ્યુના સમયગાળા દર્મ્યાન કંપનીએ કોઈ પણ પ્રકારના વિદેશી નાણાં પ્રાપ્ત કરેલ નથી કે ચૂકવેલ નથી.

૨૭. સમયગાળાના અંત અને અહેવાલની તારીખ દરમ્યાન થયેલ કોઈપણ પ્રકારના મેટીરીયલ ફેરફારો કે કમીટમેન્ટ્સ કે જેથી નાણાકીય સ્થિતિમાં કોઈ ફેરફાર થઈ શકે:-

સમયગાળાના અંતે અને અહેવાલની તારીખ સુધીમાં ઉપર રીપોર્ટમાં જણાવ્યા સિવાય કોઈપણ પ્રકારના મેટીરીયલ ફેરફાર થયેલ નથી કે જેથી કંપનીના નાણાંકીય સ્થિતિને કોઈ પણ પ્રકારની અસર થઈ શકે. પરંતુ કંપનીએ ૩,૬૭,૭૩,૮૩૧ અને ૧,૮૬,૦૭,૮૪૩ ના રૂા. ૧૦/- પ્રતિ શેરની ફાળવણી તારીખ ૨૨ મી એપ્રિલ, ૨૦૨૨ અને ૨૦ મી જુલાઈ, ૨૦૨૨ ના રોજ અનુક્રમે કરેલ છે કે જે ગુજરાત રેઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (જી-રાઈડ) ને લગત છે.

૨૮. કંપનીની હાલની પરિસ્થિતિ કે ભવિષ્યની કામગીરીને અસર કરે તેવા કોઈ મેટીરીયલ હુકમો જે કોઈ રેગ્યુલેટરો કે અદાલતો કે ટ્રીબ્યુનલો દ્વારા પસાર કરવામાં આવેલ હોય તો તેની વિગત:-

કોઈપણ રેગ્યુલેટરો કે અદાલતો કે ટ્રીબ્યુનલો દ્વારા એવા કોઈ પણ ખાસ મેટીરીયલ હુકમ પસાર કરવામાં આવેલ નથી કે જેથી કંપનીની હાલની પરિસ્થિતિ કે ભવિષ્યની કામગીરીઓ ઉપર કોઈપણ પ્રકારની અસર થઈ શકે.

૨૯. ધ સેક્યુયલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબીશન એન્ડ રીડ્રેસલ) એક્ટ, ૨૦૧૩ અન્વેય કંપનીની રહેલ જવાબદારીઓ:-

કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાવવા માટે એક નવો કાયદો ધ સેક્યુયલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબીશન એન્ડ રીડ્રેસલ) એક્ટ, ૨૦૧૩ તા.૯ મી ડીસેમ્બર, ૨૦૧૩ ના રોજ પસાર કરવામાં આવેલ છે. આ કાયદા હેઠળ દરેક કંપનીએ એક આંતરીક ફરીયાદ સમિતીની રચના કરવી જરૂરી છે કે જે કોઈ પણ સ્ત્રી કર્મચારી દ્વારા તેઓ સાથે કામકાજના સ્થળે થયેલ જાતીય સતામણી બાબતેના ફરીયાદો સાભળે.

કંપની દ્વારા ભવિષ્યમાં એવી નીતી અપનાવશે કે જેથી સ્ત્રીઓ સાથે નોકરીના સ્થળે જાતીય સતામણ ન થાય અને આ નીતી લાગુ કરવા માટે એક સમિતિની પણ રચના કરશે. આ રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપનીને સતામણી બાબતે કોઈ પણ ફરીયાદ મળેલ નથી.

૩૦. લોન, ગેરેન્ટી અને રોકાણની વિગતો:-

હાલના રીવ્યુના સમયગાળામાં કંપનીએ કોઈ પણ પ્રકારની લોન આપેલ નથી કે કોઈ પણ પ્રકારના રોકાણો કે કોઈ લોન પર ગેરેન્ટી આપેલ નથી, કે જે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ (૩) (જી) હેઠળ આવેલ છે અને તેથી કંપનીએ આ બાબતે કોઈપણ પ્રકારનો ખુલાસો કરવાનો રહેતો નથી.

૩૧. સંબંધીત પક્ષકારોને લગત કરારો અને એગ્રીમેન્ટોની વિગતો:-

હાલના રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૮(૧) અન્વયે કંપની દ્વારા સંબંધિત પક્ષકારો સાથે કરવામાં આવેલ રીવ્યુ, કરારો અને વ્યવસ્થાઓની વિગતો કંપનીના ઓડીટ થયેલ બેલેન્સ શીટમાં

દર્શાવવામાં આવેલ છે.

૩૨. ઓડીટ સમિતિ:-

હાલના રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૭૮ અને કંપનીઝ (મીટીંગ ઓફ બોર્ડ એન્ડ ઈટસ પાવર્સ) ધારા, ૨૦૧૪ ના નિયમ (૬) હેઠળ ઓડીટ સમિતિના સંદર્ભે કોઈપણ બાબતો કંપનીને લાગુ પડતી નથી.

૩૩. નોમીનેશન અને રીમ્યુનરેશન સમિતિ:-

હાલના રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૭૮ અને કંપનીઝ (મીટીંગઝ ઓફ બોર્ડ એન્ડ ડીટસ પાવર્સ) નિયમો, ૨૦૧૪ ના નિયમ (૬) ના અનુસંધાને નોમીનેશન અને રીમ્યુનરેશન સમિતિને લગત બાબતો કંપનીને લાગુ પડતી નથી.

૩૪. નિયામકોની જવાબદારી બાબતેનો ખુલાસો:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ ના પેટા કલમ (૩) ના કલોઝ (સી) અન્વયેના નિયમકોની જવાબદારી બાબતેનો ખુલાસો નીચે મુજબ છે.

- (એ) વાર્ષિક હિસાબો તૈયાર કરવા બાબતે, લાગુ પડતા હિસાબી સિધ્ધાતોનું પાલન કરવામાં આવેલ છે અને મટીરીયલ ડીપાર્ટમેન્ટ બાબતે જરૂરી ખુલાસા પણ આપવામાં આવેલ છે.
- (બી) નિયામકો દ્વારા એવા વ્યવસ્થિત સીસ્ટમો રચવામાં આવેલ છે કે જે લાગુ પડતા નિયમોના પ્રાવધાનો મુજબ છે અને આ સીસ્ટમો સારી રીતે કામગીરી કરે છે અને જરૂરીયાત મુજબના છે.
- (સી) નિયામકોએ હિસાબી પોલીસીને પસંદ કરેલ છે અને તેને ચોક્કસપણે લાગુ પણ કરેલ છે અને જરૂરી ચુકાદાઓ અને અદાજો પણ કરેલ છે કે જે યોગ્ય અને બરાબર છે કે જેથી કંપનીને લગત લાગુ પડતા સમયગાળાની ચોખ્ખી પરિસ્થિતિ દર્શાવી શકાય અને કંપનીના નફા નુકશાન બાબતે પણ જરૂરી સમજણ પ્રાપ્ત કરી શકાય.
- (ડી) નિયામકોએ હિસાબી રેકોર્ડ જાળવતી વખતે ઉપર દર્શાવેલ ધારાના અનુસંધાને જરૂરી કાળજી અને સાવચેતી રાખેલ છે કે જેથી કંપનીના હિતોને જાળવી શકાય અને કોઈપણ પ્રકારના ફોડ અને ગેરરીતિઓને દૂર કરી શકાય.
- (ઈ) કંપનીના નિયામકોએ વાર્ષિક હિસાબોને સાતત્યતાના નિયમ મુજબ તૈયાર કરેલ છે.

૩૫. સેક્રેટરીયલ ઓડીટ અહેવાલ:-

આથી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૨૦૪ (૧) અને કંપનીઝ (એપોઈન્ટમેન્ટ એન્ડ રીમ્યુનરેશન ઓફ મેનેજરીયલ પર્સનલ) નિયમ, ૨૦૧૪ ના નિયમ (૯) મુજબ કંપનીએ સેક્રેટરીયલ ઓડીટ અહેવાલનું ફોર્મ નં. એમઆર - ૩ મેસર્સ કિરણ પટેલ એન્ટ એસોસીયેટ, કે જેઓ એક પ્રેક્ટીસીંગ કંપની સેક્રેટરી છે તેઓ પાસેથી પ્રાપ્ત કરેલ છે. આ

અહેવાલની એક નકલ નિયામકના અહેવાલ સાથે જોડેલ છે.

૩૬. રકમનો એડયુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવા બાબત:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૨૪ અને ઈન્વેસ્ટર એડીયુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ એથોરીટી (એકાઉન્ટીંગ, ઓડીટ, ટ્રાન્સફર એન્ડ રીફંડ) નિયમો, ૨૦૧૬ અન્વયે સાત વર્ષ કે તેથી વધારે સમયગાળા માટે ડીવીડન્ટની ફાળવણી માટે કંપનીના શેરો કલેમ થયા વગર કે ચૂકવણા થયા વગર બાકી રહેલ હોય તો તેને કંપની દ્વારા ભારત સરકારના ઈન્વેસ્ટર એડયુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ) માં ટ્રાન્સફર કરવું જરૂરી છે. આવા કોઈ પણ કિસ્સાઓ નથી કે જેમાં અમલીકરણ બાકી રહેલ છે.

૩૭. એકનોલેજમેન્ટ:-

કંપનીના નિયામકો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ, કંપટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયાને અને સ્ટેચ્યુટરી ઓડીટરોને તેઓ ધ્વારા આપવામાં આવેલ સહકાર બાબતે આભાર પ્રકટ કરે છે. કંપનીના નિયામકો ગુજરાત સરકાર, એમએસઆઈએલ, કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને તેઓ દ્વારા આપવામાં આવેલ સહકાર અને સત્તત ટેકા બદલ આભાર પ્રકટ કરે છે.

બોર્ડ ઓફ ડાયરેક્ટરોના વતી અને તેમના દ્વારા
બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૨૨/૦૮/૨૦૨૨

સહી/-
જવલેશ ઝવેરી
નિયામક

ડીઆઈએન : ૦૮૫૦૭૨૨૪

સહી/-
સંતોષ કુમાર
નિયામક અને સીઈઓ
ડીઆઈએન : ૦૭૮૫૪૧૭૮

સેક્ટેરીયલ ઓડિટ અહેવાલ

તા. ૩૧-૦૩-૨૦૨૨ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષનું
(કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ - ૨૦૧૪ (૧) અને કંપની (વ્યક્તિગત નિમણૂક અને મહેનતાણું)
નિમયો, ૨૦૧૪ ના નિયમ નં. ૯ અન્વયે)

પ્રતિ,

સભ્યો,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ,

બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન,

સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧.

અમોએ બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ (હવે પછી કંપની તરીકે જણાવશે) દ્વારા તેને લાગુ પડતી કાયદેસરની જોગવાઈઓની પૂર્તતા અને સારા કોર્પોરેટ વ્યવહારોનું પાલન કર્યું છે, તે અંગેનું સેક્ટેરીયલ ઓડિટ કરેલ છે. સેક્ટેરીયલ ઓડિટ એવી રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું કે કંપનીના વ્યવહાર/કાયદેસરના અનુપાલનને મૂલવવાનો અને તેના ઉપર અમારો અભિપ્રાય વ્યક્ત કરવાનો અમને વ્યાજબી આધાર પૂરો પાડે છે. કંપનીના ચોડપાઓ, કાગળો, ઠરાવ બુકો, પત્રકો, ફાઈલ કરેલ રીટર્ન અને કંપની દ્વારા નિભાવવામાં આવતા અન્ય રેકોર્ડ અને કંપની એ તેમના અધિકારીઓ, એજન્ટોએ અને અધિકૃત પ્રતિનિધિઓએ સેક્ટેરીયલ ઓડિટ દરમિયાન આપેલ ચકાસણીના આધારે અમે આથી અહેવાલ આપીએ છીએ કે, અમારા અભિપ્રાય મુજબ અહેવાલમાં જણાવ્યા સુધીનું જણાવેલ રીતે, અને જણાવેલ મર્યાદામાં કંપનીએ ૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષને આવરી લેતા (ઓડિટ સમયગાળા) દરમિયાન નીચે આપેલા કાયદાઓની જોગવાઈઓનું પાલન કર્યું છે અને કંપની પાસે યોગ્ય સંચાલક મંડળ પ્રક્રિયાઓ અને પૂર્તતા પદ્ધતિ છે :

અમોએ નીચે દર્શાવેલા કાયદાની જોગવાઈઓ પ્રમાણે કંપનીએ ૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ પૂરા જતા વર્ષ માટે નિભાવેલ ચોડપાઓ, કાગળો, ઠરાવ બુકો, પત્રકો, ફાઈલ રીટર્ન અને અન્ય રેકોર્ડ તપાસ્ય છે :

૧. કંપની ધારા, ૨૦૧૩ અને તે હેઠળ બનાવેલા નિયમો.
૨. ધી સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટસ (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૬ અને તે હેઠળ બનાવેલા નિમયો અને પેટા કાયદાઓ.
૩. ધી ડીપોઝિટરીઝ એક્ટ, ૧૯૯૬ અને તે હેઠળ બનાવેલા નિયમો અને પેટા કાયદાઓ લાગતી હદ સુધી અનુસરવામાં આવેલ છે. મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની ૨૨ જાન્યુઆરી, ૨૦૧૯ ની સૂચના મુજબ ગવર્નમેન્ટ કંપનીઓને અપવાદ આપવામાં આવ્યો છે તેમના શેરોને ડીમીટીરીયલાઈઝ કરવાનો કે જે આ કંપનીને લાગુ પડતો નથી.
૪. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ૧૯૯૯ અને તે હેઠળ બનાવેલા નિમયો, સીધા વિદેશી રોકાણો, દરિયાપાર ના સીધા રોકાણો અને બહારના વાણિજ્યિક ઉદ્યોગના નાણાંને લગતી બાબતો.

૫. ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા, ૧૯૯૨ ('સેબી એક્ટ') હેઠળ સૂચિત કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓ; કે જે આ સમયગાળા દરમિયાન કંપનીને લાગુ પડતી નથી.
- (અ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સબ્સ્ટેન્શીયલ એકવીઝીશન ઓફ શેર એન્ડ ટેક ઓવર્સ) નિયમો, ૨૦૧૧.
- (બ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (પ્રોહિબિશન ઓફ ઈન્સાઇડર ટ્રેડિંગ) નિયમો, ૧૯૯૨
- (ક) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડીસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ) નિયમો, ૨૦૦૯
- (ડ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (એમ્પ્લોઈ સ્ટોક ઓપ્શન સ્કીમ અને એમ્પ્લોઈ સ્ટોક પરચેઝ સ્કીમ), માર્ગદર્શિકાઓ, ૧૯૯૯
- (ઈ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇસ્યુ એન્ડ લિસ્ટિંગ ઓફ ડેટ સીક્યોરિટીઝ) નિયમો, ૨૦૦૮
- (એફ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇસ્યુના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટસ) નિયમો, ૧૯૯૩ - કંપની ધારા અને ગ્રાહક સાથેના વ્યવહારને લગતા
- (ગ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ડી લીસ્ટિંગ ઓફ ઈક્વિટી શેર) નિયમો, ૨૦૦૯
- (હ) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (બાય બેક ઓફ સીક્યોરિટીઝ) નિયમો, ૧૯૯૮
૬. આ સાથે વધુમાં રજૂ કરેલું છે કે, કંપનીમાં પાલન થતી પ્રથા કે જેની સંબંધિત દસ્તાવેજો અને પત્રકોની સૈદ્ધાંતિક તપાસના આધારે કંપનીએ કંપનીના નિમયો પ્રમાણે નીચે પ્રમાણેના નિમયોને અમલમાં મૂકેલ છે કે જે કંપનીને વિશેષ રીતે લાગુ પડે છે.
- (૧) ધી કોન્ટ્રાક્ટ લેબર (રેગ્યુલેશન એન્ડ એબોલીશન) એક્ટ, ૧૯૭૦
આ સાથે લાગુ પડતી જોગવાઈઓ પણ અમે ચકાસી છે કે જે નીચે મુજબ છે.
- (૧) ભારતીય કંપની સચિવ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ સેક્રેટરીયલ ધોરણો
- (૨) ધી સીક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને ડીસ્ક્લોઝર રેકિવરીમેન્ટસ) નિયમો, ૨૦૧૫ (ઓડિટના સમય દરમિયાન કંપનીને આ લાગુ પડતા નથી.)
- સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીએ કાયદા, નિયમો, માર્ગદર્શિકા, ધોરણો વગેરેની જોગવાઈઓનું અમારા અવલોકનને આધિન પાલન કરેલું છે.
- અમને જણાવેલી માહિતી અનુસાર અમે વધુમાં માહિતી આપીએ છીએ કે કંપનીએ હાલમાં યોગ્ય કંપની સેક્રેટરીની નિમણૂકની પ્રક્રિયામાં છે કે જે કંપનીઝ એક્ટ ૨૦૧૩ ની કલમ ૨૦૩ મુજબ મુખ્ય વહીવટીય અધિકારી તરીકે વર્તે.

કંપીના નિયામક મંડળની રચના ૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ કરવામાં આવી છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન નિયામક મંડળની રચનામાં જે ફેરફારો થયા છે તે કાયદાની જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવ્યા છે.

બોર્ડ મિટિંગો સુનિશ્ચિત કરવા માટે તમામ નિયામકોને પૂરતી સૂચના આપવામાં આવી છે, કાર્યસૂચિ અને કાર્યસૂચિ પરની વિગતવાર નોંધ ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ મોકલવામાં આવી હતી અને ટૂંકી સૂચનાના કિસ્સામાં કંપની અધિનિયમ, ૨૦૧૩ મુજબ આવશ્યક પગલાઓના પાલનની ખાતરી આપવામાં આવી છે.

બધા જ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે અને જે ઠરાવના ભાગરૂપે નોંધ લેવામાં આવે છે.

અમો વધુમાં જણાવીએ છીએ કે, લાગુ પડતા કાયદાઓ, નિયમો, પેટાનિયમો, માર્ગદર્શિકાઓના નિયંત્રણ અને પાલનની ખાતરી કરવા માટે કંપનીના કદ અને કામગીરીને અનુરૂપ પૂરતી પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ કંપનીમાં છે.

અમો વધુમાં અહેવાલ આપીએ છીએ કે,

૧. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીએ

- (અ) તા. ૧૧-૦૬-૨૦૨૧ ના રોજ બોલાવેલ નિયામક મંડળની બેઠકમાં સરક્યુલેશન દ્વારા પસાર કરેલ સામાન્ય ઠરાવથી તેમના શેરધારકો ને રાઈટ બેસીસના આધારે રૂા. ૧૦ ના એક એવા ૩,૨૬,૨૫,૦૦૦ ના કુલ એકંદરે રૂા. ૩૨,૬૨,૫૦,૦૦૦/- ના શેરની ફાળવણી કરેલ છે.
- (બ) તા. ૦૩-૦૨-૨૦૨૨ ના રોજ બોલાવેલ નિયામક મંડળની બેઠકમાં સરક્યુલેશન દ્વારા પસાર કરેલ સામાન્ય ઠરાવથી રૂા. ૧૦ ના એવા ૧૪,૫૮,૧૭,૨૦૦ ઈક્વીટી શેર્સ એકંદરે કુલ ૧૪૫,૮૧,૭૨,૦૦૦/- તેમના વર્તમાન શેરધારકોને રાઈટ બેસીસ આારે ફાળવેલા છે.
- (બ) તા. ૦૮-૦૩-૨૦૨૨ ના રોજ બોલાવેલ નિયામક મંડળની બેઠકમાં સરક્યુલેશન દ્વારા પસાર કરેલ સામાન્ય ઠરાવથી રૂા. ૧૦ ના એવા ૧૨,૬૦,૦૦,૦૦૦ ઈક્વીટી શેર્સ એકંદરે કુલ ૧૨૬,૦૦,૦૦,૦૦૦/- તેમના વર્તમાન શેરધારકોને રાઈટ બેસીસ આારે ફાળવેલા છે.

તારીખ: ૨૦-૦૭-૨૦૨૨
સ્થળ : ગાંધીનગર

કે. કે. પટેલ એન્ડ એસોસીએટસ

સહી/-
સીએસ કિરન કુમાર પટેલ
પ્રોપરાઈટર
સભ્ય નં. ૬૩૮૪, સી. પી. નં. ૬૩૫૨
યુડીન : એફ૦૦૬૩૮૪સી૦૦૦૬૫૫૧૫૩

‘પરિશિષ્ટ - અ’

પ્રતિ,

સભ્યો,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમિટેડ,

બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉદ્યોગ ભવન,

સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧.

અમારો આજ તારીખનો અહેવાલ આ પત્ર સાથે વાંચવો.

- (૧) સેક્ટેરીયલ રેકોર્ડની જાળવણીએ કંપનીના મેનેજમેન્ટની જવાબદારી છે. અમારા ઓડિટના આધારે આ સચવાયેલ રેકોર્ડ પર અભિપ્રાય વ્યક્ત કરવાની જવાબદારી અમારી છે.
- (૨) અમોએ એવી ઓડિટ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ અનુસરી છે કે જે સેક્ટેરીયલ રેકર્ડમાં સમાવિષ્ટ બાબતોના ખરાપણા અંગે વ્યાજબી ખાતરી મળી શકે તે માટે યોગ્ય હોય. સેક્ટેરીયલ રેકર્ડમાં સાચી વિગતો પ્રતિબિંબિત થઈ છે. ચકાસણીના આધારે અમો માનીએ છીએ કે અમોએ જે પ્રક્રિયા અને પદ્ધતિઓ અનુસરી છે, તે અમારા અભિપ્રાય માટે વ્યાજબી અધાર પૂરો પાડે છે.
- (૩) અમોએ નાણાકીય રેકોર્ડ અને હિસાબી ચોપડાઓની ચોકસાઈ અને યોગ્યતા ચકાસ્યા નથી.
- (૪) કંપનીના અને અન્ય કાયદાઓ, નિયમો, રેગ્યુલેશન્સ, ધોરણોની પૂર્તતા કરવાની જવાબદારી વહીવટની છે. અમારી તપાસ ફક્ત કાર્યપ્રણાલિની ચકાસણી સુધી સીમિત હતી.
- (૫) સેક્ટેરીયલ ઓડિટ અહેવાલની ભાવિ સદ્ધરતા અંગે અથવા તેના કામકાજનું સંચાલન કેટલી કાર્યક્ષમતા કે અસરકારકતાથી કર્યું છે તે અંગે ખાતરી આપતું નથી.

તારીખ: ૨૦-૦૭-૨૦૨૨

સ્થળ : ગાંધીનગર

કે. કે. પટેલ એન્ડ એસોસીએટ્સ

સહી/-

સીએસ કિરન કુમાર પટેલ

પ્રોપરાઈટર

સભ્ય નં. ૬૩૮૪, સી. પી. નં. ૬૩૫૨

એનેક્ષર - ૧

પ્રિન્સીપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડીટ) - ૨, ગુજરાતની કચેરી

નં. એએમજી-૧ / એકાઉન્ટસ / બીઆરસીએલ / ૨૦૨૧-૨૨ / ઓડબલ્યુ૭૦૬ / ૦૮.૦૮.૨૦૨૨

પ્રતિ,

મેનેજિંગ ડિરેક્ટર,

બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડ,

૭ મો માળ, બ્લોક નં. ૬, ઉદ્યોગ ભવન,

સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧.

વિષય:- કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) હેઠળ ૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિતના બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડના નાણાંકીય પત્રકો પર કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની ટીપ્પણીઓ.

સાહેબશ્રી,

આ સાથે ૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) હેઠળનું બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડની નાણાંકીય પત્રકોને લગત ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલની ટીપ્પણીઓ બાબતે નીલ કમેન્ટ પ્રમાણપત્ર કંપનીના વાર્ષિક સામાન્ય બેઠકમાં રજુઆત સારું સામેલ રાખેલ છે.

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) અન્વયે કંપની દ્વારા ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલની ટીપ્પણીઓ દરેક વ્યક્તિઓને મોકલવી જરૂરી છે કે જેઓને કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૬ (૧) મુજબ ઓડીટેડ નાણાંકીય પત્રકો મોકલવામાં આવે છે, અને તેજ સમયે તે રીપોર્ટને કંપનીના સ્ટેચ્યુટરી ઓડીટર રીપોર્ટમાં દર્શાવેલ હોય તેજ પ્રમાણે તેને કંપનીના વાર્ષિક સામાન્ય બેઠકમાં પણ પ્રસ્તુત કરવું જરૂરી છે. ભારતના કમ્પ્ટ્રોલર એન ઓડીટર જનરલના એહવાલને વાર્ષિક સામાન્ય બેઠકમાં રજુ કરતી તારીખ ઓફિસમાં અગાઉથી જાણ કરવી જરૂરી છે.

છાપેલા હિસાબોની છ નકલો ઓફિસમાં કામકાજ અને રેકોર્ડ માટે મોકલવી જરૂરી છે.

આ પત્ર અને તેના સલગ્ન જોડાણો મળ્યા બાબતે જરૂરી રસીદ આપવા વિનંતી છે.

આપનો વિશ્વાસુ

સીનીયર ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ (એએમજી-૧)

બીડાણ:- ઉપર મુજબ

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) અન્વયે ૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડના નાણાંકીય પત્રકો અન્વયે ભારતના કંમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટીપ્પણીઓ

કંપની ધારા, ૨૦૧૩ અન્વયે ૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત નાણાકીય સિંધાતો મુજબ બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડના નાણાંકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી કંપનીના મેનેજમેન્ટની છે. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા નિયુક્ત કરેલ સ્ટેચ્યુટરી ઓડિટરોએ તે ધારાની કલમ ૧૩૯ (૫) અને કલમ ૧૪૩ મુજબ આ નાણાંકીય પત્રકો પર તેઓનો સ્વતંત્ર અભિપ્રાય આપવો જરૂરી છે અને તેનો આધાર તે ધારાની કલમ ૧૪૩ (૧૦) માં દર્શાવેલ ઓડિટીંગના સિંધાતો મુજબ થવી જોઈએ. તેઓએ દ્વારા તેમ કરવામાં આવેલ છે તેવું તેઓના ઓડિટ રીપોર્ટ તારીખ ૨૦ મી જુલાઈ, ૨૦૨૨ થી સ્પષ્ટ કરેલ છે.

અમોએ ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના વતી તે ધારાની કલમ ૧૪૩ (૬) (એ) મુજબ ૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડના નાણાંકીય પત્રકોનું સપ્લીમેન્ટ્રી ઓડિટ કરેલ છે. આ સપ્લીમેન્ટ્રી ઓડિટ સ્વતંત્ર રીતે સ્ટેચ્યુટરી ઓડિટરોના કામકાજના કાગળો ધ્યાને લીધા સીવાય આપેલ છે અને ફક્ત સ્ટેચ્યુટરી ઓડિટરોની તપાસ અને કંપની કર્મચારીઓના અને અમુક હિસાબી રેકર્ડની ચકાસણી પર આધારિત છે.

અમારા ઓડિટ મુજબ કોઈ એવી બાબત માલુમ પડેલ નથી કે જેથી સ્ટેચ્યુટરી ઓડિટરના રીપોર્ટ પર કોઈ ટીપ્પણી કરી શકાય કે કોઈ સપ્લીમેન્ટ કરી શકાય.

તેમના દ્વારા અને તેમના વતી

ભારતના કંમ્પ્ટ્રોલર એન ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા

સ્થળ:- અમદાવાદ

તારીખ:-૦૯-૦૯-૨૦૨૨

સહી/-

(એચ. કે. ધર્માદર્શી)

પ્રિન્સીપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ - ૨), ગુજરાત

સ્વતંત્ર ઓડીટરોનો અહેવાલ

પ્રતિ

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના

સભ્યોને

નાણાંકીય પત્રકો પર અહેવાલ

અભિપ્રાય:-

અમોએ ૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડના (કંપનીના) બેલેન્સ શીટની ચકાસણી કરેલ છે અને તેમાં વર્ષ અંતિત નફા અને નુકશાનના પત્રકો (જેમાં કોમ્પ્રીહેન્સીવ આવકનો સમાવેશ થાય છે), વર્ષ અંતિતના કેશ ફ્લોના પત્રકો, વર્ષ અંતિતના ઈન્વીટીમાં ફેરફારના પત્રકો અને નાણાકિય પત્રકોના નોંધોનો સમાવેશ થાય છે અને તે ઉપરાંત તેમાં અગત્યના હિસાબી પધ્ધતિઓ અને અન્ય સમજણોનો સમાવેશ થાય છે (જેઓને હવે પછી “નાણાકીય પત્રકો” તરીકે ઉલ્લેખવામાં આવશે).

અમારા મત અનુસાર અને અમને આપવામાં આવેલ માહિતી અને સમજણ અનુસાર ઉપર જણાવેલ નાણાકીય પત્રકો કંપની ધારા, ૨૦૧૩ અને તેમા (ધારામાં) સમય સમય પર થયેલ સુધારાના જરૂરી કલમો અનુસારની માહિતી આપે છે અને તે એક સાચો અને ખરો ચિત્ર દર્શાવે છે કે જે ભારતમાં ચાલતી હિસાબી પધ્ધતિઓ અનુસાર છે અને તેમાં ઈન્ડ એએસનો સમાવેશ થાય છે અને ૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત કંપનીની સ્થિતી દર્શાવે છે અને કંપનીની નાણાકિય કામગીરી કે જેમાં અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક અને કેશ ફ્લો અને વર્ષના અંતે રહેલ ઈકવીટીમાં ફેરફાર દર્શાવે છે.

અભિપ્રાયનો આધાર:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૧૦) માં દર્શાવેલ ઓડીટીંગની પધ્ધતિ (એસએ) મુજબ અમોએ ઓડીટ કરેલ છે. તે પધ્ધતિ અનુસારની અમારી જવાબદારીઓને અમારા રીપોર્ટમાં દર્શાવેલ ઓડીટના નાણાકીય પત્રકોમાં ઓડીટરની જવાબદારીઓમાં વધુ સારી રીતે દર્શાવેલ છે. અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના કોડ ઓફ એથીક્સમાં દર્શાવ્યા મુજબ કંપનીથી સ્વતંત્ર છીએ અને અમારા એથીકલ જવાબદારીઓ અનુસાર કે જે અમારા દ્વારા કરવામાં આવેલ નાણાકીય પત્રકોના ઓડીટ ને લગત છે તેનું પાલન અમોએ કંપની ધારા, ૨૦૧૩ મુજબ કરેલ છે અને તેના નીયમોનું પાલન કરેલ છે અને કોડ ઓફ એથીક્સ મુજબની તમામ એથીકલ જવાબદારીઓ પૂર્ણ કરેલ છે. અમો માનીયે છીએ કે જે ઓડીટને લગત

પૂરાવાઓ અમોને પ્રાપ્ત થયેલ છે તે અમારા નાણાંકીય પત્રકોને લગત અમારા દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય માટે બરોબર છે.

નાણાંકીય પત્રકો માટે મેનેજમેન્ટની અને તેના વહીવટકર્તાઓની જવાબદારીઓ:-

કંપની ધારા, ૨૦૧૩ (ધારા) ની કલમ ૧૩૪ (પ) માં દર્શાવેલ બાબતેની જવાબદારી કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરોની છે કે તે તૈયાર કરવામાં આવેલ નાણાંકીય પત્રકો કે જે નાણાંકીય સ્થિતિ, નાણાંકીય કામગીરી અને કંપનીના કેશ ફ્લોનો સાચો ચિત્ર દર્શાવે છે તે ભારતમાં ચાલતા હિસાબી સિધ્ધાંતોને અનુરૂપ હોવો જોઈએ અને તેમાં ભારતીય હિસાબી પદ્ધતિ (ઈન્ડ એએસ) કે જે તે ધારાની કલમ ૧૩૩, કે જે કંપનીઝ (ભારતીય એકાઉન્ટીંગ સ્ટેન્ડર્ડ્સ) નીયમો, ૨૦૧૫ માં દર્શાવેલ છે.

જવાબદારીઓમાં જરૂરી હિસાબી રેકોર્ડની જાળવણી કે જે ધારાના પ્રાવધાન મુજબ હોવી જોઈએ કે જેથી કંપનીના મીલકતોની સુરક્ષા જળવાઈ રહે અને ગેરરીતી અને છેતરપીંડીને અટકાવી શકાય, જરૂરી હિસાબી પદ્ધતિઓનું અમલીકરણ કરી શકાય, તેવા નિર્ણયો કરી શકાય કે જે વ્યાજબી અને બરોબર હોય અને જરૂરી આંતરીક નાણાંકીય નિયંત્રણો લાગુ કરી શકાય તે માટે જરૂરી વ્યવસ્થા તૈયાર કરી તેનું અમલીકરણ કરી શકાય અને નાણાંકીય રેકોર્ડોની ચોકસાઈ અને પૂર્ણતા પણ જાળવી શકાય અને સાચા અને ખરા નાણાંકીય ચિત્રની પ્રાપ્તિ માટે નાણાંકીય પત્રકો તૈયાર કરી શકાય જેથી ભુલ કે છેતરપીંડીથી ખોટા પત્રકો તૈયાર કરવામાં ન આવે.

નાણાકીય નિવેદનો તૈયાર કરતી વખતે મેનેજમેન્ટ કંપનીની સાતત્યતાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે જવાબદાર છે. જ્યાં સુધી મેનેજમેન્ટ કંપનીનું વિનિમય અથવા બંધ કરવાનો ઈરાદો ન રાખે કે જ્યાં સુધી કંપનીની સાતત્યતાને લગતા, પરિબળો જેવા કે દાર્શનિકતા, સાતત્યતાને લગતા પરિબળો તથા લાગુ પડતી બાબતોનું ધ્યાન રાખવું પડે.

કંપનીના નાણાંકીય પ્રગતિની વિગતોની ચકાસવાની જવાબદારીઓ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરોની રહેલ છે.

નાણાંકીય પત્રકોના ઓડીટ બાબતે ઓડીટરની જવાબદારી:-

અમરો ઉદ્દેશ્ય એ છે કે તે બાબતે ખાતરી કરવી કે નાણાંકીય પત્રકોમાં ઉચાપત કે ભૂલને કારણે કોઈ મટીરીયલ મીસમેચથી મુક્ત છે કે કેમ વ્યાજબી ખાત્રી એક ઉચ્ચ સ્તરની ખાત્રી છે, પરંતુ તે એ બાબતની ખાત્રી નથી કે એસએ મુજબ કરવામાં આવેલ ઓડીટ હંમેશા રહેલ મટીરીયલ ગેરરીતીને હંમેશા ઓળખી બતાવે. ખોટી રજુઆતો અને ઉચાપતો કે ભુલ જો કોઈ થયેલ હોય તો તેને ધ્યાને લીધેલ છે અને વ્યક્તિગત રીતે કે એગ્રીગેટમાં નાણાંકીય સ્ટેટમેન્ટ ઉપર યુઝર દ્વારા લેવામાં આવેલ નાણાંકીય નિર્ણયો પરની અસરને પણ ધ્યાને લીધેલ છે.

એસએ મુજબના ઓડીટના ભાગરૂપે, અમોએ પ્રોફેશનલ જજમેન્ટ રાખેલ છે અને ઓડીટમાં પ્રોફેશનલ સ્કેપટીસમ પણ રાખેલ છે. ઉપરાંત અમોએ:-

- નાણાકીય પત્રકોમાં રહેલ મટીરીયલ મીસસ્ટેટમેન્ટને ઓળખી તેની ચકાસણી કરેલ છે કે જે કોઈ પણ ગેરરીતી કે ભૂલ,

ડીઝાઈનને કારણે થયેલ હોય અને ખતરાઓને લગત ઓડીટ પધ્ધતિઓનું પાલન કરેલ છે અને અમારા અભિપ્રાય માટે જરૂરી ઓડીટ પૂરાવાઓ પ્રાપ્ત કરેલ છે અને તે અમારા અભિપ્રાયનો આધાર છે. કોઈ પણ છેતરપીંડીને કારણે થયેલ મટીરીયલ મીસસ્ટેટમેન્ટને ઓળખવામાં રહેલ ખતરો એક ભુલના પરીણામે થયેલ ખતરા કરતા વધારે છે, કારણ કે છેતરપીંડીમાં મીલીભગત, ફોર્જરી, જાણી જોઈને કરવામાં આવેલ ઓમીશન, ખોટી રજુઆતો કે આંતરીક નિયંત્રણના ઓવર રાઈડનો સમાવેશ થાય છે.

- આંતરીક નિયંત્રણને લગત સમજણ પ્રાપ્ત કરેલ છે કે જેની મદદથી પરીસ્થિતી અનુસાર ઓડીટ પધ્ધતિઓ તૈયાર કરી શકાય. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩(૩)(આઈ) મુજબ અમારી જવાબદારી છે કે અમો તેવો અભિપ્રાય આપીએ કે શું કંપની પાસે જરૂરી આંતરીક નાણાંકીય નિયંત્રણ વ્યવસ્થા રહેલ છે અને તેની કામગીરી આવી વ્યવસ્થાને અનુરૂપ છે.
- ઉપયોગમાં લેવામાં આવેલ હિસાબી પધ્ધતિઓના વ્યાજબીપણાને ચકાસવી અને હિસાબ અંદાજોની યોગ્યતા ચકાસવી અને મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલ ખુલાસાની ચકાસણી કરવી.
- ગોઈંગ કન્સર્નના આધારે મેનેજમેન્ટના દ્વારા કરવામાં આવેલ તેના ઉપયોગને ચકાસવી અને ઓડીટના પૂરાવાના આધારે ઈવેન્ટ અને કંન્ડીશનોને લગત મટીરીયલ અનિશ્ચિતા રહેલ છે કે કેમ તે ચકાસવી કે જે કંપીનના ચાલુ રહેવાની ક્ષમતા પર અસર કરી શકે. જો અમોને તેમ જણાઈ આવે કે મટીરીયલ અનિશ્ચિતા રહેલ છે તો નાણાંકીય પત્રકોના અમારા ઓડીટ રીપોર્ટમાં અમારે તે બાબતે ધ્યાન દોરવાની રહે અને જો આવા ખુલાસાઓ બરોબર ન હોય તો અમારા અભિપ્રાયમાં પરીવર્તન લાવવું. પરંતુ, ભવિષ્યની પરીસ્થિતીઓ અને સંજોગોને કારણે કંપની ચાલુ ન પણ રહી શકે.
- અમોએ નાણાંકીય પત્રકોને લગત તમામ પ્રેઝન્ટેશન, સ્ટ્રક્ચર અને વિગતોને ચકાસેલ છે અને તેમા ખૂલાસાઓને સમાવેશ થાય છે કે જેમાં નાણાંકીય પત્રકો લેવડ દેવડો દર્શાવતી હોય અને એક સાચો પ્રેઝન્ટેશન દર્શાવે છે.

વહિવટ કરનાર વ્યક્તિઓનો અમોએ સંપર્ક કરેલ છે અને તેમની પાસે અન્ય બાબતો ઉપરાંત ઓડીટમાં પ્રાપ્ત થયેલ વિગતો બાબતે ચર્ચા કરેલ છે અને તેમાં આંતરીક નિયંત્રણમાં રહેલ ખામીઓ કે જે અમારા ઓડીટમાં જણાઈ આવેલ છે તેની પણ ચર્ચા કરેલ છે.

તેના ઉપરાંત વહીવટમાં રહેલ વ્યક્તિઓને અમોએ એવો પત્રક આપેલ છે કે અમોએ અમારી એથીકલ જરૂરીયાતો કે જે સ્વતંત્રતાને લગત છે તેનું પાલન કરેલ છે અને તેઓને તમામ સંબંધો બાબતે અને અન્ય બાબતે માહિતી આપેલ છે કે જે અમારા ઓડીટની સ્વતંત્રતા ને લગત અને તેના સેફગાર્ડને લગત છે.

વહીવટમાં રહેલ વ્યક્તિઓને આપેલ બાબતોમાં અમોએ નાણાંકીય પત્રકોને લગત સૌથી વધારે અગત્ય બાબતો નક્કી કરેલ છે કે જે હાલના સમયગાળાને લગત છે અને ખાસ ઓડીટ બાબતોને લગત છે. અમારા ઓડીટ રીપોર્ટમાં તમામ બાબતો દર્શાવેલ છે સીવાય કે જાહેરમાં જાહેર કરવાને લગત બાબતો કે જે રોજબરોજની ન હોય અને અમારા દ્વારા કઈ બાબતો રીપોર્ટમાં

દર્શાવવાની છે તે નક્કી કરવામાં આવેલ છે કારણે કે જો તેમ ન કરવામાં આવે તો તેના વિપરીત પરીણામો આવી શકે અને તેના કારણે જાહેર હિત પર ખોટી અસર થઈ શકે.

અન્ય કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાતો પરનો અહેવાલ:-

૧. કંપનીની (ઓડીટર અહેવાલ) ઓર્ડર, ૨૦૨૦ (ધી ઓર્ડર) મુજબની કંપનીની જરૂરીયાતો કે જે ભારત સરકાર દ્વારા ધારાની કલમ ૧૪૩ ની પેટા કલમ (૧૧) મુજબ છે તેના અનુસંધાને અમો “એનેક્સર - એ” આપીયે છીએ કે જે ઓર્ડર મુજબ એક સ્ટેટમેન્ટ છે અને તે ફકરા ૩ અને ૪ માં દર્શાવેલ છે.
૨. ધારાની કલમ ૧૪૩ (૫) મુજબ અમોએ “એનેક્સર સી” આપેલ છે કે જે તે ધારા અનુસાર કોમ્પ્રોલર અને ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલ નિર્દેશોને અનુસાર છે.
- ૩) ધારાની કલમ ૧૪૩ (૩) મુજબ અમો જણાવીએ છીએ કે:-
 - એ) અમારી જરૂરીયાત પ્રમાણે અમોએ ઓડીટને લગતી તમામ માહિતી અને સ્પષ્ટીકરણો પ્રાપ્ત કરેલ છે કે જે અમારા સંપૂર્ણ જ્ઞાન અને માન્યતા અનુસાર ઉપર જણાવેલ નાણાંકીય પત્રકોના અમારા ઓડીટ માટે જરૂરી છે.
 - બી) અમારા મત પ્રમાણે ચોપડાઓની ચકાસણીથી જણાઈ આવેલ છે કે કંપની દ્વારા હાલના કાયદા પ્રમાણે હિસાબોના ચાપડાઓ ખરી રીતે બનાવવામાં આવેલ છે.
 - સી) આ રીપોર્ટને લગતા બેલેન્સ શીટ, નફા નુકશાનના પત્રકો કે જેમાં અન્ય કોમ્પ્રીહેન્સીવ આવકના પત્રકોનો સમાવેશ થાય છે અને ઈકવીટીમાં ફેરફારના પત્રકો અને કેશ ફ્લોના પત્રકો કે જે આ અહેવાલને લગત છે તે હિસાબી ચોપડા પ્રમાણે બનાવવામાં આવેલ છે કે જે આ નાણાંકીય પત્રકો માટે જરૂરી છે.
 - ડી) અમારા મત પ્રમાણે, ઉપર જણાવેલ નાણાકિય પત્રકોની જાળવણી કરતી વખતે ભારતીય હિસાબી ધોરણો (ઈન્ડ એએસ) કે જે ધારાની કલમ ૧૩૩ અને કંપની (ઈન્ડિયન એકાઉન્ટીંગ સ્ટેન્ડર્ડ્સ) નિયમ, ૨૦૧૫ અને તેમાં સમય સમયમાં થયેલ ફેરફારોના પ્રાવધાનોનું પાલન કરવામાં આવેલ છે.
 - ઈ) આ કંપની એક સરકારી કંપની હોવાથી માનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના તારીખ ૫ મી જુન, ૨૦૧૫ ના ઠરાવ નં. જી.એસ.આર.૪૬૩ (ઈ) મુજબ કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૬૪ નુ પેટા કલમ ૨ લાગુ પડતી નથી.
 - એફ) અમારા કંપનીના નાણાંકીય અહેવાલને લગત આંતરીક નાણાકીય નિયંત્રણની જરૂરીયાત મુજબ અને નિયંત્રણના કાર્યક્ષમતા મુજબની વિગતો અમોએ અલગ અહેવાલથી “એનેક્સર બી” માં રજુ કરેલ છે.
 - જી) કંપની એક સરકારી કંપની હોવાથી માનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના તારીખ ૫ મી જુન, ૨૦૧૫ ના ઠરાવ નં. જી.એસ.આર.૪૬૩ (ઈ) મુજબ કંપની ધારા, ૨૦૧૩ નં કલમ ૧૮૭ નુ પેટા કલમ ૧૬ લગુ પડતી નથી.

એચ) ઓડીટર અહેવાલની અન્ય બાબતો કે જે કંપનીઝ (ઓડીટ એન્ડ ઓડીટર્સ) નિયમ, ૨૦૧૪ ના નીયમ ૧૧ ને લગત છે તે વિષે જણાવવાનું કે અમારી માહિતી અને અમારા અભિપ્રાય અનુસાર અને તેના અનુસંધાને મળેલ સ્પષ્ટીકરણ મુજબની વિગત નીચે પ્રમાણે છે.

- ૧) તા. ૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતીતના બેલન્સ શીટમાં કોઈ પ્રકારના દાવાઓ બાકી રહેલ નથી.
- ૨) કંપનીએ લાબા સમયના કરાર કે જેમાં ડેરીવેટીવ કરારોનો સમાવેશ થાય છે તેના અનુસંધાને હાલના નિયમો અને ભારતીય હિસાબી પદ્ધતિઓ મુજબ જરૂરી પ્રાવધાનો કરેલ છે.
- ૩) કંપની દ્વારા ઈન્વેસ્ટર એડ્યુકેશન અને પ્રોટેક્શન ફંડમાં નાણા ટ્રાન્સફર કરવામાં કે ટ્રાન્સફર કરવાની જરૂરીયાતમાં કોઈપણ પ્રકારનો વિલંબ કરેલ નથી.
- ૪ એ) મેનેજમેન્ટે અમોને જણાવેલ છે કે તેઓની પાસે રહેલ માહિતી અને મંતવ્ય અનુસાર કંપની દ્વારા કોઈપણ ભંડોળો લોન તરીકે કે રોકાણ (ઉધાર લીધેલ નાણા કે શેર પ્રીમીયમ કે કોઈ અન્ય પ્રકારના ભંડોળ) આપવામાં આવેલ નથી કે કોઈ પણ વ્યક્તિ અથવા એન્ટીટી જેમા વિદેશી એન્ટીટીનો સમાવેશ થાય છે (“મધ્યસ્થી”) ને કોઈપણ જાતના સમજૂતી લેખીત કે અન્ય કોઈપણ રીતે કરવામાં આવેલ નથી કે જેમાં આવા મધ્યસ્થીઓ
 - સીધી અને આડકતરી રીતે કોઈ પણ અન્ય વ્યક્તિ કે એન્ટીટીમાં ઉધાર કે રોકાણ કોઈ પણ રીતે કંપનીના વતી (“અંતિમ લભાર્થી”) રોકાણ કરશે કે
 - કોઈપણ એવી ગેરેન્ટી, સેક્યુરીટી કે એવી કોઈ પણ કામગીરી અંતિમ લભાર્થી વતી કરશે.
- બી) મેનેજમેન્ટે અમોને જણાવેલ છે કે તેઓની પાસે રહેલ માહિતી અને મંતવ્ય અનુસાર કંપનીને કોઈ પણ વ્યક્તિ અથવા એન્ટીટી જેમા વિદેશી એન્ટીટીનો સમાવેશ થાય છે (“ફંડીટ પાર્ટીઝ”) તેઓ પાસેથી કોઈપણ ભંડોળ માટે કોઈ પણ સમજૂતી કે જે લેખીત અથવા અન્ય કોઈ રીતે કરેલ જેમાં,
 - સીધી અને આડકતરી રીતે કોઈ પણ અન્ય વ્યક્તિ કે એન્ટીટીમાં ઉધાર કે રોકાણ કોઈ પણ રીતે કંપનીના વતી (“અંતિમ લભાર્થી”) રોકાણ કરશે કે
 - કોઈપણ એવી ગેરેન્ટી, સેક્યુરીટી કે એવી કોઈ પણ કામગીરી અંતિમ લભાર્થી વતી કરશે.
- સી) તેઓ ઓડીટ પદ્ધતિઓના આધારે કે જેને બરોબર અને યોગ્ય પરિસ્થિતીમાં કરેલ માની શકાય તેઓ કોઈ પણ બાબત અમારા ધ્યાન પર આવેલ નથી કે જેનાથી અમો એમ માની શકીએ કે ઉપર જણાવેલ પેટા કલમ (એ) અને (બી) મુજબ કોઈ પણ મટીરીયલ મીસ સ્ટેટમેન્ટ રહેલ હોય.
- પ) કંપનીએ વર્ષ દરમ્યાન કોઈ પણ ડીવીડન્ડ જાહેર કરેલ નથી કે ચૂકવેલ નથી અને વર્ષ માટે કોઈપણ આખરી ડીવીડન્ડ સૂચવેલ નથી.

- ૧) કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૨૦૩(૧) અને તેની સાથે કંપનીઝ (મેનેજેરીયલ પર્સનલની નિયુક્તિ અને પગાર) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૮ મુજબ કે જેથી ખાસ મેનેજેરીયલ પર્સનલ (કેએમપી) ની નિયુક્તિ કરવાની થાય છે. કંપનીએ કોઈ પણ કુલ ટાઈમ ક્વોલીફાઈડ કંપની સેક્રેટરીને અહેવાલની તારીખ સુધી નિયુક્ત કરેલ નથી. પરંતુ અમારી માહિતી અનુસાર અને મેનેજમેન્ટ દ્વારા અમોને આપવામાં આવેલ સમજ અનુસાર કંપનીએ પ્રેક્ટીસ કરનાર કંપની સેક્રેટરીની સેવાઓ પ્રાપ્ત કરેલ છે.

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

એફઆરએન : ૧૦૮૪૩૨૩બલ્યુ

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય. નં. ૦૩૬૭૭૬

યુડીઆઈએન : ૨૨૦૩૬૭૭૬એએનજેપીવાયએ૩૬૩૮

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨

સ્વતંત્ર ઓડીટરના અહેવાલને લગત એનેક્ષર - એ

(કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાતોના રીપોર્ટના ફકરા નંબર - ૧ ના અનુસંધાને)

૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિતના નાણાકીય પત્રકો અમારા દ્વારા બહુચરાણુ રેલ કોર્પોરેશન લિમીટેડના સભ્યોને આથી સમર્પિત.

અમો અહેવાલ આપીએ છીએ કે:-

૧. કંપનીની ફીક્સ એસેટના સંદર્ભમાં:

(એ) કંપની પાસે કોઈ ફીક્સ એસેટ રહેલ નથી અને તેથી આ કલમ લાગુ પડતુ નથી.

(બી) કંપની દ્વારા બધા જ રેકોર્ડ સારી રીતે જાળવવામાં આવેલ છે કે જે નાણાંકીય પત્રકોમાં રાઈટ ટુ યુઝ એસેટસની તમામ વિગતો દર્શાવે છે.

(સી) અને (ડી) અમોને આપવામાં આવેલ માહિતી અને સમજણ અનુસાર, હાલના વર્ષમાં કંપની પાસે કોઈપણ અસ્થાયી મીલકત રહેલ નથી અને તેથી આ કલમ કંપનીને લાગુ પડતુ નથી. કંપની દ્વારા અવાસ્તવિક એસેટ કે જે ડેવલોપમેન્ટ હેઠળ રહેલ છે તેની વિગતો દર્શાવતા તમામ રેકોર્ડ રાખેલ છે અને તે નાણાકીય પત્રકોમાં દર્શાવેલ છે.

(ઈ) અમોને આપવામાં આવેલ માહિતી અને સમજણ અનુસાર, કંપની સામે એવી કોઈ પણ કાર્યવાહીઓ કરવામાં આવી નથી કે પડતર નથી કે જે કંપની દ્વારા કોઈ પણ બેનામી પ્રોપર્ટી કે જે બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહીબીશન) ધારા, ૧૯૮૮ (૪૫) ઓફ ૧૯૮૮) કે તેના નીચમો અંતર્ગત છે. આથી આ કલમ કંપનીને લાગુ પડતુ નથી.

૨. ચાલુ નાણાંકીય વર્ષમાં કંપની પાસે કોઈપણ પ્રકારની ઈન્વેન્ટરી નથી અને તેથી આ કલમ લાગુ પડતી નથી.

૩. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ અને અમારા દ્વારા ચાલુ વર્ષે કંપનીના રેકર્ડની ચકાસણી મુજબ કંપનીએ કોઈ પણ રોકાણ કરેલ નથી કે, કોઈ પણ ગેરેન્ટી કે સેક્યુરીટી કે લોન આપેલ નથી કે જે કોઈ પણ લોન કે જે સિક્યોર કે અનસિક્યોર કંપનીને હોય, કે ફર્મને હોઈ કે લિમીટેડ લાયબલીટી પાર્ટનરશીપને લગત હોય કે જે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૯ મુજબ રાખવામાં આવેલ રજીસ્ટરમાં દર્શાવવામાં આવતી હોય. તેથી ફકરા નંબર ૩ ની કલમ (૩) કંપનીને લાગુ પડતુ નથી.

૪. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપનીએ કોઈ પણ લોન આપેલ નથી કે કોઈ પણ ગેરેન્ટી કે સીક્યુરીટી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૫ અને ૧૮૬ મુજબ આપેલ નથી. તેથી ફકરા નંબર ૩ ની કલમ (૪) કંપનીને લાગુ પડતુ નથી.

૫. કંપનીએ આપેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપનીએ કોઈપણ જાતનું નિવેશ કે નાણાં સ્વીકારેલ નથી કે જે હાલના વર્ષમાં રોકાણ તરીકે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલ આદેશો મુજબ માની શકાય અને જે કંપની ધારા,

૨૦૧૩ ની કલમ ૭૩ થી ૭૬ માં દર્શાવેલ છે અને તેથી ફકરા નંબર ૩ ની કલમ (૫) કંપનીને લાગુ પડતુ નથી.

૬. કેન્દ્ર સરકાર દ્વારા કંપની ધારા, ૨૦૧૩ ના કલમ ૧૪૮ ના પેટા કલમ (૧) માં જણાવેલ કોસ્ટ રેકોર્ડની જાળવણી કંપનીને લાગુ પડતુ નથી. આથી ફકરા નંબર ૩ ની કલમ (૬) કંપનીને લાગુ પડતુ નથી.
૭. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ સ્ટેચ્યુટરી લેણાની માહિતી નીચે મુજબ છે:-
 - એ) કંપની અવિવાદીત કાયદાકીય ભરણા ભરવામાં નિયમિત છે જેમાં ઈનકમ ટેક્સ, ગુડ્સ અને સર્વિસ ટેક્સ અને અન્ય મટીરીયલ સ્ટેચ્યુટરી લેણાના સમાવેશ થાય છે કે જે લાગતી વળગતી સત્તાઓને ચુકવવાની થાય છે.
 - બી) કોઈ પણ પ્રકારની ડ્યુટી કે ટેક્સ બાબતે કોઈ પણ રેવન્યુ સત્તા સાથે કોઈ પણ પ્રકારની તકરારો હાલમાં ચાલુ નથી.
 ૮. અમોને આપવામાં આવેલ માહિતી અને સમજણ અનુસાર અને અમારા દ્વારા કંપનીના રેકોર્ડની ચકાસણી કરવાથી જણાઈ આવે છે કે કંપની દ્વારા કોઈ પણ લેવટ દેવડને સરન્ડર કે જાહેર કરવામાં આવેલ નથી કે જે હિસાબી ચોપડામાં અગાઉ આવક તરીકે દર્શાવવામાં આવેલ નથી કે જે ચાલુ વર્ષે ઈન્કમ ટેક્સ ધારા, ૧૯૬૧ ના એસેસમેન્ટમાં આવે છે.
 ૯. (એ) કંપનીએ કોઈ પણ નાણાકીય સંસ્થા, બેન્ક, સરકાર કે ડીબેન્યર ધારક દ્વારા ચાલુ વર્ષે કોઈ પણ લોન કે ઉધાર લીધેલ નથી. આથી ફકરા નંબર ૩ ની કલમ (૯) અત્રે લાગુ પડતુ નથી.
 - (બી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર અને અમારા દ્વારા કંપનીના હિસાબોની ચકાસણી અનુસાર કંપનીને કોઈ પણ બેન્ક કે નાણાંકીય સંસ્થા કે સરકાર કે સરકારી સંસ્થા દ્વારા નાદારી જાહેર કરવામાં આવેલ નથી.
 - (સી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર કંપનીએ હાલના વર્ષમાં કોઈ પણ ટર્મ લોન પ્રાપ્ત કરેલ નથી. તેથી ઓર્ડરની કલમ ૩ (૯) (સી) કંપનીને લાગુ પડતુ નથી.
 - (ડી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર અને કંપનીના બેલેન્સ શીટની ચકાસણી કરવાથી અમો જણાવીએ છીએ કે ટુકા ગાળા માટે લેવામાં આવેલ કોઈ પણ ફંડને લાબા ગાળાની કામગીરી માટે કંપની દ્વારા વાપરવામાં આવેલ નથી.
 - (ઈ) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર અને કંપનીના નાણાંકીય પત્રકોની ચકાસણીથી અમો જણાવીએ છીએ કે કંપનીએ કોઈ પણ દ્વારા કોઈ પણ એન્ટીટી કે વ્યક્તિ પાસેથી તેના સબસીડીરીની જવાબદારી માટે કંપની ધારા, ૨૦૧૩ ની જવાબદારીઓ અનુસાર કોઈ પણ ફંડ લીધેલ નથી. કંપની કોઈ પણ એસોસિયેટ કંપની કે સૈયુક્ત એકમમાં કોઈ પણ પ્રકારનો રોકાણ કરેલ નથી કે જે કંપની ધારા, ૨૦૧૩ મુજબ છે.
 - (એફ) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર અને અમારા દ્વારા કરવામાં આવેલ પદ્ધતિઓ અનુસાર અમો જણાવીએ છીએ કે ચાલુ વર્ષે કંપનીએ કોઈ પણ લોન લીધેલ નથી કે કંપની ધારા, ૨૦૧૩ માં જણાવ્યા મુજબ તેના સબસીડીરીમાં રહેલ સીક્યુરીટીના પ્લેજથી ઉભા કરેલ છે.

૧૦. (એ) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર આ વર્ષે કંપનીએ કોઈ પણ શરૂઆતી પબ્લીક ઓફર કે વધુના પબ્લીક ઓફર (જેમાં ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ) થી કોઈ પણ નાણાં પ્રાપ્ત કરેલ નથી અને વધુમાં કંપનીએ કોઈ પણ પ્રકારની ટર્મ લોન પ્રાપ્ત કરેલ નથી અને તેથી આ કલમ કંપનીને લાગુ પડતુ નથી. પરંતુ કંપનીએ ઈકવીટી શેરોથી પ્રાપ્ત થયેલ નાણાંનો ઉપયોગ કરેલ છે અને તે નાણાં જેના માટે ઉભા કરેલ છે તે જ હેતુ માટે વાપરવામાં આવેલ છે.
- (બી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર અને અમારા દ્વારા કંપનીના રેકોર્ડની ચકાસણીના આધારે કંપનીએ કોઈ પણ પ્રેફરન્શીયલ એલોટમેન્ટ કે શેરોનો કે રૂપાંતરિત ડીબેન્ચરોનો (પૂરેપૂરી કે પાર્શ્વિક કે ઓપશનલી કન્વર્ટેબલ) નો ઉપયોગ આ વર્ષે કરેલ નથી કે જે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૪૨ અને કલમ ૬૨ ને લગત છે. આથી ઓર્ડરની કલમ ૩ (૧૦) (બી) લાગુ પડતુ નથી.
૧૧. (એ) અમારા દ્વારા કંપનીના ચોપડા અને રેકોર્ડની ચકાસણીના આધારે અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણના આધારે કંપની દ્વારા કોઈ પણ છેતરપીડી કે કંપનીના અધિકારીઓ કે તેના કર્મચારીઓ દ્વારા ચાલુ સમયગાળામાં કોઈ પણ જાતની છેતરપીડી નજરે આવેલ નથી.
- (બી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર, ઓડીટરો દ્વારા કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ ના પેટા કલમ (૧૨) મુજબ કોઈ પણ અહેવાલ ફોર્મ એડીટી - ૪ મુજબ કરવામાં આવેલ નથી કે જે કંપનીઝ (ઓડીટ એન્ડ ઓડીટસ) નિયમ, ૨૦૧૪ ના નીયમ ૧૩ માં દર્શાવવામાં આવેલ છે અને જે કેન્દ્ર સરકાર સાથેના સુધારા મુજબ છે.
- (સી) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કોઈ પણ જાતની વ્હિસલ બ્લોઅર ફરીયાદ કંપનીને વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલ નથી.
૧૨. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપની એક નીધી કંપની નથી. તેથી ઓર્ડરની કલમ ૩ (૧૨) લાગુ પડતુ નથી.
૧૩. અમારા મતે અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૮ અને ૧૭૭ નું જે સ્થાને લાગુ પડે ત્યાં કંપની પાલન કરે છે. લાગતા વળગતા પાર્ટીઓના તમામ લેવડદેવડ અને પક્ષકારોના લેવડદેવડની વિગતો નાણાંકીય પત્રકોમાં દર્શાવેલ છે કે જે ભારતીય હિસાબી પદ્ધતિમાં દર્શાવેલ છે.
૧૪. (એ) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ અને અમારી ઓડીટ પદ્ધતિ મુજબ અમારા મતે કંપની પાસે તેની સાઈઝ અને ધંધાના પ્રકાર મુજબ એક આંતરીક ઓડીટ સીસ્ટમ રહેલ છે.
- (બી) અમારા દ્વારા ઓડીટના સમયગાળા માટે કંપનીના આંતરીક ઓડીટ રીપોર્ટને ચકાસેલ છે.
૧૫. અમારા મત અનુસાર અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ આ સમયગાળા દરમિયાન કંપનીએ તેના કોઈ પણ નિયામક કે તેઓ સાથે જોડાયેલ વ્યક્તિઓ સાથે કોઈ પણ બીન રોકડ લેવડ દેવડ કરેલ નથી.

૧૬. (એ અને બી) કંપનીએ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૪ ની કલમ ૪૫ - આઈ એ મુજબ નોંધણી કરવાવવાની જરૂરીયાત રહેલ નથી. તેથી ઓર્ડરની કલમ ૩ (૧૬) (એ) અને (બી) અત્રે લાગુ પડતુ નથી.
- (સી અને ડી) રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ કંપની એક કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની (સીઆઈસી) નથી. તેથી ઓર્ડરની કલમ ૩ (૧૬) (સી) અને (ડી) અત્રેને લાગુ પડતુ નથી.
૧૭. કંપનીએ ચાલુ સાલે કે આગળના નાણાકીય વર્ષમાં કોઈ પણ કેશ લોસનો સામનો કરવો પડેલ નથી.
૧૮. આ સમયગાળા દરમ્યાન કોઈ પણ સેટ્યુટરી ઓડીટરોએ રાજીનામુ આપેલ નથી.
૧૯. નાણાકીય રેશીઓ, એજીગ અને નાણાકીય એસેટોના રીયલાઈઝેશનની તારીખ અને નાણાકીય જવાબદારીઓના ચુકવણા અને નાણાકીય પત્રકો સાથેની અન્ય માહિતી અને નિયામક મંડળના પ્લાનો અને મેનેજમેન્ટ અનુસાર અમારો એવો મત છે કે ઓડીટ રીપોર્ટની તારીખે મટીરીયલ અનીશ્ચિતા ઓડીટ રીપોર્ટની તારીખે રહેલ નથી, અને કંપની તેની જવાબદારીઓ પૂરી કરી શકે છે કે જે બેલેન્સ શીટની તારીખે રહેલ છે અને બેલેન્સ શીટની તારીખથી એક વર્ષમાં જ્યારે પણ તે સામે આવે.
૨૦. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા અનુસાર વપરાયા સીવાયની જે રકમ કંપની ધારાના શેડ્યુલ ૭ માં દર્શાવેલ ફંડમાં ટ્રાન્સફર કરવાના હોય છે કે જે આ ધારાની કલમ ૧ ઉપ ના પેટા કલમ (૫) ના બીજા પ્રોવીઝોમાં દર્શાવેલ છે તે કંપનીને લાગુ પડતુ નથી. તેથી ઓર્ડરની કલમ ૩ (૨૦) (એ) અને ૩ (૨૦) (બી) લાગુ પડતુ નથી.
૨૧. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપની પાસે કોઈપણ એસોસિયેટ કે જોઈન્ટ વેન્યર કંપની નથી. તેથી ઓર્ડરના ફકરા નંબર ૩ ની કલમ (૨૧) કંપનીને લાગુ પડતુ નથી.

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

એફઆરએન : ૧૦૯૪૩૨૩બલ્યુ

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય નં. ૦૩૬૭૭૬

યુડીઆઈએન : ૨૨૦૩૬૭૭૬એએનજેપીવાયએ૩૬૩૮

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨

સ્વતંત્ર ઓડીટર્સના અહેવાલને લગત એનેક્ષર - બી

(અહેવાલના અન્ય કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાત વિભાગમાં ફકરા નંબર ૩ (એફ) માં દર્શાવેલ છે કે જે અમારા અહેવાલની તારીખ મુજબ છે.)

નાણાકીય અહેવાલ ઉપર આંતરીક નાણાકીય નિયંત્રણો પરનો અહેવાલ

આંતરીક નાણાકીય નિયંત્રણો પરનો અહેવાલ કે જે કંપની ધારા, ૨૦૧૩ (તે ધારા) ની કલમ ૧૪૩ ના પેટા કલમ ૩ ના કલોઝ (૧) નીચે આવે છે.

અમોએ ૩૧ મી માર્ચ, ૨૦૨૨ મુજબ બહુચરાજી રેલ કોર્પોરેશન લીમીટેડ (તે કંપની) ના નાણાકીય પત્રકો ઉપરના આંતરીક નાણાકીય નિયંત્રણની ચકાસણી કરેલ છે અને તે અમારા નાણાકીય પત્રકો પરના અમારા ઓડીટ મુજબ છે કે જે વર્ષના અંતેની તારીખે છે.

આંતરીક નાણાકીય નિયંત્રણો માટે મેનેજમેન્ટની જવાબદારી:-

આંતરીક નાણાકીય નિયંત્રણ જાળવવાની જવાબદારી કંપનીના મેનેજમેન્ટની છે અને તેનો આધાર કંપનીના ફાઈનાન્શીયલ રીપોર્ટીંગ કાઈટેરીનું આંતરીક નિયંત્રણ છે જે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયા (આઈસીએઆઈ) દ્વારા જારી કરવામાં આવેલ ઓડીટ ઓફ ઈન્ટરનલ ફાઈનાન્શીયલ કંટ્રોલ ઓવર નાણાકીય રીપોર્ટીંગના ગાઈડન્સ નોટમાં દર્શાવવામાં આવેલ છે. આ જવાબદારીઓમાં ડીઝાઈન, અમલીકરણ અને આંતરીક નાણાકીય નીયંત્રણોની જાળવણીનો સમાવેશ થાય છે કે જેથી ધંધો સારી અને સમયબધ્ધ રીતે ચાલી શકે, કંપનીની નિતીઓનું પાલન થાય, તેના હેતુઓ સચવાય, ઉચાપત અને ભુલોને અટકાવી શકાય અને ઓળખી શકાય, હિસાબી રેકોર્ડને બરાબર અને સંપૂર્ણ રીતે જાળવી શકાય અને કંપની ધારા, ૨૦૧૩ અંતરગત જરૂરી નાણાકીય માહિતી સમયસર તૈયાર કરી શકાય તેવી બાબતોનો સમાવેશ થાય છે

ઓડીટરોની જવાબદારી:-

અમારી જવાબદારી અમારા ઓડીટના આધારે કંપનીના આંતરીક નાણાકીય નિયંત્રણો દ્વારા કંપનીના નાણાકીય અહેવાલ બાબતે અભિપ્રાય આપવાનો છે. અમોએ અમારૂં ઓડીટ નાણાકીય અહેવાલ (ધી ગાઈડ નોટ) પર આંતરીક નાણાકીય નિયંત્રણના ગાઈડન્સ નોટના આધારે અને કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૧૦) કે જે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયા દ્વારા જારી કરેલ સ્ટેન્ડર્ડ ઓન ઓડીટીંગ પર આધારિત છે કે જેથી આંતરીક નાણાકીય નિયંત્રણો પર અંકુશ રાખી શકાય. આ સ્ટેન્ડર્ડ અને ગાઈડન્સ નોટ મુજબ અમોએ એથીકલ જરૂયાતોનું પાલન કરવું પડે અને ઓડીટ તે રીતે કરવું પડે કે જેથી તે સાબીત થાય કે નાણાકીય અહેવાલ પર આંતરીક નાણાકીય નિયંત્રણો લાગુ કરવામાં આવેલ છે અને તે જાળવવામાં આવેલ છે અને તે મટીરીયલ સંદર્ભમાં સારી રીતે લાગુ કરવામાં આવેલ છે.

અમારા ઓડીટમાં તેની પ્રક્રિયા સામેલ છે કે જેથી અમો નાણાંકીય અહેવાલ અને તેની અસરકારકતા ઉપર આંતરીક નાણાંકીય નિયંત્રણ વ્યવસ્થાની કામગીરી જાણી શકાય.

અમારા ઓડીટમાં એવી પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવેલ છે કે જેથી નાણાંકીય અહેવાલ પર આંતરીક નાણાંકીય નિયંત્રણો લાગુ કરવામાં આવેલ છે તે બાબતે ઓડીટમાં સાબીતી પ્રાપ્ત કરી શકાય. અમારા ઓડીટમાં નાણાંકીય અહેવાલ પર થયેલ આંતરીક નાણાંકીય નિયંત્રણો અને મેટીરીયલ રીસ્કની ચકાસણી અને એસેસ રીસ્ક પર ડીઝાઈનનું ટેસ્ટીંગ અને ઈવેલ્યુએશનની અસર વગેરે સામેલ છે. લાગુ કરવામાં આવેલ પ્રક્રિયા ઓડીટરના જજમેન્ટ પર આધારિત છે જેમાં નાણાંકીય અહેવાલ પર મેટીરીયલ મીસસ્ટેટમેન્ટનો પણ સમાવેશ થાય છે કે જે છેપરપીડી કે ભુલના કારણે હોય શકે.

અમો માનીએ છીએ કે અમારા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ ઓડીટની વિગતો કંપનીના નાણાંકીય અહેવાલ પર રહેલ આંતરીક નાણાંકીય નિયંત્રણો બાબતે ઓડીટ અભિપ્રાય પ્રાપ્ત કરવા માટે યોગ્ય અને બરાબર છે.

નાણાંકીય અહેવાલ પર આંતરીક નાણાંકીય નિયંત્રણનું અર્થ:-

કંપનીનું નાણાંકીય અહેવાલ પરનું આંતરીક નાણાંકીય નિયંત્રણ તે પ્રક્રિયા છે કે જેથી નાણાંકીય અહેવાલ બાબતે ખાત્રી પ્રાપ્ત કરી શકાય અને હિસાબી નીતીઓ મુજબ એક્ષટરનલ કામગીરી માટે નાણાંકીય પત્રકો તૈયાર કરી શકાય. એક કંપનીના નાણાંકીય અહેવાલ પરના આંતરીક નાણાંકીય નિયંત્રણમાં તે નિતીઓ અને પદ્ધતિઓનો સમાવેશ થાય છે કે:-

- (૧) રેકોર્ડની જાળવણી કરવા સારૂ કે જે વિગતવાર, ચોકસાઈથી અને યોગ્ય રીતે કંપનીની મિલકતોના વ્યવહારોને દર્શાવી શકે,
- (૨) એવી ખાત્રી આપી શકે કે નાણાંકીય પત્રકો માટેના લેવડ દેવડ કરવા માટે માન્યતાપ્રાપ્ત હિસાબી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવેલ છે અને કંપનીના રસીદો અને ખર્ચાઓ કંપનીના મેનેજમેન્ટ અને નિયામકોના મજુરી મુજબ કરવામાં આવેલ છે,
- (૩) એવી ખાત્રી પ્રાપ્ત કરી શકાય કે કોઈ ગેરકાયદેસર એકવેઝીશન કે કંપનીના એસેટનું ખોટી રીતે ઉપયોગ કે જે નાણાંકીય પત્રક પર અસર કરી શકે તેની સમયસર માહિતી પ્રાપ્ત કરી શકાય.

નાણાંકીય અહેવાલ પર આંતરીક નાણાંકીય નિયંત્રણની મર્યાદાઓ:-

નાણાંકીય અહેવાલ પર આંતરીક નાણાંકીય નિયંત્રણની મર્યાદાઓ સિમિત હોવાથી, કે જેમાં કોલ્યુશનની કે ખોટા મેનેમેન્ટની સંભાવના રહેલ હોવાથી ભૂલ કે ગેરરીતીથી થયેલ મેટીરીયલ મીસસ્ટેટમેન્ટને ઓળખી ન શકાય. વધુમાં ભવિષ્યના સમયગાળા માટેના નાણાંકીય અહેવાલ પરના આંતરીક નાણાંકીય નિયંત્રણોના વિશલેષણમાં તે ખતરો રહેલ છે કે પરીસ્થિતિમાં ફેરફારથી કે અન્ય કારણોથી તેનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકાય નહીં.

અભિપ્રાય:-

અમારા મતે ને અમારી પાસે રહેલ માહિતી અને અમોને આપવામાં આવેલ સ્પષ્ટતા મુજબ કંપની પાસે તમામ મેટીરીયલ સંદર્ભમાં, નાણાંકીય અહેવાલ પર આંતરીક નાણાંકીય નિયંત્રણ છે અને નાણાંકીય અહેવાલ પર આવા આંતરીક નાણાંકીય નિયંત્રણો ૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ સુધી અમલમાં છે અને કંપની દ્વારા નાણાંકીય અહેવાલ પર મુકવામાં આવેલ આંતરીક

નિયંત્રણના આધારે અને આંતરીક નિયંત્રણના જરૂરી કોમ્પોનેન્ટસના આધારે તેમ કહી શકાય કે તે ઈન્સ્ટીટ્યુટર ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયાના ઓડીટ ઓફ ઈન્ટરનલ ફાઇનાન્શીયલ કંટ્રોલ ઓવર નાણાકીય અહેવાલના માર્ગદર્શક નોંધ મુજબ છે.

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

એફઆરએન : ૧૦૮૪૩૨૩બલ્યુ

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય. નં. ૦૩૬૭૭૬

યુડીઆઈએન : ૨૨૦૩૬૭૭૬એએનજેપીવાયએ૩૬૩૮

સ્વતંત્ર ઓડીટર્સના અહેવાલને લગત એનેક્ષર - સી

પ્રતિ,
સભ્યો,

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ (તે કંપની) ના નાણાંકીય પત્રકો ઉપરના સ્વતંત્ર ઓડીટર અહેવાલ કે જે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (પ) મુજબ વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨ માટે લાગુ કરવામાં આવેલ છે તે નીચે મુજબ છે.

ભાગ - ૧

નાણાંકીય વર્ષ ૨૦૨૧ - ૨૨ માટે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩(પ) મુજબનો અહેવાલ.

૧. મુખ્ય સુચનો

ક્રમ નં.	માર્ગદર્શન	પ્રત્યોત્તર
૧.	શુ કંપની એવી કોઈ પ્રક્રિયા અમલમાં રાખેલ છે કે જેથી કે તમામ હિસાબીય લેવડ દેવડ આઈટી પ્રક્રિયાથી થઈ શકે ? જો ના, તો આઈટી પ્રક્રિયા સિવાય કરવામાં આવેલ હિસાબી લેવડ દેવડ અને અન્ય કામગીરી અને તેની હિસાબો પર અસર અને તેની નાણાકીય અસરો જો કોઈ હોય તો તે દર્શાવવો.	હા, કંપને તમામ નાણાકીય લેવડ દેવડ માટે આઈટી સીસ્ટમ અમલમાં લાવેલ છે. તેથી હિસાબોની ગુણવત્તા પર કોઈ નાણાકીય અસર રહેલ નથી.
૨.	શુ કોઈ લેન્ડર દ્વારા કંપની દ્વારા લોન ન ભરવાના કારણે કોઈ ચાલુ લોન પર રીસ્ટ્રક્ચરીંગ કરવામાં આવેલ છે કે ડેબ્ટસ / લોન / વ્યાજ વિગેરેના કોઈ વેવર / રાઈટઓફ ના કિસ્સા બનેલ છે ? જો હા તો તેની નાણાકીય અસરો દર્શાવો.	ઓડીટના સમય દરમ્યાન કંપનીએ કોઈ વેવર / રાઈટ ઓફ કરેલ નથી.
૩.	શું કેન્દ્રીય / રાજ્ય એજન્સી તરફથી કોઈ ખાસ સ્કીમ માટે મળેલ / મળવા પાત્ર ભંડોળનો હિસાબ પ્રમાણે / તેની શરતો અને નિયમો મુજબ વાપરવામાં આવેલ છે. જે તેમ ન કરવામાં આવેલ હોય તો તેની યાદી.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપનીને કોઈ પણ ખાસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર / રાજ્ય એજન્સીઓ પાસેથી કોઈ નાણાં મળેલ નથી સીવાય કે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ પાસેથી પ્રાપ્ત થયેલ શેર કેપીટલની રકમ અને તેનો હિસાબ બરાબર રાખવામાં આવેલ છે અને તે બેન્ક ખાતામાં જમા કરવામાં આવેલ છે.

૨. શાખાને લગત સૂચનો : માળખાકીય શાખાઓ:-

ક્રમ નં.	પેટા માર્ગદર્શન	પ્રત્યોત્તર
૧.	કંપની પાસે રહેલ જમીન પર દબાણ ન થાય તે માટે કંપની તરફથી યોગ્ય પગલાઓ લેવામાં આવેલ છે કે કેમ. શુ કંપનીના કોઈ જમીન પર દબાણ થયેલ છે કે તે દાવા અંતર્ગત છે કે તેનો ઉપયોગ કરવામાં આવેલ નથી કે તેને સર્પલ્સ જાહેર કરવામાં આવેલ છે. વિગતો આપવી.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ પ્રમાણે ઓડીટના સમયગાળામાં અમારા જાણ પર આવેલ કે કંપની પાસે કોઈ પણ પ્રકારની જમીન રહેલ નથી. તેથી અધિગ્રહણનો કોઈ પણ સવાલ રહેતો નથી.
૨.	શુ સરકારના સૂચનો / નીતીઓ મુજબ પબ્લીક પ્રાઈવેટ ભાગીદારી મુજબ કોઈ પણ પ્રોજેક્ટનું વેગ માટે ઓળખાણ કરવામાં આવેલ છે. જો કોઈ ફેરબદલી હોય તો જણાવો.	લાગુ પડતી નથી.
૩.	શુ કોઈ ચાલુ કરાર કે જેમાં કામગીરીના લક્ષ્યાંકો દર્શાવેલ છે તેમા ભાવ વધારા કે અન્ય કારણોસર કોઈ રેવન્યુ / નુકશાન કરારોના કારણે થયેલ છે અને શુ તે ચોપડાઓમાં બરોબર દર્શાવવામાં આવેલ છે.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ અમો નીચે મુજબ જણાવીએ છે કે:- ૧. કામગીરીના અમલીકરણની ચકાસણી માટેની વ્યવસ્થા:- એ) કંપનીએ તેઓના પહેલા બોર્ડ મીટીંગમાં કે જે ૦૮/૦૧/૨૦૧૯ ના રોજ થયેલ છે તેમાં ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (જી - રાઈડ) ને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ (પીએમસી) તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે અને આ પીએમસી માટેનો કરાર તા.૨૮/૦૮/૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ છે. બ) આથી કંપનીએ પ્રોજેક્ટની કામગીરીની ચકાસણી માટે સચોટ વ્યવસ્થા કરેલ છે કે જેમાં જી - રાઈડ સેવાઓ આપે છે કે જે પીએમસી કરારના ફકરા નંબર ૧.૧ માં જણાવેલ છે અને તેમાં કંપનીના પ્રોજેક્ટની ચકાસણીની વ્યવસ્થા કરેલ છે. ૨. એગ્રીમેન્ટ લક્ષ્યાંકની સ્થિતિ:- એ) કંપનીએ ઈપીસી કોન્ટ્રાક્ટ કલ્પતરુ પાવર ટ્રાન્સમીશન લીમીટેડ (કેપીટીએલ) ને સોંપેલ છે કે જે કોટાસણ રોડ - બહુચરાજી (૨૬.૬ કિ મી)

		<p>ના ફેઝ ૧ માટે છે અને આ પ્રોજેટક માટેનો લક્ષ્યાક (એમએસ) નીચે મુજબ છે, અને તેને એક પત્રથી લંબાવવામાં આવેલ છે અને તેનો ક્રમાંક:- જી - રાઈટ/ટ્રાન્સેક્શન એડવાઈઝર / ૨૦૧૯-૨૦ / ૦૩૮ / ૨૭૨૯ તારીખ ૧૮/૦૧/૨૦૨૨ છે જે કેપીટીએલને મીનીસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, ડીપાર્ટમેન્ટ ઓફ રેવેન્યુ, પ્રોક્યોરમેન્ટ પોલીસી વિભાગ દ્વારા કેપીટીએલને પાઠવવામાં આવેલ છે:-</p> <table border="1"> <thead> <tr> <th>ક્રમ</th> <th>માઈલસ્ટોન</th> <th>કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ</th> <th>રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ</th> <th>ટીપ્પણીઓ</th> </tr> </thead> <tbody> <tr> <td>૧</td> <td>એમએસ - ૧</td> <td>૧૯-૦૮-૨૦૨૦</td> <td>૧૪-૦૨-૨૦૨૧</td> <td>લક્ષ્યાંક ડીસેમ્બર - ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલ છે.</td> </tr> <tr> <td>૨</td> <td>એમએસ - ૨</td> <td>૧૯-૦૬-૨૦૨૧</td> <td>૧૯-૦૪-૨૦૨૨</td> <td>લક્ષ્યાંક ફેબ્રુઆરી - ૨૦૨૨ ના રોજ પ્રાપ્ત થયેલ છે.</td> </tr> <tr> <td>૩</td> <td>એમએસ - ૩</td> <td>૧૯-૧૦-૨૦૨૧</td> <td>૧૯-૦૪-૨૦૨૨</td> <td>લક્ષ્યાંક રીપોર્ટની તારીખ સુધી પ્રાપ્ત થયેલ નથી.</td> </tr> <tr> <td>૪</td> <td>એમએસ - ૪</td> <td>૧૯-૦૨-૨૦૨૨</td> <td>૧૯-૦૮-૨૦૨૨</td> <td>-</td> </tr> </tbody> </table>	ક્રમ	માઈલસ્ટોન	કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ	રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ	ટીપ્પણીઓ	૧	એમએસ - ૧	૧૯-૦૮-૨૦૨૦	૧૪-૦૨-૨૦૨૧	લક્ષ્યાંક ડીસેમ્બર - ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલ છે.	૨	એમએસ - ૨	૧૯-૦૬-૨૦૨૧	૧૯-૦૪-૨૦૨૨	લક્ષ્યાંક ફેબ્રુઆરી - ૨૦૨૨ ના રોજ પ્રાપ્ત થયેલ છે.	૩	એમએસ - ૩	૧૯-૧૦-૨૦૨૧	૧૯-૦૪-૨૦૨૨	લક્ષ્યાંક રીપોર્ટની તારીખ સુધી પ્રાપ્ત થયેલ નથી.	૪	એમએસ - ૪	૧૯-૦૨-૨૦૨૨	૧૯-૦૮-૨૦૨૨	-
ક્રમ	માઈલસ્ટોન	કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ	રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ	ટીપ્પણીઓ																							
૧	એમએસ - ૧	૧૯-૦૮-૨૦૨૦	૧૪-૦૨-૨૦૨૧	લક્ષ્યાંક ડીસેમ્બર - ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલ છે.																							
૨	એમએસ - ૨	૧૯-૦૬-૨૦૨૧	૧૯-૦૪-૨૦૨૨	લક્ષ્યાંક ફેબ્રુઆરી - ૨૦૨૨ ના રોજ પ્રાપ્ત થયેલ છે.																							
૩	એમએસ - ૩	૧૯-૧૦-૨૦૨૧	૧૯-૦૪-૨૦૨૨	લક્ષ્યાંક રીપોર્ટની તારીખ સુધી પ્રાપ્ત થયેલ નથી.																							
૪	એમએસ - ૪	૧૯-૦૨-૨૦૨૨	૧૯-૦૮-૨૦૨૨	-																							
		<p>બી) કંપનીએ ઈપીસી કોન્ટ્રાક્ટ અશોકા બીલ્ડકોન લીમિટેડ (એબીએલ) ને સોંપેલ છે કે જે બહુચરાજી-રાનુજ (૩૮.૧૫૩કિમી) ના ફેઝ ૨ માટે છે અને આ પ્રોજેટક માટેનો લક્ષ્યાક (એમએસ) નીચે મુજબ છે:-</p> <table border="1"> <thead> <tr> <th>ક્રમ</th> <th>માઈલસ્ટોન</th> <th>કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ</th> <th>રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ</th> <th>ટીપ્પણીઓ</th> </tr> </thead> <tbody> <tr> <td>૧</td> <td>એમએસ - ૧</td> <td>૩૧-૦૮-૨૦૨૨</td> <td>-</td> <td>-</td> </tr> <tr> <td>૨</td> <td>એમએસ - ૨</td> <td>૨૮-૦૨-૨૦૨૩</td> <td>-</td> <td>-</td> </tr> <tr> <td>૩</td> <td>એમએસ - ૩</td> <td>૩૦-૦૭-૨૦૨૩</td> <td>-</td> <td>-</td> </tr> <tr> <td>૪</td> <td>એમએસ - ૪</td> <td>૩૦-૧૧-૨૦૨૩</td> <td>-</td> <td>-</td> </tr> </tbody> </table> <p>૩. ખર્ચમાં ભાવવધારાની અસરો:- અહેવાલના વર્ષ દરમ્યાન ઈપીસી કોન્ટ્રાક્ટર દ્વારા હિસાબી ચોપડામાં કલેઈમ કરવામાં આવેલ હોય તે</p>	ક્રમ	માઈલસ્ટોન	કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ	રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ	ટીપ્પણીઓ	૧	એમએસ - ૧	૩૧-૦૮-૨૦૨૨	-	-	૨	એમએસ - ૨	૨૮-૦૨-૨૦૨૩	-	-	૩	એમએસ - ૩	૩૦-૦૭-૨૦૨૩	-	-	૪	એમએસ - ૪	૩૦-૧૧-૨૦૨૩	-	-
ક્રમ	માઈલસ્ટોન	કરાર પ્રમાણે કાર્ય પૂર્ણ કરવાની તારીખ	રીવાઈજ થયેલ પુરુ થનાર તારીખ	ટીપ્પણીઓ																							
૧	એમએસ - ૧	૩૧-૦૮-૨૦૨૨	-	-																							
૨	એમએસ - ૨	૨૮-૦૨-૨૦૨૩	-	-																							
૩	એમએસ - ૩	૩૦-૦૭-૨૦૨૩	-	-																							
૪	એમએસ - ૪	૩૦-૧૧-૨૦૨૩	-	-																							

		માટેના એસ્કેલેશન રકમનું પ્રાવધાન રાખેલ છે, કે જે કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ મુજબ છે અને તે લાગતા વળગતા સત્તાઓ દ્વારા મંજૂર કરવામાં આવેલ હોય તે મુજબ છે.
૪.	શુ કોઈ કોઈ ખાસ સ્કીમ માટે કેન્દ્ર / રાજ્ય સરકાર પાસેથી મળેલ / મળવા પાત્ર ભંડોળનું બરાબર હિસાબ રાખવામાં આવેલ છે / ઉપયોગ કરવામાં આવેલ છે. જો ન કરવામાં આવેલ હોય તો તેની વિગતો.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપની દ્વારા કોઈ ખાસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર / રાજ્ય એજન્સીઓ પાસેથી કોઈ નાણાં પ્રાપ્ત થયેલ નથી સીવાય કે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પાસેથી પ્રાપ્ત થયેલ શેર કેપીટલની રકમ અને તેનું હિસાબ સારી રીતે રાખવામાં આવેલ છે અને તેને બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે.
૫.	શુ આ સમયગાળામાં કોઈ બેંક ગેરેન્ટી રીવેલીડેટ કરવામાં આવેલ છે.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ ચાલુ સાલે કંપની દ્વારા કોઈ બેંક ગેરેન્ટી સુવિધાનો ઉપયોગ કરવામાં આવેલ નથી અને તેથી આ મુદ્દો લાગુ પડતો નથી.
૬.	ટ્રેડ રીસીવેબલ, ટ્રેડ પેયેબલ, ટર્મ ડીપોઝીટ, બેંક ખાતાઓ અને પ્રાપ્ત થયેલ રોકડના બેલેન્સના કંફર્મેશન પર ટીપ્પણીઓ.	અમોને નીચે મુજબના કંફર્મેશન પ્રાપ્ત થયેલ છે અને તે નાણાંકીય પત્રકોના આંકડાઓને અનુરૂપ છે. ૧) યસ બેન્ક અને યુનીયન બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી બેન્ક બેલેન્સ પ્રમાણપત્ર. ૨) જીએસએફએસ પાસેના ડીપોઝીટ માટે બેલેન્સ અને ઈન્ટરેસ્ટ પ્રમાણપત્ર. ૩) ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ લીમિટેડ પાસેથી બેલેન્સ કંફર્મેશન. ૪) મોબીલાઈઝેશન એડવાન્સ અને યુકવવાપાત્ર ટ્રેડ પરના બેલેન્સ અને ઈન્ટરેસ્ટ કે જે ઈપીસી કોન્ટ્રાક્ટર (મેસર્સ કલ્પતરુ પાવર ટ્રાન્સમીશન લીમિટેડ અને મેસર્સ અશોકા બીલ્ડકોન લીમિટેડ) ૫) મેનેજમેન્ટ પાસેથી તારીખ ૩૧/૦૩/૨૦૨૨ નો કેશ બેલેન્સ. ૬) બેલેન્સ શીટની તારીખે ટ્રેડ રીસીવેબલ (મેસર્સ માડ્ડતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડ) માંથી બેલેન્સ પ્રમાણપત્ર.

૭.	એબોન્ડન કરવામાં આવેલ પ્રોજેક્ટ માટે થયેલ ખર્ચા અને ખરેખર રાઈટ ઓફ કરવામાં આવેલ રકમ દર્શાવો.	અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કોઈ પણ પ્રોજેક્ટ એબોન્ડન કરવામાં આવેલ નથી. તેથી આ કલમ લાગુ પડતી નથી.
----	--	--

શાહ એન્ડ દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

એફઆરએન : ૧૦૯૪૩૨૬બલ્યુ

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨

સહી/-

મલય દલાલ

ભાગીદાર

સભ્ય. નં. ૦૩૬૭૭૬

યુડીઆઈએન : ૨૨૦૩૬૭૭૬એએનજેપીવાયએ૩૬૩૮

બહુચરાત્રુ રેલ કોર્પોરેશન લિમીટેડ (જી - રાઈડ, જીઆઈડીસી અને એમએસઆઈએલ નો સૈયુક્ત સાહસ) સીઆઈએન:- યુ૪૫૧૦૧જી૪૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨ ૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત બેલેન્સ શીટ			
(રકમ રૂ.માં)			
વિગત	નોંધ નંબર	૩૧-૩-૨૦૨૨ ના રોજ	૩૧-૩-૨૦૨૧ ના રોજ
મિલકતો			
નોન કરન્ટ એસેટ			
રાઈટ ટુ યુઝ એસેટ - લીઝહોલ્ડ ઓફીસ	૪	૬૮ ૬૮ ૭૪૯	-
ચાલુ મુડી કામ	૫	૬ ૧૨ ૦૪ ૮૭૫	૮ ૧૭ ૨૩૫
વિકાસ હેઠળનો ઈન્ટેન્જેબલ એસેટ	૬	૨૨૭ ૫૧ ૬૫ ૮૬૦	૬૫ ૩૭ ૩૩ ૮૭૯
અન્ય નોન - કરન્ટ એસેટ	૭	૪૪ ૯૭ ૮૦ ૦૯૬	૨૯ ૮૨ ૯૩ ૦૭૯
કરન્ટ ટેક્સ એસેટ (નેટ)	૧૧	૮૯ ૮૮ ૪૮૮	-
કુલ નોન કરન્ટ એસેટ		૨૮૦ ૨૦ ૦૮ ૧૬૮	૯૫ ૨૮ ૪૪ ૨૬૩
કરન્ટ એસેટ			
નાણાંકીય એસેટ			
(૧) મળવાપાત્ર લેણા	૮	૧૩ ૬૭ ૯૯ ૧૯૬	-
(૨) રોકડ અને રોકડને સમાન્તર	૯	૮ ૧૫ ૭૫ ૨૨૭	૫ ૩૩ ૬૧ ૬૧૮
(૩) બેન્ક સાથેની અન્ય સિલક	૧૦	૨૩૧ ૪૩ ૪૯ ૮૪૭	૯૬ ૦૦ ૦૦ ૦૦૦
અન્ય કરન્ટ એસેટ	૧૩	૮૨ ૨૭ ૧૯૫	૧ ૦૧ ૬૯ ૪૨૪
કુલ કરન્ટ એસેટ		૨૫૪ ૦૯ ૫૧ ૫૬૫	૧૦૨ ૩૫ ૩૧ ૦૪૨
કુલ એસેટ		૫૩૪ ૨૯ ૫૯ ૭૩૩	૧૯૭ ૬૩ ૭૫ ૩૩૫
ઈકવીટી અને જવાબદારીઓ			
ઈકવીટી			
ઈકવીટી શેર ભંડોળ	૧૪	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦
અન્ય ઈકવીટી	૧૫	(૩ ૦૪ ૧૫ ૦૩૦)	(૩ ૫૬ ૯૮ ૬૧૪)
કુલ ઈકવીટી		૪૯૩ ૮૭ ૫૬ ૯૭૦	૧૮૮ ૮૦ ૫૧ ૩૮૬
જવાબદારીઓ			
નોન કરન્ટ જવાબદારીઓ			
નાણાંકીય જવાબદારીઓ			
(૧) અન્ય નાણાકીય જવાબદારીઓ	૧૬	૭ ૯૯ ૦૪ ૮૨૯	૨ ૪૮ ૨૯ ૦૬૮
કુલ નોન કરન્ટ જવાબદારીઓ		૭ ૯૯ ૦૪ ૮૨૯	૨ ૪૮ ૨૯ ૦૬૮

વિગત	નોંધ નંબર	૩૧-૩-૨૦૨૨ ના રોજ	૩૧-૩-૨૦૨૧ ના રોજ
કરન્ટ જવાબદારીઓ			
નાણાંકીય જવાબદારીઓ			
(૧) ચૂકવવાપાત્ર ટ્રેડ	૧૭		
એમએસએમઈ		-	૨ ૩૦ ૯૨૬
અન્ય		૧૫ ૯૫ ૨૫૦	-
તકરારી ઉધાર - એમએસએમઈ		-	-
તકરારી ઉધાર - અન્ય		-	-
(૨) અન્ય નાણાંકીય જવાબદારીઓ	૧૮	૧૩ ૧૨ ૬૨૫	-
પ્રોવીઝન	૧૯	૩૦ ૨૪ ૪૯ ૪૫૫	૫ ૩૪ ૦૧ ૦૧૬
અન્ય કરન્ટ જવાબદારીઓ	૨૦	૧ ૮૯ ૪૦ ૬૦૪	૭૮ ૬૫ ૫૮૮
કરન્ટ ટેક્સ જવાબદારીઓ (નેટ)	૨૧	-	૧૯ ૯૭ ૩૫૨
કુલ કરન્ટ જવાબદારીઓ		૩૨ ૪૨ ૯૭ ૯૩૪	૬ ૩૪ ૯૪ ૮૮૨
કુલ ઇકવીટી અને જવાબદારીઓ		૫૩૪ ૨૯ ૫૯ ૭૩૩	૧૯૭ ૬૩ ૭૫ ૩૩૫
ખાસ હિસાબી પદ્ધતિઓ			
જુઓ નાણાકીય પત્રકો સાથેની નોંધો	૧ થી ૪૫		
હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આતરીક ભાગ છે. સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે			
શાહ અને દલાલ વતી	નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા		
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ			
એફઆરએન ૧૦૯૪૩૨૩બલ્યુ			
સહી/- મલય દલાલ ભાગીદાર, સભ્ય નં.૦૩૬૭૭૬	સહી/- એસ.એન.જોષી સીએફઓ	સહી/- જવલેશ ઝવેરી નિયામક ડીઆઈએન: ૦૯૫૦૭૨૨૪	સહી/- સંતોષ કુમાર નિયામક અને સીઈઓ ડીઆઈએન : ૦૭૮૫૪૧૭૯
સ્થળ:- અમદાવાદ તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨	સ્થળ:- ગાંધીનગર તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨		

<p align="center">બહુચરાણ રેલ કોર્પોરેશન લિમીટેડ (જી - રાઈડ, જીઆઈડીસી અને એમએસઆઈએલ નો સૈયુક્ત સાહસ) સીઆઈએન:- યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨ ૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ પુરા પતા વર્ષનું નફા - નુકશાનનું પત્રક (રકમ રૂ.માં)</p>			
વિગત	નોંધ નંબર	૦૧-૦૪-૨૦૨૧ થી ૩૧-૩-૨૦૨૨ ના સમયગાળા માટે	૦૧-૦૪-૨૦૨૦ થી ૩૧-૩-૨૦૨૧ ના સમયગાળા માટે
આવક			
કામગીરીમાંથી આવક	૨૨	૪૩ ૯૨ ૪૫ ૫૩૬	-
અન્ય આવક	૨૩	૩ ૫૯ ૭૪ ૯૫૬	૧ ૯૭ ૭૯ ૨૩૨
કુલ આવક		૪૭ ૫૨ ૨૦ ૪૯૨	૧ ૯૭ ૭૯ ૨૩૨
ખર્ચાઓ			
વપરાયેલ મટીરીયલની કિંમત	૨૪	૪૪ ૨૦ ૪૭ ૩૪૯	-
કર્મચારીઓનો ખર્ચ, કોન્ટ્રાક્ટરોને અને કન્સલ્ટન્ટને ચુકવણું	૨૫	૩૦ ૯૫ ૮૦૬	૮ ૨૯ ૩૩૬
નાણાકીય કિંમત	૨૬	૩ ૫૦ ૫૩૨	-
ઘસારો અને અમોરાઈઝેશન ખર્ચ	૨૭	૭ ૬૩ ૧૯૪	-
અન્ય ખર્ચાઓ	૨૮	૧ ૪૩ ૭૩ ૮૧૧	૧ ૧૯ ૪૮ ૫૨૨
કુલ ખર્ચા		૪૬ ૦૬ ૩૦ ૬૯૨	૧ ૨૭ ૭૭ ૮૫૮
અસામન્ય બાબત અને વેરાઓ પહેલાનો નફા / (નુકશાન)		૧ ૪૫ ૮૯ ૮૦૦	૭૦ ૦૧ ૩૭૪
અસામન્ય બાબત (કરવેરા બાદ)		-	-
વેરા પહેલા નફો / (નુકશાન)		૧ ૪૫ ૮૯ ૮૦૦	૭૦ ૦૧ ૩૭૪
કરવેરા ખર્ચ			
ચાલુ વર્ષનો વેરો	૧૨	૯૨ ૨૮ ૭૬૮	૫૫ ૦૨ ૫૮૨
ગત વર્ષનો વેરો		૭૭ ૪૪૮	-
ડીફર થયેલ વેરો	-	-	-
કુલ વેરા ખર્ચ		૯૩ ૦૬ ૨૧૬	૫૫ ૦૨ ૫૮૨
વર્ષ દરમિયાન વેરા પછીનો નફો / (નુકશાન)		૫૨ ૮૩ ૫૮૪	૧૪ ૯૯ ૭૯૨

વિગત	નોંધ નંબર	૦૧-૦૪-૨૦૨૧ થી ૩૧-૩-૨૦૨૨ ના સમયગાળા માટે	૦૧-૦૪-૨૦૨૦ થી ૩૧-૩-૨૦૨૧ ના સમયગાળા માટે
અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક			
(૧) તેવી વસ્તુઓ કે જેને નફા અને નુકશાનમાં રીકલાસીફાઈ કરવામાં આવેલ નથી.		-	-
(૨) નફા અને નુકશાનમાં રીકલાસીફાઈ ન કરવામાં આવેલ હોય તેવી વસ્તુઓને લગત આવક વેરો		-	-
(૩) નફા અને નુકશાનમાં રીકલાસીફાઈ થયેલ વસ્તુઓ		-	-
(૪) નફા અને નુકશાનમાં રીકલાસીફાઈ કરવામાં આવેલ વસ્તુઓ ને લગત આવક વેરો.		-	-
વર્ષ માટે કુલ કોમ્પ્રીહેન્સીવ આવક / (નુકશાન) (કરવેરા બાદ)		-	-
વર્ષ દરમિયાન કુલ કોમ્પ્રીહેન્સીવ આવક		<u>૫૨ ૮૩ ૫૮૪</u>	<u>૧૪ ૯૮ ૭૯૨</u>
રૂ. ૧૦ પ્રતિ ઈકવીટી શેરના ફેસ વેલ્યુ	૨૯		
ધરાવતા ઈકવીટી શેર દીઠની આવક			
પાયાની		૦.૦૨	૦.૦૨
ડાયલ્યુટેડ		૦.૦૨	૦.૦૨
ખાસ હિસાબી પદ્ધતિઆ			
જુઓ નાણાકીય પત્રકો સાથેની નોંધો	૧ થી ૪૫		
હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આતરીક ભાગ છે. સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે			
શાહ અને દલાલ વતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એફઆરએન ૧૦૯૪૩૨૩બલ્યુ	નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા		
સહી/- મલય દલાલ ભાગીદાર, સભ્ય નં.૦૩૬૭૭૬	સહી/- એસ.એન.જોષી સીએફઓ	સહી/- જવલેશ ઝવેરી નિયામક ડીઆઈએન: ૦૯૫૦૭૨૨૪	સહી/- સંતોષ કુમાર નિયામક અને સીઈઓ ડીઆઈએન : ૦૭૮૫૪૧૭૯
સ્થળ:- અમદાવાદ તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨	સ્થળ:- ગાંધીનગર તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨		

બહુચરાણુ રેલ કોર્પોરેશન લિમીટેડ

(જી - રાઈડ, જીઆઈડીસી અને એમએસઆઈએલ નો સૈયુક્ત સાહસ)

સીઆઈએન:- યુ૪૫૧૦૧જી૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨

૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજનું ઈકવીટીમાં ફેરફારનું પત્રક

(રકમ રૂ.માં)

એ. ઈકવીટી શેર કેપીટલ	
૧ લી એપ્રિલ, ૨૦૨૦ અંતિત	૧ ૦૦ ૦૦ ૦૦૦
વર્ષ ૨૦૨૦ - ૨૧ માં થયેલ ફેરફારો	૧૯૧ ૩૭ ૫૦ ૦૦૦
૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિત	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦
વર્ષ ૨૦૨૧ - ૨૨ માં થયેલ ફેરફારો	૩૦૪ ૫૪ ૨૨ ૦૦૦
૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦
બી. અન્ય ઈકવીટી	
રીટેઈન થયેલ આવક	
૧ લી એપ્રિલ, ૨૦૨૦ અંતિત	(૩ ૭૧ ૯૭ ૪૦૬)
વર્ષ ૨૦૨૦ - ૨૧ નો નફા / (નુકશાન)	૧૪ ૯૮ ૭૯૨
અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક	-
કુલ કોમ્પ્રીહેન્સીવ આવક	૧૪ ૯૮ ૭૯૨
૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિત સિલક	(૩ ૫૬ ૯૮ ૬૧૪)
વર્ષ ૨૦૨૧ - ૨૨ નો નફા / (નુકશાન)	૫૨ ૮૩ ૫૮૪
અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક	-
કુલ કોમ્પ્રીહેન્સીવ આવક	૫૨ ૮૩ ૫૮૪
૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત સિલક	(૩ ૦૪ ૧૫ ૦૩૦)

જુઓ નાણાંકીય પત્રકો સાથેની નોંધો

સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

શાહ અને દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

એફઆરએન ૧૦૯૪૩૨૩બલ્યુ

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

સહી/-

મલય દલાલ

(ભાગીદાર,

સભ્ય નં. ૦૩૬૭૭૬

સહી/-

એસ. એન. જોષી

સીએફઓ

સહી/-

જવલેશ ઝવેરી

નિયામક

ડીઆઈએન: ૦૯૫૦૭૨૨૪

સહી/-

સંતોષ કુમાર

નિયામક અને સીઈઓ

ડીઆઈએન : ૦૭૮૫૪૧૭૯

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨

સ્થળ:- ગાંધીનગર

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨

<p align="center">બહુચરાત્રુ રેલ કોર્પોરેશન લિમીટેડ (જી - રાઈડ, જીઆઈડીસી અને એમએસઆઈએલ નો સંયુક્ત સાહસ) સીઆઈએન:- યુ૪૫૧૦૧જીજે૨૦૧૮એસજીસી૧૦૫૬૦૨ ૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત કેશ ફ્લોનો પત્રક (રકમ રૂ.માં)</p>		
વિગત	૦૧-૦૪-૨૦૨૧ થી ૩૧-૩-૨૦૨૨ ના સમયગાળા માટે	૦૧-૦૪-૨૦૨૦ થી ૩૧-૩-૨૦૨૧ના સમયગાળા માટે
૧. ઓપરેટીંગ કામગીરીમાંથી કેશ ફ્લો		
નફા ભુકશાનના પત્રક મુજબ વેરા પહેલા નફા/(ભુકશાન)	૧ ૪૫ ૮૮ ૮૦૦	૭૦ ૦૧ ૩૭૪
એટજેસ્ટ કરેલ:-		
વ્યાજનો આવક	(૩ ૫૮ ૫૬ ૩૧૨)	(૧ ૮૪ ૩૨ ૧૫૨)
નાણાકીય ખર્ચ	-	-
વર્કીંગ કેપીટલમાં ફેરફાર પહેલા ઓપરેટીંગ નફો/(ભુકશાન)	(૨ ૧૨ ૬૬ ૫૧૨)	(૧ ૨૪ ૩૦ ૭૭૮)
વર્કીંગ કેપીટલના મુવમેન્ટ માટે એટજેસ્ટમેન્ટ:-		
મળવાપાત્ર ટ્રેડમાં (વધારો)/ઘટાડો	(૧૩ ૬૭ ૮૮ ૧૮૬)	-
નાણાકીય એસેટમાં (વધારો)/ઘટાડો	(૧૩૫ ૪૩ ૪૮ ૮૪૭)	(૮૬ ૦૦ ૦૦ ૦૦૦)
અન્ય કરન્ટ એસેટમાં (વધારો)/ઘટાડો	૧ ૦૧ ૬૬ ૦૪૮	-
કરન્ટ ટેક્સ એસેટમાં (વધારો)/ઘટાડો	(૮૮ ૮૮ ૪૮૮)	-
ચૂકવવા પાત્ર ટ્રેડમાં વધારો/(ઘટાડો)	(૨ ૩૦ ૮૨૬)	(૧ ૮૦ ૩૭ ૪૭૭)
પ્રવીઝનમાં વધારો/(ઘટાડો)	૪૭ ૮૫ ૧૮૫	(૭ ૦૩ ૮૧૦)
અન્ય કરન્ટ જવાબદારીઓમાં વધારો/(ઘટાડો)	૧ ૧૦ ૭૫ ૦૧૬	૭૭ ૭૯ ૨૦૭
અન્ય નાણાકીય જવાબદારીઓમાં વધારો/(ઘટાડો)	૧૩ ૧૨ ૬૨૫	-
કરન્ટ વેરાની જવાબદારીઓમાં વધારો/(ઘટાડો)	(૧૮ ૮૭ ૩૫૨)	૧૮ ૮૭ ૩૫૨
વર્કીંગ કેપીટલમાં ફેરફારો બાદનો ઓપરેટીંગ પ્રોફીટ	(૧૪૭ ૫૦ ૧૭ ૦૩૪)	(૯૬ ૯૯ ૬૪ ૭૨૮)
ચૂકવેલ વેરો (રીફંડ બાદ કર્યા પછી)	(૮૩ ૦૬ ૨૧૬)	૫૫ ૦૨ ૫૮૨
ઓપરેટીંગ કામગીરીમાં નેટ કેશ ફ્લો ઉપયોગમાં (એ)	(૧૫૦ ૫૫ ૮૯ ૭૬૨)	(૯૮ ૭૮ ૯૮ ૦૮૮)
૨. રોકાણની કામગીરીમાં કેશ ફ્લો:-		
ચાલુ કામગીરીમાં વર્કીંગ કેપીટલમાં (વધારો)/ઘટાડો	(૬ ૦૪ ૩૧ ૬૧૩)	(૨ ૫૮ ૧૮૫)
વિકાસ હેઠળના ઈન્ટેન્જેબલ એસેટમાં (વધારો)/ઘટાડો	(૧૩૨ ૦૪ ૬૩ ૭૪૩)	(૫૭ ૫૬ ૨૧ ૫૭૮)
રાઈટ ટુ યુઝ એસેટમાં (વધારો)/ઘટાડો	(૬૮ ૬૮ ૭૪૮)	-
નોન કરન્ટ એસેટમાં (વધારો)/ઘટાડો	(૧૫ ૧૪ ૮૭ ૦૧૭)	(૧૬ ૪૧ ૩૪ ૪૭૮)
વ્યાજની આવક	૨ ૭૬ ૩૨ ૪૮૩	૮૨ ૬૨ ૭૨૮
રોકાણની કામગીરીમાં નેટ કેશ ફ્લો ઉપયોગમાં (બી)	(૧૫૧ ૧૬ ૧૮ ૬૨૮)	(૭૩ ૦૭ ૫૨ ૫૧૫)

૩. નાણાકીય કામગીરીમાંથી કેશ ફ્લો:-		
શેર કેપીટલમાંથી	૩૦૪ ૫૪ ૨૨ ૦૦૦	૧૯૧ ૩૭ ૫૦ ૦૦૦
ચુકવવામાં બાકી રહેલ ટુકાગાળાના	-	(૧૪ ૩૧ ૨૭ ૮૫૫)
બોરોઈંગમાંથી પ્રોસીડ / (રીપેમેન્ટ)		
નાણાકીય કામગીરીમાં નેટ કેશ ફ્લો ઉપયોગમાં (સી)	૩૦૪ ૫૪ ૨૨ ૦૦૦	૧૭૭ ૦૬ ૨૨ ૧૪૫
રોકડ અને રોકડને સમાન્તરમાં વધારો (એ) + (બી) + (સી)	૨ ૮૨ ૧૩ ૬૦૯	૫ ૧૯ ૭૧ ૫૪૨
વર્ષની શરૂઆતમાં રોકડ અને રોકડને સમાન્તર	૫ ૩૩ ૬૧ ૬૧૮	૧૩ ૯૦ ૦૭૬
વર્ષના અંતે કેશ અને કેશ ઈકવીવિલેન્ટ	૮ ૧૫ ૭૫ ૨૨૭	૫ ૩૩ ૬૧ ૬૧૮
વર્ષના અંતે રોકડ અને રોકડને સમાન્તરનું વર્ગીકરણ	-	-
કરન્ટ / સેવીંગ ખાતામાં બેંક સાથે રહેલ સિલક	૮ ૧૫ ૭૫ ૨૨૭	૫ ૩૩ ૬૧ ૬૧૮
	૮ ૧૫ ૭૫ ૨૨૭	૫ ૩૩ ૬૧ ૬૧૮

નોંધો:-

૧. રોકડ અને રોકડને સમાન્તરમાં રોકડ અને બેંકની સીલક અને બેંકમાં રહેલ ડીપોઝીટ (જેની પાકતી તારીખ ૩ મહિના કરતા ઓછી હોય તેનો સમાવેશ થાય છે).
૨. ભારતીય હિસાબી પધ્ધતિ-૭ મુજબ સ્ટેટમેન્ટ ઓફ કેશ ફ્લોમાં દર્શાવેલ 'ઈન્ડાયરેક્ટ મેથડ' મુજબ ઉપર દર્શાવેલ કેશ ફ્લો પત્રક તૈયાર કરવામાં આવેલ છે.
૩. જરૂરીયાત મુજબ ગત વર્ષના આકડાઓને રીગ્રુપ અને રીકલાસીફાઈ કરવામાં આવેલ છે જેથી કરીને હાલના વર્ષના આકડાઓ સાથે સમતુલા જળવાઈ રહે.

હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આતરીક ભાગ છે.

સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે

શાહ અને દલાલ વતી

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

એફઆરએન ૧૦૯૪૩૨૩બલ્યુ

સહી/-

મલય દલાલ

ભાગીદાર,

સભ્ય નં. ૦૩૬૭૭૬

સહી/-

એસ. એન. જોષી

સીએફઓ

સહી/-

જવલેશ ઝવેરી

નિયામક

ડીઆઈએન: ૦૯૫૦૭૨૨૪

સહી/-

સંતોષ કુમાર

નિયામક અને સીઈઓ

ડીઆઈએન : ૦૭૮૫૪૧૭૯

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨

સ્થળ:- ગાંધીનગર

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ

૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતિત નાણાકીય પત્રકોને લગત નોંધો

૧. કંપનીની માહિતી:

બહુચરાજી રેલ કોર્પોરેશન લિમીટેડ એ ગુજરાત સરકારના તા. ૦૫/૦૨/૨૦૧૮ ના રોજના ઠરાવ નં. એમઆઈએસ૧૦-૨૦૧૭-૧૬૬૫-૧ - ૧ અન્વયેનો બહુચરાજી - કાટોસણ રેલવે પ્રોજેક્ટ માટેનો એક સ્પેશીયલ પર્પસ વ્હીકલ (એસપીવી) છે જેઓ ગુજરાત રાજ્યના કોટાસણ રોડ - બહુચરાજી - ચાણસ્મા - રણુજ ૬૫ કિમી લાઈનના ગેજ ફેરફારને લગત ડેવલોપમેન્ટ, નાણાકીય કામગીરી, આયોજન અને ઈમ્પલીમેન્ટેશનની કામગીરી કરશે.

૨. બોર્ડ ઓફ ડાયરેક્ટરો દ્વારા તા. ૨૦મી જુલાઈ-૨૦૨૨ ના રોજ પસાર કરવામાં આવેલ ઠરાવ મુજબ નાણાકીય પત્રકોને મંજૂરી આપવામાં આવેલ છે.

૩(૧) તૈયારીનો આધાર:

આ નાણાકીય પત્રકો હિસ્ટોરીકલ કોસ્ટના આધાર પર તૈયાર કરવામાં આવેલ છે, સિવાય કે અમુક નાણાકીય ઉપકરણો જે ફેર વેલ્યુ પર દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે હિસ્ટોરીકલ કોસ્ટ માલ અને સેવાની વળતરની ફેર વેલ્યુના આધારે હોય છે. ફેર વેલ્યુ એટલે કે એ કિંમત જે બજારના સહભાગીઓ મૂલ્યાંકન તારીખે કોઈ એસેટ વેચીને અથવા તો જવાબદારીઓ હસ્તાંતર કરવા માટે આપેલી કિંમત.

એ. પૂર્તતાનું નિવેદન :

આ નાણાકીય પત્રકો ભારતીય હિસાબી પદ્ધતિઓ (ઈન્ડ એએસ) મુજબ કંપનીઝ (ઈન્ડીયન એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ) નિયમો, અને તેના અન્ય પ્રાવધાનો કે જે કંપની દ્વારા ૨૦૧૩ મુજબ સમયાંતરે બદલાતા રહે છે. તે મુજબ તૈયાર કરવામાં આવેલ છે.

કંપનીના હિસાબી પદ્ધતિઓની વિગત નોંધ ૩ (૨) માં દર્શાવેલ છે.

બી. કાર્યાત્મક અને કરન્સીની રૂપરેખા :

આ નાણાકીય પત્રકોને ભારતીય રૂપિયામાં (આઈ.એન.આર.) માં તૈયાર કરવામાં આવેલ છે જે કંપનીનો કાર્યરત કરન્સી છે.

સી. અંદાજો અને નિર્ણયોનો ઉપયોગ :

આ નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે મેનેજમેન્ટ દ્વારા નિર્ણયો, અંદાજો અને ધારણાઓ કરેલ છે કે જે હિસાબી

પદ્ધતિઓના અમલને અસર કરે છે અને એસેટ, લાયબલીટી, આવક અને ખર્ચને દર્શાવેલ છે. ખરેખરના પરિણામો કરેલા અંદાજોથી જુદા હોઈ શકે છે.

અગત્યના અંદાજો અને જજમેન્ટ

આ નોંધમાં ઉચ્ચ સ્તરના જજમેન્ટ અને ઝટીલતાની રૂપરેખા આપે છે અને તેવી આઈટમો કે જેને અંદાજો અને એસમ્પશનોના કારણે વધારે એટજેસ્ટ કરવામાં આવે અને તે ખરેખર કરતા જુદો એસેસ થાય તેને દર્શાવવામાં આવેલ છે. દરેક અંદાજો અને જજમેન્ટની વિગતવાર માહિતી લાગતા વળગતા નોંધોમાં આપવામાં આવેલ છે અને તેના આધારે દરેક આઈટમની ગણતરી નાણાકીય પત્રકમાં કરવામાં આવેલ છે.

અગત્યના અંદાજો અને જજમેન્ટને અસરકરતા ક્ષેત્રો :

ઘસારો અને ઋણમુક્તિ :

ઘસારો અને ઋણમુક્તિનો આધાર ભવિષ્યમાં ઉપયોગમાં લાવી શકાય તેવી મિલકત, પ્લાન્ટ, ઉપકરણ અને ઈન્ટેન્જેબલ એસેટ ઉપરનો મેનેજમેન્ટ અંદાજ છે. આવા અંદાજોમાં ડેકનોલોજીકલ વિકાસ, ફરીફાઈ, બજારની પરીસ્થિતિઓને કારણે કે અન્ય બાબતોને કારણે ફેરફાર થઈ શકે છે અને અને તેના કારણે અંદાજીત ઉપયોગીતાના સમયગાળામાં અને ઘસારા અને એમોરાઈઝેશન ચાર્જસમાં પણ ફેરફાર થઈ શકે છે.

અન્ય ક્ષેત્રો નીચે મુજબ છે.

ચાલુ ચૂકવવાપાત્ર વેરા અને વિલંબીત વેરાનો અંદાજ :

વિલંબીત મિલકત ત્યાં સુધી જ ઓળખવામાં આવે જ્યાં સુધી કામચલાઉ તફાવતોની સમજણ ના પડે ત્યાં સુધી કરવામાં આવે છે. કંપની અમુક કેસમાં વિલંબીત મિલકત કર અને જવાબદારીઓ ચાલુ કરના કાયદાઓ અને દરના આધારે અંદાજો કરતી હોય છે. જેમાં ધંધાનો પ્લાન, સંચાલનની અપેક્ષાઓ અને મિલકતની સમયસર પુનઃપ્રાપ્તિ પણ સામેલ થાય છે. આ અંદાજોમાં ફેરફાર વિલંબીત જવાબદારી કર અથવા વિલંબીત મિલકત કરનું મૂલ્યાંકન પર અસર કરે છે અને તેના હિસાબે નફા-નુકસાનમાં કર નોંધવામાં આવે છે.

કરની જવાબદારીની જોગવાઈઓને કર કાયદાનું અર્થઘટનના ચુકાદાની, કેસના વિકાસની અને કર ઓડિટમાં સંભવિત પરિણામો અને અપીલની જરૂર પડતી હોય છે તેથી વાસ્તવિક પરિણામ અપેક્ષાઓથી અલગ હોઈ શકે અને તે જોગવાઈઓમાં પરિવર્તિત થાય છે. વિલંબીત મિલકત કરનું મૂલ્યાંકન, રોકડ કર સેટલમેન્ટ અને તેથી નફા-નુકસાન ખાતામાં તે પ્રમાણે કર નોંધવામાં આવે છે.

જોગવાઈઓ અને આકસ્મિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન અને માપન

સમયાંતરે કંપનીને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે. જેનું અંતિમ પરિણામ અનિશ્ચિતાઓથી ભરેલું છે. ખર્ચ માટેનું જોગવાઈઓ ત્યારે કરવામાં આવે છે કે જે ચૂકવણી નિશ્ચિતપણે કરવામાં આવશે અથવા કરેલ છે અને કે જેનું વ્યાજબી અંદાજ મૂકવામાં આવેલ છે.

અન્ય પરીબળોની વચ્ચે બિનતરફેણ કારી પરિણામની સંભાવના અને સંભવિત નુકસાનની રકમનો વ્યાજબી અંદાજ કાઢવાની ક્ષમતાનો મૂલ્યાંકન કરતી વખતે નોંધપાત્ર નિર્ણય લેવામાં આવે છે. ખર્ચની જોગવાઈઓની સમીક્ષા દરેક હિસાબી સમયગાળામાં કરવામાં આવે છે અને હકીકતો અને સંજોગોમાં થયેલ ફેરફારોને આધારિત સુધારાઓ કરવામાં આવે છે.

સંપત્તિઓની ક્ષતિ :

પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઈક્વીપમેન્ટમાં અવાસ્તવિક મિલકતો કે જેનું ઘસારા અને ઋણમુક્તિ થાય તેને ક્ષતિઓ માટે સમયાંતરે ચકાસવામાં આવે છે. વધુમાં જ્યારે એવી પરિસ્થિતિ સ્થાપિત થાય કે જેમાં રોકડ પ્રવાહ ધરાવતું યુનિટની વસૂલી કિંમત તેની ચાલુ કિંમત કરતા ઓછી હોય તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રોકડ પ્રવાહ ધરાવતું યુનિટની વસૂલી કિંમત એટલે તેની ચાલુ કિંમત અને વ્યાજબી કિંમત ઓછા વેચાણ ખર્ચ બંનેમાંથી જે વધુ હોય એ હોય છે કે ગણતરીમાં અમને નોંધપાત્ર અંદાજો અને ધારણાઓનો સમાવેશ થાય છે. જેમાં ટર્ન ઓવર અને અરનિંગ ગુણાંક, વૃદ્ધિ દર, અને નેટ માર્જિનનો સમાવેશ થાય છે. જે અંદાજિત ભાવિ રોકડ પ્રવાહની ગણતરી કરવા માટે વપરાય છે.

અંદાજો અને ધારણાઓને સમયસર ચકાસવામાં આવે છે. હિસાબી અંદાજોમાં સુધારણાઓ સંભવિત પણે દર્શાવાવામાં આવે છે.

ડી. ફેર વેલ્યુની ગણતરી :

ફેર વેલ્યુ માટે કંપનીના ઘણા બધા હિસાબી પદ્ધતિઓની અને ખુલાસાઓની જરૂરીયાત રહેલ છે, બંને નાણાંકીય અને બીન - નાણાંકીય એસેટ્સ અને જવાબદારીઓને લગત.

ફેર વેલ્યુઓને જુદા જુદા લેવલમાં વિભાજિત કરવામાં આવેલ છે અને તેનો આધાર નીચે જણાવેલ વેલ્યુએશન પદ્ધતિઓ પર રહેલ છે.

- પ્રથમ લેવલ:- સક્રિય બજારમાં નિર્ધારિત થયેલ કિંમત (એડજસ્ટ કર્યા સિવાયના) કે જે એક જ પ્રકારના એસેટ અને જવાબદારીઓ માટે છે.

- બીજો લેવલ:- લેવલ ૧ માં નિર્ધારિત કરેલ કિંમતો સિવાયના કે જેને એસેટ કે લાયબલીટી, સીધી રીતે (એટલે કે કિંમત તરીકે) કે આડકતરી રીતે (એટલે કે કિંમતમાંથી પ્રાપ્ત થયેલ) નોંધવામાં આવેલ છે.
- ત્રીજો લેવલ:- એસેટ કે લાયબલીટીમાંથી પ્રાપ્ત થયેલ ઈનપુટ કે ઓબઝર્વેબલ માર્કેટ ડેટા (અનઓઝરવેબલ ઈનપુટ) પર આધારિત ન હોય.

જ્યારે કોઈ પણ એસેટ કે લાયબલીટીની ફેર વેલ્યુની ગણતરી કરવામાં આવેલ ત્યારે કંપની દ્વારા દર્શનીય બજાર કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ પણ એસેટ કે લાયબલીટીના ફેર વેલ્યુ માટે ઉપયોગ કરવામાં આવેલ ઈનપુટ જુદા જુદા ફેર વેલ્યુમાં આવતી હોય તો ફેર વેલ્યુની ગણતરીને સૌથી નીચેના સ્તરના ઈનપુટ પર દર્શાવવામાં આવે છે કે સંપૂર્ણ ગણતરી માટે જરૂરી છે.

કંપની ફેર વેલ્યુના સ્તરો વચ્ચેના ટ્રાન્સફરને રીપોર્ટીંગ સમયગાળાના અંતે થયેલ ફેરફારોના આધારે ઓળખે છે.

ફેર વેલ્યુની ગણતરીના સમયે કરેલ એસમ્પ્શનો બાબતેની વિગત નીચે દર્શાવેલ નોંધોમાં સામેલ રાખેલ છે.

ઇ. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ :

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીએ વિશ્વ અને ભારતની આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર રીતે ધીમી કરેલ છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (કોવિડ-૧૯) નું ભારતમાં ફાટી નીકળવું એ ધીમી અર્થતંત્રની કામગીરીને નોંધપાત્ર રીતે વિઘ્ન છે. વર્ષ દરમિયાન કોવિડ-૧૯ ને લીધે કંપનીની કામગીરી પર અસર પડેલ છે. કંપનીએ નાણાંકીય પત્રકો, મળવાપાત્ર મિલકતની કિંમત આંતરીક અને બાહ્ય માહિતી, વર્તમાન અને ભવિષ્યની અર્થતંત્રની નીતિઓની હિસાબી ચોપડે હકારાત્મક અસર નોંધેલ છે. રૂપાંતર દરે ઐતિહાસિક ખર્ચના આધારે માપવામાં આવી છે.

૩(૨) અગત્યના હિસાબી પોલીસીઓ :

નીચે દર્શાવેલ હિસાબી પોલીસીઓ હાલના નાણાંકીય પત્રકોના સમયગાળા દરમિયાન અમલમાં મુકવામાં આવેલ છે.

એ. વિદેશી ચલણ વ્યવહારો :

કંપનીના વિદેશી ચલણમાં કરેલા વ્યવહારો કાર્યાત્મક ચલણમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે અને આ વ્યવહારોની તારીખે રૂપાંતર દર અથવા સરેરાશ દરે કરવામાં આવ્યા છે. અને વ્યવહારની તારીખે સરેરાશ તરીકે વાસ્તવિક દર આશરે કરવામાં આવેલ છે.

નાણાંકીય સંપત્તિ અને જવાબદારીઓ કે જે વિદેશ ચલણમાં થયો છે તે જાણ કરવાની તારીખે રૂપાંતરિત થઈને રૂપાંતર દરે કાર્યાત્મક ચલણમાં કરવામાં આવી છે. બિન નાણાંકીય સંપત્તિ અને જવાબદારીઓ કે જે વિદેશી ચલણમાં વાજબી દરે

થઈ છે તે જ્યારથી વ્યાજબી દર નિર્ધારિત થઈ ત્યારે રૂપાંતર દરે કાર્યાત્મક ચલણમાં રૂપાંતર કરવામાં આવી છે. બિન નાણાંકીય સંપત્તિ અને જવાબદારીઓ વ્યવહારની તારીખે વિદેશી ચલણમાંથી ઐતિહાસિક કિંમતે ટ્રાન્સફર કરવામાં આવે છે.

નીચે જણાવેલ ઓસીઆઈ સ્વીકૃત રીતે રૂપાંતર દર તફાવત કે જે રૂપાંતરમાંથી થયેલ છે અને તેના સિવાય રૂપાંતર તફાવત નફા અથવા નુકસાનમાં માન્ય રાખવામાં આવેલ છે.

- ઓસીઆઈ દ્વારા વ્યાજબી દરે ઈકિવટી રોકાણ (એફવીઓસીઆઈ)

- જ્યાં સુધી હેજિસ અસર કરે ત્યાં સુધી યોગ્ય રોકડ પ્રવાહ હેજિસ.

બી. નાણાંકીય ઉપકરણો :

ઓળખ અને પ્રાથમિક ગણતરીઓ

ટેર્ડ રીસીવેબલ ઊભા થાય ત્યારે જ તેની ઓળખ કરવામાં આવેલ છે. અન્ય તમામ નાણાંકીય એસેટ અને નાણાંકીય જવાબદારીઓને અગાઉથી જ કંપની ઓળખે છે કે જ્યારે તે ઈન્સ્ટ્રુમેન્ટના કરારના પ્રાવધાનોનો ભાગ બને છે.

એક નાણાંકીય એસેટ કે નાણાંકીય જવાબદારીને સૌ પ્રથમ તેના ફેર વેલ્યુમાં ગણવામાં આવે છે અને તેવા આઈટમો કે જે ફેર વેલ્યુમાં નથી તેને નફા નુકસાનથી (એફવીટીપીએલ)થી ગણતરી કરવામાં આવે છે, ટ્રાન્સેક્શનની કિંમતને સીધી રીતે તેને પ્રાપ્ત કે ઈશ્યુ કરતી વખતે ગણતરી કરવામાં આવે છે.

વર્ગીકરણ અને ત્યારબાદની ગણતરી અને નફા અને નુકસાન : નાણાંકીય એસેટ

એમોરટાઇઝડ કિંમતે નાણાકીય એસેટ : આવા એસેટો પાછળથી તેના એમોરટાઇઝડ કિંમતે અસરકારક વ્યાજ પદ્ધતિથી ગણવામાં આવે છે. ઈમ્પેરમેન્ટ નુકસાનથી એમોરટાઇઝડ કિંમતમાં ઘટાડો થાય છે. વ્યાજની આવક, ફોરેન એક્સચેન્જની પ્રાપ્તિ અને નુકસાનોની ઓળખ નફા કે નુકસાન ઉપર થાય છે. કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન કે ડીરેક્ટગનાઈઝેશનની અસર નફા અને નુકસાનના પત્રકો ઉપર થાય છે.

નાણાકીય એસેટની સાચી કિંમત કોમ્પ્રીહેન્સીવ આવક (એફવીટી ઓસીઆઈ)ના આધારે : તમામ ઈકિવટી રોકાણોને ફેર વેલ્યુમાં ગણતરી કરવામાં આવે છે. જેવા રોકાણો કે જે વેચાણ માટે કરવામાં ન આવેલ હોય અને જ્યાં કંપની દ્વારા તેને એફવીટીઓસીઆઈમાં વર્ગીકૃત કરવાના વિકલ્પનો ઉપયોગ કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં રોકાણમાં થયેલ તમામ ફેર વેલ્યુ ચેન્જને અધર કોમ્પ્રીહેન્સીવ ઈન્કમમાં (ઓસીઆઈ) માં દર્શાવવામાં આવે છે. એક્યુમીલેટ થયેલ નફા અને નુકસાનને ઓસીઆઈમાં દરેક ઈન્વેસ્ટમેન્ટના વેચાણથી થયેલ આવકમાં ફેરવર્ગીકરણ કરવામાં આવે છે.

નફા અને નુકસાનથી ફેર વેલ્યુને લગત નાણાંકીય એસેટ્સ (એફવીટીપીએલ) - આવા એસેટ્સ પાછળથી ફેર વેલ્યુ તરીકે આપવામાં આવે છે. નેટ નફા અને નુકસાન, જેમાં કોઈ વ્યાજ કે ડીવીડન્ટની આવકનો સમાવેશ થાય છે તે નફા કે નુકસાન તરીકે દર્શાવાય છે.

વર્ગીકરણ, પાછળથી કરવામાં આવેલ ગણતરી અને નફો અને નુકસાન : નાણાંકીય જવાબદારીઓ

નાણાંકીય જવાબદારીઓને પાછળથી એમોરટાઇઝડ કિંમત પર ગણતરી કરવામાં આવે છે અને તેમાં અસરકારક વ્યાજ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વેચાણ અને એક વર્ષમાં ચૂકવવા પાત્ર રકમો માટે કે જે બેલેન્સ શીટની તારીખથી એક વર્ષમાં હોય તેમાં રકમ કિંમત ફેર આવા રોકાણોમાં રહેલ ફેર વેલ્યુ કિંમત પ્રમાણે હોય છે.

ઈક્વિટી સાધનો

ઈક્વિટી સાધન એ કરાર છે કે કંપનીની જવાબદારીઓ ચૂકવ્યા બાદ મિલકતોમાં શેષ વ્યાજનો પૂરાવો આપે છે ઈક્વિટી સાધન જારી કરવા સુધી વધારાના ખર્ચને સીધા આભારી ખર્ચ કોઈ પણ ચોખ્ખા કરની અસરને ઈક્વિટીમાંથી બાદ કર્યા બાદ ઓળખવામાં આવે છે.

ડીરેકગનાઈઝેશન : નાણાંકીય એસેટ

કંપની દ્વારા કોઈ પણ નાણાંકીય એસેટને ડીરેકગનાઈઝ ત્યારે કરવામાં આવે જ્યારે આવા નાણાંકીય એસેટમાંથી રહેલ કેશ ફ્લોના કોન્ટ્રાક્ટુઅલ હક્ક પુરા થઈ જાય કે તેના દ્વારા કોન્ટ્રાક્ટ્યુઅલ કેશ ફ્લો ના હક્કોને ટ્રાન્સફર કરવામાં આવે કે જેથી રહેલ તમામ માલિકીના રીસ્ક અને ફાયદાઓને ટ્રાન્સફર કરવામાં આવે કે જ્યારે કંપની દ્વારા તમામ માલિકીના રીસ્ક અને ફાયદાઓને ટ્રાન્સફર કે રીટેઈન કરવામાં ન આવે અને તેના દ્વારા નાણાંકીય એસેટ પર કોઈ પણ પ્રકારનો નિયંત્રણ રહે નહીં.

જો કંપની દ્વારા તેવા લેવડ દેવડો કરવામાં આવે કે જેથી તેના દ્વારા બેલેન્સ શીટમાં દર્શાવેલ એસેટને ટ્રાન્સફર કરવામાં આવે પરંતુ તેના દ્વારા તમામ રીસ્ક અને આવકને પોતાની પાસે રાખવામાં આવે તો આવા ટ્રાન્સફર કરવામાં આવેલ એસેટને ડીરેકગનાઈઝ કરવામાં ના આવે.

ડીરેકગનાઈઝેશન : નાણાંકીય જવાબદારીઓ

કંપની દ્વારા કોઈ નાણાંકીય જવાબદારીઓને ત્યારે ડીરેકગનાઈઝ કરવામાં આવે છે કે જ્યારે તેને લગત કરારની જવાબદારીઓને પુરી કે રદ કરવામાં આવેલ હોય કે તે એક્ષપાયર થઈ ગયેલ હોય.

કંપની દ્વારા ત્યારે પણ એક નાણાંકીય જવાબદારીને ડીરેકગનાઈઝ કરવામાં આવે છે જ્યારે તેના ટર્મમાં ફેરફાર કરવામાં

આવેલ હોય અને નવા ટર્મ મુજબ કેશ ફલોમાં ખૂબ જ વધારે ફેરફારો હોય. હાલના કિસ્સામાં, એક નવા નાણાંકીય જવાબદારી કે જે ફેરબદલી કરેલ શરતો મુજબ તેના ફેર વેલ્યુ પર ઓળખવામાં આવેલ છે. પૂરી થયેલ નાણાંકીય જવાબદારીને લગત રકમ હાથ પર રાખવા અને પેરફાર મુજબના નવા નાણાંકીય જવાબદારીને ઓળખવામાં રહેલ ફરકને નફા અને નુકસાન માં દર્શાવવામાં આવે છે.

ઓફસેટીંગ

નાણાંકીય એસેટ અને નાણાંકીય જવાબદારી એક ઓફસેટ છે અને બેલેન્સ શીટમાં દર્શાવેલ નેટ રકમ ત્યારે જ હોય જ્યારે કંપની પાસે હાલમાં રકમને ઓફસેટ કરવા માટે કાયદાકીય હક્ક રહેલ હોય અને તે તેને સેટલ કરવા માંગતી હોય કે એસેટ રીલીઝ કરવા અને એક સાથે જવાબદારીઓ સેટલ કરવા માંગતી હોય.

સી. કરન્ટ અને નોન કરન્ટ વર્ગીકરણ :

કંપની દ્વારા બેલેન્સ શીટમાં એસેટ અને જવાબદારીઓ દર્શાવવામાં આવે છે અને તેનો આધાર કરન્ટ / નોન કરન્ટ વર્ગીકરણ છે. એસેટને કરન્ટ તરીકે ત્યારે દર્શાવવામાં આવે જ્યારે

(એ) તેને રીયલાઈઝ કરવા, કે વેચવા કે કંપનીની જરૂરીયાતો માટે ઉપયોગ કરવાનું હોય ત્યારે.

(બી) પ્રાથમિક ધોરણે ધંધા માટે રાખવામાં આવેલ હોય.

(સી) રીપોર્ટીંગની તારીખથી ૧૨ માસમાં તેને રીયલાઈઝ કરવાની થાય તો.

(ડી) રોકડ કે રોકડ સમાન હોય અને તેની લેવડ દેવડ કરવામાં પ્રતિબંધ ન હોય કે તેને જવાબદારી પુરી કરવા માટે રીપોર્ટીંગની તારીખથી ૧૨ માસમાં સેટલ કરવાની હોય ત્યારે.

બાકી રહેલ તમામ એસેટોને નોન - કરન્ટ તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે.

લાયબલીટી ત્યારે કરન્ટ છે કે જ્યારે :

(એ) તે કંપની દ્વારા તેના સામાન્ય ક્રમે સેટલ કરવામાં આવનાર હોય ત્યારે.

(બી) તેને ફક્ત ધંધા માટે રાખવામાં આવેલ હોય તો.

(સી) તેને રીપોર્ટીંગ તારીખથી ૧૨ માસમાં સેટલ કરવાની હોય તો.

(ડી) રીપોર્ટીંગની તારીખથી ૧૨ માસમાં કંપની પાસે જવાબદારી સેટલ કરવા માટેનો બીનશરતી હક્ક રહેલ ન હોય ત્યારે.

બાકી રહેલ તમામ જવાબદારીઓને નોન-કરન્ટ તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે.

કામગીરીની પ્રક્રિયા

પ્રોસેસ માટે પ્રાપ્ત કરવામાં આવેલ એસેટ અને તેનાથી રકમ કે તેના સમાંતર કોઈ લાભ પ્રાપ્ત થયા વચ્ચેના સમયને ઓપરેટીંગ સાયકલ કહેવામાં આવે છે. કંપનીએ તેની કામગીરીની પ્રક્રિયાને ૧૨ મહિના નક્કી કરેલ છે.

ડી. મિલકત, પ્લાન્ટ અને યંત્ર :

માન્યતા અને માપદંડ :

સંપત્તિની વસ્તુઓ, પ્લાન્ટ અને યંત્ર પડતર કિંમતે માપવામાં આવે છે. જે મૂડીકૃત ઉધાર ખર્ચ, બાદ એકત્રિત ઘસારો અને એકત્રિત ઘટાડા નુકસાન જો હોય તો સહિત હોય છે.

સંપત્તિની કોઈ પણ વસ્તુની કિંમત, પ્લાન્ટ અને સાધનો તેની ખરીદ કિંમત, આયાત જકાત અને બિનપરતપાત્ર ખરીદ કર, સહિત ને સમાવે છે અને તે વેચાણ ઘૂટ અને કસર બાદ કર્યા પછી, વસ્તુને તેની ઉપયોગી પરિસ્થિતિમાં લાવવા માટે સીધા આભારી ખર્ચ અને તેની તોડી પાડવાની અંદાજિત કિંમત અને કાઢી નાખવાની અને જે જગ્યાએ સાચવી રાખેલ હોય તેને પુનઃસ્થાપિત કરે છે.

સંપત્તિ, પ્લાન્ટ અને સાધનોની સ્વ નિર્માણ કિંમત માલસામાન કિંમત અને મંજૂરી, અન્ય સીધા આભારી ખર્ચ કે જે વસ્તુને ઉપયોગી પરિસ્થિતિમાં લાવવા માટે અને તેની તોડી પાડવાની અંદાજિત કિંમત અને કાઢી નાખવા સહિતની કિંમતને પુનઃ સ્થાપિત કરવા સહિતને સમાવે છે.

જો કોઈપણ સંપત્તિ, પ્લાન્ટ અને સાધનનો નોંધપાત્ર ભાગ અલગ ઉપયોગી જીવન ધરાવતું હોય તો તેને હિસાબી ચોપડે અલગ વસ્તુ (મુખ્ય ભાગ) સંપત્તિ, પ્લાન્ટ અને સાધન તરીકે નોંધ કરેલ છે.

સંપત્તિ, પ્લાન્ટ અને સાધનોની કોઈ વસ્તુના નિકાસ પર થતો લાભ અથવા નુકસાન નફા અથવા નુકસાન ખાતામાં બતાવવામાં આવે છે.

અનુગામી ખર્ચ :

અનુગામી ખર્ચ ત્યારે જ મૂડીકરણ થયે કે જ્યારે ખર્ચ સાથે જોડાયેલા ભવિષ્ય આર્થિક લાભો કંપનીને થશે.

ઘસારો:-

સંપત્તિ, પ્લાન્ટ અને સાધનો પર ઘસારો કંપની અધિનિયમ ૨૦૧૩ ના શિડ્યુલ ૨ માં જણાવેલ ઉપર જીવન દરના આધારે સીધી લીટીના આધાર પર પૂરો પાડવામાં આવેલ છે. કોઈ મિલકત જેની કિંમત રૂ. ૫,૦૦૦ કરતા ઓછી છે તે

જે વર્ષમાં મૂડીકરણ થયું તે જ વર્ષમાં પૂરેપૂરો ઘસારો ગણવામાં આવેલ છે.

એડીશન (ડીઝપોઝલ) પર ના ઘસારાને પ્રો - રેટા આધારે પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે કે જે તારીખથી આવા એસેટનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ હોય. (ડીઝપોઝ કરવામાં આવેલ હોય).

ઘસારાની રીત, ઉપયોગી જીવનકાળ અને રેસિડ્યુઅલ કિંમતનો રીવ્યુ દરેક નાણાકીય વર્ષમાં કરવામાં આવે છે અને દરેક નાણાંકીય વર્ષના અંતે જો જરૂરી હોય તો તેને એડજેસ્ટ કરવામાં આવે છે. જો રીવીઝન કરવાનું થાય તો, રીવાઈઝ કરવામાં આવેલ બાકી ઉપયોગી જીવનકાળ પર અનએમોરાઈઝડ ઘસારાની રકમ ચાર્જ કરવામાં આવે છે.

રીટાયરમેન્ટ કે ફાયદા કે નુકસાનથી થયેલ લોસ કે જે કોઈ પણ ફિક્સ એસેટને ડીઝપોઝ કરવાથી થાય તેને નફા અને નુકસાનના પત્રકમાં કિંમત મુજબ દર્શાવવામાં આવે છે.

ચાલુ રહેલ કેપીટલ કામગીરીમાં એવા એસેટ પર થયેલ ખર્ચ કે જેને હજુ પણ કમીશન કરવાની બાકીમાં હોય તેનો સમાવેશ થાય છે. તમામ સીધી રીતે ઓળખાયેલ અને નક્કી થઈ શકે તેવા ખર્ચાઓને કે જે એક સમાન અને એસેટના બાંધકામના સમયગાળાને લગતા હોય તેને જ્યાં સુધી તે ઉપયોગ માટે તૈયાર થયા ત્યાં સુધી તેને કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ (સીડબલ્યુઆઈપી)માં રાખવામાં આવે છે અને તે કમીશન થાય ત્યારબાદ તેને લાગતા વળગતા ફિક્સ એસેટમાં ટ્રાન્સફર કે એલોટ કરવામાં આવે છે.

ઈ. લીઝ:-

કંપની એક લીઝી હોવાથી તે રાઈટ ઓફ યુઝ એસેટ અને લીઝની જવાબદારીને લીઝ શરૂ થયાના દિવસે ગણતરી કરે છે. રાઈટ - ટુ - યુઝ એસેટને પહેલા તો કોસ્ટ ઉપર ગણવામાં આવે છે, જેમાં લીઝ જવાબદારીના પ્રાથમિક રકમને લીઝની શરૂઆતની તારીખે કે પહેલા થયેલ ચૂકવણા સાથે એડજેસ્ટ કરવામાં આવે છે, અને કોઈ સીધી પ્રાથમિક કોસ્ટ જો થયેલ હોય તો તેને પણ તેમ ગણવામાં આવે છે અને તે એસેટને ડીસમેન્ટલ અને દૂર કરવાની કિંમત કે જે જગ્યાએ તે વસ્તુ મુકવામાં આવેલ હોય તેનો પણ અંદાજ કાઢવામાં આવે છે અને તેમાંથી પ્રાપ્ત થયેલ લીઝ ઈનીશીયેટીવને બાદ કરવામાં આવે છે.

આવા રાઈટ - ઓફ - યુઝ એસેટને પછીથી ડેપ્રીશીયેટ કરવામાં આવે છે અને તેના માટે તેના શરૂ થયાની તારીખથી સીધી - લીટી પદ્ધતિયો ઉપયોગ આવા રાઈટ - ઓફ - યુઝ એસેટના ઉપયોગી જીવનકાળના અંત કે લીઝના સમયગાળાના અંત મુજબ કરવામાં આવે. આવા રાઈટ - ઓફ - યુઝ એસેટના અંજાદીત જીવનકાળની ગણતરી તેજ રીતે કરવામાં આવે છે કે જેમ મિલકત, પ્લાન્ટ અને ઉપકરણોનો કરવામાં આવે છે. આના ઉપરાંત, આવા રાઈટ - ઓફ - યુઝ એસેટને સમય સમય માં ઈમ્પેરીમેન્ટ નુકશાન, જો કોઈ હોય તેના અનુસાર ઘટાડવામાં આવે છે, અને તેને લીઝ જવાબદારીમાં રહેલ રી

- મેઝરમેન્ટ પ્રમાણે એડજેસ્ટ કરવામાં આવે છે.

લીઝ જવાબદારીની પ્રાથમિક ગણતરી લીઝ ચુકવણાના હાલની કિંમત અનુસાર કરવામાં આવે છે કે જે તેની શરૂઆતની તારીખે ચુકવવામાં આવેલ ન હોય, અને તેમાં સ્ટેન્ડર્ડ પ્રમાણે રહેલ વ્યાજના દર અનુસાર ડીસ્કાઉન્ટ કરવામાં આવે છે.

લીઝના ચુકવણામાં લીઝ જવાબદારીની ગણતરીનો સમાવેશ થાય છે કે જેમાં ફીક્સ ચુકવણા, અને ઈન - સબસીક્યુએન્ટ ફીક્સ ચુકવણાનો સમાવેશ થાય છે. લીઝ જવાબદારીની ગણતરી એમોરટાઇઝ કિંમતમાં એસરકારક વ્યાજ પદ્ધતિનો ઉપયોગ કરી કરવામાં આવે છે. જ્યારે લીઝ જવાબદારીની ગણતરી કરવામાં આવે છે ત્યારે આવા રાઈટ - ઓફ - યુઝ એસેટના કેરીઈંગ રકમમાં એડજેસ્ટમેન્ટ કરવામાં આવે છે અથવા તો તેને નફા અને નુકશાનમાં નોંધવામાં આવે છે જ્યારે આવા રાઈટ - ઓફ - યુઝ એસેટ ને શૂન્ય તરીકે ઘટાડવામાં આવેલ હોય. કંપની દ્વારા આવા રાઈટ - ઓફ - યુઝ એસેટને નોન કરન્ટ એસેટમાં એક અલગ લાઈન આઈટમ તરીકે દર્શાવવામાં આવેલ છે અને લીઝ જવાબદારીને 'બોરોઈંગ' અને 'અન્ય નાણાંકીય જવાબદારીને' ને બેલેન્સ શીટમાં નોંધવામાં આવેલ છે.

એફ. વિકાસ હેઠળની અવાસ્તવિક સંપત્તિ :

વિકાસ હેઠળ ભાડું વહેંચણી અધિકાર :

ખર્ચાઓ કે જે કન્સેશન સેવા હેઠળ સીધા ઓળખી શકાતા હોય તે વિકાસ હેઠળ ભાડા વહેંચણી અધિકાર તરીકે ઓળખવામાં આવ્યા છે. કોઈ પણ પ્રોજેક્ટ ના પરોક્ષ ખર્ચા જે તે પ્રોજેક્ટના અમલીકરણ સુધી ચાર્જ કરવામાં આવ્યા છે વધુમાં પ્રોજેક્ટના અમલીકરણ માટે જે એડવાન્સ ગતિશીલતા આપવામાં આવી છે તેના પરનો મેળવેલ વ્યાજ વિકાસ હેઠળની અવાસ્તવિક મિલકતમાંથી બાદ કરવામાં આવેલ છે.

જી. ક્ષતિ :

નાણાંકીય સાધનોને ક્ષતિ :

કંપની નાણાંકીય સંપત્તિ પરના અંદાજિત ધિરાણ માટે નુકસાન ભથ્થાને અમોરટાઇઝ કિંમત પરના માપદંડને માન્યતા આપે છે.

દર જાણ કરવાની તારીખે કંપની તેની નાણાંકીય સંપત્તિ અમોરટાઇઝ કિંમત લાવવામાં આવી છે અને ધિરાણ નુકસાન પર છે કે નહિ તેની આકારણી કરે છે. નાણાંકીય સંપત્તિ ત્યારે ધિરાણ ક્ષતિગ્રસ્ત થાય છે કે જ્યારે એક અથવા વધારે ઘટનાઓ કે જે નાણાંકીય સંપત્તિની અંદાજિત રોકડ પ્રવાહ પર હાનિકારક અસર થઈ હોય.

કંપની આજીવન અંદાજિત ધિરાણ નુકસાન રકમના બરાબર નુકસાન ભથ્થાનું માપન કરે છે. આ જીવન ધિરાણ નુકસાન

એ નુકસાન છે કે જે તમામ મૂળભૂત શક્યતાઓ પર નાણાંકીય સાધનોની અંદાજીત જીવનના પરિણામ રૂપે મળે.

નાણાંકીય સંપત્તિ નક્કી કરતી વખતે શરૂઆતથી જ નાણાંકીય સંપત્તિનો ધિરાણ જોખમ નોંધપાત્ર રીતે થયો હતો અને અંદાજીત અપેક્ષિત ધિરાણ નુકસાન થયા ત્યારે કંપની એ અનુસૂચિત પડતર અથવા પ્રયાસ વગર જરૂરી પ્રાપ્ત થયેલી માહિતી અને કારણભૂત ને માન્ય રાખી છે. આ વસ્તુ કંપનીની ભૂતકાળના અનુભવ અને જણાવેલ ધિરાણ આકારણી અને આગળ દેખાયેલ માહિતીના આધારે માત્રાત્મક અને ગુણાત્મક માહિતી અને વિશ્લેષણ ને પણ સામેલ કરે છે.

અપેક્ષિત ધિરાણ નુકસાનનું માપન

અપેક્ષિત ધિરાણ નુકસાન એ ભારિત સંભાવનાના ધિરાણ નુકસાન છે. ક્રેડિટ નુકસાનએ રોકડ ઘટની વર્તમાન કિંમતે માપવામાં આવે છે. (દા.ત. કરારના અનુસાર કંપનીના રોકડ પ્રવાહ અને કંપનીના અંદાજીત મેળવવાપાત્ર વેપારના રોકડ પ્રવાહ વચ્ચેનો તફાવત)

સરવૈયામાં અપેક્ષિત ધિરાણ નુકસાન માટે ભથ્થાની રજૂઆત.

નાણાંકીય સંપત્તિ પરનો નુકસાન ભથ્થો અમોરટાઈઝ કિંમતે માપવામાં આવે છે અને સંપત્તિની અંકિત વહન મૂલ્યમાંથી બાદ થાય છે.

માંડી વાળવું :

નાણાંકીય સંપત્તિની અંકિત વહન મૂલ્ય એ હદ સુધી માંડી વાળવામાં આવે છે કે જ્યાં પુનઃપ્રાપ્તિની કોઈ વાસ્તવિક તક નથી (આંશિક અથવા તો સંપૂર્ણ). આ સામાન્ય રીતે એવા કેસમાં થાય છે કે જ્યાં દેવાદાર પાસે કોઈ સંપત્તિ ન હોય અથવા આવકનો કોઈ સ્ત્રોત ન હોય જેનાથી ચૂકવવાની રકમ માટે પૂરો રોકડ પ્રવાહ હોય. જો કે જે નાણાંકીય સંપત્તિ માંડી વાળેલ છે તે એ શરતે કરેલ છે કે કંપનીની પ્રક્રિયાનું પાલન કરીને અમલીકરણની પ્રવૃત્તિઓ કરીને નાણાંકીય પુનઃપ્રાપ્તિ કરી શકાય.

બિન નાણાંકીય સંપત્તિનો દાતિ :

કંપનીની બિન નાણાંકીય સંપત્તિ, માલસામાન અને વિલંબીત કર સિવાય જાણ કરવાની તારીખે સમીક્ષા કરવામાં આવે છે કે ક્યાંક આ સંપત્તિઓ ને નુકસાનનો સંકેત નથી. અને જો એવો કોઈ સંકેત હોય તો મિલકતની પુનઃપ્રાપ્તિની રકમ અંદાજવામાં આવે. બિન નાણાંકીય મિલકતોના ઉપયોગથી અંદાજિત ભાવિ રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્ય પરથી નક્કી કરવામાં આવે છે. જો સંપત્તિ (રોકડ ઉત્પાદન એકમ)ની વસૂલ કરી શકાય તેવી રકમ તેની વહન ક્ષમતાની રકમ કરતા ઓછી હોવાનો અંદાજ હોય તો, સંપત્તિની વહન રકમ (રોકડ ઉત્પાદન એકમ) એની વહન પાત્ર રકમ સુધી ઘટાડવામાં

આવે છે. આ ક્ષતિની નુકસાન તરત જ નફા નુકસાનના પત્રમાં દર્શાવવામાં આવે છે. જ્યારે થયેલ ક્ષતિથી નુકસાન ભવિષ્યમાં દૂર થાય છે, ત્યારે મિલકતની વહન રકમ (રોકડ ઉત્પાદન એકમ) તેની વસૂલાત પાત્ર રકમના સુધારેલા અંદાજ સુધી વધારવામાં આવે છે, આ બિન-નાણાકીય મિલકતોની નવી વહનપાત્ર રકમ એ મૂળ વહનપાત્ર રકમથી વધવી ના જોઈએ. તે સુનિશ્ચિત કરવામાં આવે છે. ક્ષતિના કારણે થયેલ ખોટની વિપરીતતા તરત જ નફા નુકસાનના પત્રકમાં નોંધવામાં આવે છે. અને તેની અસર દર્શાવવામાં આવે છે.

એચ. બોરોઈંગ કિંમત :

બોરોઈંગ કિંમત બોરોઈંગ ભંડોળ/ઉછીના નાણાના સંદર્ભમાં વ્યાજ અને અન્ય કિંમત પર ઉપજે છે (વિદેશી ચલણ વ્યાજ કિંમતની ગોઠવણ ન થાય ત્યાં સુધી તેનો વિનિમય તફાવત સહિત) બોરોઈંગ કિંમત સીધા સંપાદનને આભારી છે અથવા મિલકતનો નિર્માણ કે જે ઉપયોગમાં તૈયાર થવા માટે નોંધપાત્ર સમય લે છે અને તે સંપત્તિની કિંમતના ભાગરૂપે મૂડીકરણ થાય. અન્ય બોરોઈંગ કિંમત તેમના જે તે સમયે થયા તે સમયે ખર્ચા તરીકે નોંધવામાં આવે છે.

આઈ. બોરોઈંગ :

બોરોઈંગને કરન્ટ લાયબલીટી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને ફક્ત ત્યારે કે જ્યારે કંપનીને રીપોર્ટીંગ સમયગાળાથી ૧૨ મહિના પછી એવો બીન શરતી હક્ક રહેલ હોય કે તેઓ લાયબલીટી માટે સેટલમેન્ટને ફેરવી શકે. જ્યારે લાંબા ગાળાની લોન વ્યવસ્થાના પ્રાવધાનોમાં કોઈ બ્રીચ થયેલ હોય અને તે પણ રીપોર્ટીંગ સમયગાળા પહેલા કે તેના અંતે કે જેની એવી અસર થાય કે આવા લાયબલીટી રીપોર્ટીંગની તારીખે માંગણી પર ચૂકવવા પાત્ર થાય ત્યારે કંપની આવી લાયબલીટીને કરન્ટ તરીકે નોંધતી નથી, અને જો નાણાં આપનાર સ્વીકારે તો રીપોર્ટીંગના સમયગાળા બાદ અને નાણાંકીય પત્રકોની મંજૂરી પહેલા આવા ચૂકવણાની માંગણી બ્રીચના કારણે થયેલ હોય તો.

જે. રેવન્યુની મંજૂરી

રેવન્યુને ત્યારે ઓળખવામાં આવે છે કે જ્યારે તેની ઉઘરાણીની/કે પ્રાપ્તિની પુરતી સંભાવના રહેલ હોય. કંપનીએ આવક પર ઈન્ડ એ એસ ૧૧૫ મુજબ માર્ગદર્શન લાગુ કરીયું છે. ગ્રાહક સાથેના કરારમાંથી, પક્ષ સાથેના કરારમાં જણાવેલ દરેક વિશિષ્ટ કામગીરીની જવાબદારી માટે માપદંડ લાગુ કરવામાં આવેલ છે.

વ્યાજના આવકને ઓળખવા માટે અસરકારક વ્યાજ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો અકુઅલ બેઝીસ પર હિસાબ કરવામાં આવે છે.

અન્ય તમામ આવકના સ્ત્રોતો અકુઅલ બેઝ પર એકાઉન્ટીંગ કરવામાં આવે છે.

જે. પ્રાવધાનો (કર્મચારી ફાયદા સિવાયના) :

પ્રાવધાનને કોઈ જુની ઘટનાના આધારે ઓળખવામાં આવે છે કે જેમાં કંપનીને હાલમાં પણ એવી જવાબદારી રહેલ છે કે જેનો અંદાજ લઈ શકાય અને તે સંભવિત છે કે નાણાંકીય બેનીફીટની જરૂર આવા કાયદાકીય કે કરારી જવાબદારીઓને પુરી કરવા માટે પડી શકે છે. પ્રાવધાનો તેના પર નક્કી કરવામાં આવે છે કે ભવિષ્યમાં કેટલો કેશ ફ્લો થઈ શકે (બેલેન્સ શીટની તારીખે થનાર સંભવિત ખર્ચના અંદાજોના આધારે) અને તે પણ વેરા પહેલાના દર મુજબ કે ચાલતા બજાર અંદાજો અને તે સમયે રહેલ પૈસાની કિંમત મુજબ અને જવાબદારીઓમાં રહેલ રીસ્ક મુજબ રહે છે. થનાર ડીસ્કાઉન્ટો નાણાંકીય કિંમત મુજબ રહેશે. થનાર ઓપરેટીંગ નુકસાનનો અંદાજ દર્શાવવામાં આવતો નથી.

કંટીજન્સીઓ

સંભવિત નુકસાનને લગતા પ્રાવધાનો કે જે દાવાઓ, લીટીગેશન, એસેસમેન્ટ, ફાઈન, પેનાલ્ટી વગેરે. તેઓને ત્યારે જ ઓળખી શકાય છે કે જ્યારે તેની પૂર્ણતઃ જવાબદારી ઊભી થાય છે કે જેના દ્વારા ચોક્કસ કિંમત નક્કી કરી શકાય છે.

એલ. કંટીજન્સીને લગતી જવાબદારીઓ :

કંટીજન્સીને ત્યારે દર્શાવવામાં આવે કે જ્યારે એવી સંભવિત જવાબદારી હોય કે જુના કોઈ ઘટનાના કારણે ઉદ્ભવે અને તેનો અસ્તિત્વ ત્યારે જ નિશ્ચિત થાય કે જ્યારે ભવિષ્યમાં એક કે તેનાથી વધારે ઘટનાઓ થાય કે જે કંપનીના પુરા નિયંત્રણમાં ન હોય કે ભૂતકાળના ઘટનાના કારણે હાલમાં કોઈ જવાબદારીઓ ઊભી થઈ હોય કે જ્યાં આવા ઘટનાને સેટલ કરવા માટે નાણાં ચૂકવવાની જરૂરીયાત ઊભી થાય કે આવા થનાર ખર્ચનો પુરેપુરો અંદાજ પ્રાપ્ત કરી ન શકાય. આવી કંટીજન્સી જવાબદારી એ સંભવિત ભવિષ્યની ઘટનાઓ કે જે ઘટિત અથવા અઘટિત હોય અને તે કંપનીના અંકુશમાં રહેલી ના હોય.

એમ. આવક વેરો :

આવક વેરામાં કરન્ટ અને ડીફર્ડ ટેક્સનો સમાવેશ થાય છે. એવી બાબતો કે જે ઈક્વીટી અથવા અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક સિવાયની બાબતને નફા કે નુકસાનમાં દર્શાવવામાં આવે.

કરન્ટ ટેક્સ

કરન્ટ ટેક્સમાં ચૂકવવા પાત્ર વેરો કે ટેક્ષેબલ આવકમાંથી મળવાપાત્ર આવક કે નુકસાન જે તે વર્ષનો હોય અને જુના વર્ષોના આધારે ચૂકવવા પાત્ર કે મળવાપાત્ર વેરામાં એડજેસ્ટ કરવામાં આવે છે. કરન્ટ ટેક્સની રકમ તે દર્શાવે છે કે વેરાની રકમનો સૌથી સારો અંદાજ શું છે કે જે ચૂકવવા કે મળવાપાત્ર છે અને તેના પર આવક વેરાની અનિશ્ચિતતાને ધ્યાને લીધેલ હોય.

તેની ગણતરી વેરા દરો (અને વેરાના નિયમો) કે જે રીપોર્ટીંગની તારીખે લાગુ પડતા હોય તેના આધારે કરવામાં આવે છે. કરન્ટ ટેક્સ અને કરન્ટ ટેક્સની જવાબદારીઓ ઓફસેટ ત્યારે જ હોય જ્યારે લાગુ પડતા રકમ પર કોઈ કાયદાકીય હક્કો કે અધિકારો રહેલ હોય, અને તેનો ઉદ્દેશ્ય એસેટને પ્રાપ્ત કરવા અને તેને નેટ બેઝીસ કે એક સાથે સેટલ કરવા માટે થાય છે. તેવા વેરાના લાભો કે જે કર્મચારી સ્ટોક ઓપશનના કારણે પ્રાપ્ત થયેલ હોય કે જે કોમ્પ્રીહેન્સીવ આવકમાં જમા કરવામાં આવેલ આવકમાં ચાર્જ કરવામાં આવેલ વળતર કરતા વધારે હોય ત્યારે.

ડીફર્ડ ટેક્સ

ડીફર્ડ ટેક્સને તે રીતે ઓળખવામાં આવે છે કે તે એસેટની રકમ અને જવાબદારીઓમાં રહેલ ફેરફારો કે જેનો ઉપયોગ નાણાંકીય રીપોર્ટીંગ માટે કરવામાં આવેલ હોય અને તેવા રકમને વેરાના કામે ઉપયોગ કરવામાં આવેલ હોય. ડીફર્ડ ટેક્સને એમ પણ ઓળખવામાં આવે છે કે જેમાં કેરી ફોર્વર્ડ કરવામાં આવેલ ટેક્સ અને ટેક્સ ક્રેડીટ હોય. ડીફર્ડ ટેક્સને ત્યારે રેકગનાઈઝ કરવામાં આવતી નથી જ્યારે :

- કોઈ પણ લેવડ દેવડ વખતે ટેક્સના નફા / નુકસાનની ગણતરી પર અસર ન કરે તો તેવા એસેટ કે લાયબીલીટીમાં અસ્થાઈ ફેરફાર હોય તો.
- ગુડવીલના પહેલા ઓળખ વખતે રહેલ અસ્થાઈ ટેક્સમાં ફેરફારો.

ડીફર્ડ ટેક્સ એસેટને તે હદ સુધી ઓળખવામાં આવે છે કે જ્યારે તેવી સંભાવના રહેલ હોય કે ભવિષ્યમાં ટેક્સવાળો નફો ઉપલબ્ધ હોય અને તેની સામે તેનો ઉપયોગ કરી શકાય. બીન વપરાયેલ વેરાના નુકસાનોનો અસ્થિત્વ તે ચોક્કસપણે દર્શાવે છે કે ભવિષ્યમાં વેરામાં નફો રહેશે નહિ. આથી, નુકસાનનો ઈતિહાસ હોય તો, કંપનીએ ડીફર્ડ ટેક્સ એસેટને ત્યારે જ ઓળખવી જોઈએ કે જ્યારે તેની પાસે જરૂરીયાત મુજબ ટેક્સમાં તફાવત રહેલ હોય કે ત્યારે જ્યારે એવી ચોક્કસ સાબિતી હોય કે જરૂરીયાત મુજબનો ટેક્સમાં નફો ઉપલબ્ધ રહેશે કે જેની સામે ડીફર થયેલ ટેક્સ એસેટ પ્રાપ્ત કરી શકાય. ડીફર થયેલ ટેક્સ એસેટ રેકગનાઈઝ થયેલ કે રેકગનાઈઝ થયા વગરની, તેનો રીવ્યુ દરેક રીપોર્ટીંગની તારીખે કરવામાં આવે છે અને તેને તે હદે રેકગનાઈઝ કરવામાં આવે છે કે જ્યારે તેવી સંભાવના રહેલ હોય કે સંબંધિત વેરાના ફાયદાઓ પ્રાપ્ત કરી શકાય.

ડીફર્ડ ટેક્સની ગણતરી તેવા વેરાના દર પર કરવામાં આવે છે કે જે તેવા સમયે લાગુ પડે કે જ્યારે તે એસેટ ઊભો થયો હોય કે જવાબદારી પૂરી થઈ હોય અને રીપોર્ટીંગના સમયે જે નિયમો અસરમાં હોય ત્યારે.

ડીફર્ડ ટેક્સની ગણતરી તે દર્શાવે છે કે વેરાની જવાબદારીઓ પાછળથી આવશે અને એવી રીતે આવશે કે જે રીતે કંપનીની

અપેક્ષા છે, અને તે પણ રીપોર્ટીંગની તારીખે, કે જેથી એસેટ કે લાયબલીટીના કેરીંગ એમાઉન્ટને વસુલ કે ચૂકવી શકાય.

ડીફર્ડ ટેક્સ એસેટ અને લાયબલીટી ત્યારે ઓફસેટ હોય જ્યારે કરન્ટ ટેક્સ લાયબલીટી કે એસેટને ઓફસેટ કરવાનો કોઈ કાયદાકીય લાગુ કરવાનો હક્ક રહેલ હોય, અને તે સમાન સત્તા દ્વારા વસુલ કરવામાં આવેલ આવક વેરાને લગત હોય કે સમાન ટેક્સ એન્ટીટી કે જુદો ટેક્સ એન્ટીટી હોય, પરંતુ તે કરન્ટ ટેક્સ લાયબલીટી અને એસેટને નેટ બેઝીસના આધાર સેટલ કરવા માગતી હોય કે તેઓના ટેક્સ એસેટ કે લાયબલીટીને એકસાથે પ્રાપ્ત કરી શકાય.

ટાઈમીંગના ફેરફારને લગતા ડીફર્ડ ટેક્સ કે જે તે વર્ષના ટેક્સ હોલીડે પીરીયડ રેકગનાઈઝ થયા બાદ રીવર્સ કરવામાં આવેલ હોય.

એન. શેરદીઠ આવક :

સામાન્ય આવક / (નુકસાન) પ્રતિ શેરની ગણતરી વર્ષના નેટ નફા કે નુકસાનનો ભાગાકાર કરીને કરવામાં આવે છે કે જે ઈકવિટી શેરધારકોને લગત હોય કે જે તે વર્ષના આઉટસ્ટેન્ડીંગ ઈકવિટીશેરની સંખ્યાના સરેરાશ મુજબ હોય છે. દરેક બોનસ અને શેર વિભાજનને જે તે વર્ષના આઉટસ્ટેન્ડીંગ ઈકવિટી શેરના સરેરાશ સંખ્યા સામે સરભર કરવામાં આવે છે. દરેક શેરના ડાયલ્યુટેડ આવક / (નુકસાન) ની ગણતરી કરવા માટે દરેક ઈકવિટી શેરધારકના વર્ષમાં થયેલા નફા કે નુકસાન અને વર્ષમાં આઉટસ્ટેન્ડીંગ રહેલ શેરોના ભારીત મધ્યકની સંખ્યાને એડજેસ્ટ કરવામાં આવે છે.

ઓ. કેશ અને કેશના સમાન્તરો :

એક બેલેન્સ શીટમાં કેશ અને કેશ સમાન્તરોમાં બેન્કમાં રહેલ કેશ અને હાથ પર રહેલ અને ટુકા ગાળાના ડીપોઝીટ કે જેની મેચ્યુરીટી સમય ત્રણ માસ કે તેનાથી ઓછો હોય તેનો સમાવેશ થાય છે અને તેના પર વેલ્યુમાં ફેરફારમાં રહેલ રીસ્કની અસર રહેલ છે.

કંપનીના કેશ મેનેજમેન્ટના આંતરીક ભાગ તરીકે કેશ ફ્લો, કેશ અને કેશના સમાન્તર કે જેમાં કેશ અને શોર્ટ ટર્મ ડીપોઝીટ, કે જે ઉપર દર્શાવવામાં આવેલ છે અને બેન્ક ઓવરડ્રાફ્ટના નેટનો સમાવેશ થાય છે.

પી. રીપોર્ટીંગના સમયગાળા પછી થયેલ ઈવેન્ટ :

તેવા ઈવેન્ટને એડજેસ્ટ કરવા કે જે રીપોર્ટીંગ પીરીયડના અંતે રહેલ પરિસ્થિતિ દર્શાવે છે. નાણાંકીય પત્રકોને ઈશ્યુના એથોરાઈઝેશન પહેલા દરેક ઈવેન્ટ માટે એડજેસ્ટ કરવામાં આવે છે. એડજેસ્ટ કર્યા સિવાયના ઈવેન્ટ તે દર્શાવે છે કે રીપોર્ટીંગ સમયગાળાના અંતે કેવી પરિસ્થિતિઓ રહેલી છે. રીપોર્ટીંગની તારીખે પછી થયેલ નોન - એડજસ્ટીંગ ઈવેન્ટ એકાઉન્ટ કરવામાં આવતી નથી પરંતુ તેને જાહેર કરવામાં આવે છે.

કચુ. રોકડ પ્રવાહનું પત્રક :

રોકડ પ્રવાહનો અહેવાલ પરોક્ષ પદ્ધતિથી કરેલ છે. જેમાં નફો (નુકસાન) કરવેરા પહેલા અસર આપીને આ વ્યવહારો બિન રોકડ પ્રકારના હોય તો તેનો પ્રકાર અને કોઈ ફેરફાર અથવા એકુઅલના ધોરણો અથવા ભવિષ્યમાં રોકડ આવક કે ચૂકવણાના આધારે જરૂરી અસર આપેલ છે. વર્ષ દરમિયાન રોકડ પ્રવાહને સંચાલન, રોકાણ અને નાણાંકીય પ્રવૃત્તિ એમ ત્રણ પ્રકારે દર્શાવેલ છે.

આર. સામાન્ય :

ઉપરોક્ત હિસાબી નીતિઓમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ ન હોય તેવી બાબતો સામાન્ય સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો પ્રમાણે છે.

બહુચરાણ રેલ કોર્પોરેશન લિ. ૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિત નાણાકીય પત્રકોની નોંધ		
(રકમ રૂ.માં)		
વિગત	૩૧-૩-૨૦૨૨ અંતિત	૩૧-૩-૨૦૨૧ અંતિત
૪. રાઈટ ઓફ યુઝ એસેટ - લીઝ હોલ્ડ ઓફિસ *		
ગ્રોસ કેરીઈટ વેલ્યુ		
ઉઘડતી સિલક	-	-
ઉમેરો	૭૬ ૩૧ ૯૪૩	-
ડીડપોઝલ	-	-
આઈએનડીએએસ મુજબ એડજસ્ટમેન્ટ	-	-
બંધ સિલક	૭૬ ૩૧ ૯૪૩	-
ઘસારો		
ઉઘડતી સિલક	-	-
વર્ષ દર્મયાન ફેરફાર	૭ ૬૩ ૧૯૪	-
એડજસ્ટમેન્ટ	-	-
આઈએનડીએએસ મુજબ એડજસ્ટમેન્ટ	-	-
બંધ સિલક	૭ ૬૩ ૧૯૪	-
નેટ કેરીઈગ વેલ્યુ	૬૮ ૬૮ ૭૪૯	-
* જુઓ નોંધ નં. ૪૪		
૫. કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ જેમાં:-		
કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ - કચેરી *	૧ ૯૩ ૧૭ ૩૭૭	૨ ૫૩ ૧૧૦
કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ - જમીન સંપાદન	૪ ૧૮ ૮૭ ૪૯૮	૫ ૬૪ ૧૨૫
કુલ	૬ ૧૨ ૦૪ ૮૭૫	૮ ૧૭ ૨૩૫
* જુઓ નોંધ નં. ૩૯		
૬. વિકાસ હેઠળ રહેલ અવાસ્તવિક મિલકતો		
વિકાસ હેઠળ રહેલ ફેઈટ શેરીંગ રાઈટ	૨૨૭ ૫૧ ૬૫ ૯૬૦	૬૫ ૩૭ ૩૩ ૯૭૯
કુલ	૨૨૭ ૫૧ ૬૫ ૯૬૦	૬૫ ૩૭ ૩૩ ૯૭૯
* જુઓ નોંધ નં. ૪૦		

વિગત	૩૧-૩-૨૦૨૨ અંતિત	૩૧-૩-૨૦૨૧ અંતિત
૭. અન્ય નોન - કરન્ટ એસેટ		
વિકાસ હેઠળ રહેલ ઇન્ટેન્જેબલ એસેટ માટેનો એડવાન્સ ચૂકવણી*		
- ઈપીસી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલ એડવાન્સ**	૪૦ ૫૪ ૮૪ ૫૯૭	૨૬ ૩૫ ૧૯ ૯૯૮
- ઈપીસી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલ મોબલાઈઝેશન એડવાન્સ પર મળવાપાત્ર વ્યાજ	૨ ૪૫ ૩૪ ૬૮૦	૧ ૯૩ ૯૬ ૫૧૬
સેટ્યુટરી / સરકારી સત્તાઓ પાસે રહેલ સિલક મળવાપાત્ર જીએસટી	૧ ૯૭ ૬૦ ૮૧૯	૧ ૫૩ ૭૬ ૫૬૫
કુલ	૪૪ ૯૭ ૮૦ ૦૯૬	૨૯ ૮૨ ૯૩ ૦૭૯
*તારીખ ૩૧/૦૩/૨૦૨૨ ના રોજ અંત થતા વર્ષ મુજબ આવનાર ૧૨ માસમાં વસુલ કરવાની થતી મોબલાઈઝેશન એડવાન્સ અને મળવાપાત્ર વ્યાજની રકમ નક્કી કરવામાં આવેલ નથી. આથી મોબલાઈઝેશન એડવાન્સ અને મળવાપાત્ર વ્યાજ લાભા ગાળાના એસેટ હોવાથી તેને નોન - કરન્ટ એસેટમાં દર્શાવવામાં આવેલ છે.		
** જુઓ નોંધ નં. ૩ (૨) એફ અને ૪૦		
૮. મળવાપાત્ર લેણા		
૬ માસથી ઓછા માટે		
તકરાર વગર મળવાપાત્ર લેણા - સારા પ્રકારની	૧૩ ૬૭ ૯૯ ૧૯૬	-
તકરાર વગર મળવાપાત્ર લેણા - શકમદ પ્રકારની	-	-
તકરારી મળવાપાત્ર લેણા - સારા પ્રકારની	-	-
તકરારી મળવાપાત્ર લેણા - શકમદ પ્રકારની	-	-
૬ માસ - ૧૬ વર્ષ	-	-
૧ - ૨ વર્ષ	-	-
૨ - ૩ વર્ષ	-	-
૩ વર્ષથી વધારે	-	-
કુલ	૧૩ ૬૭ ૯૯ ૧૯૬	-
૯. કેશ અને કેશનો સમાન્તર		
બેન્ક પાસે રહેલ સિલક		
યુનીયન બેંક ઓફ ઈન્ડિયા કરન્ટ ખાતુ	૭૦૮૨૩૯૧૪	૮૦૦૪૮૦૬
યસ બેંક કરન્ટ ખાતુ	૧ ૦૭ ૫૧ ૩૧૩	૪ ૫૩ ૫૬ ૮૧૨
કુલ	૮ ૧૫ ૭૫ ૨૨૭	૫ ૩૩ ૬૧ ૬૧૮

વિગત	૩૧-૩-૨૦૨૨ અંતિત	૩૧-૩-૨૦૨૧ અંતિત
૧૦. અન્ય બેંક પાસે રહેલ સિલક		
જીએસએફસી પાસે રહેલ સિલક - લીકવીટ રોકાણ	૩૧ ૪૩ ૪૯ ૯૪૭	-
જીએલએફસી પાસે રહેલ સિલક - ઈન્ટર કોર્પોરેટ રોકાણ	૨૦૦ ૦૦ ૦૦ ૦૦૦	૯૬ ૦૦ ૦૦ ૦૦૦
કુલ	૨૩૧ ૪૩ ૪૯ ૯૪૭	૯૬ ૦૦ ૦૦ ૦૦૦
૧૧. કરન્ટ વેરા એસેટ (નેટ)		
નાણાકીય વર્ષ ૨૦૨૧ - ૨૨		
માટે આવક વેરાનો પ્રાવધાન	૯૨ ૨૮ ૭૬૮	-
ઘટાડો:-		
યુકવેલ એડવાન્સ વેરો		
નાણાકીય વર્ષ ૨૦૨૧ - ૨૨	૩ ૬૦ ૯૯૩	-
મળવાપાત્ર ટીડીએસ નાણાકીય વર્ષ ૨૦૨૧ - ૨૨	૧ ૪૮ ૫૬ ૨૬૩	-
કુલ	૯૬ ૯૮ ૪૯૪	
૧૨. કરવેરા		
નફા અને ગુકશાનનના પત્રકમાં દર્શાવેલ વેરા ખર્ચ		
કરન્ટ વેરો	૯૨ ૨૮ ૭૬૮	૫૫ ૦૨ ૫૮૨
ડીફર થયેલ વેરો	-	-
ચાલુ વર્ષે ઓળખવામાં આવેલ કુલ વેરા ખર્ચ	૯૨ ૨૮ ૭૬૮	૫૫ ૦૨ ૫૮૨
વર્ષ માટેના વેરા ખર્ચને હિસાબી નફામાં નીચે મુજબ રઈકન્સાઈલ કરી શકાય:-		
વેરા પહેલાનો નફો / (નુકશાન) અને અસામાન્ય બાબતો	૧ ૪૫ ૮૯ ૮૦૦	૭૦ ૦૧ ૩૭૪
લાગુ પડતો વેરાનો દર	૨૭.૮૨	૨૭.૮૨
ગણતરી કરેલો વેરા ખર્ચ	૪૦ ૫૮ ૮૮૨	૧૯ ૪૭ ૭૮૨
વેરાની અસરો:-		
એકઝેસ્ટ થયેલ આવક	-	-
નામંજુર થયેલ ખર્ચ (૧, ૮૫, ૮૩, ૩૪૩*૨૭.૮૨%)	૫૧ ૬૯ ૮૮૬	૩૫ ૫૪ ૮૦૦
જો એમએટી કેડીટ થયેલ હોય તો	-	-
વધારાના એલોવેન્સનું નેટ		
કરન્ટ વેરાનો પ્રાવધાન	૯૨ ૨૮ ૭૬૮	૫૫ ૦૨ ૫૮૨
પીપીએલ અને ઈન્ટેન્જેબલ એસેટ પર ઈન્ક્રીમેન્ટલ ડીફર થયેલ વેરાની જવાબદારી	-	-

વિગત	૩૧-૩-૨૦૨૨ અંતિત	૩૧-૩-૨૦૨૧ અંતિત
નાણાકીય એસેટ અને અન્ય આઈટમો પર ઈન્ફીમેન્ટલ ડીફર થયેલ વેરાની જવાબદારી / (એસેટ)	-	-
ડીફર પયેલ વેરા પ્રાવધાન	-	-
નફા અને લુકશાનના પત્રમાં દર્શાવેલ વેરા ખર્ચ	૯૨ ૨૮ ૭૬૮	૫૫ ૦૨ ૫૮૨
અસરકારક વેરાનો દર	૬૩%	૭૯%
એકસેપશનલ આઈટમ પર વેરો	-	-
૧૩. અન્ય કરન્ટ એસેટ		
કેપીટલ એડવાન્સ સિવાયનો એડવાન્સ		
અન્ય એડવાન્સ		
અગાઉ થી ચુકવેલ ખર્ચ	૩ ૩૭૬	-
જીએસએફએસ પર મળવાપાત્ર વ્યાજ	૮૨ ૨૩ ૮૧૯	૧ ૦૧ ૬૯ ૪૨૪
કુલ	૮૨ ૨૭ ૧૯૫	૧ ૦૧ ૬૯ ૪૨૪
૧૪. ઈકવીટી શેર કેપીટલ		
ઓથોરાઈઝ થયેલ:-		
૭૮,૬૨,૨૦,૦૦૦ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦	૭૮૬ ૨૨ ૦૦ ૦૦૦	૭૮૬ ૨૨ ૦૦ ૦૦૦
ના ફૂલ્લી પેઈડ અપ		
(૭૮,૬૨,૨૦,૦૦૦ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦		
ના ફૂલ્લી પેઈડ અપ)*	૭૮૬ ૨૨ ૦૦ ૦૦૦	૭૮૬ ૨૨ ૦૦ ૦૦૦
કુલ	૭૮૬ ૨૨ ૦૦ ૦૦૦	૭૮૬ ૨૨ ૦૦ ૦૦૦
ઈશ્યુ કરેલ, સબસ્ક્રાઈબ કરેલ:-		
૪૯,૬૯,૧૭,૨૦૦ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦
ના ફૂલ્લી પેઈડ અપ		
(૧૯,૨૩,૭૫,૦૦૦ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦		
ના ફૂલ્લી પેઈડ અપ)*	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦
કુલ	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦
ચુકવેલ કેપીટલ:-		
૪૯,૬૯,૧૭,૨૦૦ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦
ના ફૂલ્લી પેઈડ અપ		
(૧૯,૨૩,૭૫,૦૦૦ ઈકવીટી શેર પ્રતિ રૂ. ૧૦		
ના ફૂલ્લી પેઈડ અપ)*	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦
કુલ	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦

* બ્રેકેટમાં રહેલ આંકડાઓ ગત વર્ષના આંકડાઓ દર્શાવે છે.

નોંધો:-

(૧) સમયગાળા શરૂઆતે અને અંતે આઉટસ્ટેન્ડીંગ શેરોના રીકન્સીલેશન

વિગત	૨૦૨૧-૨૨		૨૦૨૦-૨૧	
	શેરોની સંખ્યા	રકમ	શેરોની સંખ્યા	રકમ
વર્ષની શરૂઆતમાં	૧૯ ૨૩ ૭૫ ૦૦૦	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦	૧૦ ૦૦ ૦૦૦	૧ ૦૦ ૦૦ ૦૦૦
ઉમેરો : વર્ષ દરમ્યાન ઈશ્યુ થયેલ	૩૦ ૪૫ ૪૨ ૨૦૦	૩૦૪ ૫૪ ૨૨ ૦૦૦	૧૯ ૧૩ ૭૫ ૦૦૦	૧૯૧ ૩૭ ૫૦ ૦૦૦
વર્ષના અંતે આઉટસ્ટેન્ડીંગ	૪૯ ૬૯ ૧૭ ૨૦૦	૪૯૬ ૯૧ ૭૨ ૦૦૦	૧૯ ૨૩ ૭૫ ૦૦૦	૧૯૨ ૩૭ ૫૦ ૦૦૦

(૨) ઈકવીટી શેરને લગત નિયમો / હક્કો

- કંપની પાસે એક જ કલાસના ઈકવીટી શેરો છે અને તેની કિંમત રૂ. ૧૦/- પ્રતિ શેર છે.
- દરેક શેર ધારકને પ્રતિ શેર એક વોટ પ્રાપ્ત છે.
- જો કંપનીનું લીકવીડેશન થાય તો ઈકવીટી શેર ધારકોને બધી લાયબલીટીઓ ચૂકવ્યા બાદ કંપની પાસે રહેલ એસેટો પર હકક રહેશે. તેની વહેંચણી શેર ધારકો પાસે રહેલ ઈકવીટી શેરોની સંખ્યા મુજબ રહેશે.

(૩) શેરોની ફાળવણી

- ચાલુ વર્ષે કંપનીએ નીચે દર્શાવેલ દરેક પ્રમોટરોને રૂ. ૧૦/- ના ૩૦, ૪૫, ૪૨, ૨૦૦ ઈકવીટી શેરોની ફાળવણી કરેલ છે.
- ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ (જી - રાઈડ) ૧૨, ૬૦, ૦૦, ૦૦૦ (ગત વર્ષ ૧૦, ૦૮, ૪૦, ૦૦૦) પાસે રૂ. ૧૦/- પ્રતિ શેરના ઈકવીટી શેર રહેલ છે.
- મારૂતી સુઝુકી ઈન્ડિયા લીમીટેડ (એમએસઆઈએલ) ૧૪, ૫૮, ૧૭, ૨૦૦ (ગત વર્ષ ૫, ૮૧, ૭૦, ૦૦૦) પાસે રૂ. ૧૦/- પ્રતિ શેરના ઈકવીટી શેર રહેલ છે.
- ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી) ૩, ૨૬, ૨૫, ૦૦૦ (ગત વર્ષ ૩, ૨૩, ૬૫, ૦૦૦) પાસે રૂ. ૧૦/- પ્રતિ શેરના ઈકવીટી શેર રહેલ છે.

(૪) ૫% કરતા વધારે શેર કેપીટલ ધરાવતા શેર ધારકોની વિગત નીચે મુજબ છે.

શેર ધારકનું નામ	૩૧ માર્ચ ૨૦૨૨ અંતિત		૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	
	શેરોની સંખ્યા	% હોલ્ડીંગ	શેરોની સંખ્યા	% હોલ્ડીંગ
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ (જી - રાઈડ)	૨૨ ૭૨ ૫૦ ૦૦૦	૪૫.૭૩%	૧૦ ૧૨ ૫૦ ૦૦૦	૫૨.૬૩%
મારૂતી સુઝુકી ઈન્ડીયા લિમીટેડ (એમએસઆઈએલ)	૨૦ ૪૪ ૧૭ ૨૦૦	૪૧.૧૪%	૫ ૮૫ ૦૦ ૦૦૦	૩૦.૪૧%
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)	૬ ૫૨ ૫૦ ૦૦૦	૧૩.૧૩%	૩ ૨૬ ૨૫ ૦૦૦	૧૬.૯૬%

કંપનીના રેકોર્ડ અનુસાર, કે જેમાં શેર ધારકો / સભ્યોના રજીસ્ટરોનો સમાવેશ થાય છે તે મુજબ ઉપર જણાવેલ શેરધારકો શેરોના કાયદા મુજબ માલિકી દર્શાવે છે.

યાલુ વર્ષે કંપનીએ કોઈપણ બોનસ શેર બહાર પાડેલ નથી.

(૫) શેર ધારણ કરનાર પ્રમોટરોનું કીઝકલોશર

પ્રમોટરનું નામ	૩૧ માર્ચ ૨૦૨૨ અંતિત		વર્ષ દરમિયાન ફેરફારની ટકાવારી
	શેરોની સંખ્યા	% હોલ્ડીંગ	
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ	૨૨ ૭૨ ૫૦ ૦૦૦	૪૫.૭૩%	(૬.૯૦%)
મારૂતી સુઝુકી ઈન્ડીયા લિમીટેડ	૨૦ ૪૪ ૧૭ ૨૦૦	૪૧.૧૪%	૧૦.૭૩%
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન	૬ ૫૨ ૫૦ ૦૦૦	૧૩.૧૩%	(૩.૮૩%)

પ્રમોટરનું નામ	૩૧ માર્ચ ૨૦૨૧ અંતિત		વર્ષ દરમિયાન ફેરફારની ટકાવારી
	શેરોની સંખ્યા	% હોલ્ડીંગ	
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ	૧૦ ૧૨ ૫૦ ૦૦૦	૫૨.૬૩%	૧૧.૬૩%
મારૂતી સુઝુકી ઈન્ડીયા લિમીટેડ	૫ ૮૫ ૦૦ ૦૦૦	૩૦.૪૧%	(૨.૫૯)%
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન	૩ ૨૬ ૨૫ ૦૦૦	૧૬.૯૬%	(૯.૦૪)%

વિગત	૩૧-૩-૨૦૨૨ અંતિત	૩૧-૩-૨૦૨૧ અંતિત
૧૫. અન્ય ઇક્વિટી		
રીટેઇન થયેલ આવક		
રીટેઇન થયેલ આવકની ઉઘડતી સિલક	(૩૫૬૯૮૬૧૪)	(૩૭૧૯૭૪૦૬)
વર્ષ દરમ્યાનનું એડજેસ્ટમેન્ટ વધારો / ઘટાડો	-	-
વર્ષ દરમ્યાનનો નેટ (નુકશાન) / નફો	૫૨૮૩૫૮૪	૧૪૯૮૭૯૨
બંધ સિલક	(૩૦૪૧૫૦૩૦)	(૩૫૬૯૮૬૧૪)
કુલ રીઝર્વ અને સરપ્લસ	(૩૦૪૧૫૦૩૦)	(૩૫૬૯૮૬૧૪)
૧૬. અન્ય નાણાંકીય જવાબદારીઓ - નોન કરન્ટ		
રીટેન્શનની રકમ	૭૪૧૯૬૬૮૯	૨૪૮૨૯૦૬૮
લીઝની જવાબદારી (જુઓ નોંધ નં. ૪૪)	૫૭૦૮૧૪૦	-
કુલ	૭૯૯૦૪૮૨૯	૨૪૮૨૯૦૬૮
કરન્સી અને લીકવીડિટી ખતરાઓ કે જે નાણાકીય જવાબદારીઓને લગત છે તેની સામે કંપનીનો ઓકસ્પોસર નોંધ નંબર ૩૨ માં દર્શાવવામાં આવેલ છે.		
૧૭. ચૂકવવાપાત્ર ટ્રેડ - કરન્ટ		
એક વર્ષથી ઓછા સમયગાળા માટે		
૧. એમએસએમઈ	-	૨૩૦૯૨૬
૨. અન્ય	૧૫૯૫૨૫૦	-
૩. તકરારી લેણા - એમએસએમઈ	-	-
૪. તકરારી લેણા - અન્ય	-	-
૧ થી ૨ વર્ષ	-	-
૨ થી ૩ વર્ષ	-	-
૩ વર્ષથી વધારે	-	-
કુલ	૧૫૯૫૨૫૦	૨૩૦૯૨૬
કરન્સી અને લીકવીડિટી ખતરાઓ કે જે ચૂકવવાપાત્ર ટ્રેડને લગત છે તેની સામે કંપનીનો ઓકસ્પોસર નોંધ નંબર ૩૨ માં દર્શાવવામાં આવેલ છે.		
૧૮. અન્ય નાણાકીય જવાબદારીઓ - કરન્ટ લીજની હાલની જવાબદારી*		
ચૂકવવામાં બાકી રહેલ લીજની જવાબદારી ની હાલની મેચ્યુરીટી	૧૩૧૨૬૨૫	-
કુલ	૧૩૧૨૬૨૫	-
* જુઓ નોંધ નંબર ૪૪		

વિગત	૩૧-૩-૨૦૨૨ અંતિત	૩૧-૩-૨૦૨૧ અંતિત
૧૯. પ્રાવધાનો - કરન્ટ		
યૂકવવાપાત્ર કન્સલટન્સી / પ્રોફેશનલ ચાર્જસ	૮૦ ૫૫૦	૭૮ ૬૨૫
ભાડા ખર્ચ યૂકવવાપાત્ર	૪ ૩૨ ૭૬૮	-
સુધારો અને જાળવણી - મકાનનુ યૂકવવાપાત્ર	૬૩ ૧૩૨	-
યૂકવવાપાત્ર આંતરીક ઓડીટર ફીસ	૧ ૦૧ ૦૩૩	૪૭ ૦૩૩
યૂકવવાપાત્ર મેનપવર સેવાઓ ખર્ચ	૫ ૮૭ ૨૫૫	૧ ૪૦ ૧૨૬
યૂકવવાપાત્ર સેટ્યુટરી ઓડીટર ફીસ	૬૭ ૫૦૦	૪૬ ૨૫૦
યૂકવવાપાત્ર વાહનો ભાડે લેવાનો ખર્ચ	૧ ૫૨ ૩૯૮	૨ ૦૯ ૪૧૮
યૂકવવાપાત્ર સેક્રેટરીયલ ઓડીટ ફીસ	૪૫ ૦૦૦	-
યૂકવવાપાત્ર બોર્ડ મીટીંગ ખર્ચ	૧૫ ૦૦૦	-
યૂકવવાપાત્ર ખર્ચા માટેના પ્રાવધાનો - ઈપીસી કોન્ટ્રાક્ટ	૨૮ ૧૩ ૪૩ ૭૭૩	૫ ૧૧ ૩૦ ૩૮૩
યૂકવવાપાત્ર ખર્ચા માટેના પ્રાવધાનો - પીએમસી ખર્ચ	૧ ૫૫ ૯૫ ૯૯૬	૧૫ ૧૨ ૧૫૮
યૂકવવાપાત્ર ખર્ચા માટેના પ્રાવધાનો - ફીઝેબીલીટી અભ્યાસ ખર્ચ	૩૭ ૭૨ ૦૦૦	-
યૂકવવાપાત્ર ખર્ચા માટેના પ્રાવધાનો - કચેરી	૧ ૯૩ ૦૫૦	૨ ૩૭ ૦૨૩
કુલ	૩૦ ૨૪ ૪૯ ૪૫૫	૫ ૩૪ ૦૧ ૦૧૬
૨૦. અન્ય કરન્ટ જવાબદારીઓ		
બીડ સુરક્ષા / ઈર્નસ્ટ રકમનું રોકાણ	૧ ૦૭ ૨૫૦	૧ ૦૭ ૨૫૦
યૂકવવાપાત્ર સ્ટેચ્યુટરી ડ્યુ		
યૂકવવાપાત્ર ટીડીએસ	૧ ૨૨ ૭૬ ૪૫૨	૨૮ ૭૧ ૨૮૬
લેબર સેસ	૨૩ ૯૦ ૯૯૫	૧૫ ૯૩ ૪૮૨
યૂકવવાપાત્ર ટીડીએસ જીએસટી	૪૧ ૩૦ ૫૮૨	૩૨ ૯૩ ૫૭૦
યૂકવવાપાત્ર જીએસટી આરસીએમ	૩૫ ૩૨૬	-
કુલ	૧ ૮૯ ૪૦ ૬૦૪	૭૮ ૬૫ ૫૮૮
૨૧. અન્ય કરન્ટ વેરાની જવાબદારી (નેટ)		
આવક વેરાનો પ્રાવધાન - નાણાકીય વર્ષ ૨૦૨૦ - ૨૧	-	૫૫ ૦૨ ૫૮૨
લેસ:-		
અગાથી ભરપાઈ કરેલ વેરો - નાણાકીય વર્ષ ૨૦૨૦ - ૨૧	-	૨૦ ૦૦ ૦૦૦
કુલ મળવાપાત્ર ટીડીએસ	-	૧૫ ૦૫ ૨૩૦
કુલ	-	૧૯ ૯૭ ૩૫૨

વિગત	૩૧-૩-૨૦૨૨ અંતિત	૩૧-૩-૨૦૨૧ અંતિત
૨૨. કામગીરીમાંથી આવક *		
બાંધકામ સેવાઓ	૩૬ ૪૬ ૨૦ ૫૩૬	-
રેલનું વેચાણ	૬ ૬૦ ૦૦ ૦૦૦	-
પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ચાર્જ	૮૬ ૨૫ ૦૦૦	-
કુલ	૪૩ ૯૨ ૪૫ ૫૩૬	-
<p>* હાલના વર્ષમાં કંપની એમએસઆઈએલ અને જી - રાઈડ સાથે એમઓયુ કરેલ છે. આ એમઓયુ પ્રમાણે બીઆરસીએલ મુખ્ય પ્રોજેક્ટને અન્ડરટેક/પ્રોક્યોર કરી ડેજીટલ થયેલ પોઈન્ટ સુધી લઈ જશે કે જે એમએસઆઈએલ ગુજરાત પ્લાન્ટ પરીસરમાં થશે જે બહેચરાજી ખાતે આવેલ છે અને તેમાં એમએસઆઈએલ ની જરૂરીયાત મુજબનું પ્રપોઝ થયેલ રેલ્વે સાઈટીંગને બનાવવા અને લંબાવવાની કામગીરી રહેલ છે. આ પ્રોજેક્ટ એક જાણકાર કવોલીફાઈડ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે કે જે બીઆરસીએલ દ્વારા ઓળખવામાં અને નિયુક્ત કરવામાં આવશે અને તે એમએસઆઈએલ ની મંજૂરી થી કરવામાં આવશે. બીઆરસીએલએ એમએસઆઈએલ ને મદદ કરીને કોન્ટ્રાક્ટને પૂર્ણ કરવા માટે જરૂરી ટેન્ડરોની બીડ મંગાવવા માટે જરૂરી કામગીરી કરેલ છે. આ કોન્ટ્રાક્ટનું મંજૂર થયેલ કિંમત રૂ. ૬૩.૬૦ કરોડ છે અને તેમાં તમામ વેરાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને એમઓયુ મુજબ મુખ્ય પ્રોજેક્ટનું એકસ્ટેન્શન માની શકાશે.</p>		
૨૩. અન્ય આવક		
ટેન્ડર પ્રોસેસ કરવાની ફી	૧ ૧૮ ૬૪૪	૩ ૩૮ ૯૮૦
પરચૂરણ આવક	-	૮ ૧૦૦
પ્રાપ્ત થયેલ વ્યાજ		
૧) જીએસએફએસમાં આઈસીડી પરનો વ્યાજ	૨ ૮૮ ૨૬ ૬૦૬	૧ ૦૯ ૯૩ ૯૭૨
૨) લીકવીડ રોકાણ પરનો વ્યાજ	૭૦ ૨૯ ૭૦૬	૮૪ ૩૫ ૬૩૧
૩) આવક વેરાના રીફંડ પર વ્યાજ	-	૨ ૫૪૯
કુલ	૩ ૫૯ ૭૪ ૯૫૬	૧ ૯૭ ૭૯ ૨૩૨
૨૪. વપરાયેલ મટીરીયલની કિંમત		
ઈપીસી કરારનો ખર્ચ - એમએસઆઈએલ લાઈન	૩૬ ૭૩ ૩૮ ૮૩૯	-
રેલવે રેલનો ખર્ચ	૬ ૬૦ ૦૦ ૦૦૦	-
પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ખર્ચ	૮૭ ૦૮ ૫૧૦	-
કુલ	૪૪ ૨૦ ૪૭ ૩૪૯	-
૨૫. કર્મચારીઓના લાભનો ખર્ચ, કોન્ટ્રાક્ટરો અને કન્સલ્ટન્ટોનું ચૂકવણું		
મેનપાવર સેવાઓ	૩૦ ૯૫ ૮૦૬	૮ ૨૯ ૩૩૬
કુલ	૩૦ ૯૫ ૮૦૬	૮ ૨૯ ૩૩૬

વિગત	૩૧-૩-૨૦૨૨ અંતિત	૩૧-૩-૨૦૨૧ અંતિત
૨૬. નાણાંકીય કિમત		
લીઝની જવાબદારીનું વ્યાજ*	૩ ૫૦ ૫૩૨	-
કુલ	૩ ૫૦ ૫૩૨	-
* જુઓ નોંધ નં. ૪૪		
૨૭. ઘસારો અને એમોરાઇઝેશન ખર્ચ		
રાઈટ ઓફ યુઝ એસેટનો એમોરાઇઝેશન*	૭ ૬૩ ૧૯૪	-
કુલ	૭ ૬૩ ૧૯૪	-
* જુઓ નોંધ નં. ૪૪		
૨૮. અન્ય ખર્ચાઓ		
બેન્ક ચાર્જ્સ	-	૨૦૧
બોર્ડ બેઠક ખર્ચ	૧૫ ૦૦૦	-
કન્સલ્ટન્ટ્સી / પ્રોફેશનલ ચાર્જ	૬ ૩૯ ૦૦૦	૨ ૭૧ ૮૪૭
ઈન્સ્યોરેન્સ ખર્ચ	૨ ૬૯૪	-
ભાડા ખર્ચ**	૩૩ ૫૫ ૬૩૩	-
ફિજેબીલીટી અભ્યાસ ખર્ચ***	૩૭ ૭૨ ૦૦૦	-
ચૂકવેલ ટીડીએસ પરનો વ્યાજ	-	૪૭૦
કચેરી ખર્ચ	૭૬ ૫૫૦	૭૬૮
રાઈન્ડ ઓફ	-	૭
સ્ટેશનરી અને પ્રિન્ટીંગ ખર્ચ	૧ ૩૪ ૨૪૩	૭૦ ૭૩૭
સેટ્યુટરી ઓડીટ ફીસ*	૭૫ ૦૦૦	૫૦ ૦૦૦
ટ્રાવેલીંગ અને કન્વેન્સ ખર્ચ - અન્ય	-	૧૮ ૦૦૦
વાહન ભાડનો ખર્ચ	૨૫ ૫૮ ૩૩૯	૧૫ ૧૮ ૧૭૮
સુધારો અને જાળવણી**	૬ ૧૯ ૭૩૯	૧૯ ૦૦૦
વિજ્ઞાપનો આપવાનો ખર્ચ*	૫૦ ૩૧૨	૮૪ ૬૬૪
ટેન્ડર ફી	૯ ૩૪૭	-
આરઓસી અને કાયદાકીય ખર્ચ**	૩૦ ૬૫ ૯૫૪	૯૯ ૧૪ ૬૫૦
કુલ	૧ ૪૩ ૭૩ ૮૧૧	૧ ૧૯ ૪૮ ૫૨૨
* જુઓ નોંધ નં. ૩૮		
** જુઓ નોંધ નં. ૪૩		
*** આ વર્ષે જી - રાઈડે તેના બીલ થયેલ પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ ખર્ચને ૧૫% માર્ક એ થી બીલ કરેલ છે અને તે બીઆરસીએલના ચોથા બોર્ડ મીટીંગમાં (નોંધ નંબર - ૪.૦૭) માં નક્કી કરવામાં આવેલ છે.		

વિગત	૩૧-૩-૨૦૨૨ અંતિત	૩૧-૩-૨૦૨૧ અંતિત
અન્ય ખર્ચાઓમાં:-		
❖ ઓડીટરને રેમ્યુનરેશન સેટ્યુટરી ઓડીટર ફી	૭૫ ૦૦૦	૫૦ ૦૦૦
કુલ	૭૫ ૦૦૦	૫૦ ૦૦૦
અન્ય કોમ્પ્રીહેન્સીવ આવક (ઓસીઆઈ)		
તેવા કોઈપણ અન્ય કોમ્પ્રીહેન્સીવ આવકના ભાગો રહેલ નથી કે જેને દર્શાવવાની જરૂર રહેલ છે.		
૨૯. પ્રતિ શેર આવક (ઈપીએસ)		
પ્રતિ શેરના આવકની ગણતરી દરેક શેર ધારકને એટ્રીબ્યુટ કરવામાં આવેલ નેટ નફા / (નુકશાન) ને રૂ. ૧૦/- પ્રતિ ઈકવીટી શેરના વેઈટેડ સરેરાશ સંખ્યા સાથે ભાગાકાર કરીને કરવામાં આવે છે અને તેના ચાલુ વર્ષની વિગત નીચે મુજબ છે.		
	૨૦૨૧-૨૦૨૨	૨૦૨૦-૨૦૨૧
બેઝીક અને ડાયલુટ થયેલ ઈપીએસના કમ્પ્યુટેશન માટે વપરાયેલ શેર ડેટા અને નફા / (નુકશાન) ની વિગત		
ઈકવીટી શેર ધારકોને લગત નેટ નફા / (નુકશાન)	૫૨ ૮૩ ૫૮૪	૧૪ ૯૮ ૭૯૨
ચાલુ સાલે રહેલ ઈકવીટી શેરનો	૨૪ ૯૭ ૨૫ ૭૬૮	૮ ૩૪ ૨૧ ૭૮૧
વેઈટેડ સરેરાશ સંખ્યા કે જે બેઝીક અને ડાયલુટયુટેડ ઈપીએસના કમ્પ્યુટેશનને લગત છે		
પ્રતિ ઈકવીટી શેરનો ફ્રેસ વેલ્યુ રૂપિયામાં (રૂ. ૧૦)	૧૦	૧૦
પ્રતિ શેર બેજીક અને ડાયલ્યુટેડ આવક	૦.૦૨	૦.૦૨
* કોઈ પોટેન્શીયલ ઈકવીટી શેર ન હોવાથી બેઝીક અને ડાયલ્યુટેડ ઈપીએસ સમાન છે.		
૩૦. સેગમેન્ટની માહિતી:-		
ઈન્ડ - એએસ ૧૦૮ અનુસાર, સેગમેન્ટ માહિતી આપવા માટે વપરાતા ઓપરેટીંગ સેગમેન્ટને કંપનીના મેનેજમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા આંતરીક અહેવાલોના આધારે ઓળખવામાં આવે છે કે જે સેગમેન્ટોને રીસોર્સ ફાળવામાં અને તેની કામગીરીનો અંદાજ પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.		
કંપનીના નિયામક મંડળ કંપનીનો 'ચિફ ઓપરેટીંગ ડીઝીશન મેકર' અથવા તો 'સીઓડીએમ' છે કે જે ઈન્ડ એએસ ૧૦૮ ની વ્યાખ્યા અંતર્ગત આવે છે. આંતરીક રીપોર્ટીંગની કામગીરી માટેના લક્ષણો એવી રીતે ઉદભવે છે કે જે કાર્યરત પ્રફોર્મેન્સ એસેસમેન્ટ પદ્ધતિઓ સાથે સંબંધ રાખે છે.		

ભૌગોલીક વિસ્તારોની માહિતી

કંપનીને વાણીજય વાતાવરણમાં કોઈપણ કામગીરી રહેલ નથી કે જે અલગ અલગ રીસ્ક અને લાભો આપી શકે. તેથી તેને એકજ ભૌગોલીક સેગમેન્ટમાં કામ કરતી હોય તેમ માની શકાય.

૩૧. માઈક્રો, સ્માલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝને ચુકવવાપાત્ર રકમ:-

માઈક્રો, સ્માલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝને કોઈ રકમ ચુકવવાનું રહેતું નથી કે જેમને કંપનીને ઓવર ડ્યુ થયેલ છે અને જે ૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ ૪૫ થી વધારે દિવસો માટે ઓવરડ્યુ રહેલ છે.

૩૨. નાણાંકીય રીસ્ક મેનેજમેન્ટના ઉદ્દેશો અને પોલીસીઓ:-

કંપનીએ બજારમાં રહેલ ખતરાઓ, કેડીટને લગત ખતરાઓ અને લીકવીડીટીને લગત ખતરાઓનો સામનો કરવો પડે છે. આવા ખતરાઓનો સામનો કંપનીના ઉચ્ચતર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે. કંપનીના ઉચ્ચતર મેનેજમેન્ટને આવા બાબતોમાં નાણાંકીય વિભાગનો સહાય પ્રાપ્ત રહે છે અને તેઓ આવા નાણાંકીય ખતરાઓનો સામનો કરવા માટે જરૂરી ઉપદેશ આપે છે અને નાણાંકીય ખતરાઓનો સારી રીતે સામવનો કરવાની કંપનીની પ્રણાલી તૈયાર કરે છે. નાણાંકીય વિભાગ કંપનીના ઉચ્ચતર મેનેજમેન્ટને તે બાબતે આશ્વાસન આપે છે કે કંપનીના આવા નાણાંકીય ખતરાઓનો સારી રીતે સામનો કંપની કરી શકશે.

(એ) બજારને લગત ખતરાઓ:-

બજારમાં રહેલ ખતરાઓ એવા ખતરાઓ છે કે જે નાણાંકીય ઉપકરણોમાં રહેલ ભવિષ્યના કેશ ફ્લોમાં ફેરફાર થઈ શકે છે કારણે તે બજાર કિંમતોમાં ફેરફાર થાય છે. બજાર કિંમતોમાં વ્યાજ દરને લગત ખતરાઓનો સમાવેશ થાય છે. આવા વિશ્લેષણમાં માર્કેટ વેરીએબલોમાંના આવન જવનની અસર ગ્રેડ્યુટીની કેરીઈંગ કિંમત પર થાય છે અને તેમાં અને પોસ્ટ રીટાયરમેન્ટ જવાબદારીઓ પણ રહેલ છે, અને પ્રાવધાનો અને બીન નાણાંકીય એસેટો અને જવાબદારીઓ પણ રહેલ છે.

(૧) વ્યાજ દરમાં રહેલ ખતરાઓ:-

વ્યાજ દરમાં રહેલ ખતરાઓ તે ખતરાઓ છે કે જે ફેર વેલ્યુ કે નાણાંકીય ઉપકરણોમાં રહેલ ભવિષ્યના કેશ ફ્લો પર આધારીત છે કે જે બજારના વ્યાજના દરમાં થતા ફેરફારોને લીધે ફરી શકે છે. કંપની દ્વારા કરવામાં આવેલ બોરોઈંગ વ્યાજથી મુક્ત છે અને તેથી તેના પર વ્યાજ દરના ખતરાની અસર થતી નથી કે જે ઈન્ડ એસેસ ૧૦૭ માં દર્શાવેલ છે. જી-રાઈડ પાસેથી ઉધાર લેવામાં આવેલ નાણાનો વ્યાજ દર ૮.૫૦% છે. પરંતુ આ લેણા ટુકા ગાળાના છે અને તેથી તે કંપનીના ભવિષ્યના કેશ ફ્લોને લાભા ગાળમાં અસર કરી શકે નહીં.

(બી) લીકવીડીટીને લગત ખતરાઓ:-

લીકવીડીટી એવો ખતરો છે કે જેમાં કંપની તેના હાલના કે ભવિષ્યના કેશ કે કોલેટ્રલ જવાબદારીઓને સ્વીકારી શકાય તેવા નુકશાનો કર્યા સીવાય પુરા કરી ન શકે. કંપનીનો ઉદ્દેશ્ય છે કે તમામ સમયે તેને તેના તમામ કેશ અને કોલેટ્રોલ જરૂરીયાતોને પુરા કરવા માટે લીકવીડીટીનો ઓછામાં ઓછો સ્તર વાપરી શકે. કંપની તેના તેના લીકવીડીટીના સ્થિતિને ધ્યાને રાખે છે અને તેની પાસે એક સચોટ કેશ મેનેજમેન્ટ વ્યવસ્થા રહેલ છે. તેની પાસે તેવા સ્ત્રોત છે કે જેથી તે નાણાંકીય વ્યવસ્થા ઓપટીમલ કિંમતે રાખી શકે.

(૧) કરાર આધારીત ચૂકવણા અંગે કંપની નાણાકીય જવાબદારીઓ દર્શાવતુ પત્રક નીચે મુજબ છે.

૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	ઓન ડીમાન્ડ	૩ મહિનાથી ઓછુ	૩ થી ૧૨ મહિના સુધી	૧ - ૫ વર્ષ સુધી	૫ વર્ષથી વધુ	કુલ
બોરોઈંગ	-	-	-	-	-	-
ચૂકવવા પાત્ર ટ્રેડ	૧૫ ૯૫ ૨૫૦	-	-	-	-	૧૫ ૯૫ ૨૫૦
અન્ય નાણાંકીય જવાબદારીઓ - નોન કરન્ટ	-	-	-	૭ ૯૯ ૦૪ ૮૨૯	-	૭ ૯૯ ૦૪ ૮૨૯
અન્ય નાણાંકીય જવાબદારીઓ - કરન્ટ	-	-	૧૩ ૧૨ ૬૨૫	-	-	૧૩ ૧૨ ૬૨૫
૩૧ માર્ચ ૨૦૨૧ અંતિત						
બોરોઈંગ	-	-	-	-	-	-
ચૂકવવાપાત્ર ટ્રેડ	-	૨ ૩૦ ૯૨૬	-	-	-	૨ ૩૦ ૯૨૬
અન્ય નાણાંકીય જવાબદારીઓ - નોન કરન્ટ	-	-	-	૨ ૪૮ ૨૯ ૦૬૮	-	૨ ૪૮ ૨૯ ૦૬૮

(સી) કેડીટને લગત ખત્રાઓ:-

કેડીટ ખત્રો એવો ખત્રો છે કે જેમાં સામે વાળો પક્ષ તેઓની જવાબદારીઓને પુરી ન કરે કે જે ગ્રાહકના કરાર પરના નાણાંકીય ઉપકરણો પર રહેલ છે, કે જેના કારણે નાણાકીય નુકશાન થાય છે. કંપનીને તેના ઓપરેટીંગ કામગીરીઓને કારણે આવા કેડીટ ખત્રાઓનો સામનો કરવો પડે છે (પ્રાથમિક મળવાપાત્ર ટ્રેડ) અને તે તેના નાણાકીય કામગીરીને કારણે પણ થઈ શકે છે, જેમાં બેન્ક સાથેના અને અન્ય નાણાંકીય સંસ્થાઓ અને અન્ય નાણાંકીય ઉપકરણોમાં થયેલ રોકાણોનો પણ સામવેશ થાય છે.

(૧) મળવાપાત્ર ટ્રેડ:-

કંપનીના તમામ બાકી રહેલ ગ્રાહક મળવાપાત્રનો કંપની દ્વારા નિયમિતપણે ચકાસણી કરવામાં આવી રહેલ છે. કંપનીને કોઈપણ બેંક ડેપોઝિટ કે લાબાગાળાના બાકી નાણાંનો સામનો વર્ષ દરમ્યાન કરવો પડેલ નથી. વધુમાં રીપોર્ટીંગની તારીખે તમામ બાકી રહેલ ગ્રાહક મળવાપાત્ર છ માસથી ઓછાના છે. તે મુજબ ટ્રેડ મળવાપાત્ર ખુબજ ઓછા કેડીટ ખત્રાને લગત છે અને મેજેનમેન્ટે એવી ચકાસણી કરેલ છે કે કોઈ ટ્રેડ મળવાપાત્ર માટે કોઈ પણ ઈમ્પેરીમેન્ટની જરૂરીયાત રહેલ નથી.

(૨) નાણાંકીય ઉપકરણ અને કેશ રોકાણ:-

કંપનીના નાણાંકીય વિભાગ દ્વારા બેન્ક અને નાણાંકીય સંસ્થાઓ સાથે રહેલ તમામ કેડીટને લગત ખત્રાઓ સંભાળવામાં આવેલ છે અને તે કંપનીના ઉચ્ચતર મેનેજમેન્ટની નજરો હેઠળ છે. બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ સાથે રહેલ તમામ સિલ્લકો ઓછા કેડીટ ખત્રાઓને લગત છે કારણ કે કંપનીને ખુબજ સારા કેડીટ રેટીંગ આપવામાં આવેલ છે. આ રેગ્યુલેટરી સત્તાની દેખરેખ હેઠળ રહેલ છે.

૩૩. સબંધીત પાર્ટી ડીઝલોશર

(૧) સબંધીત પક્ષકારો અને સબંધોની રૂપરેખા

વિગત	ચાલુ વર્ષ	ગત વર્ષ
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (જી - રાઈડ)	સંયુક્ત સાહસ	હોલ્ડીંગ એન્ટીટી
મારૂતી સુઝુકી ઈન્ડિયા લીમીટેડ (એમએસ આઈએલ)	સંયુક્ત સાહસ	એસોસીયેટ એન્ટીટી
ગુજરાત ઈન્ડસ્ટ્રીય ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)	સંયુક્ત સાહસ	-
રેલ્વે મંત્રાલય (એમઓઆર)	સંયુક્ત સાહસ જી - રાઈડના પ્રમોટર	સંયુક્ત સાહસ જી - રાઈડના પ્રમોટર

એન્ટીટીઓ કે જેમના ઉપર ખાસ મેનેજમેન્ટ પર્સનલ અને તેઓના સબંધીઓ કોઈ પણ ખાસ પ્રકારનો પ્રભાવ કરી શકે.

ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ (જી - રાઈડ)

ખાસ મેનેજમેન્ટ પર્સનલ / એકઝીક્યુટીવ ડીરેક્ટર

શ્રી સંતોષ કુમાર

સીઈઓ/નિયામક

શ્રી અશ્વિનીકુમાર યાદવ

ચેરમેન

(તારીખ ૧૧/૧૧/૨૦૨૧ સુધી)

શ્રી એસ. એન. જોષી

સીએફઓ

નિયામક નોન - એકઝીક્યુટીવ

શ્રી બજરંગી વર્લી

નિયામક

શ્રીમતી કવીતા શેઠ

નિયામક

(તારીખ ૨૮/૦૩/૨૦૨૨ સુધી)

શ્રી બચ્ચુ વેનુગોપાલ

નિયામક

(તારીખ ૨૦/૦૫/૨૦૨૨ સુધી)

શ્રી જવલેશ ઝવેરી

નિયામક

(તારીખ ૧૬/૦૨/૨૦૨૨ થી)

શ્રી રાજ સ્વરૂપ કપુર

નિયામક

(૨) સંબંધિત પાર્ટી સાથે લેવડ દેવડ

લેવડ દેવડની વિગત / સંબંધિત પાર્ટીઓને લગત બેલેન્સ	સંયુક્ત સાહસ		સંયુક્ત સાહસના પ્રમોટર		ખાસ વહીવટી પ્રસનલ અને તેઓના સબધીઓ	
	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત
લીધેલ લોન	-	૨ ૮૯ ૭૮ ૨૫૯	-	-	-	-
ચૂકવેલ લોન	-	૧૭ ૨૧ ૦૬ ૧૧૪	-	-	-	-
ખર્ચનો વળતર (કેપીટલાઈઝ થયેલ સીડબલ્યુઆઈપી)	-	-	-	-	-	-
અન્ય ખર્ચાઓ - બોર્ડ મીટીંગ ને લગતા	-	-	-	-	૧૫ ૦૦૦	-
ચૂકવેલ વ્યાજ (કેપીટલાઈઝ થયેલ સીડબલ્યુઆઈપી)	-	૪૩ ૪૧ ૪૦૪	-	-	-	-
ફીઝીબીલીટી અભ્યાસ ખર્ચ	૩૭ ૭૨ ૦૦૦	-	-	-	-	-
ચૂકવેલ પીએમસી ખર્ચ (કેપીટલાઈઝ થયેલ સીડબલ્યુઆઈપી)	૮ ૮૬ ૩૮ ૧૬૦	૬ ૫૧ ૮૫ ૭૪૬	-	-	-	-
પીએમસી ચાર્જસમાંથી આવક (એમએસઆઈએલ પ્રોજેક્ટ)	૮૬ ૨૫ ૦૦૦	-	-	-	-	-
પીએમસી ચાર્જસમાંથી (એમએસઆઈએલ પ્રોજેક્ટ)	૮૭ ૦૮ ૫૧૦	-	-	-	-	-
રેલ ખરીદી - એમઓઆર પાસેથી	-	-	૬ ૬૦ ૦૦ ૦૦૦	-	-	-

એમએસઆઈએલ પ્રોજેક્ટ માટે							
રેલ ખરીદી (કેપીટલાઈઝ થયેલ સીડબલ્યુઆઈપી)			૧૦૦૨૦૫૭૮૫	૨૮૨૫૩૧૦૬		-	-
સીડબલ્યુઆઈપી માટે એડીશનલ ફીડર બે			-	૩૦૯૨૦૮૫૦		-	-
એમએસઆઈએલ માટે રેલનુ વેચાણ	૬૬૦૦૦૦૦		-			-	-
એમએસઆઈએલ માટે બાંધકામ સેવાઓનુ વેચાણ	૩૬૪૬૨૦૫૩૬		-			-	-
પ્રાપ્ત થયેલ ઈકવીટી શેર ભંડોળ	૩૦૪૫૪૨૨૦૦૦	૧૫૯૦૧૦૦૦૦૦				-	-
બીડ પ્રોસેસીસગ ફી - પ્રાપ્ત થયેલ અને ટ્રાન્સફર કરેલ	૭૫૦૦	૮૦૦૦૦				-	-
કુલ	૩૫૯૫૭૬૩૭૦૬	૧૮૬૦૮૦૧૫૨૩	૧૬૬૨૦૫૭૮૫	૫૬૧૭૪૦૫૬	૧૫૦૦૦		-

લેવડ દેવડની વિગત/ સંબંધિત પાર્ટીઓને લગત બેલેન્સ	સંયુક્ત સાહસ		સંયુક્ત સાહસના પ્રમોટર		ખાસ વહીવટી પ્રસનલ અને તેઓના સબધીઓ	
	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત
મળવાપાત્ર રકમ	૧૩૬૭૮૮૧૮૬	-	-	-	-	-
ચૂકવવાપાત્ર રકમ	-	-	-	-	-	-

૨૯ ફેર વેલ્યુની ગણતરી

કંપનીના નાણાંકીય ઈન્સ્ટ્રુમેન્ટના ફેર વેલ્યુ અને કેરીઈંગ રેકમની કલાસની સરખામણી નીચે મુજબ છે.

કેટેગરી	૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત		૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત	
	કેરીઈંગ વેલ્યુ	ફેર વેલ્યુ	કેરીઈંગ વેલ્યુ	ફેર વેલ્યુ
૧) એમોરાઈઝડ કોસ્ટ પર નાણાકીય એસેટ				
મળવાપાત્ર ટ્રેડ (કરન્ટ / નોન કરન્ટ)	૧૩ ૬૭ ૯૯ ૧૯૬	૧૩ ૬૭ ૯૯ ૧૯૬	-	-
રોકડ અને રોકડનો સમાન્તર	૮ ૧૫ ૭૫ ૨૨૭	૮ ૧૫ ૭૫ ૨૨૭	૫ ૩૩ ૬૧ ૬૧૮	૫ ૩૩ ૬૧ ૬૧૮
બેન્ક સાથે રહેલ અન્ય સિલ્લક	૨૩૧ ૪૩ ૪૯ ૯૪૭	૨૩૧ ૪૩ ૪૯ ૯૪૭	૯૬ ૦૦ ૦૦ ૦૦૦	૯૬ ૦૦ ૦૦ ૦૦૦
અન્ય નાણાકીય એસેટ(કરન્ટ/નોન કરન્ટ)	-	-	-	-
કુલ	૨૫૩ ૨૭ ૨૪ ૩૭૦	૨૫૩ ૨૭ ૨૪ ૩૭૦	૧૦૧ ૩૩ ૬૧ ૬૧૮	૧૦૧ ૩૩ ૬૧ ૬૧૮
૨) એમોરાઈઝડ કોસ્ટ પર નાણાકીય લાયબલીટી				
બોરોઈંગ	-	-	-	-
ચૂકવવાપાત્ર ટ્રેડ	૧૫ ૯૫ ૨૫૦	૧૫ ૯૫ ૨૫૦	૨ ૩૦ ૯૨૬	૨ ૩૦ ૯૨૬
અન્ય નાણાકીય	૮ ૧૨ ૧૭ ૪૫૪	૮ ૧૨ ૧૭ ૪૫૪	૨ ૪૮ ૨૯ ૦૬૮	૨ ૪૮ ૨૯ ૦૬૮
જવાબદારીઓ (કરન્ટ / નોન કરન્ટ)				
કુલ	૮ ૨૮ ૧૨ ૭૦૩	૮ ૨૮ ૧૨ ૭૦૩	૨ ૫૦ ૫૯ ૯૯૪	૨ ૫૦ ૫૯ ૯૯૪

નાણાકીય એસેટ અને જવાબદારીના ફેર વેલ્યુમાં તે રકમનો સમાવેશ થાય છે કે જેમાં ઈન્સ્ટ્રુમેન્ટને સમહત પક્ષકારો વચ્ચે હાલના લેવડ દેવડ તરીકે એક્ષચેન્જ કરી શકાય, સિવાય કે તે જબરજસ્તીનો કે લીકવીડેશન સેલ હોય. મેનેજમેન્ટે પ્રાપ્ત થયેલ ટ્રેડ, રોકડ અને રોકડના સમાન્તર, અન્ય બેન્કની સીલ્લક, અન્ય નાણાકીય એસેટ, બોરોઈંગ, ચૂકવવાપાત્ર ટ્રેડ, અને અન્ય નાણાકીય લાયબલીટીસને ચકાસેલ છે અને તે કેરીઈંગ એમાઉન્ટના એપ્રોકસીમેટ છે કે જે ઈન્સ્ટ્રુમેન્ટના ટુકાવાળાના મેચ્યુરીટી મુજબ છે.

ફેર વેલ્યુ હેરાફકી:-

તમામ ફાઈનાન્શીયલ ઈન્સ્ટ્રુમેન્ટ કે જે માટે ફેર વેલ્યુ ઓળખાયેલ છે કે ખુલાસો કરવામાં આવેલ છે તે ફેર વેલ્યુના કેટેગરીમાં આવે છે, અને તેનું વિવરણ નીચે આપવામાં આવેલ છે, અને તેનો આધાર સૌથી નીચેના સ્તરનું ઈનપુટ પર છે કે જે ફેર વેલ્યુની ગણતરી માટે પુરી રીતે અગત્યનું છે.

લેવલ ૧ : કોટ કરેલ (એડજેસ્ટ કર્યાસિવાય) રકમ કે જે ચાલુ માર્કેટમાં એક સમાન એસેટ કે લાયબલીટી માટે રહેલ છે.

લેવલ ૨ : વેલ્યુએશન ટેકનીકો કે જેના માટે સૌથી નીચેના સ્તરનું ઈનપુટ વપરાય કે જે ફેર વેલ્યુની ગણતરીમાં ખાસ

અસર કરી શકે અને જે ઓબઝર્વેબલ હોય સીધી કે આડકતરી રીતે.

લેવલ ૩ : તેવા વેલ્યુએશન ટેકનીકો કે જેમાં સૌથી નીચેના સ્તરનું ઈનપુટ વેલની ગણતરીમાં ખાસ અસર કરી શકે અને તેનો આધાર ઓબઝર્વેબલ માર્કેટ ડેટા પર ન રહેલ હોય.

નીચે દર્શાવેલ કોષ્ટક કંપનીના એસેટ અને લાયબલીટીઓના ફેર વેલ્યુ ગણતરીને દર્શાવે છે.

૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત એસેટનો ફેર વેલ્યુ ગણતરી માટેનો ક્વોન્ટિટેટીવ ડીસ્ક્લોઝર:-

વિગત	કુલ / (કેરીઈગી વેલ્યુ)	ચાલુ બજારમા ના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન-ઓબઝર્વેબલ ઈનપુટ (લેવલ - ૩)
એમોરાઈઝડ કોસ્પ પર ગણતરી કરેલ નાણાંકીય એસેટ				
મળવાપાત્ર ટ્રેડ	૧૩ ૬૭ ૮૮ ૧૮૬	-	-	-
રોકડ અને તેનો સમાન્તર	૮ ૧૫ ૭૫ ૨૨૭	-	-	-
અન્ય બેન્કો સાથે રહેલ સિલક	૨૩૧ ૪૩ ૪૮ ૮૪૭	-	-	-
અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ / નોન કરન્ટ)	-	-	-	-
કુલ	૨૫૩ ૨૭ ૨૪ ૩૦૦	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૨ અંતિત લાયબલીટીઓનો ફેર વેલ્યુ ગણતરી માટેનો ક્વોન્ટિટેટીવ ડીસ્ક્લોઝર:-

વિગત	કુલ / (કેરીઈગી વેલ્યુ)	ચાલુ બજારમા ના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન-ઓબઝર્વેબલ ઈનપુટ (લેવલ - ૩)
એમોરાઈઝડ કોસ્પ પર ગણતરી કરેલ નાણાંકીય લાયબલીટીઓ				
ચૂકવવાપાત્ર ટ્રેડ	૧૫ ૮૫ ૨૫૦	-	-	-
અન્ય નાણાંકીય લાયબલીટી (કરન્ટ / નોન કરન્ટ)	૮ ૧૨ ૧૭ ૪૫૪	-	-	-
કુલ	૮ ૨૮ ૧૨ ૭૦૩	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત એસેટનો ફેર વેલ્યુ ગણતરી માટેનો કવોન્ટીટેટીવ ડીસ્ક્લોઝર:-

વિગત	કુલ /(કેરીઈગી વેલ્યુ)	ચાલુ બજારમા ના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન-ઓબઝર્વેબલ ઈનપુટ (લેવલ - ૩)
એમોરાઈઝડ કોસ્થ પર ગણતરી કરેલ નાણાંકીય એસેટ				
મળવાપાત્ર ટ્રેડ	-	-	-	-
રોકડ અને તેનો સમાન્તર	૫ ૩૩ ૬૧ ૬૧૮	-	-	-
અન્ય બેન્કોમાં રહેલ સિલક	૮૬ ૦૦ ૦૦ ૦૦૦	-	-	-
અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ / નોન કરન્ટ)	-	-	-	-
કુલ	૧૦૧ ૩૩ ૬૧ ૬૧૮	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત લાયબલીટીઓનો ફેર વેલ્યુ ગણતરી માટેનો કવોન્ટીટેટીવ ડીસ્ક્લોઝર:-

વિગત	કુલ /(કેરીઈગી વેલ્યુ)	ચાલુ બજારમા ના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન-ઓબઝર્વેબલ ઈનપુટ (લેવલ - ૩)
એમોરાઈઝડ કોસ્થ પર ગણતરી કરેલ નાણાંકીય લાયબલીટીઓ				
ચૂકવવાપાત્ર ટ્રેડ	૨ ૩૦ ૮૨૬	-	-	-
અન્ય નાણાંકીય લાયબલીટી (કરન્ટ / નોન કરન્ટ)	૨ ૪૮ ૨૮ ૦૬૮	-	-	-
કુલ	૨ ૫૦ ૫૮ ૮૯૪	-	-	-

૩૫. રી - ગુપીગના કારણે ગત વર્ષના નાણાંકીય પત્રકો ઉપર થયેલ અસર

રી - ગુપ થયેલ આઈટમ	રકમ	ગયા વર્ષના ગુપ હેઠળ	ચાલુ વર્ષના ગુપ હેઠળ
જીએસએફસી પાસે રહેલ સિલ્લક - ઈન્ટર કોર્પોરેટ ડીપોઝીટ	૮૬ ૦૦ ૦૦ ૦૦૦	રોકાણ - કરન્ટ	અન્ય બેન્કો પાસે રહેલ સિલ્લક
જીએસએસએસ પાસેથી મળવાપાત્ર વ્યાજ	૧ ૦૧ ૬૮ ૪૨૪	રોકાણ - કરન્ટ	અન્ય કરન્ટ એસેટ

૩૬. જી - રાઈડને આપેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સી પરની નોંધો:-

જીરાઈડને બીઆરસીલએલ દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કોટાસણ રોડ - બેચરાજી - યાણસમા - રણુજ પ્રોજેક્ટના અમલીકરણ માટે નિયુક્ત કરવામાં આવેલ છે અને તેમાં એમએસઆઈએલ સાઈડીગનો સમાવેશ સહિત પ્રોજેક્ટ કિંમતના ૧૦% વેલ્યુ લેખે કરવામાં આવેલ છે અને તે બીઆરસીલના પહેલા બોર્ડ મીટીંગમાં મંજૂર કરવામાં આવેલ છે કે જે તારીખ ૦૮/૦૧/૨૦૧૮ ના રોજ થયેલ છે. આ માટેનો કરાર એગ્રીમેન્ટ તારીખ ૨૮/૦૮/૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ છે. પીએમસી યાર્જસ ઓરીજનલ અંદાજ કિંમત પર રાખવામાં આવેલ છે અને તે રૂ. ૪૫૨.૬૦ કરોડ છે કે જે બે ફેઝમાં છે અને કુલ પીએમસી યાર્જ રૂ. ૪૫.૨૬ કરોડ છે. ફેઝ પ્રમાણેના પીએમસી યાર્જસ નીચે મુજબ છે:-

(૧)	કોટાસણ રોડ થી બહેચરાજી એમએસઆઈએલ સલાઈડીગ સાથે (ફેઝ - ૧)	૧૯.૮૨ કરોડ
(૨)	બહેચરાજી થી રણુજ (ફેઝ - ૨)	૨૫.૪૪ કરોડ
	કુલ મંજૂર થયેલ પીએમસી યાર્જ	૪૫.૨૬ કરોડ

જીરાઈડ સાજે ૨૮ મી ઓગષ્ટ, ૨૦૨૦ માં થયેલ કરાર મુજબ જીરાઈડને ચૂકવવાના થતા પીએમસી યાર્જસની સ્ટેજવાઈજ વિગત નીચે મુજબ છે:- (રૂ. કરોડમાં)

ક્રમ	પીએમસીનો ફેઝ	ફેઝ - ૧ માટે મંજૂર થયેલ પીએમસી યાર્જ	ફેઝ - ૧ માટેનો સ્ટેજવાઈજ પી એમસી યાર્જસ, વેરા સાથે
૧.	ટ્રાન્ઝેક્શન એડવાઈઝરી (ફેઝ - ૧ માટે મંજૂર થયેલ ૩૦% યાર્જસ)	૧૯.૮૨	૫.૯૪૬
૨.	પ્રોજેક્ટ મેનેજમેન્ટ (ફેઝ - ૧ માટે મંજૂર થયેલ ૪૫% યાર્જસ)		૮.૯૧૯
૩.	કમીશનીંગ અને ટેસ્ટીંગ (ફેઝ - ૧ માટે મંજૂર થયેલ ૨૫% યાર્જસ)		૪.૯૫૫

(રૂ. કરોડમાં)

ક્રમ	પીએમસીનો ફેઝ	ફેઝ - ૨ માટે મંજૂર થયેલ પીએમસી યાર્જ	ફેઝ - ૨ માટેનો સ્ટેજવાઈજ પી એમસી યાર્જસ, વેરા સાથે
૧.	ટ્રાન્ઝેક્શન એડવાઈઝરી (ફેઝ - ૨ માટે મંજૂર થયેલ ૩૦% યાર્જસ)	૨૫.૪૪	૭.૬૩૨
૨.	પ્રોજેક્ટ મેનેજમેન્ટ (ફેઝ - ૨ માટે મંજૂર થયેલ ૪૫% યાર્જસ)		૧૧.૪૪૮
૩.	કમીશનીંગ અને ટેસ્ટીંગ (ફેઝ - ૨ માટે મંજૂર થયેલ ૨૫% યાર્જસ)		૬.૩૬૦

તા. ૩૧/૦૩/૨૦૨૨ મુજબ બીલીગ સ્થિતી

(રૂ. કરોડમાં)

ક્રમ	પીએમસીનો સ્ટેજ	જીએસટી સાથે સર્ટીફાઇ થયેલ રકમ	વધારવામાં આવેલ બીલીગ
૧.	ટ્રાન્ઝેક્શન એડવાઈઝરી ફેઝ - ૧ માટે મંજૂર થયેલ ૩૦% ચાર્જસ)	-	૫ ૯૪ ૬૦ ૦૦૦
૨.	ટ્રાન્ઝેક્શન એડવાઈઝરી ફેઝ - ૨ માટે મંજૂર થયેલ ૩૦% ચાર્જસ)	-	૭ ૬૩ ૨૦ ૦૦૦
૩.	પ્રોજેક્ટ મેનેજમેન્ટ (ફેઝ - ૧ માટે મંજૂર થયેલ ૪૫% ચાર્જસ) (રૂ. ૮.૯૧૯ કરોડ પ્રમાણે પીએમસી ચાર્જસના રૂ. ૨૬૩.૫૨ કરોડ)		
એ.	આઈપીસી - ૦૧ થી આઈપીસી - ૨૧	૧૩૯ ૯૬ ૪૮ ૦૭૬	૪ ૭૩ ૭૧ ૯૬૯
બી.	તારીખ ૨૨/૦૪/૨૦૨૨ ના રોજ આઈપીસી - ૨૨ ની અહીં દર્શાવેલ રકમ જીએસટી બાદ કર્યા પછીની છે અને પ્રાવધાન કરવામાં આવેલ છે અને તે પૂરી બીલની કિંમત નથી. (માર્ચ, ૨૦૨૨ માટે)	૮ ૫૬ ૯૩ ૯૪૫	૨૪ ૫૭ ૯૩૬
૪.	પ્રોજેક્ટ મેનેજમેન્ટ (ફેઝ - ૨ માટે મંજૂર થયેલ ૪૫% ચાર્જસ) (રૂ. ૧૧.૪૪૮ કરોડ પ્રમાણે પીએમસી ચાર્જસના રૂ. ૩૩૩.૬૨૫ કરોડ)		
એ.	તારીખ ૨૭/૦૪/૨૦૨૨ ના રોજ આઈપીસી - ૧ ની અહીં દર્શાવેલ રકમ જીએસટી બાદ કર્યા પછીની છે અને પ્રાવધાન કરવામાં આવેલ છે અને તે પૂરી બીલની કિંમત નથી. (માર્ચ, ૨૦૨૨ માટે)	૨૧ ૧૯ ૧૫ ૯૨૫	૬૧ ૬૨ ૪૩૯
	૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ સુધી બીલ રેઈજ કરવામાં આવેલ છે	૧૬૯ ૭૨ ૫૭ ૯૪૬	૧૪૧ ૩૭ ૯૨ ૩૪૪

આ વર્ષે જી - રાઈડને કંપની દ્વારા એમએસઆઈએલ ઈન્સાઈડ સલાઈટીંગ કામગીરી માટે પીએમએસ ચૂકવવામાં આવેલ અને તેની વિગત નીચે મુજબ છે.

કામગીરી માટે કુલ પીએમસી ચાર્જસ	૧ ૩૫ ૭૦ ૦૦૦ (૧૮% જીએસટી સાથે)
માર્ચ, ૨૦૨૨ સુધી થયેલ પીએમસી ચાર્જસ	૯૮ ૫૮ ૩૮૫ (૧૮% જીએસટી સાથે)*

* કે જેની સાથે અનબીલ આવક રૂા. ૨૩,૨૩,૩૨૧/- વગર જીએસટીનો સમાવેશ થાય છે.

૩૭. જી - રાઈડ પાસેથી ઉધાર લેવામાં આવેલ નાણાં અને જી - રાઈડ ને ચૂકવેલ વ્યાજને લગત નોંધ:-

વિગત	૨૦૨૧ - ૨૨	૨૦૨૦ - ૨૧
લોન પરની ખુલતી સિલક	-	૧૪ ૩૧ ૨૭ ૮૫૫
વર્ષ દરમ્યાન પ્રાપ્ત થયેલ લોન	-	૨ ૮૯ ૭૮ ૨૫૯
ઘટાડો : વર્ષ દરમ્યાન ચૂકવેલ લોન	-	૧૭ ૨૧ ૦૬ ૧૧૪
લોનની બંધ સિલક	-	-
પ્રતિ વર્ષ ૯.૫% લેખે જી - રાઈડને ચૂકવેલ કુલ વ્યાજ*	-	૪૩ ૪૧ ૪૦૪

* જી-રાઈડને આપેલ વ્યાજને વિકાસ હેઠળની અવાસ્તવિક મિલકતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. (જુઓ નોંધ નં. ૩૮)

૩૮. નીચે દર્શાવવામાં આવેલ ખર્ચાઓને કેપીટલાઈઝ કરવામાં આવે છે કે જે ચાલુ કાર્ય પ્રગતિમાં / વિકાસ હેઠળની અવાસ્તવિક મિલકતનો ભાગ છે:-

વિગત	૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ પૂર્ણ થતા વર્ષ માટે		૩૧ મી માર્ચ, ૨૦૨૧ ના રોજ પૂર્ણ થતા વર્ષ માટે	
	રકમ	જુઓ નોંધ નં	રકમ	જુઓ નોંધ નં
વિજ્ઞાપનનો ખર્ચ		૫		૫
ચાલુ મૂડી કાર્ય પ્રગતિ-જમીન સંપાદનમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ	૨૦ ૮૭૨		૨ ૦૫ ૩૭૪	
ચાલુ મૂડી કાર્ય પ્રગતિ-કચેરીમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ	૫ ૦૦ ૧૮૪			
ટેમ્પીંગ મશીન માટેનો ખર્ચ		૪૦		૪૦
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસેટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૧	૨ ૩૧ ૫૮૧			
ઈપીસી પ્રોજેક્ટ વિકાસ ખર્ચ		૪૦		૪૦

વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૧	૧૦૬ ૮૦ ૦૧ ૬૩૪		૫૧ ૪૬ ૬૮ ૧૨૬	
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૨	૧૮ ૯૨ ૧૦ ૬૪૭			
પીએમસી કોન્ટ્રાક્ટ ખર્ચ		૪૦		૪૦
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૧	૨ ૭૭ ૮૭ ૭૫૬		૬ ૫૧ ૮૫ ૭૪૬	
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૨	૭ ૦૮ ૪૦ ૪૦૫			
આરઓસી અને લીગલ ચાર્જીસ		૪૦		૪૦
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૧	-		૭૪ ૦૦૦	
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૨	૫૯ ૦૦૦		-	
નાણાકીય કિંમત				૪૦
વિકાસ હેઠળ રહેલ ઈન્ટેન્જેબલ એસટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ રકમ - ફેઝ ૧	-		૪૩ ૪૧ ૪૦૪	
કુલ	૧૩૫ ૬૬ ૬૨ ૦૭૯		૫૮ ૪૪ ૮૪ ૬૫૦	

૩૯. ૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજનુ ચાલુ મૂડી કાર્ય પ્રગતિની કામગીરી માટેનું એજુંગા:-

ચાલુ મૂડી કાર્ય પ્રગતિમાં	૧ વર્ષ થી ઓછુ	૧ થી ૨ વર્ષ	૨ થી ૩ વર્ષ	૩ થી વધારે વર્ષ	કુલ
ચાલુ મૂડી કાર્ય પ્રગતિમાં - કચેરી	૧ ૮૦ ૬૪ ૨૬૭	૨ ૫૩ ૧૧૦	-	-	૧ ૮૩ ૧૭ ૩૭૭
ચાલુ મૂડી કાર્ય પ્રગતિમાં - જમીત સંપાદન	૪ ૧૩ ૨૩ ૩૭૩	૫ ૬૪ ૧૨૫	-	-	૪ ૧૮ ૮૭ ૪૯૮
કુલ	૬ ૦૩ ૮૭ ૬૪૦	૮ ૧૭ ૨૩૫	-	-	૬ ૧૨ ૦૪ ૮૭૫

૪૦. વિકાસ હેઠળ રહેલ ઇન્ટેન્જેબલ એસેટ (વિકાસ હેઠળનો ફેઈટ શેરીંગ રાઈટ)

ક્રમ	કામગીરી ની બાબત / આઈટમની વિગત	ફેઝ ૧		ફેઝ ૨	
		૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતીત (એ)	૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતીત (બી)	૩૧ મી માર્ચ, ૨૦૨૨ અંતીત (સી)	૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતીત (ડી)
૧.	સીવીલ અને ટ્રેકની કામગીરી	૧૩૪૫૨૩૬૩૭૭	૪૩૭૫૨૪૭૬૭	૧૪૪૮૭૦૭૨૬	-
	પ્રોજેક્ટ સુવિધા	૧૮૦૭૬૩૭૬	૧૩૪૫૩૭૮૨	૪૨૩૩૩૦	-
	ઈથર્વર્ક	૨૪૮૮૮૪૭૩૨	૮૦૪૨૮૩૫૬	-	-
	સુરક્ષા કામગીરી	૪૮૨૬૬૪૫૭	૨૫૦૮૬૨૫૬	-	-
	મોટા પુલો પીએસસી સલેબ બ્રીજ સાથે	૪૭૬૦૬૪૮૪	-	-	-
	નાના પુલો પીએસસી સલેબ બ્રીજ સાથે	૧૭૮૬૪૧૦૦૩	-	-	-
	આરયુબીઓ	૩૦૧૦૭૬૭૦૨	૧૮૬૪૪૭૫૨	-	-
	ટ્રેક કામગીરી	૩૮૧૦૭૪૫૩૪	૨૮૦૧૭૫૩૩૮	૧૪૪૫૪૭૩૮૬	-
	અન્ય સીવીલ એન્જીનીયરીંગ કામગીરી એફઓબી અને સબવે સાથે	૧૧૮૫૦૦૦૭૮	૮૭૩૬૨૮૩	-	-
૨	સીગનલીંગ કામગીરી	૮૬૦૮૧૬૭૧	૩૧૦૪૮૭૮૬	૫૪૩૬૮૮૬	-
૩	ટેલીકોમ્યુનિકેશન કામગીરી	૧૦૨૮૬૨૮૧	૧૦૩૧૧૩૨૫	૧૦૫૮૨૬૦૭	-
૪	વીજળીની કામગીરી (ઓએચ ઇ કામગીરીઓ)	૧૧૨૮૨૮૪૧૨	૩૦૨૫૨૨૩૭	-	-
	ઓવરહેડ ઇકવીપમેન્ટ કામગીરી, ઓએચઈ મોડીફીકેશન, ટીએસએસ, એસએસ	૧૧૨૮૨૮૪૧૨	૩૦૨૫૨૨૩૭	-	-
૫	જનરલ વીજળી કામગીરી (જીડબલ્યુ)	૧૭૮૫૮૨૫૨	૫૫૩૧૦૦૧	૨૮૨૧૦૪૧૭	-
	જુદા જુદા સામાન્ય વીજળી સેવાઓની કામગીરી	૧૦૮૫૨૪૦૩	-	૨૬૩૦૨૧૩૬	-
	૩૩ કેવી સુધી એચટી પાવર લાઈ કોસીગમાં મોડીફીકેશન	૭૦૦૬૮૪૮	૫૫૩૧૦૦૧	૧૮૦૮૨૮૧	-

	(યુજી કેબલીગથી રીપ્લેસમેન્ટ)				
૬	પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટેનો કન્સલ્ટન્સી ચાર્જસ	૯૨૯૯૩૫૦૧	૬૫૧૯૫૭૪૬	૭૦૮૪૦૪૦૫	-
૭	વીજળી કામગીરી માટે જીઈટી સીઓ ને ચૂકવણું	૨૯૦૫૭૨૫૯	૨૯૦૫૭૨૫૯	૧૯૯૫૪૯૭૧૧	-
૮	સાઈટની સફાઈ કામગીરી	૧૨૧૧૨૫	૧૨૧૧૨૫	-	-
૯	લોન માટે જી - રાઈડ પાસેથી પ્રાપ્ત થયેલ વ્યાજ	૪૯૬૨૧૯૫	૪૯૬૨૧૯૫	-	-
૧૦	રેલ્વે પાસેથી રેલની ખરીદી માટે ચૂકવણું	૧૨૮૪૫૮૯૯૧	૨૮૨૫૩૧૦૬	-	-
૧૧	વધારાના ફીડર બે માટેનું ચૂકવણું	૩૦૯૨૦૯૪૯	૩૦૯૨૦૯૪૯	-	-
૧૨	અન્ય	૧૯૫૫૪૬	-	૨૮૦૪૫૪	-
	પેટા કુલ	૧૮૬૯૨૦૧૪૬૮	૬૭૩૧૭૮૫૦૬	૪૫૯૮૮૧૨૧૬	-
	ઓછું : મોબલાઈઝેશન એડાવન્સ પરનો વ્યાજ	૩૯૩૭૨૦૪૫	૧૯૪૪૪૫૨૭	૧૪૫૪૪૬૭૯	-
	વિકાસ હેઠળ રહેલ ઇન્ટેન્જેબલ એસેટ પરનો કુલ	૧૮૨૯૮૨૯૪૨૩	૬૫૩૭૩૩૯૭૯	૪૪૫૩૩૬૫૩૭	-

૩૧મી માર્ચ, ૨૦૨૨ અંતીતના વર્ષ માટે વિકાસ હેઠળ રહેલ કુલ ઇન્ટેન્જેબલ એસેટ (એ + બી + સી નુ કુલ) ૨૨૭૫૧૬૫૯૬૦

૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતીતના વર્ષ માટે વિકાસ હેઠળ રહેલ કુલ ઇન્ટેન્જેબલ એસેટ (બી + ડી નુ કુલ) ૬૫૩૭૩૩૯૭૯

નોંધ:- ઉપર દર્શાવેલ આંકડાઓમાં રૂા.૯,૭૨,૯૯,૯૮૩/- નો કિમતના તફાવતનો સમાવેશ કરવામાં આવેલ છે.

૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજનુ વિકાસ હેઠળ રહેલ અવાસ્તવિક મિલકત માટેનું એજુગા:-

વિકાસ હેઠળની અવાસ્તવિક મિલકત	૧ વર્ષ થી	૧ થી ૨ ઓછુ	૨ થી ૩ વર્ષ	૩ થી વધારે વર્ષ	કુલ વર્ષ
ચાલુ રહેલ પ્રોજેક્ટ - ફેઝ ૧	૧૧૭૬૦૯૫૪૪૪	૬૫૩૭૩૩૯૭૯	-	-	૧૮૨૯૮૨૯૪૨૩
ચાલુ રહેલ પ્રોજેક્ટ - ફેઝ ૨	૪૪૫૩૩૬૫૩૭	-	-	-	૪૪૫૩૩૬૫૩૭
કુલ	૧૬૨૧૪૩૧૯૮૧	૬૫૩૭૩૩૯૭૯	-	-	૨૨૭૫૧૬૫૯૬૦

૩૧ મી માર્ચ, ૨૦૨૧ ના રોજનુ વિકાસ હેઠળ રહેલ અવાસ્તવિક મિલકત માટેનું એજુગ:-

વિકાસ હેઠળની અવાસ્તવિક મિલકત	૧ વર્ષ થી	૧ થી ૨ ઓછુ	૨ થી ૩ વર્ષ	૩ થી વધારે વર્ષ	કુલ વર્ષ
ચાલુ રહેલ પ્રોજેક્ટ - ફેઝ ૧	૬૫ ૨૭ ૭૨ ૧૬૧	૮ ૬૧ ૮૧૮	-	-	૬૫ ૩૭ ૩૩ ૯૭૯
કુલ	૬૫ ૨૭ ૭૨ ૧૬૧	૮ ૬૧ ૮૧૮	-	-	૬૫ ૩૭ ૩૩ ૯૭૯

૪૧. કેપીટલ કમીટમેન્ટ

૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના વર્ષ અંતિત

કરાર કરવામાં આવેલ પાર્ટી નું નામ	કરારની કુલ કિમત	૩૧ મી માર્ચ, ૨૦૨૨ સુધી પૂર્ણ કરેલ કરારની કિમત	બાકી રહેલ કરારની કિમત
કલ્પતરુ પાવર ટ્રાન્સમીશન લી - ઈપીસી કોન્ટ્રાક્ટ	૨૬૩ ૫૨ ૦૦ ૦૦૦	૧૭૪ ૮૮ ૬૨ ૦૨૧	૮૮ ૬૩ ૩૭ ૯૭૯
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ - પીએમસી કરાર	૪૫ ૨૬ ૦૦ ૦૦૦	૧૯ ૧૭ ૭૨ ૩૪૫	૨૬ ૦૮ ૨૭ ૬૫૫
અશોકા બિલ્ડકોન લીમીટેડ	૩૩૩ ૬૨ ૫૦ ૦૦૦	૫૨ ૨૮ ૩૫ ૬૪૭	૨૮૧ ૩૪ ૧૪ ૩૫૩
હરેશ પટેલ એન્જીનીયર્સ અને કોન્ટ્રાક્ટરો	૪ ૪૬ ૦૮ ૮૯૯	૧ ૬૬ ૧૩ ૩૯૦	૨ ૭૯ ૯૫ ૫૦૯
કુલ કેપીટલ કમીટમેન્ટ	૬૪૬ ૮૬ ૫૮ ૮૯૯	૨૪૮ ૦૦ ૮૩ ૪૦૩	૩૯૮ ૮૫ ૭૫ ૪૯૬

૩૧ મી માર્ચ, ૨૦૨૧ ના વર્ષ અંતિત

કરાર કરવામાં આવેલ પાર્ટી નું નામ	કરારની કુલ કિમત	૩૧ મી માર્ચ, ૨૦૨૧ સુધી પૂર્ણ કરેલ કરારની કિમત	બાકી રહેલ કરારની કિમત
કલ્પતરુ પાવર ટ્રાન્સમીશન લી - ઈપીસી કોન્ટ્રાક્ટ	૨૬૩ ૫૨ ૦૦ ૦૦૦	૭૭ ૪૦ ૬૭ ૫૦૫	૧૮૬ ૧૧ ૩૨ ૪૯૫
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ - પીએમસી કરાર	૪૫ ૨૬ ૦૦ ૦૦૦	૭ ૬૬ ૫૮ ૭૯૩	૩૭ ૫૯ ૪૧ ૨૦૭
કુલ કેપીટલ કમીટમેન્ટ	૩૦૮ ૭૮ ૦૦ ૦૦૦	૮૫ ૦૭ ૨૬ ૨૯૮	૨૨૩ ૭૦ ૭૩ ૭૦૨

૪૨. જુદા જુદા નાણાંકીય રેશિયો નીચે દર્શાવવામાં આવેલ છે:-

ક્રમ	રેશિયો	ન્યુમરેટર	ડીનોમીનેટર	૩૧/૦૩/૨૦૨૨	૩૧/૦૩/૨૦૨૧
૧	કરન્ટ રેશિયો (X)	કરન્ટ એસેટ	કરન્ટ જવાબદારી	૭.૮૪	૧૬.૧૨
ફેરફાર માટે કારણ : ચાલુ વર્ષની જવાબદારીઓ કરતા ચાલુ વર્ષની મિલકતોના વધારાના કારણે.					
૨	ડેબ્ટ ઈકવીટી (X) રેશિયો	કુલ ડેબ્ટ	શેર ધારકોનો ઈકવીટી (કેપીટલ વત્તા રીઝર્વ)	-	-
૩	ડેબ્ટ સેવા કવરેજ રેશિયો (X)	વેરા પહેલાનો નેટ નફો + નોન કેશ ઓપરેટીંગ ખર્ચ જેવા કે ઘસારો અને અન્ય એમોરાઈઝેશન + વ્યાજ + અન્ય એડજસ્ટમેન્ટ જેવા કે ફીક્સ એસેટ ના વેચાણ પર થયેલ લોસ વગેરે	વ્યાજ અને લીઝ યુકવણુ + પ્રીન્સીપલ યુકવણુ	-	-
૪	ઈકવીટી પર રીટર્ન (%)	વેરા પછી નેટ નફો - પ્રેફરેન્સ ડીવીડેન્ડ (જો કોઈ હોય તો)	સરેરાશ શેર ધારકનું ઈકવીટી	૨૧%	૧૮%
૫	ઈન્વેન્ટરી ટર્નઓવર રેશિયો	વેચેલ ગુડસની કિંમત કે સેલ્સ	સરેરાશ ઈન્વેન્ટરી (ઓપનીંગ + કલોઝીંગ સિલક / ૨)	-	-

૬	મળવાપાત્ર ટ્રેડ ટર્નઓવર રેશિયો	નેટ કેડીટ સેલ (ગ્રોસ કેડીટ સેલ્સ બાદ સેલ્સ રીટર્ન)	સરેરાશ મળવાપાત્ર હિસાબો (ઓપનીંગ + બંધ સિલક / ૨)	૩.૨૧	-
ફેરફાર માટે કારણ : ગત વર્ષે કોઈપણ મળવાપાત્ર ટ્રેડ રહેલ નથી તેથી.					
૭	ચૂકવવાપાત્ર ટ્રેડ ટર્નઓવર રેશિયો	નેટ કેડીટ ખરીદી (ગ્રોસ કેડીટ ખરીદી માઈનસ ખરીદીના રીટર્ન)	સરેરાશ વર્કીંગ કેપીટલ	૦.૦૭	-
ફેરફાર માટે કારણ : ગત વર્ષે કોઈપણ ચૂકવવાપાત્ર ટ્રેડ રહેલ નથી તેથી.					
૮	નેટ કેપીટલ ટર્નઓવર રેશિયો	નેટ સેલ્સ (કુલ સેલ્સ માઈનસ સેલ્સ રીટર્ન)	સરેરાશ વર્કીંગ કેપીટલ	૦.૦૭	-
ફેરફાર માટે કારણ : ગત વર્ષે કોઈપણ વેચાણ થયેલ નથી તેથી.					
૯	નેટ નફા રેશિયો	નેટ નફો	નેટ સેલ્સ	૦.૦૧	-
ફેરફાર માટે કારણ : ગત વર્ષે કોઈપણ વેચાણ થયેલ નથી તેથી.					
૧૦	એમ્પ્લોઈડ કેપીટલ પરતુ રીટર્ન	વ્યાજ અને વેરા પહેલાનું રીટર્ન	એમ્પ્લોઈ થયેલ કેપીટલ (ટિન્જેબલ નેટ વર્થ + કુલ ડેબીટ + ડીફર થયેલ વેરાની જવાબદારી)	૦.૦૦૩	૦.૦૦૪
ફેરફાર માટે કારણ : એમ્પ્લોઈડ થયેલ કેપીટલમાં રહેલ પ્રપોર્શીનેટ વધારો આવક કરતા વધારે છે.					
૧૧	રોકાણ પર રીટર્ન	રીટર્ન	રોકાણ	-	-

૪૩. નીચેના ખર્ચાઓમાં જુના સમયગાળાના ખર્ચાઓનો સમાવેશ થાય છે:-

વિગત	રકમ	જુઓ નોંધ નં.
ભાડા ખર્ચ	૨૩ ૯૩ ૯૨૭	૨૮
રીપેયર અને મેન્ટેનેન્સ	૩ ૪૪ ૩૩૦	૨૮
આરઓસી અને લીગલ ખર્ચ - પ્રોફેશનલ વેરા	૯ ૭૧ ૭	૨૮
કુલ	૨૭ ૪૭ ૯૭૪	

૪૪. લીઝની વ્યવસ્થાઓ

કંપનીએ ગુજરાત ઉદ્યોગ ભવન સોસાયટી સાથે ઓફીસ પ્રીમાઈસીસ ને પાંચ વર્ષના લીઝ માટે રૂા. ૧, ૬૦,૨૮૫/- ના માસિક ભાડાથી પ્રાપ્ત કરવા માટે કરાર કરેલ છે.

ઉપર જણાવેલ લીઝને રાઈટ ટુ યુઝ - લીઝ હોલ્ડ ઓફિસમાં ડેબીટ કરીને તેને એકાઉન્ટ કરેલ છે અને તેની સંબંધીત લીઝ જવાબદારીમાં કેડીટ કરેલ છે. ઉપર જણાવેલ લીઝ જવાબદારીને ભવિષ્યના લીઝ ચૂકવણા ને ૫ વર્ષ માટે ૯.૫% પ્રતિ વર્ષના લેખે ડીસ્કાઉન્ટ કરી પ્રાપ્ત કરેલ છે.

લીઝના જવાબદારીનું મેચ્યુરીટી વિશ્લેશણ

વિગત	૧૨ માસથી ઓછા માટે	૧૨ માસથી વધારે માટે	કુલ જવાબદારી
૩૧ મી માર્ચ, ૨૦૨૧ મુજબ	-	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૨ મુજબ	૧૩ ૧૨ ૬૨૫	૫૭ ૦૮ ૧૪૦	૭૦ ૨૦ ૭૬૫

નફા અને નુકશાનના પત્રકમાં દર્શાવવામાં આવેલ રકમ

વિગત	૩૧-૦૩-૨૦૨૨	૩૧-૦૨-૨૦૨૧
લીઝની જવાબદારી પરનો વ્યાજ	૩ ૫૦ ૫૩૨	-
આરઓયુ એસેટ પરનું એમોરાઈઝેશન	૭ ૬૩ ૧૯૪	-
કુલ	૧૧ ૧૩ ૭૨૬	-

રાઈટ ટુ યુઝ (આરઓયુ) એસેટની વિગતો - લીઝ હોલ્ડ ઓફિસ

વિગત	૩૧-૦૩-૨૦૨૨	૩૧-૦૨-૨૦૨૧
બેલેન્સ શીટની તારીખે ઉઘડતી કેરીઈંગ વેલ્યુ	-	-
વર્ષ દરમ્યાન આરઓયુમાં ઉમેરો	૭૬ ૩૧ ૯૪૩	-
દર્ષ દરમ્યાન આરઓયુ એસેટનું એમોરાઈઝેશન	૭ ૬૩ ૧૯૪	-
બેલેન્સ શીટની તારીખે બંધ થતો કેરીઈંગ વેલ્યુ	૬૮ ૬૮ ૭૪૯	-

૪૫. ગત વર્ષના આકાંને રી ગ્રુપ/રી કલાસીફાય જયા જરૂર હોય ત્યા કરેલ છે જેથી તે ચાલુ વર્ષના આંકડા સાથે સરખામણી કરી શકાય.

નોંધ નંબર ૧ થી ૪૫ ના સીગનેટરી

સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે

શાહ અને દલાલ વતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

એફઆરએન ૧૦૯૪૩૨૩૫૯૯

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

સહી/-

મલય દલાલ

(ભાગીદાર,

સભ્ય નં. ૦૩૬૭૭૬

સહી/-

એસ. એન. જોષી

સીએફઓ

સહી/-

જવલેશ ઝવેરી

નિયામક

ડીઆઈએન: ૦૯૫૦૭૨૨૪

સહી/-

સંતોષ કુમાર

નિયામક અને સીઈઓ

ડીઆઈએન : ૦૭૯૫૪૧૭૯

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨

સ્થળ:- ગાંધીનગર

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૨

11/15

Industries & Mines Department
4th Administrative Report of
Bahucharaji Rail Corporation Limited
Pursuant to Section 394(2) of the Companies Act, 2013
(For the F.Y. 2021-22)

Bahucharaji Rail Corporation Limited (BRCL) is a Joint Venture of Gujarat Rail Infrastructure Development Corporation Limited, Gujarat Industrial Development Corporation and Maruti Suzuki India Limited, incorporated under provision of the Companies Act, 2013 on 13.12.2018.

BRCL has been incorporated to carry on the business of development, financing, planning and implementation of Gauge Conversion of Katosan Road–Becharaji–Chanasma-Ranuj (65 Kms) line project in the state of Gujarat.

During the year the Company has undertaken following business activities:

- a) Maruti Suzuki India Limited (MSIL) has entrusted BRCL for the development of MSIL in Plant yard for smooth rail connectivity at Becharaji.
- b) The work of Transaction Advisory and Project management has been assigned to GRIDE for inviting of tender, monitoring and execution of the project. EPC contractor for the project has been finalized for Phase-I and Phase-II & Execution of Phase-I & Phase-II is under progress.
- c) For field supervision and contract management, Project Management Consultancy agency has been working.
- d) Other in-house day to day works for smoother progress of project are being undertaken by the Company.
- e) Land Acquisition for the project is being coordinated with State Government and District Administration.
- f) Monitoring the progress of project for various activities.
- g) Liasoning with Railways and State Government on all issues related to Project.

The management is accelerating its activities and speed up implementation of the project during the year.

During the reporting period, company has incurred profit of Rs. 52,83,584/-

Chief Executive Officer



Bahucharaji Rail Corporation Limited*

Additional Chief Secretary

Industries & Mines Department
Government of Gujarat



BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

(CIN: U45101GJ2018SGC105602)

4th Annual Report F.Y. 2021-2022

Date : 22/09/2022

Time : 01:30 PM

Place : Block No.6, 7th Floor

Udyog Bhawan, Sector - 11,

Gandhinagar-382011, Gujarat

: Registered Office:

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Block No. 6, 7th Floor, Udyog Bhavan, Sector-11,

Gandinagar-382011

Phone: -079-232-32728/29, Email: - info@brcl.org.in

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(CIN: U45101GJ2018SGC105602)

INDEX

Sr. No.	Particulars	Page No.
1	Board of Directors	4
2	Notice of 4 th Annual General Meeting	5
3	Board's Report	8
4	Report of C & AG	21
5	Independent Auditor's Report	23
6	Balance Sheet	42
7	Profit & Loss Account	44
8	Cash Flow Statement	47
9	Notes forming part of Financial Statements	49

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(CIN: U45101GJ2018SGC105602)

Board of Directors

Sr. No.	Name & DIN of Director	Designation
1.	SHRI SANTOSH KUMAR - 07854179	Director
2.	SHRI BAJRANG CHHAGANBHAI WARLI - 07133942	Director
3.	SHRI PAWAN AGARWAL - 09650740	Director
4.	SHRI RAJ SWARUP KAPOOR - 08303688	Director
5.	JWALESH PIYUSHBHAI ZAVERI - 09507224	Nominee Director
6.	SANTOSH KUMAR - AFPPK5776D	CEO
7.	SHAMBHUPRASAD JOSHI - ABEPJ6568K	CFO

Statutory Auditors

M/s Shah & Dalal
Chartered Accountants,
Ahmedabad

Bankers

Yes Bank, Gandhinagar,
Union Bank of India, Gandhinagar.

Registered Office

Block No. 6, 7th Floor,
Udyog Bhavan, Sector-11,
Gandinagar-382011.

Notice for the 4th Annual General Meeting

NOTICE is hereby given that the Fourth Annual General Meeting of the Company Bahucharaji Rail Corporation Limited will be held on **Thursday, the 22nd September, 2022 at 1:30 p.m. (at a shorter notice) through Video conferencing/OAVM mode with a deemed place of meeting at Block No. 6, 7th Floor, Udhyog Bhavan, Sector 11, Gandhinagar – 382011** to transact the following business:

ORDINARY BUSINESS:

1. To receive, consider and adopt the Audited Financial Statement of the Company for the Financial Year ended March 31, 2022 together with the reports of the Board of Directors and Auditors and comments of Comptroller and Auditor General of India thereon.
2. To appoint Shri B. C. Warli (DIN: 07133942), who retires by rotation as a Director and being eligible offers herself for re-appointment.
3. To appoint Shri Raj Swarup Kapoor (DIN: 08303688), who retires by rotation as a Director and being eligible offers himself for re-appointment.
4. To authorize Board of Directors of the Company for appointment of Statutory Auditors upon receipt of recommendation from the Comptroller and Auditor General of India office for audit of accounts of the Company for the year 2022-23.

SPECIAL BUSINESS:

5. To consider and, if thought fit, to pass with or without modifications, the following Resolution as a Ordinary Resolution:

ORDINARY RESOLUTION

“RESOLVED THAT pursuant to the provisions of Section 149 and 152 read with Schedule IV and all other applicable provisions of the Companies Act, 2013 and the Companies (Appointment and Qualification of Directors) Rules, 2014 (including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force), Shri Pawan Agarwal (DIN: 09650740), who was appointed as an Additional Director of the Company by the Board of Directors w.e.f. 20th July, 2022 pursuant to provisions of Section 161 (1) of the Companies Act, 2013 read with provisions of the Articles of Association of the Company holds office up to the date of this Annual General Meeting, be and is hereby appointed as a Director of the Company liable to retire by rotation, nominated by Maruti Suzuki India Limited (MSIL).”

Regd. Office:

Block No. 6, 7th Floor,
Udyog Bhavan,
Sector -11,
Gandhinagar - 382 011

By order of the Board of Directors

Sd/-
CEO & DIRECTOR

Date: 22nd September, 2022**NOTES:**

1. Shareholders seeking any information regarding any aspect of this report are requested to write to the company well in advance so as to enable the management to keep the information ready.
2. Statutory Auditors are appointed upon recommendation of Comptroller and Auditor General of India every year on yearly basis. However for the financial year 2022-23, the company has not received any letter of recommendation from the office of Comptroller and Auditor General of India. Therefore, it has been proposed at agenda item No. 4 of the notice to authorise Board of directors of the company to appoint a firm of chartered accountants upon receipt of recommendation from the office of Comptroller and Auditor General for the financial year 2022-23.

EXPLANATORY STATEMENT UNDER SECTION 102(1) OF THE COMPANIES ACT, 2013**SPECIAL BUSINESS****Item No. 5****APPOINTMENT OF SHRI PAWAN AGARWAL (DIN: 09650740) AS A DIRECTOR OF THE COMPANY NOMINATED BY MARUTI SUZUKI INDIA LIMITED (MSIL)**

Shri Pawan Agarwal (DIN: 09650740), who has been appointed as an Additional Director of the Company under Section 161 (1) of the Companies Act, 2013 w.e.f. 20th July, 2022 holds office up to the date of this Annual General Meeting and is eligible for appointment as a Director of the Company as nominee of Maruti Suzuki India Limited (MSIL).

The Board of Directors has recommended the ordinary resolution for your approval.

None of the Directors or Key Managerial Personnel of the Company (including relatives of the Directors and Key Managerial Personnel), are concerned or interested, financially or otherwise, in this resolution.

Regd. Office:

Block No. 6, 7th Floor,
Udyog Bhavan,
Sector -11,
Gandhinagar - 382 011

By order of the Board of Directors**Sd/-****CEO & DIRECTOR****Date: 22nd September, 2022**

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

(CIN: U45101GJ2018SGC105602)

Reg. Office: Block No. 6, 7TH Floor, Udhog Bhavan, Sector-11, Gandhinagar, Gujarat-382011

BOARD'S REPORT

To,

The Members,

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Gandhinagar, Gujarat

Your Directors have pleasure in presenting their 4th Annual Report on the business and operations of Bahucharaji Rail Corporation Limited (“the Company”) and the accounts for the financial year ended on 31st March, 2022.

1. FINANCIAL SUMMARY OR HIGHLIGHTS/PERFORMANCE OF THE COMPANY:

The financial position of the Company for financial year ended on 31st March, 2022 is as follows:

Particulars	(Amount in ₹)	
	2021-22	2020-21
Revenue from Operations	43,92,45,536	-
Other Income	3,59,74,956	1,97,79,232
Total Revenue	47,52,20,492	1,97,79,232
Less: Total Expenses	(46,06,30,692)	(1,27,77,858)
Profit / (Loss) Before Tax	1,45,89,800	70,01,374
Less: Tax Expenses	93,06,216	55,02,582
Profit / (Loss) after tax	52,83,584	14,98,792

2. BRIEF DESCRIPTION OF THE COMPANY'S WORKING DURING THE YEAR:

The Company is started commercial operations during the year.

- a) Maruti Suzuki India Limited (MSIL) has entrusted BRCL for the development of MSIL In Plant yard for smooth rail connectivity at Becharaji.
- b) The work of Transaction Advisory and Project management has been assigned to GRIDE

for inviting of tender, monitoring and execution of the project. EPC contractor for the project has been finalized for Phase-I and Phase-II.

- c) For field supervision and contract management, Project Management Consultancy agency has been working.
- d) Other in-house day to day works for smoother progress of project are being undertaken by the Company.
- e) Land Acquisition for the project is being coordinated with State Government and District Administration.
- f) Monitoring the progress of project for various activities.
- g) Liasoning with Railways and State Government on all issues related to Project.

The management is accelerating its activities and speed up implementation of the project during the year.

3. EFFECT OF COVID-19:

FY 2021-22 continued to be a challenging year due to novel Coronavirus (COVID-19). Overcoming the challenges posed by subsequent waves of COVID-19, take numerous steps to deal with the new set of challenges and we continue to evolve our people practices supporting our employees. The Company will closely monitor any material changes arising out of future economic conditions and impact on its activities.

4. CHANGE IN THE NATURE OF BUSINESS, IF ANY:

During the financial year under review, there is no Change in the nature of business.

5. DIVIDEND:

During the financial year under review, the Board of Directors did not recommend any Dividend on the Equity Shares of the Company.

6. TRANSFER TO RESERVES:

During the financial year under review, Company has not transferred any amount to General Reserve.

7. SHARE CAPITAL OF THE COMPANY AND CHANGE IN SHARE CAPITAL, IF ANY:

The Authorized, Issued, Subscribed and Paid-up Share Capital of the Company as at 31st March, 2022 as follows:

SHARE CAPITAL STRUCTURE	
Authorised Share Capital *	Rs. 7,86,22,00,000 (Rupees Seven Hundred Eighty Six Crores and Twenty Two Lakhs Only) divided into 78,62,20,000 (Seventy Eight Crores Sixty Two Lakhs Twenty Thousand) Equity Shares of Rs. 10/- each.
Issued, Subscribed and Paid-up Share Capital **	Rs. 4,96,91,72,000/- (Rupees Four Hundred Ninety Six Crores Ninety One Lakhs Seventy Two Thousand only) divided into 49,69,17,200 (Forty Nine Crores Sixty Nine Lakhs Seventeen Thousand Two Hundred) Equity Shares of Rs. 10/- each.

** Allotment of 30,45,42,200 (Thirty Crore Forty Five Lakh Forty Two Thousand Two Hundred) Equity shares of Rs. 10/- (Ten) each to equity shareholders of the Company on right basis in tranches, which shall rank pari passu in all respect with existing share holders w.e.f 11th June, 2021, 3rd February, 2022 and 8th March, 2022 respectively during the year.

8. SUBSIDIARIES, JOINT VENTURES AND ASSOCIATE COMPANIES:

The Company is Joint Venture Company promoted by, Gujarat Rail Infrastructure Development Corporation Limited, Gujarat Industrial Development Corporation and Maruti Suzuki India Limited. Therefore by virtue of shareholding agreement of the company becomes Joint Venture Company of J.V. Partners.

9. DISCLOSURE REGARDING ISSUE OF EQUITY SHARES WITH DIFFERENTIAL RIGHTS:

The Company has not issued any Equity Shares with Differential Voting Rights during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 4 (4) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

10. DISCLOSURE REGARDING ISSUE OF SWEAT EQUITY SHARES:

The Company has not issued any Sweat Equity Shares during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 8 (13) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

11. DISCLOSURE REGARDING ISSUE OF EMPLOYEE STOCK OPTION:

The company has not issued any shares under Employee Stock Option Scheme during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 12 (9) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

12. PARTICULARS OF EMPLOYEES:

As the Bahucharaji Rail Corporation Limited is not a Listed Company therefore section 197 (12) and Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014, statement of particulars of employees are not applicable to the Company.

13. DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL:

During the financial year under review, details of Board of Directors and Key Managerial Personnel as well as changes made in the Composition of the Board of Directors and Key Managerial Personnel (KMPs) as on the date of this Report are as follows:

Sr. No.	Name of Directors/ KMP Appointed	Directors Identification Number	Date of Appointment	Date of Cessation
1	Ashwinikumar Yadav, IAS	06581753	13/12/2018	11/11/2021
2	Bajrang Chhaganbhai Warli	07133942	13/12/2018	N. A.
3	Santosh Kumar, IRSE	07854179	13/12/2018	N. A.
4	Kavita Rakeshkumar Shah (Sheth)	08268558	06/02/2020	29/03/2022
5	Batchu Venugopal	08303687	13/12/2018	20/07/2022
6	Raj Swarup Kapoor	08303688	13/12/2018	N. A.
7	Jwalesh Piyushbhai Zaveri	09507224	16/02/2022	N. A.
8	Pawan Agarwal	09650740	20/07/2022	N. A.
9	Santosh Kumar, IRSE (CEO)	AFPPK5776D	22/09/2020	N. A.
10	Shambhuprasad Joshi (CFO)	ABEPJ6568K	22/09/2020	N. A.

* N.A. = Not Applicable

14. MANAGERIAL REMUNERATION:

The Company is not required to make disclosures pursuant to Rule 5 of Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014 relating to Managerial Remuneration being an Unlisted Company.

15. DEPOSITS:

During the financial year under review, the Company has not accepted any Deposits from the public and it is therefore not required to comply with the requirement under the Companies (Accounts) Rules, 2014.

16. DIRECTORS LIABLE TO RETIRE BY ROTATION:

Pursuant to the Section 152(6) of the Companies Act, 2013, Shri B. C. Warli (DIN: 07133942) and Shri Raj Swarup Kapoor (DIN: 08303688) retires by rotation at the AGM of the Company and being eligible offer themselves for re-appointment.

The Company has received the disclosure in Form DIR-8 stating that they are eligible to be re-appointed at the forthcoming Annual General Meeting of the Company.

17. BOARD MEETING:

Notice of Meeting is prepared and circulated in advance to the Directors as required under Secretarial Standards. During the year, Four Board Meetings were convened and held on 26th May 2021, 28th September, 2021, 28th December, 2021 and 22nd March, 2022. Relaxations were given by MCA in Financial Year 2021 (For First two quarters only) due to COVID-19 outbreak vide General Circular No. 08/2021 dated 03rd May, 2021 whereby gap of 180 days between two board meetings was allowed respectively.

18. BOARD EVALUATION:

Your Board is committed to assessing its own performance in order to identify its strengths and areas in which it may improve its functioning and processes for evaluation of performance of individual Directors, Chairman of the Board, and the Board as a whole. The Director Appointment/re-appointment/ continuation of Directors are subject to the outcome of the annual evaluation process.

19. ANNUAL RETURN:

The Company do not have any website therefore pursuant to the provisions of Section 134 (3) (a) of the Companies Act, 2013 read with the rules made thereunder, with respect to requirements for website disclosures relating to Annual Return (Form MGT 7) are not applicable to the Company.

20. AUDITORS:

The Statutory Auditors are appointed as per recommendation by the Comptroller and Auditor General of India office every year. The Board of Directors shall consider appointment of Statutory Auditors upon receipt of recommendation from the Comptroller and Auditor General of India office for the F. Y. 2022-23.

21. AUDITORS' REPORT:

The Auditors' Report does not contain any qualification. Notes to Accounts and Auditors remarks in their report are self-explanatory and do not call for any further comments.

22. COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6) (b) OF THE COMPANIES ACT, 2013:

The Company has received letter no. A.M.G.-1/Accounts/BRCL/2021-22/O.W.706 dated 9th September, 2022 from Comptroller and Auditor General of India on the audited accounts of the company for the year ended on 31/03/2022 stating that nothing significant has come to the knowledge which would give raise to any comment upon statutory Auditors' Report by C & AG.

23. INTERNAL AUDIT & CONTROLS:

The internal auditor M/s Trupal J. Patel, Chartered Accountants were appointed as internal auditor for FY 2021-22. The Services of M/s Trupal J. Patel, Chartered Accountants were found satisfactory and Board reappointed them for a further period one year for F. Y. 2022-23.

24. CORPORATE SOCIAL RESPONSIBILITY (CSR):

During the year under review, the provision of Corporate Social Responsibility under Section 135 of the Companies Act, 2013 is not applicable to the company.

25. RISK MANAGEMENT POLICY:

BRCL shall identify the possible risks associated with its business and commits itself to put in place a Risk Management Framework to address the risk involved on an ongoing basis to ensure achievement of the business objective without any interruptions. BRCL shall optimize the risks involved by managing their exposure and bringing them in line with the acceptable risk appetite of the Company.

26. CONSERVATION OF ENERGY, TECHNOLOGY ABSORPTION AND FOREIGN EXCHANGE EARNINGS AND OUTGO:

The Company has no activities which required disclosure relating to conservation of energy or technology absorption as it is not a Manufacturing Company. There has been no foreign exchange earnings or outgo during the year under review.

27. MATERIAL CHANGES AND COMMITMENTS, IF ANY, AFFECTING THE FINANCIAL POSITION BETWEEN THE END OF THE FINANCIAL YEAR AND THE DATE OF THE REPORT:

No material changes and commitments have occurred after the close of the financial year

till the date of this report, which affect the financial position of the Company other than those specifically highlighted in this report. However the Company has allotted 3,67,73,831 and 1,96,07,843 equity shares of Rs. 10/- each on 22nd April, 2022 and 20th July, 2022 respectively to GUJARAT RAIL INFRASTRUCTURE DEVELOPMENT CORPORATION LIMITED [G-RIDE].

28. DETAILS OF SIGNIFICANT AND MATERIAL ORDERS PASSED BY THE REGULATORS OR COURTS OR TRIBUNALS IMPACTING THE GOING CONCERN STATUS AND COMPANY'S OPERATIONS IN FUTURE:

No significant or material orders were passed by the regulator or court or tribunals which impact the going concern status and Company's operations in future.

29. OBLIGATION OF COMPANY UNDER THE SEXUAL HARASSMENT OF WOMEN AT WORKPLACE (PREVENTION, PROHIBITION AND REDRESSAL) ACT, 2013:

In order to prevent sexual harassment of women at work place a new act The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013 has been notified on 9th December, 2013. Under the said Act every company is required to set up an Internal Complaints Committee to look into complaints relating to sexual harassment at work place of any women employee.

Company will adopt a policy in future for prevention of Sexual Harassment of Women at workplace and will set up Committee for implementation of said policy in future. During the financial year under review, Company has not received any complaint of harassment.

30. PARTICULARS OF LOANS, GUARANTEES AND INVESTMENTS:

During the year under review, the Company has not given any loans, made any investments or given guarantees on any loans, which fall within the purview of the provisions of Section 134(3)(g) of the Companies Act, 2013 and hence, no disclosures are required to be made thereof.

31. PARTICULARS OF CONTRACTS OR ARRANGEMENTS WITH RELATED PARTIES:

During the year under review, contracts and arrangements with related parties under Section 188(1) of the Companies Act, 2013, are reported in the Audited Balance sheet of the Company.

32. AUDIT COMMITTEE:

During the year under review, the provisions pursuant to Section 178 of the Companies Act, 2013 read with Rule (6) of the Companies (Meetings of Board and its Powers) Rules, 2014 was not applicable to the company in context of Audit Committee.

33. NOMINATION AND REMUNERATION COMMITTEE:

During the year under review, the provisions pursuant to Section 178 of the Companies Act, 2013 read with rule (6) of the Companies (Meetings of Board and its Powers) Rules, 2014 were not applicable to the company in context of Nomination and Remuneration Committee.

34. DIRECTORS' RESPONSIBILITY STATEMENT:

The Directors' Responsibility Statement referred to in clause (c) of sub-section (3) of Section 134 of the Companies Act, 2013, shall state that—

- (a) In the preparation of the Annual Accounts, the applicable Accounting Standards had been followed along with proper explanation relating to material departures;
- (b) The Directors had devised proper systems to ensure compliance with the provisions of all applicable laws and that such systems were adequate and operating effectively.
- (c) the Directors had selected such Accounting Policies and applied them consistently and made judgments and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the Company at the end of the financial year and of the profit and loss of the Company for that financial year;
- (d) The Directors had taken proper and sufficient care for the maintenance of adequate accounting records in accordance with the provisions of this Act for safeguarding the assets of the Company and for preventing and detecting fraud and other irregularities;
- (e) The Directors had prepared the Annual Accounts on a going concern basis;

35. SECRETARIAL AUDIT REPORT:

The Company has obtained Secretarial Audit Report in Form No. MR-3 pursuant to Section 204(1) of the Companies Act, 2013 and Rule (9) of the Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014 from M/s Kiran Patel and Associates,

a Practicing Company Secretary. A copy of the Report is annexed to this Directors Report.

36. TRANSFER OF AMOUNTS TO INVESTOR EDUCATION AND PROTECTION FUND:

In terms of Section 124 of the Companies Act, 2013, read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, shares of the Company in respect of which dividend entitlements have remained unclaimed or unpaid for seven consecutive years or more, are required to be transferred by the Company to the Investor Education and Protection Fund (IEPF) of the Government of India. There were no such instances requiring compliance with the same.

37. ACKNOWLEDGEMENTS:

Your Directors express their warm wish to place on record their sincere appreciation to the Co-Operation extended by the Registrar of Companies, Comptroller & Auditor General of India and Statutory Auditors. The Directors are also grateful to the Government of Gujarat, G-RIDE, MSIL, GIDC Officers and staff of the Company for their co-operation and look forward for their continued support.

**For & on behalf of the Board of Directors of
BAHUCHARAJI RAIL CORPORATION LIMITED**

Place : Gandhinagar

Date : 22/09/2022

**Sd/-
SANTOSH KUMAR
DIRECTOR & CEO
[DIN: 07854179]**

**Sd/-
JWALESH ZAVERI
DIRECTOR
[DIN: 09507224]**

SECRETARIAL AUDIT REPORTFOR THE FINANCIAL YEAR ENDED ON 31st MARCH, 2022

[Pursuant to section 204(1) of the Companies Act, 2013 and rule No.9 of the Companies (Appointment and Remuneration Personnel) Rules, 2014]

To,
The Members,
Bahucharaji Rail Corporation Limited
Block No. 6, 7th Floor, Udyog Bhavan
Sector-11, Gandhinagar-382 011

We have conducted the secretarial audit of the compliance of applicable statutory provisions and the adherence to good corporate practices by **Bahucharaji Rail Corporation Limited**. The Secretarial Audit was conducted in a manner that provided us a reasonable basis for evaluating the corporate conducts/statutory compliances and expressing my opinion thereon. Based on our verification of the Company's books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company and also the information provided by the Company, its officers, agents and authorized representatives during the conduct of secretarial audit, we hereby report that in our opinion, the Company has, during the audit period covering the financial year ended on **31st March, 2022** complied with the statutory provisions listed hereunder and also that the Company has proper Board-processes and compliance-mechanism in place to the extent, in the manner and subject to the reporting made hereinafter:

We have examined the books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company for the financial year ended on 31st March, 2022 according to the provisions of:

- (i) The Companies Act, 2013 (the Act) and the rules made thereunder;
- (ii) The Securities Contracts (Regulation) Act, 1956 ('SCRA') and the rules made thereunder;
- (iii) The Depositories Act, 1996 and the Regulations and Bye-laws framed there-under are complied with to the extent applicable. Further, MCA vide notification dated 22nd January, 2019 exempted government companies from dematerialization of shares and hence the same is not applicable to the Company.
- (iv) Foreign Exchange Management Act, 1999 and the rules and regulations made there-under to the extent of Foreign Direct Investment, Overseas Direct Investment and External Commercial Borrowings.

- (v) The following Regulations and Guidelines prescribed under the Securities and Exchange Board of India Act, 1992 ('SEBI Act') **are not applicable** to the Company during the period under review.
- (a) The Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011;
 - (b) The Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 1992;
 - (c) The Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2009;
 - (d) The Securities and Exchange Board of India (Employee Stock Option Scheme and Employee Stock Purchase Scheme) Guidelines, 1999;
 - (e) The Securities and Exchange Board of India (Issue and Listing of Debt Securities) Regulations, 2008;
 - (f) The Securities and Exchange Board of India (Registrars to an Issue and Share Transfer Agents) Regulations, 1993 regarding the Companies Act and dealing with client;
 - (g) The Securities and Exchange Board of India (Delisting of Equity Shares) Regulations, 2009; and
 - (h) The Securities and Exchange Board of India (Buyback of Securities) Regulations, 1998;
- (vi) I further report that, having regard to the compliance system prevailing in the Company and on examination of the relevant documents and records in pursuance thereof on test-check basis, the Company has complied with the following laws applicable specifically to the Company:
- (i) The Contract Labour (Regulation & Abolition) Act, 1970

I have also examined compliance with the applicable clauses of the following:

- (i) Secretarial Standards issued by The Institute of Company Secretaries of India.
- (ii) The Company being unlisted is not required to comply with the Listing Agreements of Stock Exchange(s) / SEBI (LODR) Regulations, 2015.

During the period under review, the Company has generally complied with the provisions of the Act, Rules, Regulations, Guidelines, Standards, etc. mentioned above subject to our following observations:

We further report that the as per information provided to us the Company is in process of appointing a suitable candidate as Company Secretary as Key Managerial Personnel (KMP) u/s 203 of the Companies Act, 2013 during the period under review.

We further report that

The Board of Directors of the Company is duly constituted as on 31st March, 2022. The changes in the composition of the Board of Directors that took place during the period under review were carried out in compliance with the provisions of the Act.

Adequate notice is given to all directors to schedule the Board Meetings, agenda and detailed notes on agenda were sent at least seven days in advance, and in case of shorter notice required compliance as per Companies Act, 2013 has been ensured.

Majority decision is carried through and recorded as part of the minutes.

We further report that

There are adequate systems and processes in the company commensurate with the size and operations of the company to monitor and ensure compliance with applicable laws, rules, regulations and guidelines.

We further report that

1. During the audit period the Company has:-

- (i) allotted 3,26,25,000 Equity Shares of Rs. 10 each aggregating to Rs.32,62,50,000 by passing the Board Resolution by circulation on 11.06.2021 to existing shareholder on right basis.
- (ii) allotted 14,59,17,200 Equity Shares of Rs. 10 each aggregating to Rs. 1,45,91,72,000 by passing the Board Resolution by circulation on 03.02.2022 to existing shareholder on right basis.
- (iii) allotted 12,60,00,000 Equity Shares of Rs. 10 each aggregating to Rs. 126,00,00,000 by passing the Board Resolution by circulation on 08.03.2022 to existing shareholder on right basis.

Date: 20.07.2022
Place: Gandhinagar

For K. K. Patel & Associates

Sd/-

CS Kiran Kumar Patel
Proprietor

FCS No.6384, CP No.6352
UDIN: F006384D000655153

*(This report is to be read with our letter of even date which is annexed as **Annexure A (Page 5)** and forms an integral part of this report.)*

'Annexure A'

To,
The Members,
Bahucharaji Rail Corporation Limited
Block No. 6, 7th Floor, Udyog Bhavan
Sector-11, Gandhinagar-382 011

Our report of even date is to be read along with this letter.

1. Maintenance of secretarial record is the responsibility of the management of the Company. Our responsibility is to express an opinion on these secretarial records based on our audit.
2. We have followed the audit practices and processes as were appropriate to obtain reasonable assurance about the correctness of the contents of the Secretarial records. The verification was done on test basis to ensure that correct facts are reflected in secretarial records. We believe that the processes and practices, we followed provide a reasonable basis for our opinion.
3. We have not verified the correctness and appropriateness of financial Statements, financial records and Books of Accounts of the company.
4. The compliance of the provisions of Corporate and other applicable laws, rules, regulations, standards is the responsibility of management. Our examination was limited to the verification of procedures on test basis.
5. The Secretarial Audit report is neither an assurance as to the future viability of the company nor of the efficacy or effectiveness with which the management has conducted the affairs of the company.

For K. K. Patel & Associates

Sd/-

(Kiran Kumar Patel)
FCS No. 6384, CP No. 6352

Date: 20.07.2022
Place: Gandhinagar

ANNEXURE – I

Office of the Principal Accountant General (Audit)-II, Gujarat

No.AMG-1/Accounts/BRCL/2021-22/OW706/09.09.2022

To,

Managing Director,

Bahucharaji Rail Corporation Limited,

7th Floor, Block No-6, Udyog Bhavan

Sector-11, Gandhinagar-382011

Subject: Comment of the Comptroller and Auditor General of India under Section 143(6)(b) of the Companies Act, 2013 on the financial statements of Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2022.

Sir,

Please find enclosed nil comment certificate of the Comptroller and Auditor General of India under Section 143(6)(b) of the Companies Act, 2013 on the financial statements of Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2022 for being placed before Annual General Meeting of the Company.

Under Section 143(6) of the Companies Act, 2013 the comments of the Comptroller and Auditor General of India are required to be sent by Company to every person entitled to copies of audited financial statements under Section 136(1) of the Companies Act, 2013 and also to be placed before the Annual General Meeting of the Company at the same time and in the same manner as the Statutory Auditor's Report of the Company. The date of placing the Report of the Comptroller and Auditor General of India before the Annual General Meeting may please be intimated to this office.

Six copies of the printed accounts may please be sent to this office for our use and record.

Receipt of this letter with its enclosures may please be acknowledged.

Yours faithfully,

Sr. Dy. Accountant General(AMG-I)

Encl: As above

COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013 ON THE FINANCIAL STATEMENTS OF BAHUCHARAJI RAIL CORPORATION LIMITED FOR THE YEAR ENDED 31 MARCH 2022

The preparation of financial statements of the Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2022 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 (Act) is the responsibility of the Management of the Company. The Statutory Auditors appointed by the Comptroller and Auditor General of India under Section 139 (5) of the Act are responsible for expressing opinion on the financial statements under Section 143 of the Act based on independent audit in accordance with the Standards on Auditing prescribed under Section 143 (10) of the Act. This is stated to have been done by them vide their Revised Audit Report dated 20 July 2022.

I, on behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit of the financial statements of Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2022 under Section 143(6)(a) of the Act, This supplementary audit has been carried out independently without access to the working papers of the Statutory Auditors and is limited primarily to inquiries of the Statutory Auditors and Company personnel and a selective examination of some of the accounting records.

On the basis of my audit nothing significant has come to my knowledge which would give rise to any comment upon or supplement to Statutory Auditor's Report.

For and on behalf of the
Comptroller and Auditor General of India

Sd/-

(H.K. Dharmadarshi)

Principal Accountant General (Audit-II), Gujarat

Place: Ahmedabad

Date: 09/09/2022

INDEPENDENT AUDITORS' REPORT

**TO THE MEMBERS OF
BAHUCHARAJI RAIL CORPORATION LIMITED**

Report on the Financial Statements

Opinion

We have audited the accompanying financial statements of **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** ('the Company'), which comprise the Balance Sheet as at March 31, 2022, and the Statement of Profit and Loss (including Other Comprehensive Income), Statement of Changes in Equity and the Statement of cash flows for the year then ended, notes to the financial statements, including a summary of significant accounting policies and other explanatory information (herein after referred to as "financial statements").

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements give the information required by the Companies Act, 2013, as amended (the Act) in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India including Indian Accounting Standards (Ind AS), of the state of affairs of the Company as at March 31, 2022, and its financial performance including other comprehensive income, changes in equity and cash flows for the year ended on that date.

Basis For Opinion

We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) specified under section 143(10) of the Companies Act, 2013. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with the ethical requirements that are relevant to our audit of the financial statements under the provisions of the Companies Act, 2013 and the Rules thereunder, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion on the Financial Statements.

Responsibilities of Management and Those Charged with Governance for the Financial Statements

The Company's Board of Directors is responsible for the matters stated in Section 134(5) of the Companies Act 2013 ("the Act") with respect to the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance, total comprehensive income, changes in equity and cash flows of the Company in accordance with the accounting principles generally accepted in India, including the Indian Accounting Standards (Ind AS) specified under Section 133 of the Act, read with Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended.

This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Company's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

Those Board of Directors are also responsible for overseeing the Company's financial reporting process.

Auditor's Responsibilities for the Audit of the Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identified and assessed the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and also performed audit procedures responsive to those risks and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtained an understanding of internal controls relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(3)(I) of the Companies Act, 2013, we are also responsible for expressing our opinion on whether the company has adequate internal financial controls system in place and the operating effectiveness of such controls.
- Evaluated the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Concluded on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.
- Evaluated the overall presentation, structure and content of the financial statements including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by the Companies (Auditor's Report) Order, 2020 ("the Order") issued by the Central Government of India in terms of Section 143(11) of the Act, we give in "**Annexure A**" a statement on the matters specified in paragraphs 3 and 4 of the Order, to the extent applicable.
2. In terms of Section 143(5) of the Companies Act, 2013, we give in **Annexure 'C'** a statement on the directions issued under the aforesaid section by the Comptroller and Auditor General of India.
3. As required by Section 143(3) of the Act, we report that:
 - a) We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit of the aforesaid financial statements.
 - b) In our opinion, proper books of account as required by law relating to preparation of the aforesaid financial statements have been kept by the Company so far as it appears from our examination of those books.
 - c) The Balance Sheet, the Statement of Profit and Loss including Statement of other comprehensive income and the Statement of Changes in equity and the Cash Flow

Statement dealt with by this Report are in agreement with the relevant books of account maintained for the purpose of financial statement.

- d) In our opinion, the aforesaid financial statements comply with the Indian Accounting Standards (Ind AS) specified under Section 133 of the Act, read with Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended.
- e) The company being Government Company, provisions of sub section 2 of section 164 of the Companies Act, 2013 are not applicable as per Notification No.G.S.R.463 [E] dated 5th June, 2015 of Ministry of Corporate Affairs.
- f) With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Company and the operating effectiveness of such controls, refer to our separate report in “**Annexure B**”; and
- g) The company being Government Company, provisions of sub section 16 of section 197 of the Companies Act, 2013 are not applicable as per Notification No.G.S.R.463 [E] dated 5th June, 2015 of Ministry of Corporate Affairs.
- h) With respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, as amended, in our opinion and to the best of our knowledge and belief and according to the information and explanations given to us:
 - 1. The Company does not have any pending litigations as on Balance Sheet dated March 31, 2022.
 - 2. The Company has made provision, as required under the applicable law or Indian Accounting Standards, for material foreseeable losses, if any, on long-term contracts including derivative contracts.
 - 3. There has been no delay in transferring amounts, required to be transferred, to the Investor Education and Protection Fund by the Company.
 - 4. (a) The management has represented that, to the best of its knowledge and belief, no funds have been advanced or loaned or invested (either from borrowed funds or share premium or any other sources or kind of funds) by the Company to or in any other persons or entities, including foreign entities (“Intermediaries”), with understanding, whether recorded in writing or otherwise, that the intermediary shall whether,

- directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the company (“Ultimate Beneficiaries”) or
- provide any guarantee, security or the like to or on behalf of the Ultimate Beneficiaries.

(b) The management has represented, that, to the best of its knowledge and belief, no funds have been received by the Company from any persons or entities, including foreign entities (“Funding Parties”), with the understanding, whether recorded in writing or otherwise, that the Company shall, whether,

- directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the Funding Party (“Ultimate Beneficiaries”) or
- provide any guarantee, security or the like from or on behalf of the Ultimate Beneficiaries: and

(c) Based on such audit procedures as considered reasonable and appropriate in circumstances, nothing has come to our notice that has caused us to believe that the representations under sub clause (a) and (b) above, contain any material misstatement.

5. The company has not declared or paid any dividend during the year and has not proposed final dividend for the year.
 - i. As per the Section 203(1) of Companies Act, 2013 read with Rule 8 of the Companies (appointment and Remuneration of Managerial Personnel) Rules 2014 which required appointment of Key Managerial Personnel (KMP). The company has not appointed full time Qualified Company Secretary till the date of report. However, as per the information and explanation provided by management, Company has availed services of Practicing Company Secretary.

For Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Sd/-
Malay Dalal
Partner
M. No. : 036776

Place : Ahmedabad
Date : 20/07/2022

UDIN : 22036776ANJPYA3638

“ANNEXURE A” TO THE AUDITORS' REPORT

(Referred to in paragraph 1 under 'Report on other legal and regulatory requirement section of our Report of even date)

The Annexure referred to in Independent Auditors; Report to the members of **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** (“the Company”) on the financial statements for the year ended 31 March 2022.

We report that:

(I) In respect of Fixed Assets:

(a) The company does not have any fixed asset therefore this clause is not applicable.

(b) The Company has maintained proper records showing full particulars of Right of Use Asset in Financial Statement.

(c) & (d) According to the information and explanation given to us, the company does not own as immovable property during the year and hence, this clause is not applicable to the company. The Company has maintained proper records showing full particulars of Intangible Assets Under Development and the yare reflected in Financial Statement.

(e) According to the information and explanation given to us, there are no proceedings have been initiated and/or are pending against the company for holding any Benami property under the Benami Transactions (Prohibition) Act, 1988 (45 of 1988) and rules made thereunder. Hence, this clause is not applicable to the company.

(ii) The company does not have any inventory therefore this clause is not applicable.

(iii) According to information and explanations given to us and on the basis of our examination of the record of the company during the year the company has not made investment in, provided any guarantee or security or granted any loans or advances in the nature of loans, secured or unsecured to companies, firms, Limited Liability Partnership or other parties covered in the register maintained under section 189 of the Companies Act, 2013. Therefore, clause (iii) of the paragraph 3 of the order is not applicable to the company.

(iv) According to the information and explanation given to us, the Company has not granted any loans, nor given any guarantees and securities u/s 185 and 186 of the Companies Act,

2013. Thus, the clause (iv) of the paragraph 3 of the order is not applicable to the company.

- (v) According to the information and explanation given to us, the Company has not accepted any deposits or amounts which are deemed to be deposits during the year as per the directives issued by Reserve Bank of India and within the meaning of provision of section 73 to 76 and other relevant provisions of the Companies Act, 2013 and the rules framed there under where applicable. Thus, the clause (v) of the paragraph 3 of the order is not applicable to the company.
- (vi) The maintenance of cost records specified by the Central Government under section 148(1) of the Companies Act, 2013 is not applicable to this Company. Thus, the clause (vi) of the paragraph 3 of the order is not applicable to the company.
- (vii) According to the information and explanation given to us, in respect of statutory dues:
- (a) The Company had been regular in depositing undisputed statutory dues, including, Income Tax, Goods and Service Tax, and other material statutory dues applicable to it to the appropriate authorities.
- (b) There is no dispute with revenue authorities regarding any duty or tax payable.
- (viii) According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, the Company has not surrendered or disclosed any transactions, previously unrecorded as income in the books of account, in the tax assessments under the Income Tax Act, 1961 as income during the year.
- (ix) (a) The company does not have any loans or borrowings from any financial institutions, banks, government, or debenture holders during the year. Thus, the clause (ix) of paragraph 3 of the order is not applicable to the company.
- (b) According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, the Company has not been declared a willful defaulter by any bank or financial institution or government or government authority.
- (c) According to the information and explanations given to us by the management, the Company has not obtained any term loans during the year. Accordingly, clause 3(ix)(c) of the Order is not applicable to the Company.
- (d) According to the information and explanations given to us and on an overall examination of the balance sheet of the company, we report that no funds raised on short-

term basis have been used for long-term purposes by the company.

e) According to the information and explanations given to us and on an overall examination of the financial statements of the company, we report that the company has not taken any funds from any entity or person on account of or to meet the obligations of its subsidiary as defined under Companies Act, 2013. The Company does not hold any investment in any associate companies or joint ventures as defined under Companies Act, 2013.

(f) According to the information and explanations given to us and procedures performed by us, we report that the company has not raised loans during the year on the pledge of securities held in its subsidiary as defined under Companies Act, 2013.

(x) (a) To the best of our knowledge and according to the information and explanation given to us, during the year Company has not raised money by way of Initial Public Offer and/or Further Public Offer (including Debt Instrument) and also company has not obtained any Term loan and therefore this clause is not applicable to the company. However, company has utilized the monies raised by way of issue of equity shares for the purpose for which they were raised.

(b) According to the information and explanations given to us and based on our examination of the records of the Company, the company has not made any preferential allotment or private placement of shares or convertible debentures (fully, partially or optionally convertible) during the year under review in terms of provisions of section 42 and section 62 of the Companies Act, 2013. Accordingly, clause 3(x)(b) of the Order is not applicable.

(xi) (a) Based on examination of the books and records of the Company and according to the information and explanations given to us, no fraud by the Company and no fraud on the Company by its officers or employees has been noticed or reported during the period.

(b) According to the information and explanations given to us, no report under sub-section (12) of Section 143 of the Companies Act, 2013 has been filed by the auditors in Form ADT-4 as prescribed under rule 13 of Companies (Audit and Auditors) Rules, 2014, as amended with the Central Government.

(c) According to information and explanations given to us, there is no whistle blower

complaint has been received by the company during the year.

- (xii) According to the information and explanations given to us, the Company is not a Nidhi Company. Accordingly, clause 3(xii) of the Order is not applicable.
- (xiii) In our opinion and according to the information and explanation given to us, the Company is in compliance with section 188 and 177 of the Companies Act, 2013, wherever applicable. For all transaction with the related parties and the details of related parties' transactions have been disclosed in the financial statements etc., as required by the applicable Indian Accounting Standards.
- (xiv) (a) Based on information and explanations provided to us and our audit procedures, in our opinion, the Company has an internal audit system commensurate with the size and nature of its business.
- (b) We have considered the internal audit reports of the Company issued till date for the period under audit.
- (xv) In our opinion and according to the information and explanation given to us, during the period Company has not entered into any non-cash transaction with its directors or persons connected with them during the period.
- (xvi) (a) & (b) The company is not required to be registered under section 45-IA of the Reserve Bank of India Act, 1934. Accordingly, provision of clause 3 (xvi) (a) & (b) of the Order is not applicable to the Company.
- (c) & (d), The Company is not a Core Investment Company (CIC) as defined in the regulations made by the Reserve Bank of India. Accordingly, clause 3(xvi)(c) and clause 3(xvi)(d) of the Order is not applicable.
- xvii. The Company has not incurred cash losses in the current and in the immediately preceding financial year.
- xviii. There has not been any resignation of the statutory auditors during the period.
- xix. On the basis of the financial ratios, ageing and expected dates of realization of financial assets and payment of financial liabilities, other information accompanying the financial statements, Plans of the Board of Directors and management we are of the opinion that no material uncertainty exists as on the date of the audit report, that the company is capable

of meeting its liabilities existing at the date of balance sheet as and when they fall due within a period of one year from the balance sheet date.

- xx. According to information and explanation given to us, unspent amount which is required to be transferred to a Fund specified in Schedule VII to the Companies Act in compliance with second proviso to sub section (5) of Section 135 of the Said Act is not applicable to the company. Accordingly, clauses 3(xx)(a) and 3(xx)(b) of the Order are not applicable.
- xxi. According to information and explanation given to us, Company does not have any Associate, Joint Venture Company. Thus, the clause (xxi) of the paragraph 3 of the order is not applicable to the company.

For Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Sd/-
Malay Dalal
Partner
M. No. : 036776

Place : Ahmedabad
Date : 20/07/2022

UDIN : 22036776ANJPYA3638

Annexure “B” TO THE INDEPENDENT AUDITOR'S REPORT

(Referred to in paragraph 3(f) under 'Report on other legal and regulatory requirement section of our report of even date)

Report on the Internal Financial Controls Over Financial Reporting

Report on the Internal Financial Control under clause (i) of Sub section 3 of Section 143 of the companies Act, 2013 ('the Act').

We have audited the Internal financial controls over financial reporting **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** (“the Company”) as on 31stMarch2022 in conjunction with our audit of the financial statements of the company for the year ended on that date.

MANAGEMENT'S RESPONSIBILITY FOR INTERNAL FINANCIAL CONTROLS

The Company's Board of Director is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential component of internal control stated in the guidance note on audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India (ICAI). These responsibilities include the design implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company's policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

AUDITOR'S RESPONSIBILITY

Our responsibility is to express an opinion on the Company's Internal financial controls over financial reporting based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the “Guidance Note”) issued by the ICAI and the standards on auditing prescribed under Section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls, both applicable to an audit of Internal Financial Controls and, both issued by ICAI. Those Standards and the Guidance Note require that we comply with ethical requirement and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate financial controls over financial reporting were established and maintained and if such controls operated effectively in

all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness.

Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedure selected depend on auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due of fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company's internal financial controls system over financial reporting.

MEANING OF INTERNAL FINANCIAL CONTROLS OVER FINANCIAL REPORTING

A company's internal financial controls over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A company's internal financial control over financial reporting includes those policies and procedures that:

1. pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company;
2. provide reasonable assurance that transaction are recorded as necessary to permit preparation of financial statement in accordance with generally accepted accounting principles, and that receipt and expenditures of the company are being made only in accordance with authorizations of management and directors of the company; and
3. provide reasonable assurance regarding prevention or timely detection of unauthorized acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

INHERENT LIMITATION OF INTERNAL FINANCIAL CONTROLS OVER FINANCIAL REPORTING

Because of the inherent limitation of internal financial controls over financial reporting,

including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projection of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

OPINION

In our opinion, to the best of our information and according to the explanation given to us, the company has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at 31st March, 2022, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting issued by The Institute of Chartered Accountant of India.

For Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Sd/-
Malay Dalal
Partner

M. No. : 036776

Place : Ahmedabad

Date : 20/07/2022

UDIN : 22036776ANJPYA3638

**“Annexure C” to the Independent Auditors' Report of
Bahucharaji Rail Corporation Limited**

To
The Members
Bahucharaji Rail Corporation Limited

In continuation of our Independent Auditor's Report on Financial Statements of **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** (“The Company”), we have reported on Directions and Sub-directions under 143 (5) of the Companies Act, 2013 applicable for the year 2021-2022, as under:

PART-1

Report under Section 143(5) of Companies Act, 2013 for the Financial Year 2021-22

(1) MAIN DIRECTION:

Sr. No.	Directions	Comments
1.	Whether the Company has system in place to process all the accounting transactions through Information Technology system? If yes, the implications of processing of accounting transactions outside IT system on the integrity of the accounts along with the financial implications, if any, may be stated.	Yes. All Accounting transactions are processed through Information Technology Systems. Therefore, there is no financial implication on the integrity of the accounts.
2.	Whether there is any restructuring of an existing loan or cases of waiver/write off of debts/loans/interest etc. made by a lender to the Company due to the Company's inability to repay the loan? If yes, the financial impact may be stated.	No waiver/write off is done during the period under Audit.
3.	Whether funds (grants/subsidy etc.) received /receivable for specific schemes from Central/State Government or its agencies were properly accounted for/utilized as per its term and conditions? List the cases of deviation.	As per the information and explanation provided to us, the Company has not received any amount for specific scheme from Central/State agencies except share capital amount received from Gujarat Industrial Development Corporation and Gujarat Rail Infrastructure Development Corporation Limited and the same is accounted properly and deposited in bank account.

(2) SECTOR SPECIFIC DIRECTIONS : INFRASTRUCTURE SECTOR

Sr. No.	Sub-Directions	Comments
1.	Whether the Company has taken adequate measures to prevent encroachment of idle land owned by it. Whether any land of the Company is encroached, under litigation, not put to use or declared surplus? Details may be provided.	As per the information and explanation provided to us, during the course of audit we have observed that the company does not have any idle land and therefore, there is no question of encroachment to the idle land as well as there is no litigation in connection to idle land.
2.	Whether the system in vogue for identification of projects to be taken up under Public Private Partnership is in line with the guidelines/ policies of the Government? Comment on deviation if any.	Not Applicable.
3.	Whether system for monitoring the execution of works vis-à-vis the milestones stipulated in the agreement is in existence and the impact of cost escalation, if any, revenues/ losses from contracts, etc., have been properly accounted for in the books.	<p>As per the information and explanation provided to us, we report as under:</p> <p><u>1. System for Monitoring the Execution of Works:</u></p> <p>a. Company has appointed Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE) in its 1st Board Meeting held on 09.01.2019 as Project Management Consultant (PMC) and the Contract for said PMC has been executed on 28.08.2020.</p> <p>b. Company therefore has an adequate system of monitoring for the project where G-RIDE is providing service as mentioned in PMC Agreement at Para 1.1, which constitute a better monitoring system for company project.</p>

		<p>2. Agreement Milestone Status:</p> <p>a. Company has awarded EPC Contract to Kalpataru Power Transmission Limited (KPTL) for 1st Phase of Katosan Road – Becharaji (26.6 Kms) and specified Milestone (MS) for the project as under, which are extended by issuing letter bearing reference no. G-RIDE/Transaction Advisor/2019 -20/038/2729 dated 18.01.2022 to KPTL as per the Office Memorandum issued by Ministry of Finance, Department of Expenditure, Procurement Policy Division:</p> <table border="1" data-bbox="799 756 1425 1224"> <thead> <tr> <th>Sr. No.</th> <th>Milestone</th> <th>Completion Date as per Contract Agreement</th> <th>Revised Completion Date</th> <th>Remarks</th> </tr> </thead> <tbody> <tr> <td>1</td> <td>MS-I</td> <td>19-08-2020</td> <td>14-02-2021</td> <td>Milestone Achieved in Dec-2020</td> </tr> <tr> <td>2</td> <td>MS-II</td> <td>19-06-2021</td> <td>19-04-2022</td> <td>Milestone Achieved in Feb-2022</td> </tr> <tr> <td>3</td> <td>MS-III</td> <td>19-10-2021</td> <td>19-04-2022</td> <td>Milestone III not achieved till date of Report.</td> </tr> <tr> <td>4</td> <td>MS-IV</td> <td>19-02-2022</td> <td>19-08-2022</td> <td>-</td> </tr> </tbody> </table>	Sr. No.	Milestone	Completion Date as per Contract Agreement	Revised Completion Date	Remarks	1	MS-I	19-08-2020	14-02-2021	Milestone Achieved in Dec-2020	2	MS-II	19-06-2021	19-04-2022	Milestone Achieved in Feb-2022	3	MS-III	19-10-2021	19-04-2022	Milestone III not achieved till date of Report.	4	MS-IV	19-02-2022	19-08-2022	-
Sr. No.	Milestone	Completion Date as per Contract Agreement	Revised Completion Date	Remarks																							
1	MS-I	19-08-2020	14-02-2021	Milestone Achieved in Dec-2020																							
2	MS-II	19-06-2021	19-04-2022	Milestone Achieved in Feb-2022																							
3	MS-III	19-10-2021	19-04-2022	Milestone III not achieved till date of Report.																							
4	MS-IV	19-02-2022	19-08-2022	-																							
		<p>b. Company has awarded EPC Contract to Ashoka Buildcon Limited (ABL) for 2nd Phase of Becharaji – Ranuj (38.153 Kms) and specified Milestone (MS) for the project as under:</p> <table border="1" data-bbox="799 1468 1425 1705"> <thead> <tr> <th>Sr. No.</th> <th>Milestone</th> <th>Completion Date as per Contract Agreement</th> <th>Revised Completion Date</th> <th>Remarks</th> </tr> </thead> <tbody> <tr> <td>1</td> <td>MS-I</td> <td>31-08-2022</td> <td>-</td> <td>-</td> </tr> <tr> <td>2</td> <td>MS-II</td> <td>28-02-2023</td> <td>-</td> <td>-</td> </tr> <tr> <td>3</td> <td>MS-III</td> <td>30-07-2023</td> <td>-</td> <td>-</td> </tr> <tr> <td>4</td> <td>MS-IV</td> <td>30-11-2023</td> <td>-</td> <td>-</td> </tr> </tbody> </table> <p>3. The Impact of Cost Escalation:</p> <p>Company has adequately accounted the Escalation Amount in Books of Account claimed by the EPC Contractor during the year under report, which are as per the Contract Agreement and approved by the competent authority.</p>	Sr. No.	Milestone	Completion Date as per Contract Agreement	Revised Completion Date	Remarks	1	MS-I	31-08-2022	-	-	2	MS-II	28-02-2023	-	-	3	MS-III	30-07-2023	-	-	4	MS-IV	30-11-2023	-	-
Sr. No.	Milestone	Completion Date as per Contract Agreement	Revised Completion Date	Remarks																							
1	MS-I	31-08-2022	-	-																							
2	MS-II	28-02-2023	-	-																							
3	MS-III	30-07-2023	-	-																							
4	MS-IV	30-11-2023	-	-																							

4.	Whether funds received/ receivable for specific schemes from central/ State agencies were properly accounted for/utilized? List the cases of deviations.	As per the information and explanation provided to us, the Company has not received any amount for specific scheme from Central/State agencies except share capital amount received from Gujarat Industrial Development Corporation and Gujarat Rail Infrastructure Development Corporation Limited and the same is accounted properly and deposited in bank account.
5.	Whether the bank guarantees have been revalidated in time?	As per the information and explanation provided to us, the company has not availed any Bank Guarantee during the year. However, the company has received Bank Guarantees and the same has been revalidated by the Company in time.
6.	Comment on the confirmation of balances of trade receivables, trade payables, term deposits, bank accounts and cash obtained.	<p>We have obtained following Confirmations and all are in agreement with figures of Financial Statements:</p> <ol style="list-style-type: none"> 1. Bank Balance Certificate from Yes Bank and Union Bank of India. 2. Balance & Interest certificate of Deposit with GSFS. 3. Balance Confirmation of Gujarat Rail Infrastructure Development Limited. 4. Balance and Interest receivable on Mobilization advances and Trade Payables from EPC Contractor (M/s. Kalpataru Power Transmission Limited and M/s. Ashoka Buildcon Limited). 5. Cash Balance as on 31.03.2022 from Management. 6. Balance Confirmation from Trade receivables (M/s. Maruti Suzuki India Limited) as on Balance Sheet date.

7.	The cost incurred on abandoned projects may be quantified and the amount actually written-off shall be mentioned.	As per the information and explanation provided to us, there are no abandoned projects therefore this point is not applicable.
<p>Place : Ahmedabad Date : 20/07/2022</p> <p style="text-align: right;">For Shah & Dalal Chartered Accountants [FRN: 109432W]</p> <p style="text-align: right;">Sd/- Malay Dalal Partner M. No. : 036776</p> <p style="text-align: right;">UDIN : 22036776ANJPYA3638</p>		

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(A JV of G-RIDE, GIDC & MSIL)
CIN:U45101GJ2018SGC105602
Balance Sheet as at March 31, 2022

(Amount in ₹)

Particulars	Notes	As at March 31, 2022	As at March 31, 2021
ASSETS			
NON-CURRENT ASSETS			
Right of Use Asset - Leasehold Office	4	68 68 749	--
Capital Work-in-Progress	5	6 12 04 875	8 17 235
Intangible Assets Under Development	6	227 51 65 960	65 37 33 979
Other Non-Current Assets	7	44 97 80 096	29 82 93 079
Current Tax Assets (Net)	11	89 88 488	--
TOTAL NON-CURRENT ASSETS		280 20 08 168	95 28 44 293
CURRENT ASSETS			
Financial Assets			
(i) Trade Receivable	8	13 67 99 196	--
(ii) Cash and Cash Equivalents	9	8 15 75 227	5 33 61 618
(iii) Other balances with banks	10	231 43 49 947	96 00 00 000
Other Current Assets	13	82 27 195	1 01 69 424
TOTAL CURRENT ASSETS		254 09 51 565	102 35 31 042
TOTAL ASSETS		534 29 59 733	197 63 75 335
EQUITY AND LIABILITIES			
EQUITY			
Equity share capital	14	496 91 72 000	192 37 50 000
Other equity	15	(3 04 15 030)	(3 56 98 614)
TOTAL EQUITY		493 87 56 970	188 80 51 386
LIABILITIES			
NON-CURRENT LIABILITIES			
Financial liabilities			
(i) Other financial liabilities	16	7 99 04 829	2 48 29 068
TOTAL NON-CURRENT LIABILITIES		7 99 04 829	2 48 29 068

Particulars	Notes	As at March 31, 2022	As at March 31, 2021
CURRENT LIABILITIES			
Financial liabilities			
(i) Trade Payable	17		
MSME		--	2 30 926
Other		15 95 250	--
Disputed Dues - MSME		--	--
Disputed Dues - Other		--	--
(ii) Other financial liabilities	18	13 12 625	--
Provisions	19	30 24 49 455	5 34 01 016
Other current liabilities	20	1 89 40 604	78 65 588
Current tax liabilities (net)	21	--	19 97 352
TOTAL CURRENT LIABILITIES		32 42 97 934	6 34 94 882
TOTAL EQUITY AND LIABILITIES		534 29 59 733	197 63 75 335
Significant accounting policies			
See accompanying Notes to Financial Statements 1 to 45			
Notes on accounts form integral part of the financial statements			
As per our report of even date			
For Shah & Dalal		For and on behalf of the Board	
Chartered Accountants			
FRN. 109432W			
Sd/-		Sd/-	
Malay Dalal		S. N. Joshi	
Partner		CFO	
Membership No. 036776		Sd/-	
		Jwalesh Zaveri	
		Director	
		DIN: 09507224	
		Sd/-	
		Santosh Kumar	
		Director & CEO	
		DIN: 07854179	
Place: Ahmedabad		Place: Gandhinagar	
Date: July 20, 2022		Date: July 20, 2022	

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(A JV of G-RIDE, GIDC & MSIL)
CIN:U45101GJ2018SGC105602
Statement of Profit and Loss for the year ended on March 31, 2022
 (Amount in ₹)

Particulars	Notes	For the period from April 01, 2021 to March 31, 2022	For the period from April 01, 2020 to March 31, 2021
Income			
Revenue from operations	22	43 92 45 536	--
Other Income	23	3 59 74 956	1 97 79 232
Total Income		47 52 20 492	1 97 79 232
Expenses			
Cost of Materials Consumed	24	44 20 47 349	--
Employee benefit expense, payment to contractors and consultants	25	30 95 806	8 29 336
Finance costs	26	3 50 532	--
Depreciation and amortisation expense	27	7 63 194	--
Other expenses	28	1 43 73 811	1 19 48 522
Total Expenses		46 06 30 692	1 27 77 858
Profit /(Loss) before exceptional item and taxes		1 45 89 800	70 01 374
Exceptional Item(Net off Tax)		--	--
Profit/(loss) before tax		1 45 89 800	70 01 374
Tax expense			
Current tax	12	92 28 768	55 02 582
Earlier Year Tax		77 448	--
Deferred Tax		--	--
Total Tax Expenses		93 06 216	55 02 582
Profit/(loss) after tax for the period		52 83 584	14 98 792

Particulars	Notes	For the period from April 01, 2021 to March 31, 2022	For the period from April 01, 2020 to March 31, 2021
Other comprehensive income			
(i) Items that will not be reclassified to profit or loss			
(ii) Income tax on items that will not be reclassified to profit or loss		--	--
(iii) Items that will be reclassified to profit or loss		--	--
(iv) Income tax relating to items that will be reclassified to profit or loss		--	--
Total Other Comprehensive Income/(Loss) for the Year(Net off Tax)		--	--
Total Comprehensive Income for the period		52 83 584	14 98 792
Earnings Per Equity Share of Face Value of Rs. 10 each	29		
Basic		0.02	0.02
Diluted		0.02	0.02
Significant accounting policies			
See accompanying Notes to Financial Statements	1 to 45		
Notes on accounts form integral part of the financial statements			
As per our report of even date			
For Shah & Dalal	For and on behalf of the Board		
Chartered Accountants			
FRN. 109432W			
Sd/- Malay Dalal Partner Membership No. 036776	Sd/- S. N. Joshi CFO	Sd/- Jwalesh Zaveri Director DIN: 09507224	Sd/- Santosh Kumar Director & CEO DIN: 07854179
Place: Ahmedabad Date: July 20, 2022	Place: Gandhinagar Date: July 20, 2022		

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(A JV of G-RIDE, GIDC & MSIL)
CIN:U45101GJ2018SGC105602
STATEMENT OF CHANGES IN EQUITY AS ON 31/03/2022

(Amount in ₹)	
A. EQUITY SHARE CAPITAL	
As at 1st April 2020	1 00 00 000
Changes during the year 2020-21	191 37 50 000
As at 31st March 2021	192 37 50 000
Changes during the year 2021-22	304 54 22 000
As at 31st March 2022	496 91 72 000
B. OTHER EQUITY	
<u>Retained Earnings</u>	
As at 1st April 2020	(3 71 97 406)
Profit/(loss) for the year 2020-21	14 98 792
Other Comprehensive Income	--
Total Comprehensive Income	14 98 792
Balance As at 31st March 2021	(3 56 98 614)
Profit/(loss) for the year 2021-22	52 83 584
Other Comprehensive Income	--
Total Comprehensive Income	52 83 584
Balance As at 31st March 2022	(3 04 15 030)
see accompanying notes to the Financial Statements	

As per our report of even date
 For Shah & Dalal
 Chartered Accountants
 FRN. 109432W

For and on behalf of the Board

Sd/-
 Malay Dalal
 Partner
 Membership No. 036776

Sd/-
 S. N. Joshi
 CFO

Sd/-
 Jwalesh Zaveri
 Director
 DIN: 09507224

Sd/-
 Santosh Kumar
 Director & CEO
 DIN: 07854179

Place: Ahmedabad
 Date: July 20, 2022

Place: Gandhinagar
 Date: July 20, 2022

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(A JV of G-RIDE, GIDC & MSIL)
CIN:U45101GJ2018SGC105602
Cash Flow Statement for the year ended March 31, 2022

(Amount in ₹)

Particulars	For the period from April 01, 2021 to March 31, 2022	For the period from April 01, 2020 to March 31, 2021
1 Cash Flows from Operating Activities		
Profit/(Loss) before tax as per Statement of Profit & Loss	1 45 89 800	70 01 374
Adjusted for:-		
Interest Income	(3 58 56 312)	(1 94 32 152)
Finance Cost	-	-
Operating Profit/(Loss) before Working Capital Changes	<u>(2 12 66 512)</u>	<u>(1 24 30 778)</u>
Adjusted for Movement in Working Capital:		
(Increase)/ Decrease in Trade Receivable	(13 67 99 196)	-
(Increase)/ Decrease in Financial Assets	(135 43 49 947)	(96 00 00 000)
(Increase)/ Decrease in Other Current Assets	1 01 66 048	-
(Increase)/ Decrease in Current Tax Asset	(89 88 488)	-
Increase/ (Decrease) in trade Payable	(2 30 926)	(1 90 37 477)
Increase/ (Decrease) in Provisions	47 95 185	(7 03 810)
Increase/ (Decrease) in Other Current liabilities	1 10 75 016	77 79 207
Increase/ (Decrease) in Other financial liabilities	13 12 625	-
Increase/ (Decrease) in Current Tax liabilities	(19 97 352)	19 97 352
Operating Profit after Working Capital Changes	<u>(147 50 17 034)</u>	<u>(96 99 64 728)</u>
Taxes Paid (Net of Refund)	(93 06 216)	55 02 582
Net cash flow from / (used in) operating activities (A)	<u>(150 55 89 762)</u>	<u>(98 78 98 088)</u>
2 Cash Flows from Investing Activities:		
(Increase)/Decrease in Capital Work in Progress	(6 04 31 613)	(2 59 185)
(Increase)/Decrease in Intangible Assets Under Development	(132 04 63 743)	(57 56 21 579)
(Increase)/Decrease in Right of use Asset	(68 68 749)	-
(Increase)/Decrease in Non Current Assets	(15 14 87 017)	(16 41 34 479)
Interest Income	2 76 32 493	92 62 728
Net cash flow from / (used in) investing activities (B)	<u>(151 16 18 628)</u>	<u>(73 07 52 515)</u>
3 Cash flow from financing activities :		
Proceeds From Share Capital	304 54 22 000	191 37 50 000
Proceeds/(Repayment) from/of short term borrowing	-	(14 31 27 855)
Net cash flow from / (used in) financing activities (C)	<u>304 54 22 000</u>	<u>177 06 22 145</u>

Particulars	For the period from April 01, 2021 to March 31, 2022	For the period from April 01, 2020 to March 31, 2021	
Net increase in cash and cash equivalents (A)+(B)+(C)	2 82 13 609	5 19 71 542	
Cash and cash equivalents as at the beginning of the year	5 33 61 618	13 90 076	
Cash and cash equivalents as at end of the year	8 15 75 227	5 33 61 618	
Break up of cash and cash equivalents at the end of the year			
Balances with Banks-In Current/Saving Accounts	8 15 75 227	5 33 61 618	
	8 15 75 227	5 33 61 618	
Notes:			
1	Cash and cash equivalent include cash and bank balances and deposits with the Bank (Original Maturity less than 3 months).		
2	The above Cash Flow Statement has been prepared under the 'Indirect method' as set out in the Ind AS - 7 Statement of Cash Flow.		
3	Previous year figures have been regrouped and reclassified wherever considered necessary to conform to the current year's figures.		
<hr/>			
Notes on accounts form integral part of the financial statements			
As per our report of even date			
For Shah & Dalal	For and on behalf of the Board		
Chartered Accountants			
FRN. 109432W			
Sd/-	Sd/-	Sd/-	Sd/-
Malay Dalal	S. N. Joshi	Jwalesh Zaveri	Santosh Kumar
Partner	CFO	Director	Director & CEO
Membership No. 036776		DIN: 09507224	DIN: 07854179
Place: Ahmedabad	Place: Gandhinagar		
Date: July 20, 2022	Date: July 20, 2022		

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED**Notes to Financial Statements for the year ending on March 31, 2022****1. Corporate Information:**

Bahucharaji Rail Corporation Limited, is a special purpose vehicle (SPV) for the Railway project as per GR No. MIS-10-2017-1665-1-1 dated 05/02/2018 issued by Government of Gujarat to carry on the business of development, financing, planning and implementation of Gauge Conversion of Katosan Road-Becharaji-Chanasma-Ranuj for 65 Kms line project in the state of Gujarat.

2. The financial statements were authorized for issue in accordance with resolution of the Directors on 20th July 2022.

3 (i) Basis of Preparation

These financial statements have been prepared on a historical cost basis, except for certain financial instruments which are measured at fair value at the end of each reporting period. Historical cost is generally based on the fair value of the consideration given in exchange for goods and services. Fair value is the price that would be received to sell an asset or paid to transfer a liability in an orderly transaction between market participants at the measurement date.

A. Statement of Compliance:

These financial statements of the company have been prepared to comply with Indian Accounting Standards (Ind AS) including the rules notified under the relevant provision of the Companies Act, 2013, amended from time to time.

Details of the Company's accounting policies are included in Note 3(ii).

B. Functional and Presentation Currency:

These financial statements are presented in Indian Rupees (INR), which is also the Company's functional currency.

C. Use of Estimates and Judgements:

In preparing these financial statements, management has made judgements, estimates and assumptions that affect the application of accounting policies and the reported amounts of

assets, liabilities, income and expenses. Actual results may differ from these estimates.

Critical Estimates and Judgments

This note provides an overview of the areas that involved a higher degree of judgement or complexity, and of items which are more likely to be materially adjusted due to estimates and assumptions turning out to be different than those originally assessed. Detailed information about each of these estimates and judgements is included in relevant notes together with information about the basis of calculation for each affected line item in the financial statements.

Areas involving critical estimates or judgements are:

• Depreciation and Amortization:

– Depreciation and amortization is based on management estimates of the future useful lives of the property, plant and equipment and intangible assets. Estimates may change due to technological developments, competition, changes in market conditions and other factors and may result in changes in the estimated useful life and in the depreciation and amortization charge.

• Other areas are as below:

- Estimation of current and deferred tax expense and payable:

Deferred tax assets are recognized to the extent that it is regarded as probable that deductible temporary differences can be realized. The Company estimates deferred tax assets and liabilities based on current tax laws and rates and in certain cases, business plans, including management's expectations regarding the manner and timing of recovery of the related assets. Changes in these estimates may affect the amount of deferred tax liabilities or the valuation of deferred tax assets and thereby the tax charge in the Statement of Profit and Loss.

Provision for tax liabilities require judgements on the interpretation of tax legislation, developments in case laws and the potential outcomes of tax audits and appeals which may be subject to significant uncertainty. Therefore, the actual results may vary from expectations resulting in adjustments to provisions, the valuation of deferred tax assets, cash tax settlements and therefore the tax charge to the Statement of Profit and Loss.

- **Recognition and measurement of provisions and contingencies:**

From time to time, the Company is subject to legal proceedings and other contingencies the ultimate outcome of each being always subject to many uncertainties inherent in litigation. A provision for expense is made when it is considered probable that a payment will be made and the amount of the loss can be reasonably estimated.

Significant judgement is made when evaluating, among other factors, the probability of unfavorable outcome and the ability to make a reasonable estimate of the amount of potential loss. Expense provisions are reviewed at each accounting period and revisions made for the changes in facts and circumstances.

- **Impairment of Assets:**

Property, plant and equipment and intangible assets that are subject to depreciation/ amortization are tested for impairment periodically including when events occur or changes in circumstances indicate that the recoverable amount of the cash generating unit is less than its carrying value. The recoverable amount of cash generating units is higher of value-in-use and fair value less cost to sell. The calculation involves use of significant estimates and assumptions which includes turnover and earnings multiples, growth rates and net margins used to calculate projected future cash flows, risk-adjusted discount rate, future economic and market conditions.

Estimates and underlying assumptions are reviewed on an ongoing basis. Revisions to accounting estimates are recognized prospectively.

D. Measurement of Fair Values:

A number of the Company's accounting policies and disclosures require measurement of fair values, for both financial and non-financial assets and liabilities.

Fair values are categorized into different levels in a fair value hierarchy based on the inputs used in the valuation techniques as follows.

- Level 1: quoted prices (unadjusted) in active markets for identical assets or liabilities.
- Level 2: inputs other than quoted prices included in Level 1 that are observable for the asset or liability, either directly (i.e. as prices) or indirectly (i.e. derived from prices).
- Level 3: inputs for the asset or liability that are not based on observable market data

(unobservable inputs).

When measuring the fair value of an asset or a liability, the Company uses observable market data as far as possible. If the inputs used to measure the fair value of an asset or a liability fall into different levels of the fair value hierarchy, then the fair value measurement is categorized in its entirety in the same level of the fair value hierarchy as the lowest level input that is significant to the entire measurement.

The Company recognizes transfers between levels of the fair value hierarchy at the end of the reporting period during which the change has occurred.

Further information about the assumptions made in measuring fair values is included in the note of financial instruments.

E. Global Health Pandemic on COVID-19

The outbreak of corona virus (COVID-19) pandemic globally and in India is causing significant disturbance and slowdown of economic activity. The Company's operations and revenue during the period were impacted due to COVID-19. The Company has taken into account the possible impact of COVID-19 in preparation of financial statements, including its assessment of recoverable value of its assets based on internal and external information up to the date of approval of these financial statements and current indicators of future economic conditions.

3 (ii) Significant Accounting Policies

The accounting policies set out below have been applied consistently to the period presented in these financial statements.

a. Foreign Currency Transactions:

Transactions in foreign currencies are translated into the functional currency of the Company at the exchange rates at the dates of the transactions or an average rate if the average rate approximates the actual rate at the date of the transaction.

Monetary assets and liabilities denominated in foreign currencies are translated into the functional currency at the exchange rate at the reporting date. Non-monetary assets and liabilities that are measured at fair value in a foreign currency are translated into the functional currency at the exchange rate when the fair value was determined. Non-monetary assets and liabilities that are measured based on historical cost in a foreign

currency are translated at the exchange rate at the date of the transaction.

Exchange differences are recognized in profit or loss, except exchange differences arising from the translation of the following items which are recognized in OCI:

- Equity investments at fair value through OCI (FVOCI);
- qualifying cash flow hedges to the extent that the hedges are effective.

b. Financial Instruments:

Recognition and Initial Measurement

Trade receivables are initially recognized when they are originated. All other financial assets and financial liabilities are initially recognized when the Company becomes a party to the contractual provisions of the instrument.

A financial asset or financial liability is initially measured at fair value plus, for an item not at fair value through profit and loss (FVTPL), transaction costs that are directly attributable to its acquisition or issue.

Classification and Subsequent Measurement and Gain and Losses: Financial Assets

Financial Assets at amortized cost- These assets are subsequently measured at amortized cost using the effective interest method. The amortized cost is reduced by impairment losses. Interest income, foreign exchange gains and losses and impairment are recognized in profit or loss. Any gains or loss or derecognition is effected in profit or loss statement

Financial Assets at Fair Value through Other Comprehensive Income (FVTOCI) – All equity investments are measured at fair values. Investments which are not held for trading purposes and where the Company has exercised the option to classify the investment as at FVTOCI, all fair value changes on the investment are recognized in Other Comprehensive Income (OCI). The accumulated gains or losses are recognized in OCI are reclassified to retained earnings on sale of such investment.

Financial assets at Fair Value through Profit and loss (FVTPL) - These assets are subsequently measured at fair value. Net gains and losses, including any interest or dividend income, are recognized in profit or loss.

Classification, Subsequent Measurement and Gains and Losses: Financial Liabilities

Financial liabilities are subsequently measured at amortized cost using effective interest

method. For trade and other payable maturing within one year from the balance sheet date, the carrying value approximates fair value due to short maturity of these investments.

Equity Instruments

An equity instrument is a contract that evidences residual interest in the assets of the company after deducting all of its liabilities. Incremental costs directly attributable to the issuance of equity instruments are recognized as a deduction from equity instrument net of any tax effects.

Derecognition: Financial Assets

The Company derecognizes a financial asset when the contractual rights to the cash flows from the financial asset expire, or it transfers the rights to receive the contractual cash flows in a transaction in which substantially all of the risks and rewards of ownership of the financial asset are transferred or in which the company neither transfers nor retains substantially all of the risks and rewards of ownership and does not retain control of the financial asset.

If the Company enters into transactions whereby it transfers assets recognized on its balance sheet but retains either all or substantially all of the risks and rewards of the transferred assets, the transferred assets are not derecognized.

Derecognition: Financial Liabilities

The Company derecognizes a financial liability when its contractual obligations are discharged or cancelled or expired.

The Company also derecognizes a financial liability when its terms are modified and the cash flows under the modified terms are substantially different. In this case, a new financial liability based on the modified terms is recognized at fair value. The difference between the carrying amount of the financial liability extinguished and the new financial liability with modified terms is recognized in profit or loss.

Offsetting

Financial assets and financial liabilities are offset and the net amount presented in the balance sheet when, and only when, the Company currently has a legally enforceable right to set off the amounts and it intends either to settle them on a net basis or to realize the asset and settle the liability simultaneously.

c. Current and Non-Current Classification

The Company presents assets and liabilities in the balance sheet based on current/non-current classification. An asset is treated as current when it is:

- (a) expected to be realised in, or is intended to be sold or consumed in Company's normal operating cycle;
- (b) held primarily for the purpose of being traded;
- (c) expected to be realised within 12 months after the reporting date; or
- (d) cash or cash equivalent unless restricted from being exchanged or used to settle a liability for at least 12 months after the reporting date.

All other assets are classified as non-current.

A Liability is current when:

- (a) it is expected to be settled in Company's normal operating cycle;
- (b) it is held primarily for the purpose of being traded;
- (c) it is due to be settled within 12 months after the reporting date; or
- (d) The Company does not have an unconditional right to defer settlement of the liability for at least 12 months after the reporting date.

All other liabilities are classified as non-current.

Operating Cycle

Operating cycle is the time between the acquisition of assets for processing and their realisation in cash or cash equivalents. The Company has identified twelve months as its operating cycle.

d. Property, Plant and Equipment

Recognition and Measurement

Items of property, plant and equipment are measured at cost, which includes capitalised borrowing costs, less accumulated depreciation, and accumulated impairment losses, if any.

Cost of an item of property, plant and equipment comprises its purchase price, including import duties and non-refundable purchase taxes, after deducting trade discounts and

rebates, any directly attributable cost of bringing the item to its working condition for its intended use and estimated costs of dismantling and removing the item and restoring the site on which it is located.

The cost of a self-constructed item of property, plant and equipment comprises the cost of materials and direct labour, any other costs directly attributable to bringing the item to working condition for its intended use, and estimated costs of dismantling and removing the item and restoring the site on which it is located.

If significant parts of an item of property, plant and equipment have different useful lives, then they are accounted for as separate items (major components) of property, plant and equipment.

Any gain or loss on disposal of an item of property, plant and equipment is recognised in profit or loss.

Subsequent Expenditure

Subsequent expenditure is capitalized only if it is probable that the future economic benefits associated with the expenditure will flow to the Company.

Depreciation

Depreciation on property, plant and equipment is provided on straight line basis based on the rates as per useful life prescribed in Schedule II to the Companies Act, 2013. Assets costing less than INR 5,000 each are fully depreciated in the year of capitalisation.

Depreciation on additions / disposals is provided on a pro-rata basis i.e. from / up to the date on which asset is ready for use / disposed of.

Depreciation method, useful lives and residual values are reviewed at each financial year-end and adjusted if appropriate. In case of a revision, the unamortized depreciable amount is charged over the revised remaining useful life.

Losses arising from retirement or gains or losses arising from disposal of fixed assets which are carried at cost are recognized in the Statement of Profit and Loss.

Capital work in progress represents projects under which property, plant & equipment are not yet ready for their intended use and are carried at cost determined as aforesaid. Indirect expense related to Capital Work in Progress has been capitalised to respective Capital Work

in Progress Account.

e. Leases

As a lessee, the company recognizes a right-of-use asset and a lease liability at the lease commencement date. The right-of-use asset is initially measured at cost, which comprises the initial amount of the lease liability adjusted for any lease payments made at or before the commencement date, plus any initial direct costs incurred and an estimate of costs to dismantle and remove the underlying asset or the site on which it is located, less any lease incentives received.

The right-of-use asset is subsequently depreciated using the Straight-line method from the commencement date to the earlier of the end of the useful life of the right-of-use asset or the end of the lease term. The estimated useful lives of right-of-use assets are determined on the same basis as those of Property, Plant & Equipment. In addition, the right-of-use asset is periodically reduced by impairment losses, if any, and adjusted for certain re-measurements of the lease liability.

The lease Liability is initially measured at the present value of the lease payments that are not paid at the commencement date, discounted using the interest rate as per standard.

Lease Payments included in the measurement of the lease liability comprise the Fix payments, including in-subsequent fixed payments. The lease liability is measured at amortized cost using the effective interest method. When the lease liability is remeasured, a corresponding adjustment is made to the carrying amount of the right-of-use asset or is recorded in profit and loss if the carrying amount of the right-of-use asset has been reduced to zero. The company presents right-of-use assets (Lease hold Office) as separate line item in Non-Current Assets and lease liabilities in 'Other financial liability' in the balance sheet.

f. Intangible Assets Under Development

Freight Sharing Right Under Development:

Expenditure which can be directly identifiable related to the service concession arrangements are recognized as freight sharing right under development. Indirect expenditure has been charged to project to the extent they are related to project execution, Also Interest earned on the mobilization advances given in respect of the project execution are reduced from the intangible assets under development.

g. Impairment

Impairment of Financial Instruments

The Company recognizes loss allowances for expected credit losses on financial assets measured at amortized cost.

At each reporting date, the Company assesses whether financial assets carried at amortized cost are credit-impaired. A financial asset is 'credit-impaired' when one or more events that have a detrimental impact on the estimated future cash flows of the financial asset have occurred.

The Company measures loss allowances at an amount equal to lifetime expected credit losses. Lifetime expected credit losses are the expected credit losses that result from all possible default events over the expected life of a financial instrument.

When determining whether the credit risk of a financial asset has increased significantly since initial recognition and when estimating expected credit losses, the Company considers reasonable and supportable information that is relevant and available without undue cost or effort. This includes both quantitative and qualitative information and analysis, based on the Company's historical experience and informed credit assessment and including forward-looking information.

Measurement of Expected Credit Losses

Expected credit losses are a probability-weighted estimate of credit losses. Credit losses are measured as the present value of all cash shortfalls (i.e. the difference between the cash flows due to the Company in accordance with the contract and the cash flows that the Company expects to receive).

Presentation of Allowance for Expected Credit Losses in the Balance Sheet

Loss allowances for financial assets measured at amortized cost are deducted from the gross carrying amount of the assets.

Write-off

The gross carrying amount of a financial asset is written off (either partially or in full) to the extent that there is no realistic prospect of recovery. This is generally the case when the Company determines that the debtor does not have assets or sources of income that could

generate sufficient cash flows to repay the amounts subject to the write-off. However, financial assets that are written off could still be subject to enforcement activities in order to comply with the Company's procedures for recovery of amounts due.

Impairment of Non-Financial Assets

The Company's non-financial assets, other than inventories and deferred tax assets are reviewed at each reporting date to determine whether there is any indication of impairment. If any such indication exists, then the asset's recoverable amount is estimated. The recoverable amount being higher of the net selling price or value in use. Value in use is determined from the present value of the estimated future cash flows from the continuing use of the assets.

If the recoverable amount of an asset (or cash-generating unit) is estimated to be less than its carrying amount, the carrying amount of the asset (or cash-generating unit) is reduced to its recoverable amount. An impairment loss is recognized immediately in the Statement of Profit and Loss. When an impairment loss subsequently reverses, the carrying amount of the asset (or a cash-generating unit) is increased to the revised estimate of its recoverable amount, but so that the increased carrying amount does not exceed the carrying amount that would have been determined had no impairment loss been recognized for the asset (or cash-generating unit) in prior years. A reversal of an impairment loss is recognized immediately in the Statement of Profit and Loss.

h. Borrowing Cost

Borrowing costs are interest and other costs (including exchange differences relating to foreign currency borrowings to the extent that they are regarded as an adjustment to interest costs) incurred in connection with the borrowing of funds. Borrowing costs directly attributable to acquisition or construction of an asset which necessarily take a substantial period of time to get ready for their intended use are capitalized as part of the cost of that asset. Other borrowing costs are recognized as an expense in the period in which they are incurred.

i. Borrowing

Borrowings are classified as current liabilities unless the Company has an unconditional right to defer settlement of the liability for at least 12 months after the reporting period.

Where there is a breach of a material provision of a long-term loan arrangement on or before the end of reporting period with the effect that the liability becomes payable on demand on the reporting date, the Company does not classify the liability as current, if the lender agreed, after the reporting period and before the approval of the financial statement for issue, not to demand payment as a consequence of the breach.

j. Revenue Recognition

Revenue is recognized when there is reasonable certainty of its ultimate collection/realization. The Company has applied the guidance in IND AS 115, on “Revenue from contracts with customers”, by applying the revenue recognition criteria for each distinct performance obligation stated in contract agreement with party.

Interest income is recognized using the effective interest method and are accounted on accrual basis.

All other item of income are accounted on accrual basis.

k. Provisions (other than Employee Benefits)

A provision is recognized if, as a result of a past event, the Company has a present obligation that can be estimated reliably, and it is probable that an outflow of economic benefits will be required to settle the legal or contractual obligation. Provisions are determined by discounting the expected future cash flows (representing the best estimate of the expenditure required to settle the present obligation at the balance sheet date) at a pre-tax rate that reflects current market assessments of the time value of money and the risks specific to the liability. The unwinding of the discount is recognized as finance cost. Expected future operating losses are not provided for.

Contingencies

Provision in respect of loss contingencies relating to claims, litigation, assessment, fines, penalties, etc. are recognized when it is probable that a liability has been incurred and the amount can be estimated reliably.

l. Contingent Liabilities

Contingent liabilities are disclosed when there is a possible obligation arising from past events, the existence of which will be confirmed only by the occurrence or non-occurrence of one or more uncertain future events not wholly within the control of the Company or a

present obligation that arises from past events where it is either not probable that an outflow of resources will be required to settle, or a reliable estimate of the amount cannot be made.

m. Income Taxes

Income tax comprises current and deferred tax. It is recognized in profit or loss except to the extent that it relates to an item recognized directly in equity or in other comprehensive income.

Current Tax

Current tax comprises the expected tax payable or receivable on the taxable income or loss for the year and any adjustment to the tax payable or receivable in respect of previous years. The amount of current tax reflects the best estimate of the tax amount expected to be paid or received after considering the uncertainty, if any, related to income taxes. It is measured using tax rates (and tax laws) enacted or substantively enacted by the reporting date.

Current tax assets and current tax liabilities are offset only if there is a legally enforceable right to set off the recognized amounts, and it is intended to realize the asset and settle the liability on a net basis or simultaneously.

Tax benefits of deductions earned on exercise of employee stock options in excess of compensation charged to income are credited to other comprehensive income.

Deferred Tax

Deferred tax is recognized in respect of temporary differences between the carrying amounts of assets and liabilities for financial reporting purposes and the corresponding amounts used for taxation purposes. Deferred tax is also recognized in respect of carried forward tax losses and tax credits. Deferred tax is not recognized for:

- Temporary differences arising on the initial recognition of assets or liabilities in a transaction that affects neither accounting nor taxable profit/loss at the time of the transaction.
- Taxable temporary differences arising on the initial recognition of goodwill.

Deferred tax assets are recognized to the extent that it is probable that future taxable profits will be available against which they can be used. The existence of unused tax losses is strong

evidence that future taxable profit may not be available. Therefore, in case of a history of recent losses, the Company recognizes a deferred tax asset only to the extent that it has sufficient taxable temporary differences or there is convincing other evidence that sufficient taxable profit will be available against which such deferred tax asset can be realized. Deferred tax assets – unrecognized or recognized, are reviewed at each reporting date and are recognized/ reduced to the extent that it is probable/ no longer probable respectively that the related tax benefit will be realized.

Deferred tax is measured at the tax rates that are expected to apply to the period when the asset is realized or the liability is settled, based on the laws that have been enacted or substantively enacted by the reporting date.

The measurement of deferred tax reflects the tax consequences that would follow from the manner in which the Company expects, at the reporting date, to recover or settle the carrying amount of its assets and liabilities.

Deferred tax assets and liabilities are offset if there is a legally enforceable right to offset current tax liabilities and assets, and they relate to income taxes levied by the same tax authority on the same taxable entity, or on different tax entities, but they intend to settle current tax liabilities and assets on a net basis or their tax assets and liabilities will be realized simultaneously.

Deferred tax in respect of timing differences which reverse after the tax holiday period is recognized in the year in which the timing differences originate.

n. Earnings per Share

Basic earnings/ (loss) per share are calculated by dividing the net profit or loss for the year attributable to equity shareholders by the weighted average number of equity shares outstanding during the year. The weighted average numbers of equity shares outstanding during the year are adjusted for events of bonus issue and share split. For the purpose of calculating diluted earnings/ (loss) per share, the net profit or loss for the year attributable to equity shareholders and the weighted average number of shares outstanding during the year are adjusted for the effects of all dilutive potential equity shares.

o. Cash and Cash Equivalents

Cash and cash equivalents in the balance sheet comprise cash at banks and on hand and

short-term deposits with an original maturity of three months or less, which are subject to an insignificant risk of changes in value.

For the purpose of the statement of cash flows, cash and cash equivalents consist of cash and short-term deposits, as defined above, net of outstanding bank overdrafts as they are considered an integral part of the Company's cash management.

p. Events after the Reporting Period

Adjusting events are events that provide further evidence of conditions that existed at the end of the reporting period. The financial statements are adjusted for such events before authorization for issue. Non-adjusting events are events that are indicative of conditions that arose after the end of the reporting period. Non-adjusting events after the reporting date are not accounted but disclosed.

q. Statement of cash flows

Cash flows are reported using the indirect method, whereby profit/ (loss) before tax is adjusted for the effects of transactions of non-cash nature and any deferrals or accruals of past or future cash receipts or payments. Cash flow for the year are classified by operating, investing and financing activities.

r. General

Any other accounting policy not specifically referred to are in consistent with the generally accepted accounting principles.

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
Notes to Financial Statements for the year ending on March 31, 2022

(Amount in ₹)

Particulars	As at March 31, 2022	As at March 31, 2021
4 Right of Use Asset - Leasehold Office *		
Gross carrying value		
Opening	-	-
Addition	76 31 943	-
Disposal	-	-
Ind As Adjustment	-	-
Closing	<u>76 31 943</u>	-
Depreciation		
Opening	-	-
Changes for the year	7 63 194	-
Adjustment	-	-
Ind As Adjustment	-	-
Closing	<u>7 63 194</u>	-
Net Carrying Value	Total <u>68 68 749</u>	-
*Refer Note No.44		
5 Capital Work-in-Progress includes		
Capital Work in Progress-Office	1 93 17 377	2 53 110
Capital Work in Progress-Land Acquisition	4 18 87 498	5 64 125
*Refer Note No 39		
Total	<u>6 12 04 875</u>	<u>8 17 235</u>
6 Intangible Assets Under Development*		
Freight Sharing Right Under Development	227 51 65 960	65 37 33 979
*Refer Note No 40		
Total	<u>227 51 65 960</u>	<u>65 37 33 979</u>
7 Other Non-Current Assets		
<u>Advance Paid for Intangible Assets Under Development*</u>		
-Advance paid to EPC Contractors	40 54 84 597	26 35 19 998
-Interest Receivable on Mobilisation Advance to EPC Contractor**	2 45 34 680	1 93 96 516
Balance With Statutory/Government Authorities		
GST Receivable	1 97 60 819	1 53 76 565
Total	<u>44 97 80 096</u>	<u>29 82 93 079</u>

*As on year ended on 31.03.2022 amount of Mobilization Advance and Interest Receivable thereon recoverable in next 12 months is not ascertainable. Hence Mobilization Advance and Interest Receivable thereon being in the nature of Long Term Asset presented under other Non-Current Assets.

**Refer Note 3 (ii) f & 40

Particulars	As at March 31, 2022	As at March 31, 2021
8 Trade Receivable		
Less than 6 months		
Undisputed Trade Receivable - Considered good	13 67 99 196	--
Undisputed Trade Receivable - Considered doubtful	--	--
Disputed Trade Receivable - Considered good	--	--
Disputed Trade Receivable - Considered doubtful	--	--
6 months - 1year	--	--
1-2 years	--	--
2-3 years	--	--
More than 3 years	--	--
	13 67 99 196	--
9 Cash and Cash Equivalents		
Balances with banks		
Union Bank of India Current Account	7 08 23 914	80 04 806
Yes Bank Current Account	1 07 51 313	4 53 56 812
Total	8 15 75 227	5 33 61 618
10 Other Balances with Banks		
Balance with GSFS - Liquid Deposit	31 43 49 947	--
Balance with GSFS - Inter Corporate Deposit	200 00 00 000	96 00 00 000
Total	231 43 49 947	96 00 00 000
11 Current Tax Assets (Net)		
Income Tax Provision- F.Y. 2021-22	92 28 768	
Less:		
Advance Tax Paid F.Y 2021-22	33 60 993	
TDS Receivable F.Y.2021-22	1 48 56 263	89 88 488
Total	89 88 488	--
12 TAXATION		
TAX EXPENSE RECOGNISED IN STATEMENT OF PROFIT & LOSS		
Current Tax	92 28 768	55 02 582
deferred Tax	--	--
Total Tax Expense Recognised in Current Year	92 28 768	55 02 582
The Tax Expense for the year can be reconciled to the accounting profit as follows:		
Profit/(Loss) Before Tax and Exceptional Item	1 45 89 800	70 01 374
Applicable Tax Rate	27.82	27.82
Computed Tax Expense	40 58 882	19 47 782
TAX EFFECT OF:		
Exempted income	--	--
Expense disallowed (1,85,83,343*27.82%)	51 69 886	35 54 800
Additional Allowance net if MAT Credit	--	--
Current Tax Provision	92 28 768	55 02 582

Particulars	As at March 31, 2022	As at March 31, 2021		
Incremental deferred Tax Liability on account of PPE & Intangible Asset	--	--		
Incremental deferred Tax Liability /(Asset) on account of Financial Asset & other Item	--	--		
deferred tax Provision	--	--		
Tax Expense Recognised in statement of Profit & Loss Account	92 28 768	55 02 582		
Effective Tax Rate	63%	79%		
Tax on Exceptional Item	--	--		
13 Other Current Assets				
Advance other than capital advance				
Other Advance				
Prepaid Expense	3 376	--		
Interest Receivable from GSFS	82 23 819	1 01 69 424		
Total	82 27 195	1 01 69 424		
14 Equity Share Capital				
Authorised				
78,62,20,000 Equity Shares of ₹ 10 each, fully paid up	786 22 00 000	786 22 00 000		
(78 62 20 000 Equity Shares of ₹ 10 each, fully paid up)*	786 22 00 000	786 22 00 000		
Issued, subscribed				
49,69,17,200 Equity shares of ₹ 10 each, fully paid up	496 91 72 000	192 37 50 000		
(19,23,75,000 Equity shares of ₹ 10 each, fully paid up)*	496 91 72 000	192 37 50 000		
Paid-up Capital:				
49,69,17,200 Equity shares of ₹ 10 each, fully paid up	496 91 72 000	192 37 50 000		
(19,23,75,000 Equity shares of ₹ 10 each, fully paid up)*	496 91 72 000	192 37 50 000		
	Total	192 37 50 000		
*Figures in bracket represents Previous year's figure				
Notes:				
(i) Reconciliation of the shares outstanding at the beginning and at the end of the period				
Particulars	2021-22		2020-21	
	No of shares	Amount	No of shares	Amount
At the beginning of the year	19 23 75 000	192 37 50 000	10 00 000	1 00 00 000
Add: Issued during the year	30 45 42 200	304 54 22 000	19 13 75 000	191 37 50 000
Outstanding at the end of the year	49 69 17 200	496 91 72 000	19 23 75 000	192 37 50 000
(ii) Terms/rights attached to equity shares				
- The Company has only one class of equity shares having a par value of ₹ 10 per share.				
- Each holder of the equity shares is entitled to one vote per share.				
- In the event of liquidation of the Company, the holders of the equity shares will be entitled to receive assets of the Company remaining after settlement of all liabilities. The distribution will be in proportion of the number of equity shares held by the shareholders.				
(iii) Allotment of Shares Under Right Issue				
During the year company has allotted 30,45,42,200 numbers of Right Equity Shares of Rs.10/- each to below promoters:				
-Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE) 12,60,00,000 (P.Y. 10,08,40,000) Right Equity Shares of Rs.10/-each				
-Maruti Suzuki India Limited (MSIL) 14,59,17,200 (P.Y. 5,81,70,000) Right Equity Shares of Rs.10/-each				
-Gujarat Industrial Development Corporation (GIDC) 3,26,25,000 (P.Y. 3,23,65,000) Right Equity Shares of Rs.10/-each				

Particulars	As at March 31, 2022		As at March 31, 2021	
(iv) The details of shareholders holding more than 5 % of issued share capital is set out below:				
Name of Shareholder	As at March 31, 2022		As at March 31, 2021	
	No. of shares	% holding	No. of shares	% holding
Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)	22 72 50 000	45.73%	10 12 50 000	52.63%
Maruti Suzuki India Limited (MSIL)	20 44 17 200	41.14%	5 85 00 000	30.41%
Gujarat Industrial Development Corporation (GIDC)	6 52 50 000	13.13%	3 26 25 000	16.96%
As per records of the Company, including its register of shareholders / members, the above shareholding represents legal and beneficial ownership of shares.				
The Company has not issued any Bonus Shares during the year.				
(v) Disclosure of Shareholding of Promoters				
Promoter Name	As at March 31, 2022		% Changes during the year	
	No. of shares	% of total shares		
Gujarat Rail Infrastructure Development Corporation Limited	22 72 50 000	45.73%	(6.90)%	
Maruti Suzuki India Limited	20 44 17 200	41.14%	10.73%	
Gujarat Industrial Development Corporation	6 52 50 000	13.13%	(3.83)%	
Promoter Name	As at March 31, 2021		% Changes during the year	
	No. of shares	% of total shares		
Gujarat Rail Infrastructure Development Corporation Limited	10 12 50 000	52.63%	11.63%	
Maruti Suzuki India Limited	5 85 00 000	30.41%	(2.59)%	
Gujarat Industrial Development Corporation	3 26 25 000	16.96%	(9.04)%	
15 Other Equity				
Retained Earnings				
Opening Balance of retained earnings		(3 56 98 614)	(3 71 97 406)	
Add/ Less Adjustments during the year		--	--	
Net (Loss) / profit for the current year		52 83 584	14 98 792	
Closing Balance		(3 04 15 030)	(3 56 98 614)	
Total reserves and surplus		(3 04 15 030)	(3 56 98 614)	
16 Other financial liabilities-Non Current				
Retention Money		7 41 96 689	2 48 29 068	
Lease Liability (Refer Note No 44)		57 08 140	-	
Total		7 99 04 829	2 48 29 068	
The Company's exposure to currency and liquidity risks related to other financial liabilities covered in Note 32				
17 Trade Payable-Current				
Less than 1 Year				
(i) MSME		--	2 30 926	
(ii) Others		15 95 250	--	
(iii) Disputed Dues - MSME		--	--	
(iv) Disputed Dues - Others		--	--	

Particulars	As at March 31, 2022	As at March 31, 2021
1-2 Years	--	--
2-3 years	--	--
More than 3 Years	--	--
Total	15 95 250	2 30 926
The Company's exposure to currency and liquidity risks related to Trade Payables covered in Note 32		
18 Other financial liabilities-Current		
Current maturity of lease liability*		
Current maturity of lease liability unpaid	13 12 625	--
Total	13 12 625	--
*Refer Note No 44		
19 Provisions-Current		
Consultancy / Professional Charges Payable	80 550	78 625
Rent Expense Payable	4 32 769	--
Repair & Maintenance - Building Payable	63 132	--
Internal Audit Fees Payable	1 01 033	47 033
Man Power Service Exp Payable	5 87 255	1 40 126
Statutory Audit Fees Payable	67 500	46 250
Vehicle Hire Charges Payable	1 52 398	2 09 418
Secretarial Audit Fees Payable	45 000	--
Board Meeting Expense Payable	15 000	--
Provision for Expenses Payable-EPC Contract	28 13 43 773	5 11 30 383
Provision for Expenses Payable-PMC Charges	1 55 95 996	15 12 158
Provision for Expenses Payable- Feasibility Study Expense	37 72 000	--
Provision for Expenses Payable-Office	1 93 050	2 37 023
Total	30 24 49 455	5 34 01 016
20 Other current liabilities		
Bid Security/Ernest Money Deposit	1 07 250	107,250
Statutory Dues Payable		
TDS Payable	1 22 76 452	28 71 286
Labour Cess	23 90 995	15 93 482
TDS GST Payable	41 30 582	32 93 570
GST RCM Payable	35 326	--
Total	1 89 40 604	78 65 588
21 Current tax liabilities (net)		
Income Tax Provision- F.Y. 2020-21	--	55 02 582
Less:		
Advance Tax Paid in F.Y 2020-21	--	20 00 000
Total TDS Receivable	--	15 05 230
Total	--	19 97 352

Particulars	As at March 31, 2022	As at March 31, 2021
22 Revenue from operations*		
Construction Service	36 46 20 536	--
Sale of Rails	6 60 00 000	--
Project Management Consultancy Charges	86 25 000	--
Total	43 92 45 536	--
<p>* During the year company has entered in to MOU with MSIL & G-Ride. According to this MOU BRCL would undertake/procure the extension of main project to the designated point in the MSIL Gujarat plant premises at (Becharaji) (including extension & construction of proposed railway siding as required by MSIL. The project has been carried out by a duly qualified contractor, as identified & appointed by BRCL with approval of MSIL. BRCL has assisted MSIL to undertake appropriate bid process for calling of tenders for and finalization of contract. The agreed contract price of this project is Rs 63.60 Crores inclusive of all taxes. This project would be considered as extension of the main project as per MOU.</p>		
23 Other income		
Tender Processing Fee	1 18 644	3 38 980
Miscellaneous Income	--	8 100
Interest Received		
i) Interest on ICDS in GSFS	2 88 26 606	1 09 93 972
ii) Interest on Liquid Deposit	70 29 706	84 35 631
iii) Interest on Income Tax refund	--	2 549
Total	3 59 74 956	1 97 79 232
24 Cost of Materials Consumed		
EPC Contract Expense - MSIL Line	36 73 38 839	--
Railway Rail Expense	6 60 00 000	--
Project Management Consultancy Expense	87 08 510	--
Total	44 20 47 349	--
25 Employee benefit expense, payment to contractors and consultants		
Man Power Services	30 95 806	8 29 336
Total	30 95 806	8 29 336
26 Finance Cost		
Interest on lease liability*	3 50 532	--
Total	3 50 532	--
*Refer Note No 44		
27 Depreciation and amortisation expense		
Amortization of Right of use Asset*	7 63 194	--
Total	7 63 194	--
*Refer Note No 44		
28 Other expenses		
Bank Charges	--	201
Board Meeting Exp	15 000	--
Consultancy / Professional Charges	6 39 000	2 71 847
Insurance Expense	2 694	--
Rent Expense**	33 55 633	--
Feasibility Study Expense***	37 72 000	--
Interest on payment of TDS	--	470
Office Exp	76 550	768
Round Off	--	7
Stationery & Printing Exp	1 34 243	70 737
Statutory Audit Fees^	75 000	50 000
Traveling & Conveyance Exp-Others	--	18 000

Particulars	As at March 31, 2022	As at March 31, 2021
Vehicle Hire Charges	25 58 339	15 18 178
Repairs & Maintenance**	6 19 739	19 000
Advertisement Expenses*	50 312	84 664
Tender Fees	9 347	--
ROC & legal charges**	30 65 954	99 14 650
Total	1 43 73 811	1 19 48 522

***Refer Note No 38**

****Refer Note No 43**

*** During the year G-Ride has billed Project Development Expenditure with 15% Mark up as decided by BRCL in its 4th Board Meeting (Item No.4.07).

Other Expenses includes:

^Auditors Remuneration:

Statutory Audit Fees	75 000	50 000
Total	75 000	50 000

Other Comprehensive Income (OCI)

There are no component of other comprehensive income that are required or to be disclosed.

29 Earnings per share ('EPS')

Earnings per share is calculated by dividing the net profit/ (loss) attributable to the equity shareholders by the weighted average number of equity shares of Rs.10 each outstanding during the year which is as under:

Particulars	2021-22	2020-21
The following reflects the profit / (Loss) and share data used in the basic and diluted EPS computations:		
Net Profit/(Loss) attributable to equity shareholders	52 83 584	14 98 792
Weighted average number of equity shares in computing basic and diluted EPS	24 97 25 768	8 34 21 781
Face value of each equity share (Rs. 10)	10	10
Basic and diluted* Earning Per share	0.02	0.02

* There is no potential equity Shares so Basic and Diluted EPS are Same

30 Segment Information

In accordance with Ind-As 108, the operating segments used to present segment information are identified on the basis of internal reports used by the Company's Management to allocate resources to the segments and assess their performance.

The Board of Directors is collectively the Company's 'Chief Operating Decision Maker' or 'CODM' within the meaning of Ind AS 108. The indicators used for internal reporting purposes may evolve in connection with performance assessment measures put in place.

Information about geographical areas

The Company do not have any operations in economic environments with different set of risks and returns. Hence, it is considered to be operating in a single geographical segment.

31 Dues to Micro, Small and Medium Enterprises

There were no amounts payable to any Micro, Small & Medium Enterprises to whom the company owes dues, which are outstanding for more than 45 days as at March 31, 2022.

32 Financial Risk Management Objectives and Policies

The Company is exposed to market risk, credit risk and liquidity risk. The Company's senior management oversees the management of these risks. The Company's senior management is supported by Finance Department that advises on financial risks and the appropriate financial risk governance framework for the Company. The Finance department provides assurance to the Company's senior management that the Company's financial risk activities are appropriately governed.

(a) Market Risk

Market Risk is the risk that the fair value of future cash flows of a financial instrument will fluctuate because of changes in market prices. Market prices comprises interest rate risk. The sensitivity analyses in the following sections relate to the position as at March 31, 2022. The analyses exclude the impact of movements in market variables on; the carrying values of gratuity and other post retirement obligations: provisions; and the non-financial assets and liabilities.

(i) Interest Rate Risk

Interest Rate Risk is the risk that the fair value or future cash flows of a financial instrument will fluctuate because of changes in market interest rates. The borrowings of the Company are interest free and therefore not subject to interest rate risk as defined in Ind AS 107. Borrowing from G-RIDE is bearing interest rate of 9.50%. However, said loan is short term in nature and hence it will not affect future cash flows of the company in long run.

(b) Liquidity Risk

Liquidity Risk is the risk that the Company may not be able to meet its present and future cash and collateral obligations without incurring unacceptable losses. The Company's objective is to, at all times maintain optimum levels of liquidity to meet its cash and collateral requirements. The Company closely monitors its liquidity position and deploys a robust cash management system. It maintains adequate sources of financing including loans from banks at an optimised cost.

(i) The table below summarises the maturity profile of the Company's financial liabilities based on contractual undiscounted payments.

As at March 31, 2022	On demand	Less than 3 months	3 to 12 months	1-5 years	More than 5 years	Total
Borrowings	--	--	--	--	--	--
Trade Payable	15 95 250	--	--	--	--	15 95 250
Other Financial Liabilities-Non Current	--	--	--	7 99 04 829	--	7 99 04 829
Other Financial Liabilities- Current	--	--	13 12 625	--	--	13 12 625
As at March 31, 2021						
Borrowings	--	--	--	--	--	--
Trade Payable	--	2 30 926	--	--	--	2 30 926
Other Financial Liabilities-Non Current	--	--	--	2 48 29 068	--	2 48 29 068

(c) Credit Risk

Credit risk is the risk that counterparty will not meet its obligations under a financial instrument or customer contract, leading to a financial loss. The Company is exposed to credit risk from its operating activities (primarily trade receivables) and from its financing activities, including deposits with banks and financial institutions and other financial instruments.

(i) Trade Receivables

All outstanding customer receivables of the company are regularly monitored. Company has not witnessed any bad debts or long outstanding during the year. Furthermore, all outstanding customers receivables as on reporting date are less than 6 months. Accordingly, trade receivables are subject to extremely low credit risk and management has assessed that no impairment of trade receivables is required.

(ii) Financial Instruments and Cash Deposit

Credit risk from balances with bank and financial institutions is managed by the Company's finance department under the supervision of company's senior management. All balances with banks and financial institutions is subject to low credit risk due to good credit ratings assigned to the Company. This being under the supervision of regulatory authority.

33. Related Party Disclosures
(i) Related Parties and the nature of relationship :

Particular	Current Year	Previous Year
Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)	Joint Venture	Holding Entity
Maruti Suzuki India Limited (MSIL)	Joint Venture	Associate Entity
Gujarat Industrial Development Corporation (GIDC)	Joint Venture	-
Ministry of Railways (MOR)	Promoters of Joint Venture-G-RIDE	Promoters of Joint Venture-G-RIDE

Entities over which key management personnel and their relatives are able to exercise significant influence

Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)

Key Management Personnel / Executive Director

Shri Santosh Kumar	CEO / Director	
Shri Ashwinikumar Yadav	Chairman	(till date 11/11/2021)
Shri S N Joshi	CFO	

Director Non-Executive

Shri Bajrang Warli	Director	
Smt. Kavita Sheth	Director	(till date 29/03/2022)
Shri Batchu Venugopal	Director	(till date 20/05/2022)
Shri Jwalesh Zaveri	Director	(from 16/02/2022)
Shri Raj Swarup Kapoor	Director	

(ii) Transactions with Related Parties

Summary of transactions / Balances with Related Parties	Joint Venture		Promoters of Joint Venture		Key management personnel and relatives	
	For the year ended March 31, 2022	For the year ended March 31, 2021	For the year ended March 31, 2022	For the year ended March 31, 2021	For the year ended March 31, 2022	For the year ended March 31, 2021
Loan received	-	2 89 78 259	-	-	-	-
Loan Repaid	-	17 21 06 114	-	-	-	-
Reim. of exp. (Capitalised-CWIP)	-	-	-	-	-	-
Other Expenses - Board Meeting Exp.	-	-	-	-	15 000	--
Interest Paid (Capitalised-CWIP)	-	43 41 404	-	-	-	-
Feasibility Study Expense	37 72 000	-	-	-	-	-
PMC Charges paid (Capitalised-CWIP)	9 86 38 160	6 51 95 746	-	-	-	-
PMC Charges Income (MSIL Project)	86 25 000	-	-	-	-	-
PMC Charges Exp. (MSIL Project)	87 08 510	-	-	-	-	-
Rail Purchases- From MOR for MSIL Project	-	-	6 60 00 000	-	-	-
Rail Purchases- (Capitalised-CWIP)	-	-	10 02 05 785	2 82 53 106	-	-
Additional Feeder Bay for CWIP	-	-	-	3 09 20 950	-	-
Sale of Rails to MSIL	6 60 00 000	-	-	-	-	-
Sale of Construction Services-MSIL	36 46 20 536	-	-	-	-	-
Equity Share Contribution Received	304 54 22 000	159 01 00 000	-	-	-	-
Bid Processing Fees-Collected & Transfer	7 500	80 000	-	-	-	-
Total	359 57 93 706	186 08 01 523	16 62 05 785	5 91 74 056	15 000	-

Summary of transactions / Balances with Related Parties	Joint Venture		Promoters of Joint Venture		Key management personnel and relatives	
	For the year ended March 31, 2022	For the year ended March 31, 2021	For the year ended March 31, 2022	For the year ended March 31, 2021	For the year ended March 31, 2022	For the year ended March 31, 2021
Amount Receivable	13 67 99 196	--	--	--	--	--
Amount Payable	--	--	--	--	--	--

34 Fair Value Measurements

Set out below, is a comparison by class of the carrying amounts and fair value of the Company's financial instruments:

Category	As at March 31, 2022		As at March 31, 2021	
	Carrying Value	Fair Value	Carrying Value	Fair Value
1) Financial assets at Amortized Cost				
Trade receivables (current & non current)	13 67 99 196	13 67 99 196	--	--
Cash and Cash equivalents	8 15 75 227	8 15 75 227	5 33 61 618	5 33 61 618
Other balances with banks	231 43 49 947	231 43 49 947	96 00 00 000	96 00 00 000
Other financial asset (current & non current)	--	--	--	--
Total	253 27 24 370	253 27 24 370	101 33 61 618	101 33 61 618
2) Financial Liabilities at Amortized Cost				
Borrowings	--	--	--	--
Trade payables	15 95 250	15 95 250	2 30 926	2 30 926
Other financial liabilities (current & non current)	8 12 17 454	8 12 17 454	2 48 29 068	2 48 29 068
Total	8 28 12 703	8 28 12 703	2 50 59 994	2 50 59 994

The fair value of the financial assets and liabilities is included at the amount at which the instrument could be exchanged in a current transaction between willing parties, other than in a forced or liquidation sale. Management has assessed that trade receivables, cash and cash equivalents, other bank balances, other financial assets, borrowings, trade payables and other financial liabilities approximate their carrying amounts largely due to the short-term maturities of these instruments.

Fair Value Hierarchy

All financial instruments for which fair value is recognised or disclosed are categorised within the fair value hierarchy, described as follows, based on the lowest level input that is significant to the fair value measurement as a whole.

- Level 1:** Quoted (unadjusted) prices in active markets for identical assets or liabilities.
- Level 2:** Valuation techniques for which the lowest level input that has a significant effect on the fair value measurement are observable, either directly or indirectly.
- Level 3:** Valuation techniques for which the lowest level input that has a significant effect on the fair value measurement is not based on observable market data.

The following table provides the fair value measurement hierarchy of the Company's assets and liabilities.

Quantitative disclosures fair value measurement hierarchy for assets as at March 31, 2022:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial assets measured at amortised cost				
Trade receivables	13 67 99 196	--	--	--
Cash and Cash equivalents	8 15 75 227	--	--	--
Other balances with banks	231 43 49 947	--	--	--
Other financial asset (current/non current)	--	--	--	--
Total	253 27 24 370	--	--	--

Quantitative disclosures fair value measurement hierarchy for assets as at March 31, 2022:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial Liabilities measured at amortised cost				
Trade Payables	15 95 250	--	--	--
Other financial Liabilities(current & non current)	8 12 17 454	--	--	--
Total	8 28 12 703	--	--	--

Quantitative disclosures fair value measurement hierarchy for assets as at March 31, 2021:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial assets measured at amortised cost				
Trade receivables	--	--	--	--
Cash and Cash equivalents	5 33 61 618	--	--	--
Other balances with banks	96 00 00 000	--	--	--
Other financial asset (current & non current)	--	--	--	--
Total	101 33 61 618	--	--	--

Quantitative disclosures fair value measurement hierarchy for liabilities as at March 31, 2021:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial Liabilities measured at amortised cost				
Trade Payables	2 30 926	--	--	--
Other financial Liabilities(current & non current)	2 48 29 068	--	--	--
Total	2 50 59 994	--	--	--

35 Impact on previous year figures in Financial Statements due to Re-grouping:

Item Re-grouped	Amount	Grouped under the head in Previous year	Grouped under the head in Current year
Balance with GSFS - Inter Corporate Deposit	96 00 00 000	Investment-Current	Other balances with banks
Interest Receivable from GSFS	1 01 69 424	Investment-Current	Other Current Assets

36 Note on Project Management Consultancy to G-RIDE

GRIDE is appointed by BRCL as Project Management Consultant for execution of project of Katosan Road – Becharaji – Chanasma – Ranuj including MSIL siding at the value of 10% of the project cost as approved in the 1st meeting of Board of Director of BRCL held on 09.01.2019. Contract agreement has been executed as on 28.08.2020 for the same. The PMC charges shall be kept at Original Estimated Cost, which is Rs 452.60 Crore, in two phases for claiming total PMC charges Rs 45.26 crore. Phase-wise PMC charges are as under:

(i)Katosan Road to Becharaji incl MSIL Siding (Phase-I)	19.82 Crore
(ii)Becharaji to Ranuj (Phase-II)	25.44 Crore
Total Sanctioned PMC charge	45.26 Crore

As per contract executed with Gride on August 28, 2020 the details of stage wise PMC charges payable to GRIDE as under:

(₹ in Crore)

Sr. No	Stages of PMC	Sanctioned PMC Charges for Phase-I	Stage-wise PMC Charges for Phase-I, Including Taxes
1	Transaction Advisory (30% of sanctioned charges for Phase-I)	19.82	5.946
2	Project Management (45% of sanctioned charges for Phase-I)		8.919
3	Commissioning & Testing (25% of sanctioned charges for Phase-I)		4.955

(₹ in Crore)

Sr. No	Stages of PMC	Sanctioned PMC Charges for Phase-II	Stage-wise PMC Charges for Phase-II, Including Taxes
1	Transaction Advisory (30% of sanctioned charges for Phase-II)	25.44	7.632
2	Project Management (45% of sanctioned charges for Phase-II)		11.448
3	Commissioning & Testing (25% of sanctioned charges for Phase-II)		6.360

Billing Status as on 31.03.2022

(Amount in ₹)

Sr. No	Stages of PMC	Amount certified including GST	Bill Raised
1	Transaction Advisory (30% of sanctioned charges for Phase-I)		5 94 60 000
2	Transaction Advisory (30% of sanctioned charges for Phase-II)		7 63 20 000
3	Project Management (45% of sanctioned charges for Phase-I) (PMC Charges @ 8.919 Crore for Rs 263.52 Crore*		
a	IPC-01 to IPC 21	139 96 48 076	4 73 71 969
b	IPC-22 at 22-04-2022 Amount in Column Bill raised ₹ is excluding GST as only provision for the same has been accounted for and not the total invoice value (For the month of March 2022)	8 56 93 945	24 57 936
4	Project Management (45% of sanctioned charges for Phase-II) (PMC Charges @ 11.448 Crore for Rs 333.625 Crore*		
a	IPC-01 at 27-04-2022 Amount in Column Bill raised ₹ is excluding GST as only provision for the same has been accounted for and not the total invoice value (For the month of March 2022)	21 19 15 925	61 62 439
	Total Bill Raised up to March 31, 2022	169 72 57 946	141 37 92 344

During the year company has paid PMC to G-RIDE for MSIL inside siding work details of which are as under:

Total PMC charges for the work	1 35 70 000 (including GST @ 18%)	
PMC Charges incurred till March'22	98 58 385 (including GST @ 18%)*	

* Which includes unbilled revenue of Rs. 23,20,321 excluding GST

37 Note on borrowing from G-RIDE and Interest paid to G-RIDE

Particular	2021-22	2020-21
Opening balance of loan	-	14 31 27 855
Loan received during the year	-	2 89 78 259
Less: Loan repaid during the year	-	17 21 06 114
Closing balance of loan	-	-
Total interest paid to G-RIDE @ 9.5% Per Annum*	-	43 41 404

* Interest Paid to G-RIDE has been transferred to Intangible Asset under Development Refer Note No. 38

38 The following expenditures have been capitalised as part of Intangible Asset under Development / Capital Work in Progress

Particulars	For the year ended on 31st March 2022		For the year ended on 31st March 2021	
	Amount	Refer Note No	Amount	Refer Note No
Advertisement Expense		5		5
Amount Transfer to Capital Work in progress - Land Acquisition	20 872		2 05 374	
Amount Transfer to Capital Work in progress - Office	5 00 184			
Tamping Machine Expense		40		40
Amount transfer to Intangible asset under development - Phase I	2 31 581		-	
EPC Project Development Expense		40		40
Amount transfer to Intangible asset under development - Phase I	106 80 01 634		51 46 68 126	
Amount transfer to Intangible asset under development - Phase II	18 92 10 647		-	
PMC Contract Expense		40		40
Amount transfer to Intangible asset under development - Phase I	2 77 97 756		6 51 95 746	
Amount transfer to Intangible asset under development - Phase II	7 08 40 405		-	
ROC & Legal Charges		40		40
Amount transfer to Intangible asset under development - Phase I	-		74 000	
Amount transfer to Intangible asset under development - Phase II	59 000		-	
Finance Cost		-		40
Amount transfer to Intangible asset under development - Phase I	-		43 41 404	
Total	135 66 62 079		58 44 84 650	

39 Ageing for Capital work in progress as at March 31, 2022 is as follows:

(Amount in ₹)

Capital work in progress	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	TOTAL
Capital Work in Progress-Office	1 90 64 267	2 53 110	-	-	1 93 17 377
Capital Work in Progress-Land Acquisition	4 13 23 373	5 64 125	-	-	4 18 87 498
Total	6 03 87 640	8 17 235	-	-	6 12 04 875

40 Intangible Assets Under Development (Freight Sharing Right Under Development)

(Amount in ₹)

Sr No	Category of works / Item Description	PAHSE I		PAHSE II	
		For the Year ended on 31 March 2022 (A)	For the Year ended on 31 March 2021 (B)	For the Year ended on 31 March 2022 (C)	For the Year ended on 31 March 2021 (D)
i	Civil & Track Works	134 52 36 377	43 75 24 767	14 49 70 726	-
	Project Facilities	1 90 76 376	1 34 53 782	4 23 330	-
	Earthwork	24 99 94 732	9 04 28 356	-	-
	Protection work	4 82 66 457	2 50 86 256	-	-
	Major Bridges including PSC Slab bridge	4 76 06 494	-	-	-
	Minor Bridges including PSC Slab bridge	17 96 41 003	-	-	-
	RUBs	30 10 76 702	1 86 44 752	-	-
	Track Works	38 10 74 534	28 01 75 338	14 45 47 396	-
	Other Civil Engineering works including FOB & Subways	11 85 00 079	97 36 283	-	-
ii	Signalling Works	9 60 81 671	3 10 48 796	54 36 896	-
iii	Telecommunication works	1 02 86 291	1 03 11 325	1 05 92 607	-
iv	Electrification (OHE Works)	11 29 28 412	3 02 52 237	-	-
	Overhead Equipment Work, Modification of OHE, TSS, SS	11 29 28 412	3 02 52 237	-	-
v	General Electrical Works (GEW)	1 79 59 252	55 31 001	2 82 10 417	-
	Various electrical general services Works	1 09 52 403	-	2 63 02 136	-
	Modification of HT power lines crossings up to 33 KV (replacement by UG cabling)	70 06 849	55 31 001	19 08 281	-
vi	Project management Consultancy Charges	9 29 93 501	6 51 95 746	7 08 40 405	-
vii	Payment to GETCO for electrical work	2 90 57 259	2 90 57 259	19 95 49 711	-
viii	Site cleaning work	1 21 125	1 21 125	-	-
ix	Interest on Loan from G-RIDE	49 62 195	49 62 195	-	-
x	Payment for Rails Purchased from Railway	12 84 58 891	2 82 53 106	-	-
xi	Payment for Additional Feeder Bay	3 09 20 949	3 09 20 949	-	-
xii	Others	1 95 546		2 80 454	-
	Sub Total	186 92 01 468	67 31 78 506	45 98 81 216	-
	Less : Interest on Mobilization Advance*	3 93 72 045	1 94 44 527	1 45 44 679	-
	Total Intangible Assets Under Development	182 98 29 423	65 37 33 979	44 53 36 537	-

Total Intangible Assets Under Development year ended 31st March 2022 (Total of A+B+C) **227 51 65 960**

Total Intangible Assets Under Development year ended 31st March 2021 (Total of B+D) **65 37 33 979**

Note: Above figure includes Price Variation amount of Rs. 9,72,99,983/-

Ageing for Intangible Assets Under Development as at March 31, 2022 is as follows:

Intangible Assets Under Development	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	TOTAL
Project in progress - Phase I	117 60 95 444	65 37 33 979	-	-	182 98 29 423
Project in progress - Phase II	44 53 36 537	-	-	-	44 53 36 537
Total	162 14 31 981	65 37 33 979	-	-	227 51 65 960

Ageing for Intangible Assets Under Development as at March 31, 2021 is as follows:

Intangible Assets Under Development	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	TOTAL
Project in progress - Phase I	65 27 72 161	9 61 818	-	-	65 37 33 979
Total	65 27 72 161	9 61 818	-	-	65 37 33 979

41 Capital Commitment

For the year ended 31st March 2022

Name of party with whom Contract Executed	Total value of contract	Contract value Executed till March 31, 2022	Remaining Contract value
Kalpataru Power Transmission Limited-EPC Contract	263 52 00 000	174 88 62 021	88 63 37 979
Gujarat Rail Infrastructure Development Corporation Limited-PMC Contract	45 26 00 000	19 17 72 345	26 08 27 655
Ashoka Buildcon limited	333 62 50 000	52 28 35 647	281 34 14 353
Haresh Patel Engineers & Contractors	4 46 08 899	1 66 13 390	2 79 95 509
Total Capital Commitment	646 86 58 899	248 00 83 403	398 85 75 496

For the year ended 31st March 2021

Name of party with whom Contract Executed	Total value of contract	Contract value Executed till March 31, 2021	Remaining Contract value
Kalpataru Power Transmission Limited-EPC Contract	263 52 00 000	77 40 67 505	186 11 32 495
Gujarat Rail Infrastructure Development Corporation Limited-PMC Contract	45 26 00 000	7 66 58 793	37 59 41 207
Total Capital Commitment	308 78 00 000	85 07 26 298	223 70 73 702

42 Various Financial Ratio are disclosed as under :

Sr. No.	Ratio	Numerator	Denominator	31/03/2022	31/03/2021
1	Current ratio (X)	Current Assets	Current Liabilities	7.84	16.12
Reason for change: Proportionate change in current liability as compared to change in current assets is more.					
2	Debt equity ratio (X)	Total Debt	Shareholder's Equity(Capital plus reserve)	NIL	NIL
3	Debt service coverage ratio (X)	Net Profit before taxes + Non-cash operating expenses like depreciation and other amortizations + Interest + other adjustments like loss on sale of Fixed assets etc	Interest & Lease Payments + Principal Repayments	NIL	NIL
4	Return on Equity (%)	Net Profits after taxes – Preference Dividend (if any)	Average Shareholder's Equity	21%	18%
5	Inventory turnover ratio	Cost of goods sold OR sales	Average Inventory (Opening + Closing balance / 2)	NIL	NIL
6	Trader receivable turnover ratio	Net Credit Sales (gross credit sales minus sales return)	Average Accounts Receivable (Opening + Closing balance / 2)	3.21	NIL
Reason for change: As there were no Trade Receivables in previous year.					
7	Trade payable turnover ratio	Net Credit Purchases (gross credit purchases minus purchase return)	Average Working Capital	0.07	NIL
Reason for change: As there were no Trade Payables in previous year.					
8	Net capital turnover ratio	Net Sales (total sales minus sales returns)	Average Working Capital	0.07	NIL
Reason for change: As there were no Sales in previous year.					
9	Net profit ratio	Net Profit	Net Sales	0.01	NIL
Reason for change: As there were no Sales in previous year.					
10	Return on capital employed	Earning before interest and taxes	Capital Employed (Tangible Net Worth + Total Debt + Deferred Tax Liability)	0.003	0.004
Reason for change: Proportionate increase in capital Employed is more than increase in income					
11	Return on investment	Return	Investment	NIL	NIL

43 Following expense includes prior period expense as under:

Particulars	Amount	Refer Note No
Rent Expense	23 93 927	28
Repairs & Maintenance	3 44 330	28
ROC & legal charges - Professional Tax	9 717	28
Total	27 47 974	

44 Lease Arrangements

The Company has entered into an agreement with Gujarat Udhog Bhavan Society for obtaining office premise on lease for a period of 5 years at monthly rent of ₹. 1,60,285/-

The above lease has been accounted by debiting Right of Use - leasehold office and crediting corresponding lease liability. The value of lease liability has been derived by discounting future lease payments of 5 years @ 9.5% p.a.

Maturity Analysis of Lease Liability

Particulars	Less Than 12 Months	More Than 12 Months	Total Liability
As at March 31, 2021	-	-	-
As at March 31, 2022	13 12 625	57 08 140	70 20 765

Amount Recognised in Statement of Profit & Loss

Particulars	31-03-2022	31-03-2021
Interest on Lease Liabilities	3 50 532	-
Amortisation of ROU Assets	7 63 194	-
Total	11 13 726	-

Details of Right of Use (ROU) Assets - Leasehold office:

Particulars	31-03-2022	31-03-2021
Opening Carrying Value as at Balance Sheet Date	-	-
Addition to ROU Assets during the year	76 31 943	-
Amortisation of ROU Assets during the year	7 63 194	-
Closing Carrying Value as at Balance Sheet Date	68 68 749	-

45 Figures of previous year have been re-grouped/ re-classified wherever necessary to make them comparable with current year.

Signatories to Note 1 to 45

**As per our report of even date
For Shah & Dalal
Chartered Accountants
FRN. 109432W**

For and on behalf of the Board

**Sd/-
Malay Dalal
Partner
Membership No. 036776**

**Sd/-
S. N. Joshi
CFO**

**Sd/-
Jwalesh Zaveri
Director
DIN: 09507224**

**Sd/-
Santosh Kumar
Director & CEO
DIN: 07854179**

**Place: Ahmedabad
Date: July 20, 2022**

**Place: Gandhinagar
Date: July 20, 2022**